

ઑગણત્રીસમો વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૧
29th Annual Report 2020-21




● **G•S•F•S**

ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ
Gujarat State Financial Services Limited

કંપની ધારા ૨૦૧૩ ની કલમ ૨(૪૫) અન્વયે ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસ લીમીટેડનાં વર્ષ ૨૦૨૦-૨૧ નો કાર્યવાહી અહેવાલ.

અહેવાલ તૈયાર કરનાર અધિકારીનું નામ,



(જે.પી.ગુપ્તા)

અગ્ર સચિવ(નાણા)

નાણા વિભાગ

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લીમીટેડનાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧નાં વર્ષ ની સમીક્ષા

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લીમીટેડ, અમદાવાદની સ્થાપના તારીખ ૨૦/૧૧/૧૯૯૨ ના રોજ કંપની ધારા હેઠળ કરવામાં આવી હતી. કંપનીના મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસીએશનમાં નિયત કર્યા મુજબ કંપની મુખ્યત્વે રાજ્ય સરકારને સહાયભુત થવાની મહત્વની કામગીરી કરે છે.

સને ૨૦૨૦-૨૦૨૧ ના વર્ષ દરમ્યાન પ્રવર્તમાન કંપનીએ સાવચેતી અને સંયમપૂર્વકની ધિરાણનીતિ ચાલુ રાખી છે. વર્ષ દરમ્યાન કંપનીની કુલ આવક રૂા.૩૧૪૬ કરોડ થયેલ છે. વર્ષ દરમ્યાન સરકાર નિયંત્રિત સાહસો અને અન્ય સરકારી સંસ્થાઓના ફાજલ નાણાંનો વહીવટ એ કંપનીની મુખ્ય પ્રવૃત્તિ રહી છે. નાણાં ભંડોળના વ્યવસ્થાપનમાં અને ખાસ કરીને રાજ્ય સરકારનાં નિયંત્રણ હેઠળનાં સધ્ધર નાણાંકીય કામગીરી કરતાં જાહેર સાહસોમાં ધિરાણ કરીને કંપનીએ ઉમદા કામગીરી બજાવી હતી.

કંપનીની લીકવીડ ડીપોઝીટ યોજનાને રાજ્યનાં જાહેર સાહસો અને અન્ય સંસ્થાઓએ ઉત્તરોત્તર સુંદર પ્રતિસાદ આપેલ છે. લીકવીડ ડીપોઝીટ યોજના અન્વયે રાજ્યનાં જાહેર સાહસો અને અન્ય સંસ્થાઓનાં ચાલુ ખાતાઓમાં પડી રહેતા ફાજલ નાણાં પંદર દિવસ કરતાં પણ ટૂંકાગાળાના સમય માટે પણ સ્વીકારીને તેનું મની માર્કેટમાં રોકાણ કરી વ્યાજની આવક કમાવી આપી છે. આ યોજના હેઠળ ૩૧મી માર્ચ, ૨૦૨૧ ના રોજ કુલ રૂા.૨૮૬૧ કરોડની ડીપોઝીટ હતી. કંપનીએ વર્ષ દરમ્યાન જમા મુકવામાં આવેલ ઈન્ટર કોર્પોરેટ ડીપોઝીટ પર વધારે વ્યાજ દર આપવાનું ચાલુ રાખેલ છે.

અહેવાલનાં વર્ષ દરમ્યાન કંપનીએ રાજ્યના જાહેર સાહસોને સરકારી બેન્કો કરતાં ઓછા વ્યાજ દરે ધિરાણ આપવાનું ચાલુ રાખેલ છે. આ નીતિના હિસાબે રાજ્ય સરકારનાં જાહેર સાહસોનો ફક્ત વ્યાજ ખર્ચમાં ઘટાડો થયો, એટલું જ નહીં પરંતુ સ્પર્ધાત્મક વ્યાજ દરે નાણાં મેળવી શકાય તેવો આડકતરો લાભ પણ થયો છે, જેથી વ્યાજ ખર્ચ ઘટયો છે. રાજ્યનાં એકમોને વર્ષ દરમ્યાન લગભગ રૂા.૬૯૭૪ કરોડનું ધિરાણ કરવામાં આવેલ છે.

જીએસએફએસ એ તેની આંતરિક શક્તિ અને કુશળ સંચાલન ધ્વારા નાણાંકીય સેવાઓનાં ક્ષેત્રમાં પોતાનું આગવું અને વધારે સધ્ધર સ્થાન પ્રસ્થાપિત કર્યું છે.


ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લીમીટેડનાં નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ નો વાર્ષિક અહેવાલ સભાગૃહનાં મેજ પર મુકવા અંગેનું નિવેદન

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લીમીટેડ, અમદાવાદની સ્થાપના તારીખ ૨૦/૧૧/૧૯૯૨ ના રોજ કંપની ધારા હેઠળ કરવામાં આવી હતી.

૨૦૨૦-૨૦૨૧ નું વર્ષ ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લીમીટેડની કામગીરીનું ઓગણત્રીસમું વર્ષ હતું. પ્રસ્તુત ધારાની જોગવાઈઓ હેઠળ તા.૩૧-૦૩-૨૦૨૧ સુધીનાં હિસાબો તા.૨૮-૦૯-૨૦૨૧ ના રોજ મળેલ કંપનીની ઓગણત્રીસમી વાર્ષિક સામાન્ય સભામાં મંજૂર કરાવવામાં આવેલ હતા.

આ અંગે નિવેદન કરવાનું કે ૨૦૨૦-૨૦૨૧ ના વર્ષ માટે કંપનીના ઓગણત્રીસમાં નાણાંકીય વર્ષનાં હિસાબો તૈયાર કરી આંતરિક ઓડીટર મારફતે ચકાસણી કરાવ્યા બાદ સ્ટેચ્યુટરી ઓડીટર પાસે હિસાબોનું ઓડિટ કરાવી તેજ તારીખના સ્ટેચ્યુટરી ઓડીટરનાં અહેવાલ સાથે એકાઉન્ટન્ટ જનરલશ્રી, ગુજરાતને રજુ કરેલ હતા, તેઓશ્રીની ટિપ્પણી મેળવી હતી જે ૨૦૨૦-૨૦૨૧ ની વાર્ષિક સામાન્ય સભામાં રજુ કરી બહાલી મેળવી હતી.

આ સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ના ઓડીટેડ વાર્ષિક અહેવાલ વિધાનસભાનાં મેજ પર મુકવામાં આવે છે.


Deputy Secretary
Finance Department,
Government of Gujarat,
Sachivalaya, Gandhinagar

Annual Report of Gujarat State Financial Services Limited for the year 2020-21 u/s 2(45) of the Companies Act, 2013.

Name of Official preparing the Report



(J.P.Gupta)

Principal Secretary(Finance)

Finance Department

Review of Performance of Gujarat State Financial Services Limited for the F.Y. 2020-21

Gujarat State Financial Services Limited is incorporated on 20th November, 1992 under the Companies Act. As per the Memorandum and Articles of Association of the Company, the main activity of the Company is to support the State Government.

During the year 2020-21, company has continued its financial activities keeping safety and cautious. During the year, the total income of the company was ₹3146 crore. The main activity of the company during the year has been to manage the surplus funds of Government of Gujarat Entities. The company has done a credible act of managing the surplus funds especially providing loans to State Government entities having sound financial position.

The Liquid Deposit Scheme of the company has continued to get preference from Public Sector undertakings and other State Government entities. The company has generated income for State PSUs and other State Government entities on their funds by accepting those funds for even for less than fifteen days, which otherwise would have remained idle in their current accounts and investing them in the money market. The size of funds under this scheme was ₹2861 crore as on 31st March, 2021. The company has continued to offer higher rate of interest on funds received under Inter Corporate Deposits during the year.

During the year, the Company has continued to provide finance to various Government of Gujarat entities at lower rate than Public Sector Banks. This act has not only proved effective in reducing the interest cost of the Government of Gujarat entities but has also provided an indirect benefit to these entities to get finance at competitive rates from the market thereby reducing their overall cost of borrowing. During the year, Company has provided fresh finance of around ₹6974 crore to the Government of Gujarat entities.

GSFS, with its inherent strength and prudent management, has further established its prominent position in the field of financial services.


Statement of Annual Report of Gujarat State Financial Services Limited for the F.Y. 2020-21 to be placed on Table of Assembly House.

Gujarat State Financial Services Limited was incorporated on 20th November, 1992 under the Companies Act.

The year 2020-21 is the 29th year of operations of Gujarat State Financial Services Limited. Under the relevant provisions of Acts, the Annual Accounts for the year ended on 31st March, 2021 were approved by the members in its 29th Annual General Meeting held on 28th September, 2020.

In this connection, it needs to be mentioned that GSFS has prepared its 29th Annual Accounts for the year 2020-21 which was verified by Internal Auditor and then audited by Statutory Auditor vide their Statutory Auditors Report of even date presented to Accountant General, Gujarat. The comment of the Accountant General, Gujarat was received which was accorded in Annual General Meeting of the year 2020-21.

With this, the Audited Annual Report of Gujarat State Financial Services Limited for the F.Y. 2020-21 is hereby placed on Table of Assembly House.


Deputy Secretary
Finance Department,
Government of Gujarat,
Sachivalaya, Gandhinagar

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ

ઓગણત્રીસમો વાર્ષિક અહેવાલ ૨૦૨૦-૨૦૨૧

અનુક્રમણિકા	પાના નંબર
નિયામક મંડળ	૧
નોટિસ	૨
નિયામક મંડળનો અહેવાલ	૪
મહાલેખાકારનો અહેવાલ	૧૬
સ્વતંત્ર ઓડીટર્સનો અહેવાલ	૧૭
વાર્ષિક સરવૈયું	૨૮
નફા-નુકસાન પત્રક	૨૯
નાણાંકીય પત્રકો ઉપરની નોંધો	૩૨

THIS PAGE HAS BEEN INTENTIONALLY LEFT BLANK

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ

સીઆઈએન : યુદ્ધપલ્લવ૦જી૧૯૯૨એસજીસી૦૧૮૬૦૨

નિયામક મંડળ

શ્રી કે. કૈલાસનાથન, આઈએએસ (ડીન:૦૦૫૮૭૯૦૧)	અધ્યક્ષ
શ્રી મિલિન્દ તોરવણે, આઈએએસ (ડીન:૦૩૬૩૨૩૯૪)	નિયામક
શ્રીમતી આરતી કંવર, આઈએએસ (ડીન:૦૩૫૩૫૯૭૩)	નિયામક
શ્રી ચમલ વ્યાસ (ડીન:૦૧૩૦૮૪૪૦) (તા. ૨૨ માર્ચ, ૨૦૨૦ સુધી)	સ્વતંત્ર નિયામક
શ્રી સુનીલ તલાટી (ડીન:૦૦૬૨૧૯૪૭) (તા. ૧૫ જુલાઈ, ૨૦૨૦ થી)	સ્વતંત્ર નિયામક
શ્રી ભદ્રેશ મહેતા (ડીન:૦૨૬૨૫૧૧૫) (તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૧૯ થી)	સ્વતંત્ર નિયામક
શ્રી કમલેશ કે. પટેલ (ડીન:૦૮૬૮૭૫૬૩) (તા. ૬ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી)	નિયામક
શ્રી મેહુલ કે. વસાવા (ડીન:૦૮૯૧૮૯૦૬) (તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૦ થી)	નિયામક
શ્રી પંકજ જોષી, આઈએએસ (ડીન:૦૧૫૩૨૮૯૨)	વહીવટી સંચાલક

અન્ય ઉચ્ચ અધિકારી ગણ

શ્રી હેમંત પંત (વાઈસ પ્રેસીડન્ટ)
શ્રી વિપુલ શેઠ (વાઈસ પ્રેસીડન્ટ)
શ્રી નીતિન શાહ (મુખ્ય હિસાબી અધિકારી)

ઓડીટર્સ

મે. મુકેશકુમાર જૈન એન્ડ કું.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
અમદાવાદ

બેંકર્સ

આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ
બેંક ઓફ બરોડા
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા

કંપની સચિવ

શ્રી અનિલ માલુ (તા. ૬ ઓક્ટોબર, ૨૦૨૦ સુધી)
શ્રી નિરજ જૈન (તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૦ થી)

રજીસ્ટર્ડ ઓફિસ :

વિંગ બી, ૩જો માળ, ખનિજ ભવન,
૧૩૨ ફૂટ રીંગ રોડ, યુનિવર્સિટીના મેદાન પાસે,
વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦ ૦૫૨
ફોન : (૦૭૯) ૨૭૯૧૨૫૨૮-૩૦
ફેક્સ : (૦૭૯) ૨૭૯૧૨૫૩૪

Email : info@gsfs.in

Website : www.gsfs.co.in

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ

સીઆઈએન : યુદ્ધપલ્લવ૦જીજે૧૯૯૨એસજીસી૦૧૮૬૦૨

નોટિસ

આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીના સભ્યોની ઓગણત્રીસમી (૨૯ મી) વાર્ષિક સામાન્ય સભા મંગળવારે ૨૮ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ બપોરે ૪.૦૦ વાગે રજિસ્ટર્ડ કચેરી વિંગ “બી”, શ્રીજો માળ, ખનીજ ભવન, ૧૩૨ ફૂટ રીંગરોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ- ૩૮૦ ૦૫૨ ખાતે નીચેના કામકાજ હાથ ધરવા માટે યોજાશે:-

સામાન્ય કામકાજ:

૧. ૩૧ માર્ચ, ૨૦૨૧ ના અંતિત નાણાંકીય વર્ષ માટે કંપનીના હિસાબ તપાસી નાણાંકીય પત્રકો અને તેના પર નિયામક મંડળ અને સ્વતંત્ર ઓડિટરના અહેવાલો અને ભારતના નિયંત્રક અને મહાલેખાકારની ટિપ્પણીઓ મેળવવી, વિચારણામાં લેવી અને તેને સ્વીકારવી.
૨. ૩૧ માર્ચ, ૨૦૨૧ ના અંતિત વર્ષના ઈક્વિટી શેરો પર ડિવિડન્ડ જાહેર કરવું.
૩. વૈદ્યાનિક ઓડિટરનું મહેનતાણું નક્કી કરવું અને આ બાબતને ધ્યાનમાં લેવી અને જો યોગ્ય લાગે તો, ફેરફાર(રો) સાથે અથવા ફેરફાર વિના નીચેનો સામાન્ય ઠરાવ પસાર કરવા માટે:-

“આથી ઠરાવ કરવામાં આવે છે કે કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૩૯(૫), ૧૪૨ ની જોગવાઈઓ અને જો કોઈ હોય તો અન્ય લાગુ જોગવાઈઓ અને તે હેઠળ ઘડાયેલા નિયમો અનુસાર, આથી નિયામક મંડળને ભારતના નિયંત્રક અને મહાલેખાકાર દ્વારા કંપનીના વર્ષ ૨૦૨૧-૨૨ માટે વૈદ્યાનિક ઓડિટર તરીકે નિયુક્ત મુકેશકુમાર જૈન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અમદાવાદનું મહેનતાણું નક્કી કરવા માટે અધિકૃત કરે છે જે આગામી વાર્ષિક સામાન્ય સભા સુધી ઓડિટર તરીકે રહેશે અને કાર્ય કરશે.”

નિયામક મંડળના આદેશથી

તારીખ : ૨૨-૦૯-૨૦૨૧

સ્થળ : અમદાવાદ

સહી

નિરજ જૈન

કંપની સચિવ

રજિસ્ટર્ડ કચેરી :

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ,
સીઆઈએન : યુદ્ધપલ્લવ૦જીજે૧૯૯૨એસજીસી૦૧૮૬૦૨
વિંગ બી, ૩જો માળ, ખનીજ ભવન,
૧૩૨ ફૂટનો રીંગ રોડ, યુનિવર્સિટીના મેદાન પાસે,
વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦ ૦૫૨.

નોંધ :

૧. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૨ અનુસાર બેઠકમાં હાથ ધરવામાં આવનાર વિશેષ કામકાજને લગતું સ્પષ્ટીકરણ આપતું નિવેદન નીચે પ્રમાણે છે.
૨. સભાસદને બેઠકમાં હાજર રહી મત આપવાનો અધિકાર છે અને તે અથવા તેણીના બદલે બેઠકમાં હાજર રહેવા અને મત આપવા પ્રતિનિધિની નિમણૂક કરવા હકદાર છે, અને આવો પ્રતિનિધિ કંપનીનો સભ્ય હોય એ જરૂરી નથી.
૩. મીટિંગ માટે નિર્ધારિત સમય કરતા અડતાલીસ કલાક કરતા ઓછા નહિ, પ્રોકસીઓ, અસરકારક બનવા માટે, બંધ પ્રોકસી ફોર્મમાં રજિસ્ટર્ડ ઓફિસે પ્રાપ્ત થવું આવશ્યક છે.

૪. પચાસથી વધારે નહીં અને કંપનીની કુલ શેરમૂડીનો ૧૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતો ન હોય તે વ્યક્તિ સભાસદો વતી પ્રતિનિધિ તરીકે કામ કરી શકશે. જો સભાસદ કંપનીની કુલ શેરમૂડીના ૧૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતો હોય તો તે મત આપવાના અધિકાર સાથે એકજ વ્યક્તિને પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી શકશે તથા આ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ કે સભાસદો તરફથી પ્રતિનિધિ તરીકે કામ કરી શકશે નહીં.
૫. કંપની અધિનિયમ ૨૦૧૩ની કલમ ૧૧૩ની જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિની તરફેણમાં કોર્પોરેટ સંસ્થાવતી નિયામક મંડળ અધિકૃત કરે તો તે વ્યક્તિ તે કોર્પોરેટ સંસ્થા તરફથી પ્રતિનિધિ તરીકે કાર્ય કરી શકશે અને કોર્પોરેટ સંસ્થાવતી તેની પાસે સમાન અધિકાર અને સત્તાઓ હશે જાણે કે તે વ્યક્તિગત હોય. અધિકૃત પ્રતિનિધિ રજૂઆત પત્ર સાથે ઠરાવની પ્રમાણિત નકલ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ પર કંપનીની સામાન્ય સભા પહેલા મોકલશે.
૬. આ સૂચનામાં ઉલ્લેખિત દસ્તાવેજો, જો કોઈ હોય તો, તે કંપનીની રજિસ્ટર્ડ કચેરીએ કોઈપણ કામકાજના દિવસોમાં (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ સિવાય), સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યાની વચ્ચે આગામી વાર્ષિક સામાન્ય સભાની તારીખ સુધી કંપનીના કોઈપણ સભ્યના નિરીક્ષણ માટે ઉપલબ્ધ છે.
૭. એટેન્ડન્સ સ્લિપ, પ્રોક્સી ફોર્મ અને સભાના સ્થળનો રુટ મેપ આ સાથે જોડેલ છે.

નિયામક મંડળનો અહેવાલ

માન. સભ્યશ્રીઓ,
ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ

આપના નિયામકોને ૩૧ માર્ચ, ૨૦૨૧ ના અંતિત નાણાંકીય વર્ષના વાર્ષિક હિસાબ તપાસણી અહેવાલ સાથે કંપનીના વ્યવસાય અને કામગીરી અંગેનો ૨૯ મો વાર્ષિક અહેવાલ રજૂ કરતા ખૂબ આનંદ અનુભવે છે.

નાણાંકીય ઉપલબ્ધિઓ: (૨૬૫ લાખ રૂપિયામાં)

૩૧મી માર્ચના રોજ પૂરા થતા વર્ષમાં	૨૦૨૧	૨૦૨૦
કુલ આવક	૩,૧૪,૬૪૨	૩,૫૯,૧૦૮
કુલ ખર્ચ:-	૨,૬૯,૫૮૭	૩,૦૦,૦૯૪
- સંચાલન ખર્ચ - વ્યાજ ખર્ચ	૨,૬૭,૦૦૪	૨,૯૮,૨૩૯
- ઘસારા સહિત અન્ય ખર્ચ	૨,૫૮૩	૧,૮૫૫
કરવેરા પહેલાનો નફો/(ખોટ)	૪૫,૦૫૫	૫૯,૦૧૪
કરવેરા:		
કરવેરા ખર્ચ	(૧૦,૨૯૨)	(૧૩,૨૪૬)
વિલંબિત કર	૮,૦૪૫	૨,૮૭૮
કુલ સમગ્ર આવક	૧,૧૧,૬૭૫	૪૯,૬૪૮
પ્રતિ ઇક્વિટી શેરદીઠ કમાણી (રૂપિયામાં)	૩૧.૦૨	૩૧.૦૮

કામગીરી:

અહેવાલના વર્ષ દરમિયાન કંપનીની કુલ આવક ₹ ૩,૧૪,૬૪૨ લાખ થયેલ જે અગાઉના વર્ષમાં ₹ ૩,૫૯,૧૦૮ લાખ હતી. કંપનીએ અગાઉ વર્ષમાં ₹ ૪૨,૮૯૦ લાખ સામે અહેવાલના વર્ષમાં ₹ ૪૨,૮૦૮ લાખનો ચોખ્ખો નફો કર્યો હતો.

ડિવિડન્ડ:

નિયામક મંડળે વર્ષ ૨૦૨૦-૨૧ માટે દરેક ₹ ૧૦ ના ૧૩,૭૯,૯૬,૦૫૯ ઇક્વિટી શેરો પર પ્રતિ શેર લેખે ₹ ૨.૫૦ ના દરે ડિવિડન્ડની ભલામણ કરી છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ ડિવિડન્ડ ₹ ૩૪,૪૯,૯૦,૧૪૮ (નજીકના ગુણાંકમાં) વહેંચવામાં આવશે. ડિવિડન્ડ વહેંચણી પરનો કર નાબૂદ કરી દેવામાં આવ્યો છે અને શેરદારકો માટે ડિવિડન્ડ કરપાત્ર રહેશે.

ચાલુ વર્ષના નફામાંથી કોઈ રકમ કંપનીના સામાન્ય અનામત ખાતામાં સ્થાનાંતરિત કરવાની દરખાસ્ત નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૪ ની કલમ ૪૫-આઇસી બેગવાઈ મુજબ, આપની કંપનીએ ₹ ૮૫.૬૨ કરોડ અનામત ભંડોળમાં સ્થાનાંતરિત કર્યા છે.

વ્યવસાયિક કામગીરી:

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન તમારી કંપનીના ભંડોળનો મુખ્ય સ્રોત ગુજરાત સરકારના સંગઠિત ક્ષેત્રો અને અન્ય સંગઠિત સંસ્થાઓ પાસેથી મુખ્ય નાણાંકીય સ્રોત ઈન્ટર કોર્પોરેટ ડિપોઝીટનાં સ્વરૂપમાં હતો. આ ભંડોળ ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિની ₹ ૪૦,૯૩૬.૦૮ કરોડની સરખામણીમાં ૩૧ માર્ચ, ૨૦૨૦ ની સ્થિતિએ ₹ ૩૭,૩૩૬.૬૧ કરોડ હતું.

ગુજરાત રાજ્ય નાણાંકીય સેવાની ટૂંકાગાળાની થાપણ (લિક્વિડ ડિપોઝિટ) યોજના જે અંતર્ગત ૧૫ દિવસથી ઓછા સમય માટે વધારાનું ભંડોળ સ્વીકારવામાં આવે છે, તેને ઈન્ટર કોર્પોરેટ ડિપોઝીટ (ICD) ની સરખામણીમાં નીચી પસંદગી મેળવવાનું ચાલુ રાખેલ છે, કારણ કે તે ટૂંકા ગાળાની ઉપજ છે અને વધારાના ભંડોળને કામચલાઉ રોકાણ કરવા માટે પસંદ કરે છે. આ યોજના હેઠળ ૩૧ માર્ચ, ૨૦૨૦ ની સ્થિતિની ₹ ૧૯૩૮.૪૩ કરોડની સરખામણીમાં ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ ₹ ૨૮૬૦.૬૫ કરોડ હતું.

ગુજરાત સરકારના સાહસો / સંસ્થાઓ / સરકારને ફાળો / સહયોગ

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ દ્વારા લાવવામાં આવેલી નાણાંકીય આંતર મધ્યસ્થીની કાર્યક્ષમતાને કારણે, સરકારી કંપનીઓને સીધા અને આડકતરી રીતે વધુને વધુ લાભ મળી રહ્યા છે અને છેલ્લા નાણાંકીય વર્ષમાં તેમાં સતત વધારા થયા છે. જેની હર્ષપૂર્વક નોંધ લેવી ઘટે. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસની કામગીરીથી રાજ્ય સરકારના સાહસોને વ્યાજદરની અસ્થિરતાનાં વખતમાં પણ વધુ લાભ પ્રાપ્ત થયેલ છે.

એ નોંધવું પણ પ્રાસંગિક છે કે, કંપનીના સંચાલન હેઠળના કદ અને ભંડોળમાં વધારો થતાં, ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ રાજ્ય સરકારના ભંડોળના મહત્તમ ઉપયોગ માટે વિશ્વસનીય સાધન તરીકે ઉભરી આવ્યું છે. આનાથી સુનિશ્ચિત થયું છે કે ગુજરાત સરકારની કંપનીઓને તેમની થાપણો પર વધુ વ્યાજ દર અને તેમના વ્યાપારી ધિરાણ માટે સસ્તા દરે ધિરાણ આપવાના અભિગમને લીધે આવ જબરમાંથી નાણાં વાજબી દરે મેળવી શકાય છે.

કોવિડ-૧૯

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-૧૯ ની વિનાશક બીજી લહેર જેમાં રસીઓ, હોસ્પિટલની પથારીઓ, ઓક્સિજન સિલિન્ડર અને અન્ય જરૂરી દવાઓની અછત જેવી પ્રથમ લહેર કરતા ઘણી વધુ ગંભીર છે. આ રોગચાળાની શરૂઆતથી જ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/વિભાગો દ્વારા કોવિડ હોસ્પિટલો અને કોવિડ પથારીઓ સમર્પિત કરેલ છે અને તેમ કરવાનું ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે.

જ્યારે ગુજરાત સરકારે રોગચાળાની દૂર સુધી ફેલાતી થાપક અસરને રોકવા માટે સક્રિય અને આક્રમક પગલાઓ લેવાના શરૂ કર્યા છે, ત્યારે સરકાર માટે આવા રોગચાળાને કાબુમાં લેવાનું કામ ખૂબ પડકારજનક રહેશે. રાજ્યવ્યાપી સંશોધનો અને સેવાઓ એ સુનિશ્ચિત કરવા માટે તેનાત કરવામાં આવેલ છે કે જેથી પીડિત દર્દીઓને અત્યંત કાળજીપૂર્વક સેવા પૂરી પાડવામાં આવી રહી છે જ્યારે સંભવિત નાગરિકોને સંસર્ગનિષેધ કરવા માટે અલગ પ્રકારની ગોઠવણ ઊભી કરવામાં આવી છે. વધુમાં, કોવિડ-૧૯ પ્રત્યે જાગૃતિ લાવવા, નિવારક આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા અને આપત્તિ વ્યવસ્થાપન માટેના પગલાને લગતી વિવિધ ક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી રહી છે.

આપની કંપની સમય સમય પર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને વિવિધ વૈદ્યાનિક અને નિયમનકારી સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતી સલાહનું પાલન કરવા બંધાયેલ હતી. સામાજિક અંતરને લાગુ કરવા અને કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, કચેરી વિવિધ કાનૂની, નિયમનકારી અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકા / નિર્દેશો અનુસાર કામ કરતી હતી. આપની કંપનીએ કર્મચારીઓને ઘરેથી કામ કરવા સક્ષમ બનાવતી તર્કસંગત ટેકનોલોજીનો લાભ લઈ કામગીરી ચાલુ રાખી હતી.

કામચલાઉ ધિરાણ મોફૂઝી:

તમારી કંપનીના કોઈ પણ લોન ધારકોએ લોનની રકમની કામચલાઉ ચુકવણી મુલતવી મુદત માંગી નથી. ગુજરાત સરકારની કંપનીઓ બંધી લોન નિયમિતપણે પરત ચુકવેલ છે અને ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ શૂન્ય એનપીએ છે.

ભારતીય રિઝર્વ બેંકના વ્યવહારૂં ધોરણોને લાગુ કરવા:-

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બિન બેંકીંગ ધિરાણ કંપની (થાપણ લેતી કંપની અને થાપણ ન લેતી કંપની (રિઝર્વ બેંક) દિશા નિર્દેશો, ૨૦૧૬) (મુખ્ય નિર્દેશો) મુજબ સરકારી કંપનીઓને લાગુ પાડવામાંથી અંશત મુક્તિ આપવામાં આવી હતી. જો કે, ૩૧ મે, ૨૦૧૮ ના રોજ સુધારેલ મુખ્ય નિર્દેશો દ્વારા, સરકારી કંપનીઓને અપાયેલી મુક્તિ પાછી ખેંચી લેવામાં આવી હતી અને સમયબદ્ધ રીતે વ્યવહારૂં નિયમો, કંપની ક્ષેત્ર સંચાલન, કામકાજ નિયમોનું સંચાલન અને વૈદ્યાનિક જોગવાઈઓને લાગુ કરવામાં આવી હતી. જો કે, ૩૧ મે, ૨૦૧૮ ના રોજ સુધારેલ મુખ્ય નિર્દેશો દ્વારા, સરકારી કંપનીઓને અપાયેલી મુક્તિ પાછી ખેંચી લેવામાં આવી હતી.

રજૂઆતોને ધ્યાને લઈને ભારતીય રિઝર્વ બેંકે તેમના પત્ર નં ડીએનબીઆર(પીડી)સીઓ. ૧૨૨૩/૦૩.૧૦.૦૦૧/૨૦૧૮-૧૯ તા. ૧૮-૧૨-૨૦૧૮ થી આપવામાં આવતી ધિરાણની મર્યાદામાંથી (ક્રેડિટ કોન્ટ્રેશન) ગુજરાત સરકારની કંપનીઓને મુક્તિ આપી હતી. લોન અને મ્યુચ્યુલ ફંડોનાં રોકાણો પર જોખમનું ભારણ

ઘટાડવા માટે કરેલી કંપનીની વિનંતીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તા. ૩ માર્ચ, ૨૦૨૧ના ઈ-મેઈલ દ્વારા કંપનીની વિનંતીને સ્વીકારવામાં અસમર્થતા વ્યક્ત કરી છે જે તમારી કંપનીને નિર્ધારિત સીઆરએઆર સ્તર જાળવવામાં મદદ કરી શકે. આપની કંપની કંપનીના અલગ/અનન્ય વ્યવસાયિક માળખાના મહત્વને ધ્યાનમાં રાખીને વ્યાવહારિક ધોરણોનું પાલન કરવા માટે તેના નિષ્ઠાવાન પ્રયાસો ચાલુ રાખશે.

ગુજરાત સરકારે ઓક્ટોર, ૨૦૨૦માં કંપનીની ધિરાણ અને રોકાણ નીતિને મંજૂરી આપી છે.

મૂડી જોખમ (ભારાંક) અસ્કયામતોનો ગુણોત્તર (CRAR)

૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત તમારી કંપનીનો સીઆરએઆર ૭.૫૭% છે, જે આરબીઆઈ દ્વારા સૂચવવામાં આવેલા ૧૩% ના સ્તર કરતા ઓછો હતો. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ ગુજરાત સરકારની કંપનીઓને ફક્ત ગુજરાત સરકારની કંપનીઓ પાસેથી મળેલા ભંડોળમાંથી લોન આપે છે અને ભંડોળનું વિતરણ ગુજરાત સરકારની મર્યાદામાં જ રહે છે. ભંડોળના આવા વિતરણને સ્વતંત્ર રીતે રાજ્ય સરકારની જેમ જ સાર્વભૌમ તરીકે માનવામાં આવે છે અને હકિકતમાં તે સાર્વભૌમ છે. તેથી, ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડએ આરબીઆઈને આવી લોનના જોખમનો ભારાંક ૧૦૦% થી ઘટાડીને ઓછામાં ઓછું ૦% વિનંતિ કરી છે. વળી, કંપનીએ એસેટ્સ મેનેજમેન્ટ કંપનીઓની (એએમસી) સર્વોલ્કૃષ્ટ ધિરાણ યોજનામાં રોકાણ કર્યું છે; ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડએ પણ આરબીઆઈને એસેટ્સ મેનેજમેન્ટ કંપનીઓમાં રોકાણના જોખમનો ભારાંક ૧૦૦% થી ઘટાડીને ઓછામાં ઓછું ૧૮% કરવાની વિનંતી કરી છે. લોન અને મ્યુચ્યુલ ફંડોનાં રોકાણો પર જોખમનું ભારણ ઘટાડવા માટે કરેલી કંપનીની વિનંતીને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તા. ૩ માર્ચ, ૨૦૨૧ ના ઈ-મેઈલ દ્વારા કંપનીની વિનંતીને સ્વીકારવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. જે તમારી કંપનીને નિર્ધારિત સીઆરએઆર સ્તર જાળવવામાં મદદ કરી શકે. આપની કંપની કંપનીના અલગ/અનન્ય વ્યવસાયિક માળખાના મહત્વને ધ્યાનમાં રાખીને સીઆરએઆરના નિર્ધારિત સ્તરને જાળવવા માટે તેના નિષ્ઠાવાન પ્રયાસો ચાલુ રાખશે.

આ ઉપરાંત, તમારી કંપની સંતુલિત દરે ડિવિડન્ડ ચૂકવી રહી છે, અને ગુજરાત સ્ટેટ ડેવલોપમેન્ટ લોન (જીએસડીએલ) વધુ સરકારી સિક્યોરિટીજ રોકાણમાં પણ સતત વધારો કરી રહી છે, જે સીઆરએઆરને સુધારે છે.

નિયામકો:-

શ્રી યમલ વ્યાસે (ડીઆઇએન: ૦૧૩૦૮૪૪૦), ૨૨ માર્ચ, ૨૦૨૦ ના રોજ સ્વતંત્ર નિયામક તરીકેની સતત બીજી મુદત પૂર્ણ કરતા અને કંપની એક્ટ, ૨૦૧૩ ની જોગવાઈ મુજબ, તેઓ ફરીથી નિમણૂક માટે પાત્ર ન હોવાથી ૨૫ જૂન, ૨૦૨૦ ના રોજ મળેલી નિયામક મંડળની બેઠકમાં સમાપ્તિની નોંધ લીધી હતી.

શ્રી સુનિલ એચ. તલાટી (ડીઆઈએન: ૦૦૬૨૧૯૪૭) ની ગુજરાત સરકારના નાણાં વિભાગના મંજૂરી પત્ર નં. જેએનવી / ૧૦/ ૨૦૦૯/૧૪૯૮૫૭ / એ તારીખ ૧૫ જુલાઈ, ૨૦૨૦ થી સ્વતંત્ર નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. નિયામક મંડળે તેમને ૧૫ જુલાઈ, ૨૦૨૦ ના પરિપત્ર ઠરાવથી તેમની સહવરણી કરી હતી.

શ્રી કમલેશ કે. પટેલ (ડીઆઈએન: ૦૮૬૮૭૫૬૩) ની જગ્યાએ શ્રી મેહુલ કે. વસાવા (ડીઆઈએન: ૦૮૯૧૮૯૦૬), નાયબ સચિવ (પેન્શન) ની કંપનીના નિયામક તરીકે પત્ર નંબર.જે.એન.વી. / ૧૦/૨૦૧૪/૫૫૭૨૧૨/એ તારીખ ૬ ઓક્ટોબર, ૨૦૨૦ થી નિમણૂક કરવામાં આવી હતી. નિયામક મંડળે તેમને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૦ ના પરિપત્ર ઠરાવથી તેમની સહવરણી કરી હતી.

કંપનીના સ્વતંત્ર નિયામક / નિયામક તરીકેના કાર્યકાળ દરમિયાન તેમના દ્વારા કરવામાં આવેલા મૂલ્યવાન યોગદાન માટે તેમની પ્રશંસાની નોંધ નિયામક મંડળે લીધી હતી.

ભારત સરકારના સંગઠિત ક્ષેત્રો બાબતોના મંત્રાલયના ૫ જૂન, ૨૦૧૫ ના જાહેરનામાથી અને ૧૩ જૂન, ૨૦૧૭ ના સુધારા થયેલ

જાહેરનામાથી સરકારી કંપનીઓને અપાયેલી મુક્તિને ધ્યાનમાં રાખીને કોઈપણ નિયામક ક્રમાનુસાર નિવૃત્ત થશે નહીં.

કલમ ૧૪૯ ની પેટા કલમ (૬) હેઠળ સ્વતંત્ર નિયામકોએ આપેલ એકરાર નિવેદન:-

૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ કંપનીના સ્વતંત્ર નિયામકો શ્રી સુનિલ તલાટી અને શ્રી ભદ્રેશ મહેતાએ નિયામક મંડળને એકરાર કરેલ છે કે તેઓ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૯(૬) ની જોગવાઈ મુજબ સ્વતંત્રતાના માપદંડને સંતોષે છે.

નિયામક મંડળ અને ઓડિટ સમિતિની બેઠકોની સંખ્યા:-

નિયામક મંડળ બે બેઠકો વચ્ચે ૧૨૦ દિવસથી વધુ ન હોય એટલા નિયમિત સમયાંતરે બેઠકો કરે છે. જ્યારે જરૂરી હોય ત્યારે વધારાની બેઠકો યોજાય છે. સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન, નિયામક મંડળ ચાર વખત મળ્યું હતું. આ બેઠકો ૨૫ જૂન, ૨૦૨૦, ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૦, ૨૪ ડિસેમ્બર, ૨૦૨૦ અને ૨૪ માર્ચ, ૨૦૨૧ ના રોજ યોજાઈ હતી.

નિયામક મંડળ અને હિસાબ તપાસણી સમિતિની બેઠકોમાં વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન નિયામકોની હાજરીની વિગતો નીચે મુજબ છે :

નિયામકનું નામ	નિયામક મંડળની બેઠકોમાં હાજરી				હિસાબ તપાસણી સમિતિની બેઠકોમાં હાજરી			
	૨૫-૬-૨૦	૨૫-૯-૨૦	૨૪-૧૨-૨૦	૨૪-૩-૨૧	૨૫-૬-૨૦	૨૫-૯-૨૦	૨૪-૧૨-૨૦	૨૪-૩-૨૧
શ્રી કે. કૈલાસનાથન, આઈએએસ	હા	હા	હા	હા	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી
શ્રી પંકજ જોષી, આઈએએસ	હા	હા	હા	હા	હા	હા	હા	હા
શ્રી મિલિન્દ તોરવણે, આઈએએસ	હા	હા	હા	હા	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી
શ્રીમતી આરતી કંવર, આઈએએસ	હા	ના	ના	હા	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી
શ્રી સુનિલ તલાટી ^(૧)	લાગુ પડતું નથી	હા	હા	હા	લાગુ પડતું નથી	હા	હા	હા
શ્રી ભદ્રેશ મહેતા	હા	હા	હા	હા	હા	હા	હા	હા
શ્રી કમલેશ કે. પટેલ ^(૨)	હા	હા	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી
શ્રી મેહુલ કે. વસાવા ^(૩)	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	હા	હા	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી

(૧) ૧૫ જુલાઈ, ૨૦૨૦ થી નિમણૂક

(૨) ૬ ઓક્ટોબર, ૨૦૨૦ થી સમાપ્તિ

(૩) ૧૪ ઓક્ટોબર, ૨૦૨૦ થી નિમણૂક

કંપની ક્ષેત્રોની સામાજિક જવાબદારી (સીએસઆર):

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૫ મુજબની જોગવાઈઓ અને તે હેઠળ ઘડેલા નિયમોને અનુરૂપ, નિયામક મંડળ દ્વારા કંપની ક્ષેત્રોની સામાજિક જવાબદારી સમિતિની રચના કરવામાં આવી હતી. વર્ષ દરમિયાન સીએસઆર કમિટીની રચના નીચે મુજબ હતી :-

નિયામકનું નામ	કક્ષા	હોદ્દો
શ્રી પંકજ જોષી, આઈએએસ	વહીવટી સંચાલક	ચેરમેન
શ્રી મિલિન્દ તોરવણે	નિયુક્ત નિયામક	સભ્ય
શ્રી ભદ્રેશ મહેતા	સ્વતંત્ર નિયામક	સભ્ય

કંપનીએ કંપની ક્ષેત્રની સામાજિક જવાબદારી નીતિ પણ બનાવી છે. જે કંપનીની વેબસાઇટ www.gsfss.co.in પર ઉપલબ્ધ છે. કંપની (કંપની ક્ષેત્રની સામાજિક જવાબદારી નીતિ) નિયમો, ૨૦૧૪ હેઠળ જરૂરી સીએસઆર પ્રવૃત્તિઓ પરનો વાર્ષિક અહેવાલ, સુધાર્યા મુજબ, આ અહેવાલના 'જોડાણ-ક' તરીકે આપવામાં આવેલ છે.

વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન, એમસીએએ ૨૩ માર્ચ, ૨૦૨૦ ના રોજ કોવિડ-૧૯ માટે સીએસઆર ભંડોળના ખર્ચ અંગે પરિપત્ર બહાર પાડ્યો હતો. આપની કંપનીએ કોવિડ-૧૯ પ્રવૃત્તિઓના હેતુ માટે નિવારક આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા અને આપતિ વ્યવસ્થાપન સહિત આરોગ્ય સંભાળને પ્રોત્સાહન આપવા સંબંધિત પરિશિષ્ટ-૭ ની અનુક્રમે ૧ અને ૧૨ હેઠળ ગુજરાતનાં મુખ્યમંત્રી રાહત ફંડમાં ₹ ૧૬.૫૦ કરોડનું યોગદાન આપેલ હતું.

ઓડિટ સમિતિ:-

વર્ષ દરમિયાન હિસાબ તપાસણી સમિતિની રચના નીચે મુજબ કરવામાં આવી હતી:-

નિયામકનું નામ	કક્ષા	હોદ્દો
શ્રી સુનિલ તલાટી (૧૫ જુલાઈ, ૨૦૨૦ થી)	સ્વતંત્ર નિયામક	ચેરમેન
શ્રી ભદ્રેશ મહેતા	સ્વતંત્ર નિયામક	સભ્ય
શ્રી પંકજ જોષી, આઈએએસ	વહીવટી સંચાલક	સભ્ય

હિસાબ તપાસણી સમિતિની ભલામણોનો નિયામક મંડળે અસ્વીકાર કર્યાનો કોઈ પ્રસંગ બનેલ નથી.

કંપનીએ કંપનીના તમામ હિતધારકો માટે અન્યાય સામે અવાજ ઉઠાવવાની નીતિ (Whistle Blower Policy) દ્વારા તકેદારી તંત્રની સ્થાપના કરી છે, જે નીતિ મુજબ નિયુક્ત નિયામક / તપાસણી સમિતિના સભ્યના સીધા સંપર્કની પણ જોગવાઈ કરે છે. સદર નીતિ www.gsfss.co.in પર જોઈ શકાય છે.

વ્હિસલ બ્લોઅર પોલિસી, કંપનીના તમામ હિસ્સેદારોને લાગુ થશે, જે હિસ્સેદારોને કંપનીમાં બનતી અનૈતિક વર્તણૂક અને ગેરકાયદેસર વ્યવહાર અને ખોટી વર્તણૂક અંગેની તેમની ચિંતા અને ફરિયાદો રજૂ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે એક તંત્ર પૂરું પાડવાની કોશિશ કરે છે. આ નીતિ શુભ આશયથી જાહેર કરી શકાય એવી અને તપાસમાં સહાય કરતા કોઈપણ હિસ્સાધારક માટે તમામ વ્હિસલ બ્લોઅર્સને જરૂરી સલામતી પૂરી પાડે છે. તે વ્હિસલ બ્લોઅરને વ્યાપક કાર્યક્ષેત્ર અને ભૂમિકા પૂરી પાડે છે અને કઈ રીતે ચિંતા રજૂ કરી શકાય તે પણ પૂરું પાડે છે. વધુમાં, કંપની દ્વારા નીતિમાં જાહેર કરી શકાય એવી તપાસ કરવા, વ્હિસલ બ્લોઅરને રક્ષણ અને અહેવાલ કરવા અને દેખરેખ રાખવાને લગતી જોગવાઈઓ સામેલ છે.

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન કંપની અધિનિયમ, ૨૦૧૩ની કલમ ૧૪૩(૧૨) હેઠળ કંપનીના સ્વતંત્ર ઓડિટર દ્વારા છેતરપિંડીનો કોઈ અહેવાલ મળેલ નથી.

અકસ્થામત જોખમ જવાબદારી સંચાલન (એએલએમ) સમિતિ અને નિયામક મંડળની જોખમ સંચાલન સમિતિ (આરએમસી)

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન, અકસ્થામત જોખમ જવાબદારી સંચાલન (એએલએમ) સમિતિ અને નિયામક મંડળની જોખમ સંચાલન સમિતિની એક બેઠક મળી હતી અને વિવિધ મિલકતોના વર્ગોમાં ભંડોળની ઉપયોગી કામગીરી, થાપણોની કિંમત, લોન પરના વ્યાજ દર, સંપત્તિઓ અને જવાબદારીઓ વગેરેની પરિપક્વતા, રૂપરેખાના સંયોજનની વિગતોની સમીક્ષા કરી હતી અને જાણવા મળ્યું હતું કે કંપની હાલના આરબીઆઈની લિક્વિડિટી જોખમ સંચાલન માળખાગત કાર્યોને ધ્યાનમાં રાખીને ઠીક ઠીક પ્રવાહિતાની સ્થિતિમાં છે અને નિયામક મંડળે ઠરાવેલ માપદંડમાં કાર્યરત છે.

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન, નિયામક મંડળની જોખમ સંચાલન સમિતિએ પણ એક બેઠક કરી હતી અને ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ દ્વારા ગુજરાત સરકારની કંપનીઓની બાકી લોન, માન્ય મ્યુચ્યુઅલ ફંડ્સની લિક્વિડ / ડેબ્ટ યોજનાઓમાં રોકાણ અને અન્ય માર્ગે કરેલા રોકાણની હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી. સમિતિએ જાણવેલ ભંડોળ સાથે સંકળાયેલ જોખમના પાસા, જોખમ નિરીક્ષણ તંત્ર અને રોકાણ કરેલ કામગીરીના ધિરાણ દરની સમીક્ષા કરી હતી. સમિતિએ સ્વીકાર્યું હતું કે જ્યારે અમુક પ્રકારના જોખમો સહજ, અણધાર્યા, પ્રણાલીગત છે અને તેથી ધિરાણ અને રોકાણના વ્યવસાયમાં કોઈ પણ સંસ્થા માટે અગાઉથી મૂલ્યાંકન કરવું અને તેનું અનુમાન કરવું મુશ્કેલ હોય છે, ત્યારે તેણે એ પણ સ્વીકાર્યું હતું કે ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ ધિરાણ કરતી વખતે, તેના અલગ/અનન્ય વ્યવસાયિક આદર્શ મુજબ ફક્ત રાજ્યની સંસ્થાઓના દાયરામાં રહીને નાણાંકીય સંસાધનોના સંચાલન સાથે કામ કરે છે. સમિતિએ નોંધ્યું હતું કે ધિરાણ અને રોકાણો કંપનીની ધિરાણ અને રોકાણ નીતિ મુજબ કરવામાં આવે છે જે ગુજરાત સરકાર દ્વારા માન્ય છે.

જોખમ વ્યવસ્થાપન નીતિ:-

જોખમોનું વ્યવસ્થાપન કરવા માટે નિયામક મંડળે કંપનીના નાણાંકીય કાર્યોની દેખરેખ રાખવા નાણાંકીય કામગીરીની દેખરેખ રાખવા માટે નાણાં સમિતિની રચના કરી છે. આ ઉપરાંત, આપની કંપનીએ જોખમ સંચાલન સમિતિની રચના કરી છે અને આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર મુખ્ય ધિરાણ અધિકારી શ્રી વિપુલ શેઠ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વાઈસ પ્રેસિડન્ટ તરીકે કંપનીમાં કામ કરી રહેલને તા. ૧૧ જુલાઈ, ૨૦૨૧ થી બે વર્ષ માટે નિમણૂક પણ કરી છે. આપની કંપની કંપનીના અલગ/અનન્ય વ્યવસાયિક બાબતને ધ્યાનમાં રાખીને જોખમનું મૂલ્યાંકન કરે છે.

નિયામકોની જવાબદારીનું નિવેદન:-

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના નાણાંકીય પત્રકોના સંદર્ભમાં કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૪(૩) ની બાબતમાં નિયામક મંડળ જણાવે છે કે:-

- અ) વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં હિસાબી ધારાધોરણોનું યોગ્ય સ્પષ્ટીકરણ સાથે પાલન કરવામાં આવ્યું છે. જ્યાં ફેરફાર હોય ત્યાં યોગ્ય સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે;
- બ) નિયામકોએ વાજબી અને તર્કસંગત હોય એવી હિસાબી નીતિઓ પસંદ કરી છે અને તેને સતત લાગુ કરી છે અને યોગ્ય અને વાજબી નિર્ણયો અને અનુમાન કર્યા છે જેથી ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ કંપનીની કામગીરીની વર્તમાન સ્થિતિ અને ૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત વર્ષના નફા અંગે સાચા અને તર્કસંગત દ્રષ્ટિકોણ આપી શકાય;
- ક) કંપનીની સંપત્તિની સુરક્ષા માટે અને છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા અને શોધી કાઢવા માટે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈઓ અનુસાર હિસાબોના રેકર્ડની જાળવણી માટે નિયામકોએ યોગ્ય અને પૂરતી કાળજી લીધી છે; અને
- ડ) નાણાંકીય પત્રકો કંપની વર્ષો સુધી કાર્યરત રહેવાની છે એ રીતે તૈયાર કરવામાં આવી છે.
- ચ) નિયામકોએ ઘડેલા આંતરિક નાણાંકીય નિયંત્રણો કંપની દ્વારા અનુસરવામાં આવે છે અને આવા આંતરિક નાણાંકીય નિયંત્રણો પૂરતા છે અને અસરકારક રીતે ચાલે છે.
- છ) નિયામકોએ કંપનીના વ્યવસ્થાપકો તરફથી સમયાંતરે અહેવાલ આપીને, તમામ લાગુ કાયદાઓની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પ્રણાલીઓ ઘડી કાઢી છે અને નિયમિત કાર્યસૂચિ તરીકે તેમની બેઠકમાં તેની સમીક્ષા કરે છે અને આવી પ્રણાલી પૂરતી અને અસરકારક રીતે કાર્યરત છે.

નાણાંકીય પત્રકોના સંદર્ભમાં આંતરિક નાણાંકીય નિયંત્રણ:-

આપની કંપની પાસે તેના વ્યાપ અને વ્યવસાયના પ્રકાર સાથે પૂરતી આંતરિક આર્થિક નિયંત્રણને અનુરૂપ કાર્યપ્રણાલી છે. આ નિયંત્રણોમાં સારી રીતે વ્યાખ્યાયિત ધોરણસરની સંચાલન કાર્યવાહી, નીતિઓ, માર્ગદર્શિકા, અધિકૃતતા અને મંજૂરી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. કંપનીના હિસાબી રેકર્ડની ચોકસાઈ અને સંપૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે આંતરિક નાણાંકીય નિયંત્રણો, વિશ્વસનીય નાણાંકીય માહિતીની સમયસર તૈયારી કરવી, ભૂલો અટકાવવી, સંપત્તિનું રક્ષણ કરવું અને વ્યવસાયનું વ્યવસ્થિત અને કાર્યક્ષમ કામગીરી હાથ ધરવા માટે પર્યાપ્ત છે.

ઓડિટર્સ અને તેમના અહેવાલો:-

વેદાનિક:

ભારતના નિયંત્રક અને મહાલેખાકારે મેસર્સ મુકેશકુમાર જૈન એન્ડ કું., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અમદાવાદની વર્ષ ૨૦૨૦-૨૧

માટે કંપનીના વેદાનિક ઓડિટર્સ તરીકે નિમણૂક કરી હતી અને તેમનો ઓડિટ અહેવાલ સમાવિષ્ટ છે.

સેક્રેટરીયલ:

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈઓને અનુસરીને, શ્રી અશ્વિન શાહ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી, અમદાવાદ (સી.પી. નંબર. ૧૬૪૦) ની વર્ષ ૨૦૧૬-૧૭ થી કંપનીના સેક્રેટરીયર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સેક્રેટરીયર ઓડિટરનો વર્ષ ૩૧ માર્ચ, ૨૦૨૧ના રોજ પૂરા થતાનો અહેવાલ **પરિશિષ્ટ-ખ** તરીકે નિયત નમૂના એમઆર-૩ માં નિયામક મંડળના અહેવાલ સાથે જોડવામાં આવ્યો છે.

વેદાનિક ઓડિટર દ્વારા તેના અહેવાલમાં અને પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી દ્વારા તેના સેક્રેટરીયલ ઓડિટના અહેવાલમાં કરવામાં આવેલ દરેક ટિપ્પણીઓ, વાંધાઓ અને પ્રતિકૂળ ટીકાઓ અને દાવાઓના જવાબમાં બોર્ડ દ્વારા આપવામાં આવેલ સમજૂતિ કે ટિપ્પણીઓ.

વેદાનિક:

ઓડિટર દ્વારા તેના અહેવાલમાં કોઈ લાયકાત, વાંધાઓ અથવા પ્રતિકૂળ ટિપ્પણી અથવા અસ્વીકરણ સામેલ નથી.

સેક્રેટરીયલ:

નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન, બે સ્વતંત્ર નિયામકોમાંથી એકએ તેની બીજી મુદત ૨૨ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂર્ણ કરી છે. બે કે ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ એ ગુજરાત સરકારની કંપની હોવાથી સ્વતંત્ર નિયામકની નિમણૂક માટે ગુજરાત સરકારનો અભિપ્રાય લેવો જરૂરી હતો. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ ગુજરાત સરકારના અભિપ્રાય માટે દરખાસ્ત કરી હતી. સરકારે ૧૫ જુલાઈ, ૨૦૨૦ ના તેમના પત્ર દ્વારા સ્વતંત્ર નિયામકની નિમણૂકને મંજૂરી આપી હતી અને તે મુજબ કંપનીએ ૧૫ જુલાઈ, ૨૦૨૦ થી સ્વતંત્ર નિયામક તરીકે શ્રી સુનિલ તલાટીની નિમણૂક કરી હતી. તેથી, આપની કંપની, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૭૭ અને ૧૭૮ અને તે નીચે ઘડેલા નિયમોની જરૂરિયાતો મુજબ ત્યાં સુધી ઓડિટ સમિતિ અને નામાંકન અને મહેનતાણા સમિતિની રચના કરી શકી નથી.

કંપનીના નાણાંકીય પત્રકો પર ભારતના નિયંત્રક અને મહાલેખાકારની સામાન્ય ટિપ્પણીઓ:-

કંપનીના નાણાંકીય પત્રકો પર ભારતના નિયંત્રક અને મહાલેખાકારની ૩૧ માર્ચ, ૨૦૨૧ના નાણાંકીય વર્ષ માટે શૂન્ય ટિપ્પણી નિયામક મંડળના અહેવાલમાં **પરિશિષ્ટ-ઘ** તરીકે સામેલ છે.

વાર્ષિક પત્રકો (કલમ ૯૨(૩) અને તે હેઠળ ઘડેલા નિયમો)

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૯૨(૩) અને કંપનીઓ (સંચાલન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૨(૧)

અનુસાર ૩૧ માર્ચ, ૨૦૨૧ નાં રોજ પૂરા થતા નાણાંકીય વર્ષનું વાર્ષિક નિયતપત્રક કંપનીની વેબસાઈટ www.gsfs.co.in. પર ઉપલબ્ધ છે તથા તેના પર જોઈ શકાય છે.

જાહેર થાપણો:-

આપની કંપનીએ જનતા પાસેથી કોઈ પણ થાપણો સ્વીકારેલ નથી. વર્ષના અંતે કોઈ થાપણો ચૂકવાયા વગરની કે દાવો નહીં કરાયેલ રહેતી નથી. તમારી કંપની કોઈ થાપણો સ્વીકારતી નહીં હોવાથી થાપણોની ચૂકવણી કે તેના પર ચૂકવવાનું થતું વ્યાજ જેવા મૂળભૂત પ્રશ્નો ઉદ્ભવતા નથી. કોઈ જ જાહેર થાપણો ન હોવાથી કંપનીના કાયદો, ૨૦૧૩નાં પ્રકરણ-૫ની જરૂરિયાત પ્રમાણે અને તેમાં દર્શાવેલ નિયમો મુજબ પાલન ન થયું હોય તેવું બનેલ નથી.

આપની કંપની પાસે કોઈ પણ દાવો નહીં કરાયેલ ડિવિડન્ડ નથી. વર્ષ દરમિયાન ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (આઈઈપીએફ)માં તબદીલ કરવા માટે કોઈ રકમ બાકી નહોતી.

સંબંધિત પક્ષો સાથે કરાર અથવા પ્રબંધની વિગતો:-

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૮૮ અને તે હેઠળ ઘડેલા નિયમોની જોગવાઈઓ અનુસાર, સંબંધિત પક્ષો સાથે કરાયેલા વ્યવહારો સામાન્ય કામકાજના અને બીજા પક્ષને અસર કર્યા વિના સ્વતંત્ર ભાવોના આધારે છે જેની વિગતો નાણાંકીય પત્રકોના ભાગની નોંધોમાં સામેલ છે. વર્ષ દરમિયાન કલમ ૧૮૮ ના કાર્યક્ષેત્રમાં આવતી કોઈ બાબતે સંબંધિત પક્ષ સાથે વ્યવહારો કર્યા નથી. ઉપરોક્ત કલમ હેઠળ કોઈ નાણાંકીય વ્યવહારો આવતાં નથી, તેથી નમૂનો એઓસી - ૨ માં આપવી પડતી માહિતી જોડેલ નથી.

લોનો, જામીનગીરીઓ અથવા રોકાણોની વિગતો:-

જો કે, તમારી કંપની નોન-ઝેડિંગ ધિરાણ કંપની હોવાથી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૮૬(૧૧) ની જોગવાઈઓ હેઠળ આપવામાં આવેલી લોન, જામીનગીરીઓ અને બાંધકામ અંગેની વિગતોને જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. વળી, આપની કંપની સરકારની કંપની હોવાથી, ૫ જૂન, ૨૦૧૫ થી કોર્પોરેટ ક્ષેત્ર બાબતોના મંત્રાલયના જાહેરનામાથી અપાયેલી મુક્તિને ધ્યાનમાં રાખીને, કલમ ૧૮૬ ને લાગુ પાડવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

કંપની દ્વારા કરવામાં આવેલા રોકાણોના સંદર્ભમાં, આની વિગતો ૩૧ માર્ચ, ૨૦૨૧ ના અંતિત વર્ષ માટે, કંપનીના વાર્ષિક હિસાબોના ભાગરૂપે હોય છે, તેમાં સમાવેશ કરવામાં આવેલ છે.

કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (રોક, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩ હેઠળ જાહેરાત:-

કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (રોક, નિષેધ અને નિવારણ) અધિનિયમ ૨૦૧૩ (“પોશ કાયદો”) અને તેના હેઠળ બનેલા નિયમોની જરૂરિયાતો અનુસાર, કંપનીએ જાતીય

સતામણીની ફરિયાદોને રોકવા અને નિવારણ માટે એક મજબૂત રચના સ્થાપિત કરેલ છે. વર્ષ દરમિયાન કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

ઊર્જા બચત, તકનીકી સમાવેશ, વિદેશી હુંડિયામણની કમાણી અને જાવક:-

કંપની દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓના પ્રકારને ધ્યાનમાં રાખીને, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૪ ને કંપનીઓ (હિસાબો) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૮(૩) ને સાથે વાંચતા અનુક્રમે ઊર્જા બચત અને તકનીકી સમાવેશ કંપનીને લાગુ પડતી નથી. વર્ષ દરમિયાન, કંપનીએ વિદેશી ચલણમાં કોઈ રકમ વાપરી નથી. સમીક્ષા હેઠળના વર્ષમાં કંપનીને કોઈ વિદેશી હુંડિયામણની કમાણી થઈ નથી.

પેટા કંપની, સંયુક્ત સાહસો અને સહયોગી કંપનીઓ:-

આપની કંપનીને કોઈ પેટા કંપની, સંયુક્ત સાહસો અને સહયોગી કંપનીઓ નથી.

વ્યવસ્થાપન સંબંધી મુખ્ય અધિકારીઓ:-

સમીક્ષા હેઠળના વર્ષ દરમિયાન શ્રી અનિલ માલૂએ ૬ ઓક્ટોબર ૨૦૨૦ થી કંપની સચિવ અને પૂર્ણ સમયના ચાવીરૂપ અધિકારીના પદ પરથી રાજીનામું આપ્યું છે અને શ્રી નીરજ જૈનને કંપની સચિવ અને પૂર્ણ સમયના ચાવીરૂપ અધિકારી તરીકે તા. ૭ ઓક્ટોબર, ૨૦૨૦ થી નિયુક્ત કરવામાં આવ્યા છે.

માનવ સંસાધન વ્યવસ્થાપન:-

કંપની તેના માનવ સંસાધનોને તેના સૌથી મૂલ્યવાન અસ્કયામતો માંની એક માને છે અને સતત તેને લગતી નીતી અને પદ્ધતિની ચકાસણી દ્વારા એવું વાતાવરણ ઉભું થાય છે. જેમાં કર્મચારીઓને પ્રોત્સાહન મળે. તેમને તકો મળે અને પોતાની ક્ષમતા પ્રમાણે કામગીરી બજાવી શકે, ભવિષ્યની ધંધાકીય જરૂરિયાત માટે કંપની કર્મચારીઓની નિપુણતા, કાર્યક્ષમતા વધારવાના પ્રયત્નો પણ કરી રહી છે.

કર્મચારીઓના મહેકમ અંગેની નીતિ:-

આપની કંપનીએ કર્મચારીઓના સંબંધિત શ્રેણી મુજબ ગુજરાત સરકારના પગાર ધોરણ (સમય-સમય પર અમલમાં મૂકેલ છે) અપનાવ્યું છે. ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ, આપની કંપનીએ સાતમા પગારપંચ દ્વારા ભલામણ કરેલ અને સંબંધિત સરકારી સંસ્થાઓના કર્મચારીઓ માટે ગુજરાત સરકારે અપનાવ્યા પ્રમાણેનું પગાર ધોરણ છે.

કંપનીઓ (વ્યવસ્થાપકીય કર્મચારીઓની નિમણૂક અને મહેનતાણું) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૫(૨) અને (૩) હેઠળ મહેનતાણું મેળવવાના સંદર્ભમાં શ્રેષ્ઠ દસ કર્મચારીઓના જરૂરી નામો અને અન્ય વિગતો મંડળના અહેવાલમાં જોડેલ છે. જો કે, જોડાણને બાદ કરતાં શેરદારકોને મંડળનો અહેવાલ મોકલવામાં

આવી રહ્યો છે. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૬ ના સંદર્ભમાં, આગામી વાર્ષિક સામાન્ય સભાની તારીખ સુધી કામકાજના દિવસો દરમિયાન રજિસ્ટર્ડ ઓફિસમાં સભ્યો દ્વારા નિરીક્ષણ માટે પરિશિષ્ટ ઉપલબ્ધ છે. સદર પરિશિષ્ટની નકલ મેળવવા રસ ધરાવતા કોઈપણ શેરદારક કંપનીને પત્ર લખી શકે છે. ઉપર કહેલ નિયમોના નિયમ ૫(૨) હેઠળ ઠરાવેલ મર્યાદાથી વધુ વળતર મેળવનાર કોઈ કર્મચારી ન હતો.

ખર્ચ રેકોર્ડસના જાળવણી માટેની આવશ્યકતા:-

કંપની નોન-બેંકિંગ નાણાંકીય કંપની હોવાથી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૮(૧) હેઠળ કેન્દ્ર સરકારે નિર્દિષ્ટ કર્યા મુજબ ખર્ચ રેકોર્ડસ જાળવવાની જરૂર રહેતી નથી.

શેરોનું ઇલેક્ટ્રોનિક રૂપાંતરણ:-

આપની કંપનીએ કેન્દ્રીય ડિપોઝિટરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ પાસેથી આંતરરાષ્ટ્રીય સુરક્ષા ઓળખ નંબર (ISIN: INE02MG01017) મેળવ્યો છે અને તેના રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ દ્વારા શેરના ઇલેક્ટ્રોનિક રૂપાંતરણને સરળ બનાવ્યું છે.

અસાધારણ ફેરફારો અને મુકદમાઓ:-

નાણાંકીય વર્ષના અંતની વચ્ચે નાણાંકીય પત્રકોને લગતી અને અહેવાલની તારીખે કંપનીની નાણાંકીય સ્થિતિને અસર કરતી કોઈ અસાધારણ ફેરફાર થયેલ નથી. કંપનીના કામકાજના સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિયમનકારો / અદાલતો અથવા પંચો દ્વારા ભવિષ્યમાં કંપની અને / અથવા કંપનીના સ્થિતિને અસર કરતો કોઈ નોંધપાત્ર અથવા અસાધારણ હુકમ પસાર કરવામાં આવેલ નથી.

સેક્રેટરીયલ ઘોરણો:-

આપની કંપનીએ અનુક્રમે નિયામક મંડળની બેઠક અને સામાન્ય સભાઓ માટે લાગુ પડતા સેક્રેટરીયલ ઘોરણો એટલે કે એસ.એસ.-૧ અને એસ.એસ.-૨ નું પાલન કર્યું છે.

ભાવિ સંકેતો:-

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીસે આંતરિક શક્તિ અને નિર્ણયાત્મક સંચાલનને કારણે નાણાંકીય સેવા ક્ષેત્રે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે. તમારી કંપની ગુજરાત સરકારની સંસ્થાઓ વધારાના ભંડોળના કાર્યક્ષમ રીતે સંચાલન માટે એજન્સી તરીકે કાર્ય કરવાનું ચાલુ રાખશે.

આભારદર્શન:-

ગુજરાત સરકાર, રાજ્ય સરકાર સંચાલિત સાહસો અને અન્ય સંસ્થાઓ, થાપણદારો, ગ્રાહકો તેમજ કંપનીના બેંકર્સ અને અન્ય તમામ સહયોગીઓ તરફથી પ્રાપ્ત થયેલ સતત સહકારને કારણે કંપનીએ સારી કામગીરી બજાવી છે કંપનીના નિયામકો તેની નોંધ લે છે તથા કંપનીમાં સૌ કોઈએ મૂકેલા વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરે છે. કંપનીના વિકાસમાં દરેક સ્તરે કર્મચારીઓએ આપેલ સક્રિય યોગદાન તથા સહકારની કંપનીના નિયામકો ખાસ નોંધ લે છે.

નિયામક મંડળ તરફથી અને વતી

શ્રી કે. કેલાસનાથન, આઇએએસ

અધ્યક્ષ

(ડીન:૦૦૫૮૭૯૦૧)

સ્થળ: ગાંધીનગર

તારીખ: ૨૨-૦૯-૨૦૨૧

નિયામક મંડળનો અહેવાલ પરિશિષ્ટ-ક

સીએસઆર પ્રવૃત્તિઓ પર વાર્ષિક અહેવાલ

૧. કંપનીની સીએસઆર નીતિ અંગેની સંક્ષિપ્ત રૂપરેખા.

પરિચય

આપની કંપનીએ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૫ અને તે હેઠળ ઘડેલા નિયમોની જોગવાઈઓ અનુસાર અને સીએસઆર સમિતિની ભલામણોના આધારે ૨૧ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજની નિયામક મંડળની બેઠકમાં સીએસઆર નીતિ ઘડી હતી અને તેને મંજૂર કરી હતી. વધુમાં, સુધારેલા નિયમો મુજબ, કંપનીએ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ યોજાયેલી નિયામક મંડળની બેઠકમાં સીએસઆર નીતિમાં તે મુજબ સુધારો કર્યો છે.

રૂચિ ક્ષેત્ર:

આપની કંપની સામાજિક ક્ષેત્રોમાં જે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હોય અને જે માનવ વિકાસ સૂચકાંક (એચડીઆઈ) હેઠળ આવરી લેવામાં આવેલ હોય અને પ્રવૃત્તિઓ અલગ-અલગ વિસ્તારોના લોકોના ભલા માટે થતી હોય તેને મહત્વ આપે છે. આપની કંપની સમાજમાં જ્યાં તેનું કાર્યક્ષેત્ર છે ત્યાં પોતાની સેવાઓથી, આચારથી અને પહેલ દ્વારા મૂલ્ય સર્જન વધારવાના પ્રયાસ કરશે. જેથી સમાજ અને સમુદાય માટે સતત વૃદ્ધિનું પ્રોત્સાહન પૂરું પાડી સામાજિક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે અત્યંત પર્યાવરણીય ચિંતકની ભૂમિકા પૂરી કરી શકાય.

આ સીએસઆર નીતિ સંબંધિત સીએસઆર પ્રવૃત્તિઓ અગ્રતા ધોરણે મહત્વતા વિસ્તારોમાં હાથ ધરવાની દરખાસ્ત પૂરી પાડે છે. આ મહત્વના ધરાવતા વિસ્તારો કંપનીઝ એક્ટ ૨૦૧૩ના પરિશિષ્ટ-૭ની સાથે સુસંગતતા ધરાવે છે અને તેમાં નીચે દર્શાવેલ વિસ્તારોનો સમાવેશ કરેલ છે.

(૧) જાહેર શૌચાલય સહિત નિરોધક સ્વાસ્થ્ય સંભાળ અને સ્વચ્છતા પ્રોત્સાહન.

(૨) નિદાન દ્વારા સ્વાસ્થ્ય સંભાળ

(૩) કુપોષણ અને ઉદ્યોગ સાહસિકતા અને

(૪) આજીવિકા વધારનારા પ્રોજેક્ટ માટે કુશળતા.

(૫) શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવું તથા જુદા જુદા પ્રકારના વિકલાંગ વ્યક્તિઓનો વિશેષ શિક્ષણમાં સમાવેશ થયેલ હોય. (*)

(૬) સિંચાઈને લગતા પ્રોજેક્ટ સહિત ગ્રામ વિકાસના પ્રોજેક્ટ ચેક ડેમનું નિર્માણ અને લિફ્ટ સિંચાઈનું સ્થાપન. (**)

* (તા. ૩૦મી નવેમ્બર, ૨૦૧૭ના નિયામક મંડળની મળેલ ૧૧૯મી બેઠકમાં મંજૂર કરી ઉમેરાયેલ છે.)

** (તા. ૧૬મી માર્ચ, ૨૦૧૯ના નિયામક મંડળની મળેલ ૧૨૫મી બેઠકમાં મંજૂર કરી ઉમેરાયેલ છે.)

ઓળખ, મંજૂરી અને અમલ

આ નીતિમાં સીએસઆર પ્રોજેક્ટોની ઓળખ, ખાસ કરીને મહત્વના વિસ્તારોમાં અને સીએસઆર સમિતિ દ્વારા અંદાજિત ખર્ચ અને અમલના સમયપત્રક સાથે મંજૂરીની જોગવાઈ છે. સીએસઆર વાર્ષિક યોજનાના કુલ ખર્ચને સીએસઆર સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવતા નિયામક મંડળ દ્વારા મંજૂરી આપવામાં આવે છે.

આપની કંપની આ હેતુ માટે મહત્વના વિસ્તારના વિશાળ વર્ગમાં કોઈપણ પ્રોજેક્ટ(ટો) અથવા ગુજરાત સીએસઆર ઓથોરિટી દ્વારા ઓળખવામાં આવેલ અથવા અન્ય અમલીકરણ એજન્સી / એજન્સીઓને સીધો ફાળો આપી શકે છે.

સીએસઆર સમિતિએ સીએસઆર નીતિમાં નિયામક મંડળની દેખરેખ, ફરજો અને જવાબદારીઓની; સીએસઆર પ્રવૃત્તિઓ માટે ભંડોળની ફાળવણીની વિગતો; અને સીએસઆર યોજનાની સામયિક સમીક્ષા / સુધારા-વધારાની યાદી કરવી.

૨. સીએસઆર સમિતિની રચના:

કંપનીની સીએસઆર સમિતિમાં ત્રણ નિયામકો હોય છે, તે પૈકી એક નિયામક સ્વતંત્ર નિયામક હોય છે. ૧૧ નવેમ્બર, ૨૦૧૯ (સમિતિની બેઠકની તારીખ) ની સ્થિતિએ સીએસઆર સમિતિની રચના નીચે મુજબ હતી:

નિયામકનું નામ	હોદ્દો/કક્ષા	વર્ષ દરમિયાન યોજાયેલી CSR સમિતિની બેઠકોની સંખ્યા*	વર્ષ દરમિયાન CSR સમિતિની બેઠકોની હાજરી આપેલ સંખ્યા*
શ્રી પંકજ જોશી, આઈએએસ	ચેરમેન (વહીવટી સંચાલક)	૦	૦
શ્રી મિલિન્દ તોરવણે, આઈએએસ	સભ્ય (નિયુક્ત નિયામક)	૦	૦
શ્રી ભદ્રેશ મહેતા	સભ્ય (સ્વતંત્ર નિયામક)	૦	૦

* રોગચાળાની પરિસ્થિતિ અને સમયના અભાવને કારણે, સીએસઆર સમિતિએ ૧ એપ્રિલ, ૨૦૨૦ ના રોજ પરિપત્ર ઠરાવ પસાર કરીને સીએસઆર યોગદાનની ભલામણ કરી હતી.

૩. સીએસઆર સમિતિની રચના, સીએસઆર નીતિ અને બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ સીએસઆર પ્રોજેક્ટ્સ કંપનીની વેબસાઈટ પર જ્યાં જાહેર કરવામાં આવેલ છે તે વેબ-લીંકની જાણકારી આપો : www.gsfs.co.in
૪. કંપની (કંપની ક્ષેત્ર સામાજિક જવાબદારી નીતિ) નિયમો ૨૦૧૪ ના નિયમ ૮ ના પેટા નિયમ (૩)ના અનુસંધાનમાં કરવામાં આવેલ સીએસઆર પ્રોજેક્ટ્સની મૂલ્ય-આંકણીની અસરની વિગતો પ્રદાન કરો. જો લાગુ હોય તો (અહેવાલ ખેડો); સમીક્ષા હેઠળના નાણાંકીય વર્ષ માટે લાગુ પડતું નથી.
૫. કંપની (કંપની ક્ષેત્ર સામાજિક જવાબદારી નીતિ) નિયમો ૨૦૧૪ ના નિયમ ૭ ના પેટા નિયમ (૩) ને અનુસરીને સેટ ઓફ માટે ઉપલબ્ધ રકમની વિગતો અને નાણાંકીય વર્ષ માટે સેટ-ઓફ માટે જરૂરી રકમ, જો કોઈ હોય તો

અનુક્રમ નં.	નાણાંકીય વર્ષ	અગાઉના નાણાંકીય વર્ષથી સેટ-ઓફ માટે ઉપલબ્ધ રકમ	નાણાંકીય વર્ષ માટે સેટ-ઓફ કરવાની આવશ્યક રકમ, જો કોઈ હોય તો
શૂન્ય			

૬. કલમ ૧૩૫(૫) મુજબ કંપનીનો સરેરાશ ચોખ્ખો નફો : ₹ ૨૮૮,૨૬,૪૭,૩૯૧.૮૧
૭. (અ) કલમ ૧૩૫(૫) મુજબ કંપનીના સરેરાશ ચોખ્ખા નફાના ૨% : ₹ ૫,૭૬,૫૨,૯૪૮.૦૦
(બ) અગાઉના નાણાંકીય વર્ષના સીએસઆર પ્રોજેક્ટ્સ અથવા પ્રોગ્રામ્સ અથવા પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતી ફાજલ રકમ : શૂન્ય
(ક) નાણાંકીય વર્ષ માટે સેટ-ઓફ કરવાની આવશ્યક રકમ, જો કોઈ હોય તો : શૂન્ય
(ડ) નાણાંકીય વર્ષમાં કુલ સીએસઆર જવાબદારી (૭અ + ૭બ - ૭ક) : ₹ ૫,૭૬,૫૨,૯૪૮.૦૦
૮. (અ) નાણાંકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલ અથવા બિનખર્ચિત સીએસઆર રકમ :

નાણાંકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલ કુલ રકમ (₹ માં)	બિનખર્ચિત રકમ (₹ માં)	
	કલમ ૧૩૫(૬) મુજબ બિનખર્ચિત સીએસઆર ખાતામાં તબદીલ કરાયેલ કુલ રકમ	કલમ ૧૩૫(૫) ની અન્ય જોગવાઈ મુજબ પરિશિષ્ટ-૭ હેઠળ ઉલ્લેખિત કોઈ પણ ભંડોળમાં તબદીલ કરેલ રકમ
₹ ૧૬,૫૦,૦૦,૦૦૦	શૂન્ય	

(બ) નાણાંકીય વર્ષ માટે પ્રવર્તમાન પ્રોજેક્ટસ સામે ખર્ચવામાં આવેલી સીએસઆર રકમની વિગતો :

૧	૨	૩	૪	૫		૬	૭	૮	૯	૧૦	૧૧	
અનુ. નં.	પ્રોજેક્ટનું નામ	અધિનિયમના પરિશિષ્ટ-૭ની પ્રવૃત્તિ અંગેની સૂચિમાંથી આઈટમ	સ્થાનિક વિસ્તાર (હા/ના)	પ્રોજેક્ટનું સ્થાન		પ્રોજેક્ટ સમયગાળો	પ્રોજેક્ટ માટે ફાળવેલ રકમ (₹ માં)	વર્તમાન નાણાંકીય વર્ષમાં ખર્ચ કરેલ રકમ (₹ માં)	કલમ ૧૩૫(૬) મુજબ પ્રોજેક્ટ માટે બિનખર્ચિત સીએસઆર ખાતામાં તબદીલ કરવામાં આવેલ રકમ	અમલીકરણની રીત પ્રત્યક્ષ (હા/ના)	અમલીકરણની પદ્ધતિ અમલીકરણ એજન્સી દ્વારા	
				રાજ્ય	જિલ્લો						નામ	સીએસ આર રજીસ્ટ્રેશન નંબર
શૂન્ય												

(ક) નાણાંકીય વર્ષ માટે પ્રવર્તમાન પ્રોજેક્ટસ સિવાયના અન્ય ખર્ચમાં સીએસઆર રકમની વિગતો :

૧	૨	૩	૪	૫		૬	૭	૮	
અનુ. નં.	પ્રોજેક્ટનું નામ	અધિનિયમના પરિશિષ્ટ-૭ની પ્રવૃત્તિ અંગેની સૂચિમાંથી આઈટમ	સ્થાનિક વિસ્તાર (હા/ના)	પ્રોજેક્ટનું સ્થાન		પ્રોજેક્ટ માટે ખર્ચવામાં આવેલ રકમ (₹ માં)	અમલીકરણની રીત પ્રત્યક્ષ (હા/ના)	અમલીકરણની પદ્ધતિ અમલીકરણ એજન્સી દ્વારા	
				રાજ્ય	જિલ્લો			નામ	સીએસ આર રજીસ્ટ્રેશન નંબર
૧	મુખ્યમંત્રી રાહત નિધિ, ગુજરાત	નિવારક આરોગ્ય સંભાળ, સ્વચ્છતા અને આપત્તિ વ્યવસ્થાપન સહિત આરોગ્ય સંભાળનો પ્રચાર	હા	ગુજરાત	-	₹ ૧૬,૫૦,૦૦,૦૦૦	ના	મુખ્યમંત્રી રાહત નિધિ	-

(ડ) વહીવટી ઓવરહેડ્સમાં ખર્ચવામાં આવેલી રકમ : શૂન્ય

(છ) મૂલ્ય આંકણીની અસર પર ખર્ચવામાં આવેલી રકમ, જે લાગુ હોય તો : લાગુ પડતું નથી.

(જ) નાણાંકીય વર્ષ માટે ખર્ચ કરવામાં આવેલ કુલ રકમ - ₹ ૧૬,૫૦,૦૦,૦૦૦ (૮૫+૮૬+૮૭+૮૮)

(ઝ) સેટ ઓફ માટે વધારાની રકમ, જે કોઈ હોય તો : ₹ ૧૦,૭૩,૪૭,૦૫૨.૦૦

અનુ. નં.	વિગતો	રકમ (₹ માં)
૧.	કલમ ૧૩૫(૫) મુજબ કંપનીના સરેરાશ ચોખ્ખા નફાના બે ટકા	૫,૭૬,૫૨,૯૪૮.૦૦
૨.	નાણાંકીય વર્ષમાં ખર્ચ કરેલ કુલ રકમ	૧૬,૫૦,૦૦,૦૦૦.૦૦
૩.	નાણાંકીય વર્ષ માટે ખર્ચવામાં આવેલ વધારાની રકમ (૨-૧)	૧૦,૭૩,૪૭,૦૫૨.૦૦
૪.	સીએસઆર પ્રોજેક્ટસ અથવા પ્રોગ્રામ્સમાંથી અથવા પાછલા નાણાંકીય વર્ષોની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતી ફાજલ રકમ, જે કોઈ હોય તો	-
૫.	અનુગામી નાણાંકીય વર્ષમાં સેટ ઓફ માટે ઉપલબ્ધ રકમ (૩-૪)	૧૦,૭૩,૪૭,૦૫૨.૦૦

૯. (અ) અગાઉના ત્રણ નાણાંકીય વર્ષ માટે બિનખર્ચિત સીએસઆર રકમની વિગતો :

અનુ. નં.	અગાઉના નાણાંકીય વર્ષ	કલમ ૧૩૫(૬) હેઠળ બિનખર્ચિત સીએસઆર ખાતામાં તબદીલ કરેલ રકમ (₹ માં)	અહેવાલના નાણાંકીય વર્ષમાં ખર્ચવામાં આવેલી રકમ (₹ માં)	કલમ ૧૩૫(૬) મુજબ પરિશિષ્ટ-૭ હેઠળ ઉલ્લેખિત કોઈપણ ફંડમાં તબદીલ કરેલ રકમ, જે કોઈ હોય તો			અનુગામી નાણાંકીય વર્ષોમાં ખર્ચ કરવાની બાકી રકમ (₹ માં)
				ફંડનું નામ	રકમ (₹ માં)	તબદીલની તારીખ	
શૂન્ય							

(બ) અગાઉનાં નાણાંકીય વર્ષ (વર્ષો)ના પ્રવર્તમાન પ્રોજેક્ટસ માટે નાણાંકીય વર્ષમાં ખર્ચવામાં આવેલ સીએસઆર રકમની વિગતો :

અનુ. નં.	પ્રોજેક્ટ આઈડી	પ્રોજેક્ટનું નામ	નાણાંકીય વર્ષ કે જેમાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હોય	પ્રોજેક્ટનો સમયગાળો	પ્રોજેક્ટ માટે ફાળવેલ કુલ રકમ (₹ માં)	અહેવાલના નાણાંકીય વર્ષમાં પ્રોજેક્ટ પર ખર્ચવામાં આવેલી રકમ (₹ માં)	અહેવાલના નાણાંકીય વર્ષના અંતે ખર્ચવામાં આવેલી સંચિત રકમ (₹ માં)	પ્રોજેક્ટની સ્થિતિ પૂર્ણ પ્રવર્તમાન
				શૂન્ય				

૧૦. નાણાંકીય વર્ષમાં ખર્ચવામાં આવેલ સીએસઆર દ્વારા મૂડી અસ્ક્યામતના સર્જન અથવા સંપાદનના કિસ્સાની રીતે બનાવેલ અથવા હસ્તગત કરવામાં આવેલી સંપત્તિને લગતી વિગતો આપો (સંપત્તિ મુજબની વિગતો) :

(અ) મૂડી અસ્ક્યામતો (ઓ)ના નિર્માણ અથવા સંપાદનની તારીખ : લાગુ પડતું નથી

(બ) મૂડી સંપત્તિના નિર્માણ અથવા સંપાદન માટે ખર્ચવામાં આવેલ સીએસઆરની રકમ : લાગુ પડતું નથી

(ક) એકમ અથવા જાહેર તંત્ર અથવા લાભાર્થીની વિગતો જેમના નામ હેઠળ આવી મૂડી સંપત્તિ નોંધાયેલ છે, તેમનું સરનામું વગેરે : લાગુ પડતું નથી

(ડ) બનાવેલ અથવા હસ્તગત કરેલી મૂડી સંપત્તિ (સંપૂર્ણ સરનામું અને મૂડી સંપત્તિના સ્થાન સહિત)ની વિગતો પ્રદાન કરો : લાગુ પડતું નથી

૧૧. જે કંપની કલમ ૧૩૫(૫) મુજબ સરેરાશ ચોખ્ખા નફાના બે ટકા ખર્ચ કરવામાં નિષ્ફળ ગઈ હોય તો તેનું કારણ સ્પષ્ટ કરો : લાગુ પડતું નથી

સ્થળ: ગાંધીનગર
તારીખ: ૨૨.૦૯.૨૦૨૧

સહી/-
મિલિન્દ તોરવણે
નિયામક
(ડીન: ૦૩૬૩૨૩૯૪)

સહી/-
પંકજ જોષી
અધ્યક્ષ - સીએસઆર સમિતિ
(ડીન: ૦૧૫૩૨૮૯૨)

નિયામક મંડળનો અહેવાલ પરિશિષ્ટ-ખ

સેક્ટરીયલ ઓડિટ અહેવાલ

ફોર્મ નં. - એમઆર-૩

૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત નાણાંકીય વર્ષ માટે

કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૨૦૪(૧) અને કંપનીઓ (વ્યવસ્થાપકીય કર્મચારીઓની નિમણૂક અને મહેનતાણું) ના નિયમો, ૨૦૧૪ ના નિયમ ૯ ને અનુરૂપ

પ્રતિ,

માન. સભ્યશ્રીઓ

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (હવે પછી 'કંપની' તરીકે ઓળખવામાં આવશે) દ્વારા સારા કોર્પોરેટ વ્યવહારનું અને લાગુ પડેલ કાનૂની જોગવાઈઓનું પાલન યોગ્ય રીતે થાય છે કે નહિ તે અમોએ સેક્ટરીયલ ઓડિટ મારફત હાથ ધરેલ છે. સેક્ટરીયલ ઓડિટ-એ રીતે હાથ ધરવામાં આવેલ છે કે જેનાથી કોર્પોરેટની કાર્યપ્રણાલી/વૈધાનિક ચકાસણીનું તેના પર જરૂરી મૂલ્યાંકન કરી અમારા અભિપ્રાય વ્યક્ત કરવા માટે જરૂરી વાજબી આધાર પૂરો પાડી શકાય છે.

અમોએ કરેલ ચકાસણી દરમિયાન ચોપડાઓ, કાગળો, મિનિટ બુક, ફોર્મ અને રીટર્ન નોંધણી અને અન્ય રેકોર્ડ કંપની દ્વારા જાળવવામાં આવેલ છે. કંપની તેના અધિકારીઓ, એજન્ટો અને અધિકૃત પ્રતિનિધિઓ દ્વારા સેક્ટરીયલ ઓડિટ દરમિયાન અમોને પૂરી પાડેલ માહિતી મુજબ કંપનીએ ૩૧ માર્ચ, ૨૦૨૧નાં રોજ પૂરા થતા નાણાંકીય વર્ષના ઓડિટ સમયગાળામાં નીચે દર્શાવેલ યાદી મુજબ વૈધાનિક જોગવાઈઓનું પાલન કરેલ છે તથા કંપની પાસે યોગ્ય નિયામક મંડળ પ્રક્રિયાઓ અને પાલન પદ્ધતિ, જરૂરી છે તેટલે અંશે અને રિપોર્ટિંગ હવે પછી બતાવ્યા પ્રમાણે હાથ ધરવામાં આવે છે.

૩૧ માર્ચ, ૨૦૨૧નાં રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ માટે અમોએ ચોપડાઓ, કાગળો, મિનિટ બુક, ફોર્મ અને નોંધાયેલ રીટર્ન અને નીચે દર્શાવેલ જોગવાઈઓ અનુસાર અન્ય રેકોર્ડ્સ કંપની દ્વારા જાળવવામાં આવતા હોય તેનું અમોએ તપાસણી કરેલ છે.

૧) કંપનીઝ એક્ટ, ૨૦૧૩ (કાયદો) અને તે હેઠળ ઘડવામાં આવેલ નિયમો

૨) કાયદો જે ખાસ કરીને કંપનીને લાગુ પડે છે તે નીચે મુજબનો છે :

અ. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૪

નીચે જણાવ્યા મુજબ લાગુ પડતી જોગવાઈઓ સાથે પાલન થાય છે કે નહીં તેની પણ અમોએ તપાસ કરેલ છે :

૧) ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપનીઝ સેક્ટરી ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પડાયેલ સેક્ટરીયલ ધોરણો : (સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન સૂચિત થયેલ ન હોવાથી લાગુ પડતા નથી)

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ઉપર ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે કંપનીએ એક્ટ, નિયમો, વિનિયમો, માર્ગદર્શિકાઓ, ધોરણો વગેરેની જોગવાઈઓનું પાલન કર્યું છે.

કંપનીઓના નિયમો, ૨૦૧૪ હેઠળ મુકરર થયેલ ફોર્મ નં. એમઆર-૩માં દર્શાવ્યા પ્રમાણે કંપની માટે અન્ય નિયમન જોગવાઈના પાલન માટે જરૂરી નહતા. કારણ કે નાણાંકીય વર્ષ દરમિયાન કોઈ કિસ્સાઓ/ઘટનાઓ આ નિયમનોના કાર્યક્ષેત્રને અસર કરતા નથી.

અમો વધુમાં અહેવાલ આપીએ છીએ કે,

ઓડિટના સમયગાળા દરમિયાન, કંપનીના નિયામક મંડળની સંરચનામાં કંપની ધારાની કલમ ૧૪૯નું પાલન કરવામાં આવેલ ન હતું. તેથી કંપની ધારાની કલમ ૧૭૭ અને ૧૭૮ હેઠળ સૂચવેલ જોગવાઈઓનું પાલન કરવા માટે કંપની વિવિધ સમિતિઓની રચના કરી શકી નથી.

સુનિશ્ચિત થયેલ નિયામક મંડળની બેઠકો, કાર્યસૂચિ અને વિગતવાર થયેલ કાર્યસૂચિ પર નોંધો સાત દિવસ અગાઉથી સામાન્યપણે મોકલવામાં આવેલ હતા. આ અંગેની પર્યાપ્ત સૂચનાઓ તમામ નિયામકોને આપવામાં આવેલ છે. બેઠક પહેલા અને બેઠકમાં અર્થપૂર્ણ ભાગીદારી માટે વધુ માહિતી અને કાર્યસૂચિ બાબતે સ્પષ્ટીકરણ મેળવવા માટેની પદ્ધતિ અસ્તિત્વમાં છે.

નિર્ણયો બહુમતિ મારફતે કરવામાં આવે છે. અને તેને મિનિટના ભાગ તરીકે નોંધવામાં આવે છે.

અમો વધુમાં અહેવાલ આપીએ છીએ કે કંપનીમાં પર્યાપ્ત પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ છે જે કંપનીના ક્રદ અને કામગીરીને અનુરૂપ છે અને જેનાથી લાગુ પડેલ કાયદાઓ, નિયમો, વિનિયમો અને માર્ગદર્શિકા સાથે પાલન થઈ શકે તે રીતે દેખરેખ રાખી શકાય છે.

સ્થળ: અમદાવાદ

તારીખ: ૨૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૧

યુડીઆઈએન : એફ૦૦૧૬૪૦સી૦૦૦૯૯૦૧૨૨

સહી/-

સીએસ અશ્વિન શાહ

કંપની સચિવ C.P. No. 1640

નોંધ: આ અહેવાલ અમારા સમાન તારીખના પત્ર સાથે વાંચવાનો છે જે "પરિશિષ્ટ-ખ-૧" તરીકે જોડેલ છે અને આ અહેવાલનો અભિન્ન ભાગ બનાવે છે.

પરિશિષ્ટ-ખ-૧
હિસાબ તપાસણી સેક્રેટરીયલ અહેવાલ

પ્રતિ,

માન. સભ્યશ્રીઓ

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ

અમારો આજ તારીખનો અહેવાલ આ પત્ર સાથે રાખીને વાંચી શકાય છે :

૧. સેક્રેટરીયલ રેકોર્ડની જાળવણી એ કંપનીના સંચાલકોની જવાબદારી છે અમારી જવાબદારી સેક્રેટરીયલ રેકોર્ડના આધારે અમોએ કરેલ ઓડિટ પર અભિપ્રાય વ્યક્ત કરવાની છે.
૨. અમોએ ઓડિટમાં સમાવિષ્ટ સેક્રેટરીયલ રેકોર્ડની ચોકસાઈ અંગે વાજબી ખાતરી મેળવવા યોગ્ય પદ્ધતિઓ અને પ્રક્રિયાઓને અનુસરેલ છે યોગ્ય તથ્યો પ્રતિબિંબિત થાય છે કે નહિ તેની ખાતરી કરવા માટે સેક્રેટરીયલ રેકોર્ડની ચકાસણી ટેસ્ટ આધારિત કરવામાં આવેલ છે.
૩. અમોએ કંપનીના હિસાબો અને નાણાંકીય રેકોર્ડની યોગ્યતા તથા ખરાઈની ચકાસણી કરેલ નથી.
૪. જ્યાં જરૂર પડે ત્યાં અમોએ કાયદા, નિયમો અને નિયમોના પાલન તથા બની રહેલ ઘટનાઓ વિશે વ્યવસ્થાપક તંત્રની રજૂઆતો મેળવી છે.
૫. કોર્પોરેટ અને અન્ય લાગુ પડેલ કાયદાઓ, નિયમો, વિનિયમો, ઘોરણો વગેરેની જોગવાઈઓનું પાલન કરાવવું એ સંચાલકોની જવાબદારી છે અમારી તપાસણી એ કાર્યવાહીની ટેસ્ટ ઘોરણે કરેલ ચકાસણી સુધી સિમિત હતી.
૬. સેક્રેટરીયલ ઓડિટ અહેવાલ ન તો કંપનીના ભાવિ અસ્તિત્વની ખાતરી આપે છે કે ન તો સંચાલકો અસરકારકતા કે પ્રભાવશાળી રીતે કંપનીની બાબતોને હાથ પર ધરી શકે છે.

સહી/-

સ્થળ: અમદાવાદ

તારીખ: ૨૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૧

યુડીઆઈએન : એફ૦૦૧૬૪૦સી૦૦૦૯૯૦૧૨૨

સીએસ અશ્વિન શાહ

કંપની સચિવ C.P. No. 1640

પરિશિષ્ટ-ઘ
નિયંત્રક અને મહાલેખાકારનો અહેવાલ

ભારતના નિયંત્રક અને મહાલેખાકારની ૩૧ માર્ચ, ૨૦૨૧ અંતિત વર્ષ માટે ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિ. ના નાણાંકીય પત્રકો ઉપર કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૬)(બી) હેઠળ ટિપ્પણી

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના ૩૧ માર્ચ, ૨૦૨૧નાં રોજ પૂરા થતા વર્ષના તૈયાર થયેલ નાણાંકીય પત્રકો કંપનીદ્વારા ૨૦૧૩ નીચે સ્વીકૃત પામેલ માળખાકીય નાણાંકીય અભિપ્રાય એ કંપનીના સંચાલકોની જવાબદારી છે. કલમ ૧૩૯(૫) હેઠળ ભારત સરકારના કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા નિમણૂંક પામેલ વૈધાનિક ઓડિટરની કલમ ૧૪૩ નીચે નાણાંકીય પત્રકો પર અભિપ્રાય વ્યક્ત કરવાની જવાબદારી છે અને આ અભિપ્રાય તેમના સ્વતંત્ર રીતે કરેલા ઓડિટ તથા કાયદાની કલમ ૧૪૩(૧૦) હેઠળ દર્શાવેલ ઓડિટીંગ સ્ટાન્ડર્ડ મુજબ આધારિત હોવો જોઈએ. આ પ્રમાણે તેઓ દ્વારા કરવામાં આવે છે તે તેમના ઓડિટ અહેવાલ ૨૨ જૂન, ૨૦૨૧માં જણાવેલ છે.

ભારત સરકારનાં કોમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ વતી અમોએ કંપની ધારાની કલમ ૧૪૩(૬)(એ) હેઠળ ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડનાં ૩૧ માર્ચ, ૨૦૨૧નાં રોજ પૂરા થતા વર્ષના નાણાંકીય પત્રકોનું પૂરવણી ઓડિટ કરેલ હતું. આ પૂરવણી ઓડિટ સ્વતંત્ર રીતે કરેલ હતું અને જેમાં વૈધાનિક ઓડિટરના કાર્યવાહી કાગળોનો ઉપયોગ કરેલ ન હતો અને કંપનીના કર્મચારીઓ તથા નામાનાં રેકોર્ડમાંથી થોડા ઘણાની પ્રાયોગિક ઘોરણે ચકાસણી કરેલ છે.

મારા પૂરક ઓડિટના આધારે, હું કંપની ધારાની કલમ ૧૪૩(૬)(બી) અંતર્ગત વૈધાનિક ઓડિટરનો અહેવાલ અંગે કે એની પૂરવણી અંગે કોઈપણ પ્રકારની નોંધપાત્ર ટીપ્પણીઓ અમારા ધ્યાનમાં આવેલ નથી.

સ્થળ: અમદાવાદ

તારીખ: ૨૩-૦૮-૨૦૨૧

ભારતના નિયંત્રક અને મહાલેખાકાર વતી

(એચ. કે. ધર્મદર્શી)

પ્રિન્સીપાલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ-૨), ગુજરાત

સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ

ગુજરાત રાજ્ય નાણાંકીય સેવા લિમિટેડના સભ્યો તરફ
ભારતીય હિસાબી ધોરણો મુજબના નાણાંકીય પત્રકો પરનો ઓડિટ અહેવાલ

અભિપ્રાય

અમોએ ૩૧ માર્ચ, ૨૦૨૧ ના અંતિત વર્ષના ગુજરાત રાજ્ય નાણાંકીય સેવા લિમિટેડના (કંપની) સ્વતંત્ર નાણાંકીય પત્રકો, સ્વતંત્ર સરવૈયા અંતર્ગત અને નફા અને નુકસાનના (અન્ય સમગ્ર આવક સહિત) સ્વતંત્ર પત્રકો, ઇક્વિટી ફેરફારના સ્વતંત્ર પત્રકો અને રોકડ પ્રવાહના સ્વતંત્ર પત્રકો અને નાણાંકીય પત્રકો પરની સ્વતંત્ર નોંધો, નોંધપાત્ર હિસાબી નીતિઓ અને બીજી સ્પષ્ટીકરણ માહિતી (અહીં હવે પછી “સ્વતંત્ર નાણાંકીય પત્રકો” કહેવાશે) સહિત સ્વતંત્ર તપાસણી કરી છે.

અમારા અભિપ્રાય અને શ્રેષ્ઠ જાણકારી અને અમોને આપવામાં આવેલ સ્પષ્ટીકરણ મુજબ ઉપરોક્ત સ્વતંત્ર નાણાંકીય પત્રકો કંપની અધિનિયમ, ૨૦૧૩ (અધિનિયમ) ની આવશ્યતા મુજબ ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી નીતિઓ અનુરૂપ અને તે તારીખે પૂરા થતા વર્ષનો નફો અને બીજી સમગ્ર આવક, ઇક્વિટીમાં ફેરફાર અને તેના રોકડ પ્રવાહની સાચી અને સ્પષ્ટ માહિતી આપે છે.

અભિપ્રાયનો આધાર

અમે કંપનીઓ અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૧૦) હેઠળ ઠરાવેલ તપાસણીના ધોરણો અનુસાર અમોએ તપાસણી કરી હતી. આ ધોરણો હેઠળ અમારી જવાબદારીઓ અમારા અહેવાલના ભારતીય હિસાબી ધોરણના નાણાંકીય પત્રકોના ભાગની તપાસણી માટેની તપાસણીદારની જવાબદારીઓ આગળ વર્ણવવામાં આવી છે. અમે ભારતીય ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે બહાર પાડેલ આચાર સંહિતા અનુસાર કંપનીથી સ્વતંત્ર છીએ અને અધિનિયમ અને તે હેઠળ ઘડેલા નિયમો હેઠળની જોગવાઈઓ અનુસાર ભારતીય હિસાબી ધોરણો નાણાંકીય પત્રકોના અમારી તપાસણીને સંબંધિત નૈતિક જરૂરિયાતો સાથે, અને અમે આ જરૂરિયાતો અને આચાર સંહિતા અનુસાર અમારી અન્ય નૈતિક જવાબદારીઓ પૂરી કરી છે. અમે માનીએ છીએ કે અમને મળેલા તપાસણી પુરાવા અમારા અભિપ્રાય માટે આધાર પૂરો પાડવા માટે પૂરતા અને યોગ્ય છે.

ભાર મૂકવા જેવી બાબત

અમારા નિષ્પક્ષ તપાસણી અહેવાલને મર્યાદિત કર્યા વિના -

૧. અમે ભારતીય હિસાબી ધોરણના નાણાંકીય પત્રકોની નોંધ નંબર ૪૧ માં લીપ વર્ષના કિસ્સામાં થાપણ અને લોન પર વ્યાજની ગણતરી માટે કંપનીના જુદા દૃષ્ટિબિંદુ તરફ ધ્યાન દોરીએ છીએ. વ્યાજની ગણતરી માટે થાપણ પર કંપનીએ ૩૬૫ દિવસને આધાર તરીકે લેવાની નીતિ હતી અને લોનના હેતુ માટે કંપનીએ આધાર તરીકે ૩૬૬ લીધા હતા. વર્ષ દરમિયાન કંપનીએ આગામી લીપ વર્ષથી એક સમાન નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. આધારનું તુલનાત્મક કોષ્ટક નીચે આપેલ છે. આ સંદર્ભમાં અમે અભિપ્રાય બદલ્યો નથી.

(₹ કરોડમાં)

બાબતો	કંપનીના હિસાબો પ્રમાણે	જુદા જુદા આધાર પર વ્યાજની ગણતરી		
		૩૬૬ દિવસ પ્રમાણે	૩૬૫ દિવસ પ્રમાણે	તફાવત
થાપણ પર વ્યાજ (આઈસીડી અને એલડીએસ)	૨૦૪૧.૮૩	૨૦૩૬.૩૫	૨૦૪૧.૮૩	૫.૫૮
લોન પર મળતું વ્યાજ	૬૬૭.૮૮	૬૬૭.૮૮	૬૬૬.૦૭	૧.૮૨

૨. અમે ભારતીય હિસાબી ધોરણના નાણાંકીય પત્રકોની નોંધ નંબર ૩૮ પર કંપનીને બે સ્વતંત્ર નિયામકો હોવાને બદલે ૦૧-૦૪-૨૦૨૦ થી ૧૫-૦૭-૨૦૨૦ ના સમયગાળા દરમિયાન માત્ર એક જ સ્વતંત્ર નિયામક છે તે ધ્યાન ખેંચીએ છીએ. જો કે, કંપનીએ ૧૫-૦૭-૨૦૨૦ ના રોજ બીજા સ્વતંત્ર નિયામકની નિમણૂક કરી છે.

૩. અમે ભારતીય હિસાબી ધોરણના નાણાંકીય પત્રકોની નોંધ નંબર ૭ અને ૨૮.૩ ના સંદર્ભમાં દર્શાવેલ અને દર્શાવ્યા વગરના ઇક્વિટી શેરના મૂલ્યાંકન તરફ ધ્યાન ખેંચીએ છીએ. આ સંદર્ભમાં અમે અભિપ્રાય બદલ્યો નથી.

અન્ય માહિતી

કંપનીના વ્યવસ્થાપકો અને નિયામક મંડળ અન્ય માહિતી માટે જવાબદાર છે. અન્ય માહિતીમાં કંપનીના વાર્ષિક અહેવાલમાં સમાવિષ્ટ માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ તેમાં ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકોની અને તેના પર અમારા તપાસણીદારના અહેવાલનો સમાવેશ થતો નથી.

ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકો પર અમારો અભિપ્રાય અન્ય માહિતીને આવરી લેતો નથી અને અમે તેના પર કોઈ પણ પ્રકારના તથ્યાત્મક નિષ્કર્ષને વ્યક્ત કરતા નથી.

નાણાકીય પત્રકોની અમારી તપાસણી સંદર્ભે, અમારી જવાબદારી અન્ય માહિતી વાંચવાની છે, અને આમ કરતા, અન્ય માહિતી નાણાકીય પત્રકો સાથે વાસ્તવિક રીતે અસંગત અથવા અમારી તપાસણીમાં મેળવેલી જાણકારી અથવા અન્યથા વાસ્તવિક રીતે ખોટી રજૂઆત છે કે કેમ તેનો વિચાર કરવાનો છે. જો, અમે બજાવેલા કામના આધારે, અમે નિર્ણય કરીએ કે તેમાં આ બીજી માહિતીની વાસ્તવિક ગેરરજૂઆત છે તો, અમારે આ હકિકતને અહેવાલમાં કરવી જોઈએ. અમારે આ બાબતમાં કોઈ જણાવવા જેવું નથી.

ભારતીય હિસાબી પત્રકોનો અમલ કરાવે છે તેઓની અને સંચાલકોની જવાબદારી

ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકો માટે કામગીરી સંભાળતા વ્યવસ્થાપક અને શાસકોની જવાબદારી છે. કંપનીના વ્યવસ્થાપક અને નિયામક મંડળ અધિનિયમની કલમ ૧૩૪(૫) માં જણાવેલ બાબતો માટે અધિનિયમની કલમ ૧૩૩ હેઠળ ઠરાવેલ ભારતીય હિસાબી ધોરણો સહિત ભારતમાં સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી નીતિને અનુરૂપ કંપનીની વર્તમાન સ્થિતિ, નફો અને અન્ય સમગ્ર આવક, ઇક્વિટીમાં ફેરફાર કંપનીના રોકડ પ્રવાહની સાચી અને વાજબી રીતે આપતા વાસ્તવિક સ્વતંત્ર નાણાકીય પત્રકો તૈયાર કરવા સંદર્ભે જવાબદાર છે. આ જવાબદારીમાં કંપનીની મિલકતના સંરક્ષણ અને છેતરપિંડી અને બીજી અનિયમિતતાઓ અટકાવવા; સુસંગત હિસાબી પદ્ધતિઓની પસંદગી અને અમલ કરવા, વાજબી અને તર્કસંગત હોય એવા નિર્ણયો અને અંદાજો કરવા; અને સાચા અને વાજબી દૃષ્ટિકોણ આપતા અને કાં તો ઉચાપત અથવા ભૂલને કારણે વાસ્તવિક ગેરરજૂઆતથી મુક્ત સ્વતંત્ર નાણાકીય પત્રકો તૈયાર કરવા અને રજૂ કરવાને અનુરૂપ હિસાબી દફતરોની ચોક્કસાઈ અને સર્વાંગપૂર્ણતાની ખાતરી માટે કાર્યક્ષમ રીતે કામ કરે એવા પૂરતા આંતરિક નાણાકીય નિયંત્રણો ઘડવા, અમલ કરવો અને જાળવવા માટે અધિનિયમની જોગવાઈઓ અનુસાર પૂરતું હિસાબી દફતર નિભાવવાનો પણ સમાવેશ થાય છે.

સ્વતંત્ર નાણાકીય પત્રકો તૈયાર કરવામાં વ્યવસ્થાપક અને નિયામક મંડળ વર્તમાન સ્થિતિમાં ચાલુ રહેવા, વર્તમાન સ્થિતિને સંબંધિત લાગુ પડતી બાબતો જાહેર કરવા અને હિસાબોને આધારે વર્તમાન સ્થિતિનો ઉપયોગ કરીને વ્યવસ્થાપક કાં તો કંપનીને ફંડમાં લેવાનો અથવા કામગીરી અંત કરવાનો અથવા તેમ કરવામાં કોઈ વાસ્તવિક વિકલ્પ નથી કે કેમ તેનું કંપનીની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે જવાબદાર છે.

નિયામક મંડળ કંપનીની નાણાકીય અહેવાલ પ્રક્રિયાના નિરીક્ષણ કરવા માટે પણ જવાબદાર છે.

સ્વતંત્ર નાણાકીય પત્રકોની તપાસણી માટે ઓડિટરની જવાબદારીઓ

અમારો ઉદ્દેશ ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકો પછી ભલે ક્ષેત્ર અથવા ભૂલોને લઈને સંપૂર્ણ રીતે વાસ્તવિક ગેરરજૂઆતથી મુક્ત છે અને અમારા અભિપ્રાયનો સમાવેશ કરતા તપાસણીદારના અહેવાલને બહાર પાડવો કે કેમ તેની વાજબી ખાતરી મેળવવાનો છે. વાજબી ખાતરી એ ખાતરીનું ઊંચું સ્તર છે, પરંતુ ધોરણસરના હિસાબો અનુસાર કરેલ તપાસણી જ્યારે તે હોય છે ત્યારે હંમેશા વાસ્તવિક ગેરરજૂઆતને શોધશે તેની કોઈ બાંધધરી આપતી નથી. ગેરરજૂઆતો ક્ષેત્ર અથવા ભૂલમાંથી થઈ શકે છે અને જે વ્યક્તિગત રીતે અથવા ભેગા મળીને કરવામાં આવે તો વાસ્તવિક ગણવામાં આવે છે, તે વાજબી રીતે આ સ્વતંત્ર નાણાકીય પત્રકોના આધારે લેવામાં આવેલા વપરાશકર્તાઓના આર્થિક નિર્ણયોને પ્રભાવિત કરે તેવી અપેક્ષા રાખી શકાય છે.

ધોરણસરના હિસાબો અનુસાર તપાસણીના ભાગ રૂપે, અમે વ્યાવસાયિક નિર્ણય વ્યક્ત કરીએ છીએ અને સમગ્ર તપાસણી દરમિયાન વ્યાવસાયિક સંશયવાદને જાળવીએ છીએ. અમે પણ તેમ કરીએ છીએ.

- હિસાબી ધોરણના નાણાકીય પત્રકોની મહત્વની ગેરરજૂઆતના જોખમોને ઓળખી અને મૂલ્યાંકન કરીને, પછી ભલે તે ક્ષેત્ર અથવા ભૂલને લીધે હોય, તે જોખમો માટે પ્રભાવક તપાસણી કાર્યવાહી રૂપરેખા અને કામગીરી કરીને અને અમારા મંતવ્ય માટે આધાર પૂરો પાડવા માટે પૂરતા અને યોગ્ય એવા તપાસણી પુરાવા મેળવવા. છેતરપિંડીના પરિણામે વાસ્તવિક ગેરરજૂઆતને શોધી ન લેવાનું જોખમ એ ભૂલના પરિણામ રૂપે ઊંચું છે, કારણ કે છેતરપિંડીમાં સામેલગીરી, ક્ષેત્ર, ઘટાડાપૂર્વકની ભૂલ, ખોટી રજૂઆત અથવા આંતરિક નિયંત્રણને કચડી નાખવાનું સામેલ હોઈ શકે છે.

- સંજોગોમાં વાજબી એવી તપાસણી કાર્યવાહી ઘડવા માટે તપાસણી સંબંધિત આંતરિક નિયંત્રણની સમજ મેળવવી, જે અધિનિયમની કલમ ૧૪૩(૩)(આઇ) હેઠળ, કંપની પાસે ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકોના સંદર્ભમાં, આવા નિયંત્રણોની કામગીરીની કાર્યક્ષમતાના સંદર્ભમાં, કંપની પાસે પૂરતા આંતરિક નાણાકીય નિયંત્રણ છે કે કેમ તે અંગે અમારો અભિપ્રાય વ્યક્ત કરવા માટે અમે જવાબદાર છીએ.
- ઉપયોગમાં લેવામાં આવતી હિસાબી નીતિઓની યોગ્યતા અને હિસાબી અંદાજોની યોગ્યતા અને વ્યવસ્થાપક દ્વારા કરેલ સંબંધિત જાહેરાતોનું મૂલ્યાંકન કરવું.
- હિસાબોના વર્તમાન પ્રભાવના આધારે વ્યવસ્થાપકના પ્રયોજનની યોગ્યતા અને નિષ્કર્ષ, અને મેળવેલા તપાસણીના પુરાવાને આધારે, વાસ્તવિક અનિશ્ચિતતાની ઘટનાઓ અથવા પરિસ્થિતિઓ સંબંધિત હોય એવી કંપનીની સતત કાર્યરત તરીકે ચાલુ રાખવાની ક્ષમતા પર નોંધપાત્ર શંકા વ્યક્ત કરી શકે છે. જો અમે એવું તારણ કાઢીએ કે વાસ્તવિક અનિશ્ચિતતા છે, તો અમારે અમારા તપાસણીદારના અહેવાલમાં ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકોમાં સંબંધિત જાહેરાતો પર અથવા જો આવી જાહેરાતો અપૂરતી હોય તો, અમારા મંતવ્યને સુધારવા માટે ધ્યાન દોરવું જરૂરી છે. અમારો નિષ્કર્ષ અમારા તપાસણીદારના અહેવાલની તારીખ સુધી મળેલ તપાસણીના પુરાવા પર આધારિત છે. જો કે, ભવિષ્યની ઘટનાઓ અથવા પરિસ્થિતિ કંપનીને સતત કાર્યરત તરીકે ચાલુ રાખવાનું બંધ કરી શકે છે.
- જાહેર કરાયેલ માહિતી સહિત અને ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકોની એકંદર રજૂઆત, માળખું અને વાસ્તવિકતા અને ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકો યોગ્ય રજૂઆતને સફળ કરે તે રીતે અંતર્ગત વ્યવહારો અને ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરે છે કેમ તેનું મૂલ્યાંકન કરવું.

અન્ય બાબતોની સાથે તપાસણીના આયોજિત વ્યાપ અને તપાસણીનો સમય અને નોંધપાત્ર તપાસણીના તારણો સહિત અમે અમારી તપાસણી દરમિયાન શોધી શકાય એવી આંતરિક નિયંત્રણની નોંધપાત્ર ખામીઓ જણાવીએ છીએ.

અમે શાસકોને નિવેદન સાથે પણ આપીએ છીએ કે અમે સ્વતંત્રતા સંબંધિત અને તેમની સાથે તમામ સંબંધો અને અન્ય બાબતો કે જે અમારી સ્વતંત્રતા પર વ્યાજબી રીતે સમજી શકે તેવી અને જ્યાં લાગુ પડે ત્યાં સંબંધિત સલામતી માટે વાતચીત કરવાની નૈતિક જરૂરિયાતોનું પાલન કર્યું છે.

શાસકોએ પૂરી પાડેલી બાબતોમાંથી, અમે વર્તમાન સમયગાળાના ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકોની તપાસણીમાં ખૂબ મહત્વ ધરાવતી હોય એવી બાબતોનો અમે નિર્ણય કરીએ છીએ; જ્યાં સુધી કાયદો અથવા નિયમન આ બાબતે ખુલ્લી જાહેરાત થતાં અટકાવે નહીં ત્યાં સુધી અમે આ બાબતોને અમારા તપાસણી અહેવાલમાં વર્ણવીએ છીએ અથવા જ્યાં સુધી, ખૂબ જ અપૂર્વ સંજોગોમાં, અમે નિર્ધારિત કરીએ ત્યાં સુધી અમારો અહેવાલ જાહેર કરવો જોઈએ નહીં કારણ કે આમ કરવાના વિપરીત પરિણામો વ્યાજબી રીતે આવા સંદેશાવ્યવહારના જનહિત લાભોને વટાવી લેવાની અપેક્ષા રાખવામાં આવશે.

અન્ય કાનૂની અને વૈધાનિક જરૂરિયાતો પરનો અહેવાલ

- (૧) અધિનિયમની કલમ ૧૪૩(૧૧) ના સંદર્ભમાં કેન્દ્ર સરકારે બહાર પાડેલા કંપની (ઓડિટરનો અહેવાલ) હુકમ (હુકમ), ૨૦૧૬ મુજબ, અમે “પરિશિષ્ટ-ક” માં હુકમના ફકરા ૩ અને ૪ માં દર્શાવેલ બાબતો પરના નિવેદનો આપીએ છીએ.
- (૨) નિયંત્રક અને મહાલેખકારે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩ ની પેટા કલમ (૫) ના સંદર્ભમાં પરિક્ષણના ક્ષેત્રો દર્શાવતા નિર્દેશો અને પેટા નિર્દેશો બહાર પાડ્યા છે. તેનું પાલન કરવાનું “પરિશિષ્ટ-ખ” માં ઠરાવેલ છે.
- (૩) અધિનિયમની કલમ ૧૪૩(૩) મુજબ અમો અહેવાલ કરીએ છીએ કે:-
 - (ક) અમે અમારી શ્રેષ્ઠ જાણકારી અને માનવા મુજબ અમારી તપાસણીના હેતુ માટે જ્યાં જરૂરી હોય ત્યાં તમામ માહિતી અને સ્પષ્ટીકરણો માંગ્યા છે અને મેળવ્યા છે.
 - (ખ) અમારા અભિપ્રાય મુજબ અમારા નિરીક્ષણમાંથી કાનૂની રીતે જરૂરી એવા કંપનીએ રાખેલા હિસાબી ચોપડા યોગ્ય હોવાનું જણાયેલ છે.
 - (ગ) આ અહેવાલમાં ઉલ્લેખ કરાયેલ પાકું સરવૈયું, નફા-નુકસાનનું પત્રક (અન્ય સમગ્ર આવક સહિત), ઇક્વિટીમાં ફેરફારનું પત્રક અને રોકડ પ્રવાહનું પત્રક, હિસાબી ચોપડા સુસંગત છે.
 - (ઘ) અમારા અભિપ્રાય મુજબ ઉપરોક્ત નાણાકીય પત્રકો અધિનિયમની કલમ ૧૩૩ હેઠળ ઠરાવેલ ભારતીય હિસાબી ધોરણનું પાલન કરે છે.

- (ચ) ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ કંપનીના નિયામકો પાસેથી મળેલ લેખિત રજૂઆતના આધારે ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ અધિનિયમની કલમ ૧૬૪(૨) ના સંદર્ભમાં નિયામક મંડળે રેકર્ડમાં લીધેલા નિમાયેલ એકપણ નિયામકો ગેરલાયક ઠર્યા નથી.
- (છ) કંપનીના નાણાંકીય અહેવાલમાં આંતરિક નાણાંકીય નિયંત્રણની પર્યાપ્તતા અને આવા નિયંત્રણની કામગીરી કાર્યક્ષમતાના સંદર્ભમાં અમારા અલગ અહેવાલ “પરિશિષ્ટ-ગ” જોવું.
- (જ) સુધારા મુજબ અધિનિયમની કલમ ૧૯૭(૧૬) ની જરૂરિયાત અનુસાર તપાસણીદારના અહેવાલમાં સમાવિષ્ટ અન્ય બાબતોના સંદર્ભમાં:
કંપની સરકારી કંપની હોવાથી કાયદાની કલમ ૧૯૭(૧૬) કંપનીને લાગુ પડતી નથી.
- (ઝ) કંપની (તપાસણી અને તપાસણીદારો) નિયમો, ૨૦૧૪ સુધાર્યા મુજબ નિયમ ૧૧ અનુસાર તપાસણીદારના અહેવાલમાં સમાવેશ કરવાની થતી અન્ય બાબતોના સંદર્ભમાં અમારા અભિપ્રાય અને અમારી શ્રેષ્ઠ જાણકારી મુજબ અને અમોને આપવામાં આવેલ સ્પર્ટીકરણ મુજબ:-
- (૧) કંપનીએ તેમના ભારતીય હિસાબી ધોરણોના નાણાંકીય પત્રકોમાં તેની નાણાંકીય પરિસ્થિતિ ઉપર પડતર દાવાઓની અસર જાહેર કરેલ છે- નોંધ ૧૯.૧ જુઓ.
- (૨) કંપનીએ લાગુ પડતાં કાનૂનો અથવા હિસાબી ધોરણો મુજબ અનુમાનિત ખરેખર નુકસાનો જે કોઈ હોય તો તેની, ભારતીય હિસાબી ધોરણોના નાણાંકીય પત્રકોમાં લાંબા ગાળાના કરારો પર - ઇક્વિટી ફેરફાર પરની નોંધ-૧૭ જુઓ; અને કંપનીએ આરબીઆઇના પરિપત્ર નં. આરબીઆઈ/૨૦૧૯-૨૦/૧૭૦ ડીઓઆર (એનબીએફસી) સી.સી. પી.ડી. નં. ૧૦૯/૨૨.૧૦.૧૦૬/૨૦૧૯-૨૦ તારીખ ૧૩ માર્ચ, ૨૦૨૦નું પાલન કરતા હિસાબોમાં જરૂરી જોગવાઈ કરેલ છે.
- (૩) કંપની દ્વારા રોકાણકાર કેળવણી અને સલામતી ફંડ ખાતે રકમ તબદીલ કરવાની જરૂરિયાત રહેતી નથી.

મુકેશકુમાર જૈન એન્ડ કંપની વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
(એફઆરએન: ૧૦૬૬૧૯૬૦૫૯)

સહી/-
પિયુષ જૈન, સીએ.
ભાગીદાર

(સભ્યપદ નં. ૪૧૩૩૭૭)

યુડીઆઈએન: ૨૧૪૧૩૩૭૭એએએએબીપી૪૪૭૦

સ્થળ : અમદાવાદ
તારીખ : ૨૨ જુન, ૨૦૨૧

પરિશિષ્ટ-“ક” સ્વતંત્ર ઓડિટર્સના અહેવાલના સંદર્ભે

(સમાન તારીખના અમારા અહેવાલના ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના સભ્યોને ‘અન્ય કાનૂની અને નિયમનકારી આવશ્યકતાઓ પરનો અહેવાલ’)

(૧) કંપનીની મિલકત, સંચય અને સાધનો બાબતે -

(ક) કંપનીએ સ્થાયર મિલકત, સંચય અને સાધનોની વિગતો દર્શાવતું દફતર નિભાવેલ છે. જોકે મિલકતોની ચોક્કસ ઓળખના સંદર્ભમાં વિગતો અદ્યુરી છે.

(ખ) અમોને સ્પષ્ટતા કર્યા મુજબ કંપની પાસે ત્રણ વર્ષમાં એકવાર મિલકતની તમામ વસ્તુઓને આવરી લેતું ચકાસણીનું સમયપત્રક છે. અમારા અભિપ્રાય મુજબ કંપનીના વ્યાપ અને તેની મિલકતના પ્રકારના સંદર્ભમાં વાજબી છે. સમયપત્રકને ધ્યાનમાં લેતા સંચાલકે વર્ષ દરમિયાન કેટલીક મિલકતની ભૌતિક ચકાસણી કરી હતી. અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ અનુસાર મહત્વની વિસંગતાઓ આવી ચકાસણીમાં ધ્યાને આવેલ નથી.

(ગ) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ અનુસાર, અમોએ પરીક્ષણ કરેલ દફતરમાં કંપની તેના નામે કોઈપણ અસ્થાયી મિલકતો ધરાવતી નથી અને તેથી અસ્થાયી મિલકતોના માલિકી હકને લગતા કંપનીના નામે ધારણ કરેલ પેટા ખંડ લાગુ પડતો નથી.

(૨) કંપની બિન બેંકીંગ નાણાંકીય કંપની છે. તદ અનુસાર તેને કોઈ માલસામાન રાખવાની જરૂર નથી. આમ કંપની (તપાસણીદાર અહેવાલ) આદેશ, ૨૦૧૬ નો પેટા ખંડ ૩(૨) લાગુ પડતો નથી.

(૩) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ અનુસાર, કંપનીએ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૮૯ અને તે નીચે ઘડેલા નિયમો હેઠળ નિભાવેલ રજીસ્ટરમાં કંપનીઓ, પેટી અથવા બીજા કોઈને તારણવાળી અથવા બિન તારણવાળી કોઈ લોન લીધેલ નથી કે આપેલ નથી તેથી આ જોગવાઈ જે તપાસણીના વર્ષ માટે લાગુ પડતી નથી.

(૪) કંપનીએ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૮૫ અને ૧૮૬ હેઠળ આવતી હોય એવી કોઈ લોન, રોકાણ, જામીનગીરીઓ અને બાંધધરીઓ આપેલ નથી.

(૫) અમારા અભિપ્રાય અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપનીએ કોઈ થાપણ સ્વીકારી નથી, અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બહાર પાડેલ નિર્દેશો અને કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમો ૭૩ અને ૭૬ ની જોગવાઈઓ અથવા અને કંપની (થાપણ સ્વીકાર) નિયમો, ૨૦૧૪ અને તેની નીચે ઘડેલા નિયમોની બીજી સંબંધિત જોગવાઈઓ તપાસણીના વર્ષ માટે લાગુ પડતી નથી.

(૬) કંપની ઉત્પાદન, પ્રક્રિયા, નિર્માણ અથવા ખનીજ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ નથી. તેથી, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૮(૧) હેઠળ કેન્દ્ર સરકારે ઠરાવેલ ખર્ચ રેકોર્ડ નિભાવવાના આદેશનો પેટા ખંડ ૩(૬) કંપનીને લાગો પડતો નથી.

(૭) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કાનૂની દેણાંના સંભર્ભમાં:-

(ક) કંપની યોગ્ય સત્તાવાળાઓને બિન વિવાદાસ્પદ ભવિષ્ય નિધિ, કર્મચારીના રાજ્ય વીમા, આવકવેરો, માલ અને સેવા કર અને તેને લાગુ પડતાં બીજા કાનૂની દેણાં સહિત કાનૂની દેણાં જમા કરાવવામાં સામાન્ય રીતે નિયમિત છે અને ૩૧ મી માર્ચ, ૨૦૨૧ ના રોજ ચૂકવવાપાત્ર થયાની તારીખથી છ મહિનાથી વધુના સમયગાળા માટે ચૂકવવાની બાકી થયેલ નથી.

(ખ) ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ જમા ન કરેલ વિવાદિત કાનૂની દેણાંની વિગતો નીચે મુજબ છે:-

ક્રમ	અધિનિયમનું નામ	દેણાંનો પ્રકાર	રકમ (રૂપિયા)	કયા વર્ષની રકમ છે (નાણાંકીય વર્ષ)	વિવાદ કયાં પડતર છે.
૧	આવકવેરા અધિનિયમ	આવકવેરો	૭,૧૯૮,૫૨૨	૨૦૦૩-૦૪	ગુજરાત હાઇકોર્ટ, આઈટીએટી સેટ એસાઈડ
૨	આવકવેરા અધિનિયમ	આવકવેરો	૬૬,૫૧૮,૨૭૧	૨૦૦૫-૦૬	ગુજરાત હાઇકોર્ટ
૩	આવકવેરા અધિનિયમ	આવકવેરો	-	૨૦૦૭-૦૮	આકારણી અધિકારીએ સેટ એસાઈડ

૪	આવકવેરા અધિનિયમ	આવકવેરો	-	૨૦૧૧-૧૨	ગુજરાત હાઇકોર્ટ
૫	આવકવેરા અધિનિયમ	આવકવેરો	-	૨૦૧૦-૧૧	ગુજરાત હાઇકોર્ટ
				૨૦૦૯-૧૦	ગુજરાત હાઇકોર્ટ
૬	આવકવેરા અધિનિયમ	આવકવેરો	-	૨૦૦૬-૦૭	ગુજરાત હાઇકોર્ટ
૭	આવકવેરા અધિનિયમ	આવકવેરો	-	૨૦૦૪-૦૫	ગુજરાત હાઇકોર્ટ
૮	આવકવેરા અધિનિયમ	આવકવેરો	-	૨૦૦૨-૦૩	ગુજરાત હાઇકોર્ટ
	કુલ			૭૩,૭૧૬,૭૯૩	

- (૮) અમારા અભિપ્રાય મુજબ અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની પાસે નાણાંકીય સંસ્થાઓ અથવા બેંકોનું આવું કોઈ દેણું નથી. વર્ષ દરમિયાન કંપની પાસે કોઈ ડિબેચર બાકી નથી. આથી, આદેશનો પેટા ખંડ ૩(૮) કંપનીને લાગુ પડતો નથી.
- (૯) કંપનીએ પ્રારંભિક જાહેર પ્રસ્તાવ અથવા આગળનો જાહેર પ્રસ્તાવ (બ્રહ્મ દસ્તાવેજો સહિત) અથવા મુદ્દતી લોન મારફત નાણાં ઊભા કરેલ નથી અને તેથી કંપનીને અહેવાલ કરવાનો આદેશનો પેટા ખંડ ૩(૯) હેઠળ લાગુ પડતો નથી.
- (૧૦) અમારી શ્રેષ્ઠ જાણકારી અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ અહેવાલના વર્ષ દરમિયાન કંપનીએ અથવા તેના અધિકારીઓ અથવા કર્મચારીઓએ કોઈ દેખિતી છેતરપિંડી કરેલાનું ધ્યાનમાં આવેલ નથી.
- (૧૧) અમારા અભિપ્રાય અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ અને કંપનીના અમારા દફતર પરીક્ષણના આધારે વ્યવસ્થાપકીય વેતન ચુકવેલ નથી/જોગવાઈ કરેલ નથી આથી, આ ખંડ કંપનીને લાગુ પડતો નથી.
- (૧૨) અમારા અભિપ્રાય અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપની નિધિ કંપની નથી અને તેથી હુકમનો ખંડ ૩ કંપનીને લાગુ પડતો નથી.
- (૧૩) અમારા અભિપ્રાય અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ જ્યાં લાગુ પડે ત્યાં સંબંધિત પક્ષકારો સાથેના તમામ વ્યવહારો કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમો ૧૭૭ અને ૧૮૮ નું પાલન કરે છે અને સંબંધિત પક્ષકારોના વ્યવહારોની વિગતો લાગુ પડતાં ભારતીય હિસાબી ધોરણો-૨૪ “સંબંધિત પક્ષકારો જાહેર કરવા” મુજબ ભારતીય હિસાબી ધોરણો નાણાંકીય પત્રકોની નોંધોમાં જાહેર કરેલ છે.
- (૧૪) અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ અને કંપનીના અમારા દફતર પરીક્ષણના આધારે વર્ષ દરમિયાન કંપનીએ શેરોની અથવા ખાનગી ગોઠવણ અથવા સંપૂર્ણ અથવા અંશતઃ પરિવર્તનીય ડિબેન્ચરોની પસંદગીની ફાળવણી કરેલ નથી.
- (૧૫) અમારા અભિપ્રાય અને અમોને આપવામાં આવેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ વર્ષ દરમિયાન કંપનીએ તેના નિયામકો અથવા તેના નિયામકોને સંબંધિત વ્યક્તિઓ સાથે કોઈ બિન રોકડ વ્યવહાર કરેલ નથી અને તેથી, હુકમનો ખંડ કે (૧૫) લાગુ પડતો નથી.
- (૧૬) કંપની બિન-બેંકીંગ નાણાંકીય કંપની છે અને ભારતીય રીઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-આઈએ હેઠળ જરૂરી નોંધણી નંબર મેળવેલો છે.

મુકેશકુમાર જૈન એન્ડ કંપની વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
(એફઆરએન: ૧૦૬૬૧૯૬બલ્યુ)

સહી/-
પિયુષ જૈન, સીએ.
ભાગીદાર

(સભ્યપદ નં.. ૪૧૩૩૭૭)

યુડીઆઈએન: ૨૧૪૧૩૩૭૭એએએએબીપી૪૪૭૦

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૨ જુન, ૨૦૨૧

પરિશિષ્ટ-“ખ” સ્વતંત્ર ઓડિટર્સનો અહેવાલ

(સમાન તારીખના ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના સભ્યોને અમારા અહેવાલના ‘અન્ય કાનૂની અને નિયમનકારી આવશ્યકતાઓ પરનો અહેવાલ’ ભાગ હેઠળનો ફકરો-૩ જુઓ)

ભારતના નિયંત્રક અને મહાલેખાકારે કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૫) હેઠળ ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના વર્ષ ૨૦૨૦-૨૧ ના હિસાબ તપાસણી પર કાનૂની તપાસણીદારને તપાસણી હાથ ધરવા આપેલ નિર્દેશો

ક્રમ	નિર્દેશો/પેટા નિર્દેશો	અવલોકનો/તથ્ય
(ક)	નિર્દેશો - સામાન્ય	
૧	કંપનીમાં આઇટી પદ્ધતિ મારફત તમામ હિસાબી વ્યવહારોની પ્રક્રિયા કરવાની પદ્ધતિ અમલમાં છે કે કેમ? જો હા તો, હિસાબોનું સમન્વય પર આઇટી સિવાય હિસાબી વ્યવહારોની પ્રક્રિયાની અસરો સહિત નાણાકીય અસરો જો કોઈ હોય તો જણાવવી.	કંપની તમામ નાણાકીય વ્યવહારો માટે ફોક્સ પ્રો અને આઇટી મારફત આઇસીડી અને એલડીએસ નોંધણી માટે ઓરેકલ સોફ્ટવેરનો ઉપયોગ આઇટી સિસ્ટમ દ્વારા કરે છે.
૨	હાલની લોનનું કોઈ પુનર્ગઠન અથવા લોન ચૂકવવા માટે કંપનીની અસમર્થતાને લીધે કંપનીએ કરવદારને આપેલી લોન/ વ્યાજ વગેરેમાંથી માફી / માંડવાળ કરવાના કિસ્સાઓ બન્યા છે કે કેમ? જો હા, નાણાકીય અસર જણાવો.	અમારી તપાસણી અને અમોને આપેલ માહિતી અને સ્પષ્ટીકરણના આધારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આવો કોઈ કિસ્સો બનેલ નથી. તેથી ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકો પર કોઈ અસર નથી.
૩	કેન્દ્રીય/ રાજ્ય એજન્સીઓ તરફથી ચોક્કસ યોજના માટે તેની બોલી અને શરતો અનુસાર મળેલ/મળવાપાત્ર અનુદાનનો યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ? વિચલનના કિસ્સાની યાદી આપવી.	અમારી તપાસણી અને અમોને આપેલ માહિતી અને સ્પષ્ટીકરણના આધારે કેન્દ્રીય/ રાજ્ય એજન્સીઓ તરફથી મળેલ/ મળવાપાત્ર ભંડોળ મળેલ નથી, તેથી લાગુ પડતું નથી.
૪	કંપનીએ અનુક્રમે ગીરો મુક્ત અને પટાવાળી જમીન માટે સ્પષ્ટ માલિકી હક / પટા કરાર કરેલ છે કે કેમ? જો ના તો, માલિકી હક/ પટા કરાર ઉપલબ્ધ ન હોય એવી ગીરો મુક્ત અને પટાવાળી જમીનનો વિસ્તાર જણાવો.	કંપનીને આ લાગુ પડતું નથી કારણ કે કંપની આવી કોઈ માલિકી હક/ પટા કરારની મિલકત ધરાવતી નથી.
૫	દેવા/ લોન/ વ્યાજ વગેરેને માફ કરવા/ માંડવાળ કરવાના કોઈ કિસ્સા બન્યા છે કે કેમ, જો હા, તો કારણો અને તે સંડોવાયેલી રકમ જણાવવી.	અમારા અભિપ્રાય અને અમોને આપેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ દરિયાન દેવા/ લોન/ વ્યાજ વગેરે માફ કરવા/ માંડવાળ કરવાના કોઈ કિસ્સા બન્યા નથી.
૬	તૃતીય પક્ષો અને સરકાર અથવા અન્ય સત્તાધિકારીઓ પાસેથી ભેટ/ અનુદાન તરીકે મળેલ સંપત્તિ સાથેની યાદીઓ માટે યોગ્ય રેકોર્ડ જાળવવામાં આવે છે કે કેમ?	કંપની બિન-બેંકીંગ કંપની છે. તેથી તેની પાસે યાદી નથી. આ ફકરો લાગુ પડતો નથી.

(ખ) ક્ષેત્ર વિશેષ પેટા નિર્દેશો- ધિરાણ ક્ષેત્ર

<p>કંપનીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરેલા નીચેના નિર્દેશોનું પાલન કર્યું છે કે કેમ?</p> <ul style="list-style-type: none"> - બિન-બેંકીંગ ધિરાણ કંપની (એનબીએફસી) - એન.પી.એ. નું વર્ગીકરણ 	<p>અમારા અભિપ્રાય અને અમોને આપેલ માહિતી અને સ્પષ્ટીકરણ મુજબ કંપનીએ બિન-બેંકીંગ ધિરાણ કંપની માટેના ભારતીય રિઝર્વ બેંકે જાહેર કરેલ નિર્દેશોનું પાલન કર્યું છે.</p> <p>નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન, કંપનીને કોઈ બિન કાર્યક્ષમ મિલકત નથી, તેથી આ ખંડ લાગુ પડતો નથી.</p>
---	--

	<p>- એનબીએફસીના મૂડી પ્રચક્ષિતા ધોરણો</p>	<p>૩૧-૦૩-૨૦૨૧ ની સ્થિતિએ, કંપની ઠરાવેલ ૧૩% સીઆરએઆર સામે ૭.૫૭% સીઆરએઆર (અગાઉના વર્ષમાં ઠરાવેલ ૧૨% ની સામે સીઆરએઆર ૭.૪૪%) ધરાવે છે.</p> <p>ઉપરનો સીઆરએઆર ભારતીય રીઝર્વ બેંકના તા. ૧૩ માર્ચ ૨૦૨૦ ના જાહેરનામા નં. આરબીઆઈ/૨૦૧૯-૨૦/૧૭૦/ડીઓઆર (એનબીએફસી) સીસી. પીડી. નં. ૧૦૯/૨૨.૧૦.૧૦૬/૨૦૧૯-૨૦ અને તા. ૨૪ જુલાઈ, ૨૦૨૦ ના જાહેરનામા નં. આરબીઆઈ/૨૦૨૦-૨૧/૧૫ ડીઓઆર (એનબીએફસી) સીસી. પીડી. નં. ૧૧૬/૨૨.૧૦.૧૦૬/૨૦૨૦-૨૧ મુજબ છે.</p> <p>ભારતીય રિઝર્વ બેંકે વિસ્તૃત નિર્દેશો ડીએનબીઆર. પી.ડી ૦૦૮/ ૦૩.૧૦.૧૧૯ / ૨૦૧૬-૧૭ (૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ થી સુધાર્યા પ્રમાણે) સરકારી એનબીએફસીએસ, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૨ (૪૫) ની પુષ્ટિ કરતા થાપણ ન લેતી કંપની અથવા થાપણ લેતી કંપની (રિઝર્વ બેંક) નિર્દેશો, ૨૦૧૬ તા. ૩૧ મે, ૨૦૧૮ થી કંપનીઓને લાગુ પાડેલ છે.</p> <p>ઉપરોક્ત જાહેરનામા અનુસાર સરકારી એનબીએફસી માટે ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ પૂરા થયેલા વર્ષના સીઆરએઆરનું પાલન કરવાની સમયમર્યાદા સરકારી એનબીએફસી માટે ઠરાવેલ સીઆરએઆર ૧૩% છે.</p> <p><u>તેથી કંપની સૂચવેલી ૧૩% સીઆરએઆર જાળવતી નથી.</u></p> <p>૮ મી જુન, ૨૦૧૭ ના વિસ્તૃત નિર્દેશો નં. ડીએનબીએસ. પીપીડી. નં. ૦૪/૬૬.૧૫.૦૦૧/૨૦૧૬-૧૭ ના ભાગ-‘અ’ના ફક્કરા ૧.૧ માં જણાવેલ નિર્દેશો અનુસાર કંપની આઘટી વ્યૂહરચના સમિતિ બનાવી શકેલ નથી.</p>
૨	<p>કંપની પાસે પૂરતી બોજા મુક્ત જામીનગીરી અને ગીરો મિલકત પર પ્રથમ હક દ્વારા સુરક્ષિત કરવા સુનિશ્ચિત પદ્ધતિ છે કે કેમ? વધુમાં, જમ કરાયેલા એકમોના નિકાલમાં અયોગ્ય વિલંબ થવાના કિસ્સા નોંધાયેલા છે?</p>	<p>કંપની ફક્ત ગુજરાત સરકારની સંસ્થાઓને લોન મંજુરી અને વહેંચણી કરતી હોવાથી, આ ખંડ લાગુ પડતો નથી.</p>
૩	<p>કંપની/ સરકારની નીતિ/ માર્ગદર્શિકાનું પાલન થાય ત્યાં લેણાં પતાવટ અને કોઈ યોજના દાખલ કરેલ છે કે કેમ?</p>	<p>કંપની દ્વારા બાકી લેણાં પતાવટ અને તેને લંબાવવા માટેની નીતિ કંપની દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જો કે, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આવા બાકી લેણાં પતાવટ અથવા લોન મર્યાદા લંબાવેલ નથી.</p>

૪	મળવાપાત્ર વેપાર, ચૂકવવાપાત્ર વેપાર, મુદતી થાપણો, બેંક ખાતાઓ અને મેળવેલી રોકડ રકમની બાકીના મેળવણા પરની ટિપ્પણી	હા. લોન, બેંક ખાતા અને રોકડ સિલકનું મેળવણું થયેલ છે અને મેળવેલ છે.
૫	બેંક બાંધઘટી સમયસર પુનઃકાયદેસર કરવામાં આવી છે કે કેમ?	લાગું પડતું નથી.

મુકેશકુમાર જૈન એન્ડ કંપની વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
(એફઆરએન: ૧૦૬૬૧૯૬૦૯૫૫)

સહી/-
પિયુષ જૈન, સીએ.
ભાગીદાર

(સભ્યપદ નં.. ૪૧૩૩૭૭)

ચુડીઆઈએન: ૨૧૪૧૩૩૭૭એએએબીપી૪૪૭૦

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૨ જુન, ૨૦૨૧

પરિશિષ્ટ- “ગ” સ્વતંત્ર ઓડિટર્સના અહેવાલ સાથે

(સમાન તારીખના ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના સભ્યોને અમારા અહેવાલના ‘અન્ય કાનૂની અને નિયમનકારી આવશ્યકતાઓ પરનો અહેવાલ’ ભાગ હેઠળનો ફકરો-૧(એફ) જુઓ)

કંપની અધિનિયમ, ૨૦૧૩ (“અધિનિયમ”) ની કલમ ૧૪૩ ની પેટા કલમ ૩ ના ખંડ (૧) હેઠળ નાણાંકીય અહેવાલ પરના આંતરિક નાણાંકીય નિયંત્રણ પરનો અહેવાલ.

અમોએ ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (“કંપની”) ના નાણાંકીય અહેવાલ પર આંતરિક નાણાંકીય નિયંત્રણોની તે તારીખે પૂરાં થતાં વર્ષનું કંપનીના ભારતીય હિસાબી ધોરણના નાણાંકીય પત્રકોની માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ અમારી તપાસણીની સાથે તપાસણી કરેલ છે.

આંતરિક નાણાંકીય નિયંત્રણ માટે સંચાલકોની જવાબદારી

ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે બહાર પાડેલ નાણાંકીય અહેવાલ કરવા પર આંતરિક નાણાંકીય નિયંત્રણની માર્ગદર્શક નોંધમાં જણાવેલ આંતરિક નિયંત્રણના આવશ્યક ભાગોને ધ્યાનમાં લેતા, કંપનીએ આંતરિક નિયંત્રણના આધારે પ્રસ્થાપિત કરેલ નાણાંકીય અહેવાલના માપદંડ સ્થાપિત કરવા અને જાળવવા માટે જવાબદાર છે. આ જવાબદારીઓમાં કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ તેના વ્યવસાયના વ્યવસ્થિત અને કાર્યક્ષમ કામગીરીને સુનિશ્ચિત કરવા તેની મિલકતોનું રક્ષણ, છેતરપિંડી અને ભૂલો નિવારવી અને તપાસ, હિસાબી રેકોર્ડની ચોકસાઈ અને સંપૂર્ણતા અને વિશ્વસનીય નાણાંકીય માહિતીની સમયસર તૈયારી કરવા માટે પર્યાપ્ત આંતરિક નાણાંકીય નિયંત્રણોનું માળખું, અમલીકરણ અને જાળવણીનો સમાવેશ થાય છે.

ઓડિટરની જવાબદારી

અમારી જવાબદારી અમારી તપાસણીના આધારે કંપનીની નાણાંકીય અહેવાલ કરવા પર આંતરિક નાણાંકીય નિયંત્રણ પર અભિપ્રાય વ્યક્ત કરવાની છે. અમે અમારી તપાસણી ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે બહાર પાડેલ નાણાંકીય અહેવાલ પર આંતરિક નાણાંકીય નિયંત્રણની તપાસણી ઉપરની માર્ગદર્શિક નોંધમાં અને આંતરિક નાણાંકીય નિયંત્રણની લાગુ પડતી હદ સુધી કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૪૩(૧૦) હેઠળ ઠરાવેલ તપાસણી પરના ધોરણોમાં ઠરાવ્યા અનુસાર તપાસણી કરેલ છે. આ માપદંડો અને માર્ગદર્શિક નોંધ જણાવે છે કે અમે નૈતિક જરૂરિયાતનું પાલન કરીએ અને નાણાંકીય રજૂઆતમાં પૂરતા આંતરિક નાણાંકીય નિયંત્રણ સ્થાપિત કર્યું હતું અને જાળવેલ હતું અને જે આગું નિયંત્રણ તમામ બાબતોના સંબંધમાં કાર્યક્ષમ રીતે છે કે કેમ તેની વાજબી ખાતરી મેળવવા માટે આયોજન અને તપાસણી કરી હતી અને બજાવી હતી.

અમારી તપાસણીમાં નાણાંકીય રજૂઆતમાં પૂરતા આંતરિક નાણાંકીય નિયંત્રણ પદ્ધતિ અને તેના કાર્યક્ષમ રીતે સંચાલનની પર્યાપ્તતા વિશે તપાસ પુરાવા મેળવવા માટે કામગીરી કાર્યવાહી સામેલ છે.

નાણાંકીય રજૂઆતમાં આંતરિક નાણાંકીય નિયંત્રણ અમારી તપાસણીમાં નાણાંકીય રજૂઆતમાં આંતરિક નાણાંકીય નિયંત્રણની સમજૂતી મેળવવા, રહેલી નોંધપાત્ર નબળાઈઓના જોખમનું મૂલ્યાંકન કરવાનો, અને મૂલ્યાંકન કરેલ જોખમના આધારે આંતરિક નિયંત્રણની કસોટી અને માળખાનું મૂલ્યાંકન સંચાલન કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ કર્યો હતો. પસંદ કરેલ કાર્યવાહીઓ કાં તો છેતરપિંડી અથવા ભૂલને કારણે ભારતીય હિસાબી ધોરણના નાણાંકીય પત્રકોમાં દેખિતી ગેરરજૂઆતના જોખમનું મૂલ્યાંકન કરવા સહિત તપાસણીદારના નિર્ણય પર નિર્ભર છે.

અમે માનીએ છીએ કે નાણાંકીય રજૂઆતમાં કંપનીના આંતરિક નાણાંકીય નિયંત્રણ પદ્ધતિ પર અમારી તપાસણી માટે આધાર પૂરો પાડવા અમે મેળવેલા તપાસણી પુરાવા પૂરતા અને વાજબી હતા

નાણાંકીય રજૂઆત પર આંતરિક નાણાંકીય નિયંત્રણનો અર્થ

કંપનીની નાણાંકીય રજૂઆત પર આંતરિક નાણાંકીય નિયંત્રણ નાણાંકીય રજૂઆતની વિશ્વસનીયતા સંબંધે વાજબી ખાતરી પૂરી પાડવા માટેની માળખાગત અને સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી નીતિઓ અનુસાર બાહ્ય હેતુ માટે નાણાંકીય પત્રકો તૈયાર કરવાની પ્રક્રિયા છે. કંપનીના નાણાંકીય રજૂઆત પર આંતરિક નાણાંકીય નિયંત્રણમાં એવી નીતિઓ અને કાર્યવાહીનો સમાવેશ થાય છે, જે :-

- (૧) કંપનીની મિલકતોની વાજબી વિગતો, ચોક્કસાઈ અને સ્પષ્ટ રીતે વ્યવહારો અને નિકાલને પ્રતિબિંબિત કરે તેને લગતું દફતર નિભાવવું;
- (૨) સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો અનુસાર વ્યાજબી ખાતરી પૂરી પાડે એવા ભારતીય હિસાબી ધોરણના નાણાંકીય

પત્રકો તૈયાર કરવા સ્વીકૃતિ આપવા માટે જરૂર મુજબ નોંધવામાં આવતા વ્યવહારો; અને તે કંપનીના આવક અને ખર્ચ ફક્ત કંપનીના સંચાલકો અને નિયામકોની સત્તા અનુસાર કરવામાં આવે; અને

- (૩) અનધિકૃત સંપાદનને અટકાવવા અથવા સમયસર તપાસ કરવા અંગે વાજબી ખાતરી મેળવવી, ભારતીય હિસાબી ધોરણના નાણાકીય પત્રકો પર ખરેખર અસર કરે તેવી કંપનીની મિલકતનો ઉપયોગ કરવો અથવા નિકાલ કરવો.

નાણાકીય રજૂઆત પર આંતરિક નાણાકીય નિયંત્રણની આંતરિક મર્યાદાઓ

સાંઠગાંઠ અથવા અયોગ્ય વ્યવસ્થાપન નિયંત્રણને નજરઅંદાજ કરવાની સંભાવના, ભૂલ અથવા છેતરપિંડીના કારણે નાણાકીય અહેવાલમાં આંતરિક નાણાકીય નિયંત્રણોની અંતર્ગત મર્યાદાઓ નોંધપાત્ર ગેરરજૂઆતને લઈને થઈ શકે છે અને કદાચ શોધી પણ ન શકાય. ઉપરાંત, ભવિષ્યના સમયગાળાની નાણાકીય રજૂઆતમાં આંતરિક નાણાકીય નિયંત્રણોના કોઈપણ મૂલ્યાંકનના અંદાજો પરિસ્થિતિમાં ફેરફારને કારણે નાણાકીય અહેવાલ પરનું આંતરિક નાણાકીય નિયંત્રણ જોખમને આધીન અપૂરતું થઈ શકે છે, અથવા નીતિઓ અથવા કાર્યવાહીઓનું પાલન કરવાની હદ વિકૃત થઈ શકે છે.

અભિપ્રાય

અમારા અભિપ્રાયમાં, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડેલ નાણાકીય રજૂઆત પર આંતરિક નાણાકીય નિયંત્રણની માર્ગદર્શક નોંધમાં જણાવેલ નાણાકીય નિયંત્રણના આવશ્યક ઘટકોને ધ્યાનમાં લેતા, કંપની પાસે, તમામ બાબતે ભારતીય હિસાબી ધોરણોના નાણાકીય પત્રકોના સંદર્ભમાં આંતરિક નાણાકીય નિયંત્રણ પદ્ધતિ છે અને નાણાકીય પત્રકોના સંદર્ભમાં કંપની દ્વારા સ્થાપિત નાણાકીય રજૂઆતના માપદંડ પરના આંતરિક નિયંત્રણના આધારે આવા આંતરિક નાણાકીય નિયંત્રણ ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ કાર્યક્ષમ રીતે કાર્ય કરી રહ્યા હતા.

મુકેશકુમાર જૈન એન્ડ કંપની વતી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
(એફઆરએન: ૧૦૬૬૧૯૬બલ્યુ)

સહી/-
પિયુષ જૈન, સીએ.
ભાગીદાર

(સભ્યપદ નં.. ૪૧૩૩૭૭)

યુડીઆઈએન: ૨૧૪૧૩૩૭૭એએએએબીપી૪૪૭૦

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૨ જુન, ૨૦૨૧

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ

સીઆઈએન : યુદ્ધ૫૯૧૦જીજ૯૧૯૨૨એસજીસી૦૧૮૬૦૨

૩૧ મી માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિનું સરવૈયું

(₹ લાખમાં)

બાબત	નોંધ નં.	ની સ્થિતિએ	
		૩૧ મી માર્ચ, ૨૦૨૧	૩૧ મી માર્ચ, ૨૦૨૦
મિલકતો			
(૧) નાણાંકીય મિલકતો			
(ક) રોકડ અને રોકડ સમકક્ષ	૫	૨૧૨૪૯.૫૫	૪૩૬૯૯.૦૫
(ખ) લોનો	૬	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦
(ગ) રોકાણો	૭	૩૭૬૧૩૧૬.૫૨	૩૨૦૮૦૩૭.૦૪
(ઘ) અન્ય નાણાંકીય મિલકતો	૮	૧૬૦૯૧.૧૪	૧૨૯૪૪.૬૯
કુલ નાણાંકીય મિલકતો		૪૯૯૫૬૭૦.૧૭	૪૪૪૯૬૧૬.૧૮
(૨) બિન નાણાંકીય મિલકતો			
(ક) વર્તમાન કર અસ્ક્યામતો (ચોખ્ખી)	૨૬.૩	૧૫૦૯.૭૦	૧૯૭૨.૭૩
(ખ) મિલકતો, સંયંત્રો અને ઉપકરણો	૯	૩૨.૯૩	૩૯.૪૬
(ગ) અન્ય બિન નાણાંકીય મિલકતો	૧૦	૪.૫૬	૪.૦૬
કુલ બિન નાણાંકીય મિલકતો		૧૫૪૭.૧૯	૨૦૧૬.૨૫
કુલ મિલકતો		૪૯૯૭૨૧૭.૩૬	૪૪૫૧૬૩૨.૪૩
જવાબદારીઓ અને ઇક્વિટી			
જવાબદારીઓ			
(૧) નાણાંકીય જવાબદારીઓ			
(ક) દેણાં			
વેપારી દેણાં	૧૧		
(૧) સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોની કુલ બાકી	-	૪.૨૭	૪.૪૩
(૨) સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો સિવાયના લેણદારોની કુલ બાકી	-	૧૫.૮૬	૧૫.૩૪
(ખ) થાપણો	૧૨	૪૩૭૯૬૭૩.૮૫	૩૮૨૬૩૬૫.૬૪
(ગ) અન્ય નાણાંકીય જવાબદારીઓ	૧૩	૧૨૫૪૪૯.૯૯	૧૩૯૦૨૮.૧૭
કુલ નાણાંકીય જવાબદારીઓ		૪૫૦૫૧૪૩.૯૭	૪૦૬૫૪૧૩.૫૮
(૨) બિન નાણાંકીય જવાબદારીઓ			
(ક) વર્તમાન કર જવાબદારીઓ (ચોખ્ખી)		૦.૦૦	૦.૦૦
(ખ) બેગવાઈઓ	૧૪	૮.૮૫	૫.૦૨
(ગ) વિલંબિત કર જવાબદારીઓ (ચોખ્ખી)	૨૬.૬	૩૦૦૫૩.૨૫	૩૧૫૬૩.૭૧
(ઘ) અન્ય બિન નાણાંકીય જવાબદારીઓ	૧૫	૨૪૬૫.૬૧	૩૩૨૯.૬૭
કુલ બિન નાણાંકીય જવાબદારીઓ		૩૨૫૨૭.૭૧	૩૪૮૯૮.૪૦
(૩) ઇક્વિટી			
(ક) ઇક્વિટી શેર મૂડી	૧૬	૧૩૭૯૯.૬૧	૧૩૭૯૯.૬૧
(ખ) અન્ય ઇક્વિટી	૧૭	૪૪૫૭૪૬.૦૭	૩૩૭૫૨૦.૮૪
કુલ ઇક્વિટી		૪૫૯૫૪૫.૬૮	૩૫૧૩૨૦.૪૫
કુલ જવાબદારીઓ અને ઇક્વિટી		૪૯૯૭૨૧૭.૩૬	૪૪૫૧૬૩૨.૪૩

આ સાથેની નોંધો નાણાંકીય પત્રકોનો અભિન્ન ભાગ છે.

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મુકેશકુમાર જૈન કંપની વતી

સંસ્થા નોંધણી નં. ૧૦૬૬૧૯૬બલ્યુ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

સહી

પિયુષ જૈન

(ભાગીદાર)

સભ્યપદ નં. ૪૧૩૩૭૭

યુડીઆઈએન:૨૧૪૧૩૩૭૭એએએએવીપી૪૪૭૦

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૨-૦૬-૨૦૨૧

નિયામક મંડળના આદેશથી

શ્રી પંકજ જોષી

(વહીવટી સંચાલક)
(ડીન:૦૧૫૩૨૮૯૨)

શ્રી સુનીલ તલાટી

(નિયામક)
(ડીન:૦૦૬૨૧૯૪૭)

શ્રી નીતિન શાહ

(મુખ્ય નાણાકીય અધિકારી)

શ્રી નિરજ જૈન

(કંપની સચિવ)
(એસીએસ:૪૪૭૨૫)

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૨-૦૬-૨૦૨૧

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ
૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત વર્ષનું નફા અને નુકસાનનું પત્રક

(₹ લાખમાં)

વિગત	નોંધ નં	ના વર્ષના અંતે	
		૩૧ મી માર્ચ, ૨૦૨૧	૩૧ મી માર્ચ, ૨૦૨૦
કામગીરીમાંથી આવક			
૧ વ્યાજની આવક	૨૦.૧	૧૩૨૭૨૩.૮૮	૧૩૩૭૬૯.૦૮
૨ બજાર મૂલ્યના ફેરફાર પર ચોખ્ખો લાભ	૨૦.૨	૧૭૮૦૬૪.૧૯	૨૧૭૪૭૧.૫૨
(૧) કામગીરીમાંથી કુલ આવક		૩૧૧૭૮૮.૦૭	૩૫૧૨૪૦.૬૦
(૨) અન્ય આવક	૨૧	૨૮૫૪.૧૫	૭૮૬૭.૧૫
(૩) કુલ આવક (૧+૨)		૩૧૪૬૪૨.૨૨	૩૫૯૧૦૭.૭૫
ખર્ચા			
૧ ધિરાણ ખર્ચ	૨૨	૨૬૭૦૦૪.૫૪	૨૯૮૨૩૯.૩૫
૨ કર્મચારી લાભ ખર્ચ	૨૩	૩૮૩.૧૨	૩૨૭.૮૫
૩ ઘસારો અને ભ્રષ્ટ્ર યુક્તવર્ણી ખર્ચ	૯	૧૩.૬૨	૧૭.૨૫
૪ કોર્પોરેટ સામાજિક જવાબદારી ખર્ચ	૩૩	૧૬૫૦.૦૦	૩૫૭.૪૩
૫ અન્ય ખર્ચ	૨૪	૫૩૫.૯૯	૧૧૫૨.૦૭
(૪) કુલ ખર્ચા		૨૬૯૫૮૭.૨૭	૩૦૦૦૯૩.૯૫
૫ કર પહેલાનો નફો (૩-૪)		૪૫૦૫૪.૯૫	૫૯૦૧૩.૮૦
૬ કર ખર્ચા:	૨૬.૧		
ક વર્તમાન કર		(૧૧૨૪૭.૧૯)	(૧૩૨૪૧.૬૨)
ખ વિલંબિત કર		૮૦૪૫.૧૨	(૨૮૭૭.૬૫)
ગ અગાઉના વર્ષનું કર સમાયોજન		૯૫૫.૨૨	(૪.૮૦)
કુલ કર ખર્ચા:		(૨૨૪૬.૮૫)	(૧૬૧૨૪.૦૭)
૭ વર્ષનો નફો (૫-૬)		૪૨૮૦૮.૧૦	૪૨૮૮૯.૭૩
૮ અન્ય સમગ્ર આવક			
ક નફા અથવા નુકસાન ખાતે પુનઃવર્ગીકૃત કરવામાં ન આવેલ બાબતો નિર્ધારિત લાભ જવાબદારીઓનું પુનઃમાપન ઓસીઆઈ દ્વારા બજાર મૂલ્ય તરીકે માપવામાં આવેલ ઇક્વિટી દસ્તાવેજોમાં રોકાણ પર બજાર મૂલ્ય લાભ / (નુકસાન)	૨૫.૯	(૪.૫૫)	(૬.૫૭)
ખ નફા અથવા નુકસાન ખાતે પુનઃવર્ગીકૃત કરી ન શકાય એવી આવકવેરા સંબંધિત બાબતો	૨૬.૨	(૬૫૩૪.૬૫)	(૩૭૪૧.૩૦)
૯ કુલ સમગ્ર આવક (૭+૮)		૧૧૧૬૭૫.૧૩	૪૯૮૪૮.૪૩
૧૦ ઇક્વિટી શેર દીઠ કમાણી (પ્રત્યેક ₹ ૧૦ ની કિંમત)			
મૂળ - ₹	૩૧	૩૧.૦૨	૩૧.૦૮
ઘટાડેલ - ₹		૩૧.૦૨	૩૧.૦૮

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મુકેશકુમાર જેન કંપની વતી
સંસ્થા નોંધણી નં. ૧૦૬૬૧૯૬બલ્યુ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

સહી

પિયુષ જેન

(ભાગીદાર)

સભ્યપદ નં. ૪૧૩૩૭૭

યુડીઆઈએન:૨૧૪૧૩૩૭૭એએએએબીપી૪૪૭૦

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૨-૦૬-૨૦૨૧

નિયામક મંડળના આદેશથી

શ્રી પંકજ જોષી

(વહીવટી સંચાલક)

(ડીન:૦૧૫૩૨૮૯૨)

શ્રી સુનીલ તલાટી

(નિયામક)

(ડીન:૦૦૬૨૧૯૪૭)

શ્રી નીતિન શાહ

(મુખ્ય નાણાકીય અધિકારી)

શ્રી નિરજ જેન

(કંપની સચિવ)

(એસીએસ:૪૪૭૨૫)

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૨-૦૬-૨૦૨૧

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ
૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિમ વર્ષ માટે ઇક્વિટી પરિવર્તન પત્રક

(ક) ઇક્વિટી શેર મૂકી

(₹ લાખમાં)

બાબતો	ની સ્થિતિએ	
	૩૧ માર્ચ, ૨૦૨૧	૩૧ માર્ચ, ૨૦૨૦
અહેવાલની શરૂઆતમાં સિલક	૧૩૭૮૯.૬૧	૧૩૭૮૯.૬૧
વર્ષ દરમિયાન ફેરફારો	૦.૦૦	૦.૦૦
અહેવાલના સમયે સિલક	૧૩૭૮૯.૬૧	૧૩૭૮૯.૬૧

(ખ) અન્ય ઇક્વિટી

(₹ લાખમાં)

બાબતો	અનામત અને બચત						કુલ
	સામાન્ય અનામતો	સુરક્ષિત આવક	ભારતીય રીઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫-૧૮ (૧) હેઠળ અનામત ભંડોળ	જામીનગીરી-ઓની ઊંચી કિંમત	ક્ષતિગ્રસ્ત અનામત	અન્ય સમગ્ર આવક દ્વારા ઇક્વિટી દસ્તાવેજો	
એપ્રિલ ૦૧, ૨૦૨૦ ની સ્થિતિએ બાકી આ સમયનો નફો	૨૭૦૭.૯૭	૧૭૦૪૫૭.૩૯	૧૪૦૮૭.૪૫	૧૩૮૪૦૭.૮૯	૪૭૫૭.૧૭	૬૦૮૨.૯૭	૩૩૭૫૨૦.૮૪
સુરક્ષિત આવકમાંથી તબદીલ		૪૨૮૦૮.૧૦					૪૨૮૦૮.૧૦
ક્ષતિગ્રસ્ત અનામતમાંથી તબદીલ		(૮૫૬૨.૦૦)	૮૫૬૨.૦૦		૫૬.૫૬		૦.૦૦
વર્ષ માટે ઓસીઆઈની બાબતોનો ચોખ્ખો કર		(૪.૫૫)					(૪.૫૫)
નિર્ધારિત લાભ ચોખ્ખાઓની પુનઃ નિર્ધારણ લાભ ઓસીઆઈ (ચોખ્ખો કર) દ્વારા ઇક્વિટી દસ્તાવેજોના રોકાણ પર ચોખ્ખી બજાર કિંમત (નફો/ખોટ) ડિવિડન્ડ						૬૮૮૭૧.૫૮	૬૮૮૭૧.૫૮
		(૩૪૪૯.૯૦)					(૩૪૪૯.૯૦)
માર્ચ ૩૧, ૨૦૨૧ ના રોજ બાકી	૨૭૦૭.૯૭	૨૦૧૧૯૨.૪૮	૨૨૬૫૯.૪૫	૧૩૮૪૦૭.૮૯	૪૮૧૩.૭૩	૭૪૬૬૪.૫૫	૪૪૫૭૪૬.૦૭
એપ્રિલ ૦૧, ૨૦૧૯ ના રોજ બાકી આ સમયનો નફો	૨૭૦૭.૯૭	૧૩૭૫૨૭.૪૯	૫૫૧૯.૫૦	૧૩૮૪૦૭.૮૯	૦.૦૦	(૮૭૨.૩૦)	૨૮૪૨૯૦.૫૫
સુરક્ષિત આવકમાંથી તબદીલી અનામત ઘટાડામાંથી તબદીલી		૪૨૮૮૯.૭૩	૮૫૭૭.૯૫				૪૨૮૮૯.૭૩
૦૧ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ બાકી રહેલી સિલકમાંથી પ્રમાણભૂત મિલકત સામે આકસ્મિક જોગવાઈથી ક્ષતિગ્રસ્ત અનામતમાં સ્થાનાંતરિત ક્ષતિગ્રસ્ત અનામતમાંથી તબદીલ		(૮૭.૫૭)			૪૬૭૩.૬૦	૮૭.૫૭	૪૬૭૩.૬૦
વર્ષના ચોખ્ખા નફા માટે ઓસીઆઈની બાબતો		(૬.૫૭)					(૬.૫૭)
નિર્ધારિત લાભ ચોખ્ખાઓની પુનઃ નિર્ધારણ લાભ ઓસીઆઈ (ચોખ્ખો કર) દ્વારા ઇક્વિટી દસ્તાવેજોના રોકાણ પર ચોખ્ખી બજાર કિંમત (નફો/ખોટ) ડિવિડન્ડ (કર ડિવિડન્ડ સહિત)						૬૯૬૫.૨૭	૬૯૬૫.૨૭
		(૧૨૯૧.૭૪)					(૧૨૯૧.૭૪)
માર્ચ ૩૧, ૨૦૨૦ ના રોજ બાકી	૨૭૦૭.૯૭	૧૭૦૪૫૭.૩૯	૧૪૦૮૭.૪૫	૧૩૮૪૦૭.૮૯	૪૭૫૭.૧૭	૬૦૮૨.૯૭	૩૩૭૫૨૦.૮૪

- સામાન્ય અનામત**
સામાન્ય અનામત એ મુક્ત અનામત છે જેનો ઉપયોગ સમય ફાળવણીના હેતુ માટે રાખેલ આવકમાંથી નફાને સ્થાનાંતરિત કરવા માટે કરવામાં આવે છે.
- ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫ - આઈસી (૧) હેઠળ અનામત ભંડોળ**
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫ - આઈસી (૧) મુજબ, કંપની એક રિઝર્વ ફંડ નિભાવે છે અને દર વર્ષે તેના ચોખ્ખા નફાના વીસ ટકા કરતા ઓછી રકમ ન હોય અને નફો અને ખોટ ખાતામાં અને કોઈ ડિવિડન્ડ જાહેર થાય તે પહેલાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. સમયાંતરે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દિષ્ટ હેતુ સિવાય કંપની અનામત ભંડોળમાંથી કોઈપણ રકમ વિનિયોગ કરી શકતી નથી. આજ સુધી ભારતીય રિઝર્વ બેંક ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ ૪૫ - આઈસી (૧) હેઠળ જાળવવામાં આવેલા અનામત ભંડોળની ફાળવણી માટે કોઈ હેતુ સ્પષ્ટ કર્યો નથી.
- ક્ષતિગ્રસ્ત અનામત**
ભારતીય રિઝર્વ બેંકના તા. ૧૩ માર્ચ, ૨૦૨૦ ના પરિપત્ર નં. આરબીઆઈ/૨૦૧૯-૨૦/૧૭૦ ડીઓઆર (એનબીએફસી).સીસી.પીડી. નં. ૧૦૯/૨૨.૧૦.૧૦૬/૨૦૧૯-૨૦ મુજબ, ભારતીય રિઝર્વ બેંકની આવક માન્યતા, મિલકત વર્ગીકરણ અને જોગવાઈ ધોરણો મુજબ ક્ષતિગ્રસ્ત અનામતની જોગવાઈ ઊભી કરવામાં આવે છે. જે ભારતીય હિસાબી ધોરણો-૧૦૯ હેઠળ કરવામાં આવતી ક્ષતિગ્રસ્ત ઘટાડા ઉપરાંતની છે.
- ઉપરોક્ત પરિપત્ર મુજબ, ભારતીય હિસાબી ધોરણો પ્રમાણે એનબીએફસીએ નાણાકીય અસ્કયામતો પર ક્ષતિગ્રસ્ત ઘટાડાની જોગવાઈ કરવાની રહેશે. - વધુમાં, ઉપરોક્ત પરિપત્ર મુજબ, આરબીઆઈની આવક માન્યતા, મિલકત વર્ગીકરણ અને જોગવાઈ ધોરણો મુજબ ક્ષતિગ્રસ્ત અનામતની જોગવાઈ ઊભી કરવામાં આવે છે. જે ઈન્ડસ્ટ્રીએસ ૧૦૯ હેઠળ કરવામાં આવતી ક્ષતિગ્રસ્ત ઘટાડા ઉપરાંતની છે. - ભારતીય હિસાબી ધોરણો-૧૦૯ માં દર્શાવેલ ઈસીએલ પદ્ધતિ પ્રમાણે ક્ષતિગ્રસ્ત અનામત શૂન્ય છે. - તદ્દનુસાર, આઈઆરએસી ધોરણો મુજબ ગણતરી કરેલ માનક અસ્કયામતો સામે આકસ્મિક જોગવાઈની વધારાની રકમ 'ક્ષતિગ્રસ્ત અનામત'માં તબદીલ કરવામાં આવે છે.
- જામીનગીરી પ્રિમીયમ** : જામીનગીરી પ્રિમીયમ શેર બહાર પાડવા પર પ્રિમીયમ રેકોર્ડ કરવા માટે વપરાય છે. અનામતનો ઉપયોગ કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૫૨ ની જોગવાઈઓ અનુસાર કરવામાં આવે છે.
- અન્ય સમગ્ર આવક દ્વારા ઇક્વિટી દસ્તાવેજો**
કંપનીએ અન્ય સમગ્ર આવકમાં ઇક્વિટી જામીનગીરીના રોકાણના બજાર મૂલ્યમાં ફેરફારને માન્યતા આપવાનું સ્વીકાર્યું છે. આ અનામત અન્ય સમગ્ર આવક દ્વારા બજાર મૂલ્ય પર પુનઃનિર્ધારણ કરવામાં આવેલ ઇક્વિટી દસ્તાવેજોના મૂલ્યાંકન પર થતાં સેવિત લાભ અને નુકસાનને બતાવે છે. જ્યારે સંબંધિત ઇક્વિટી જામીનગીરીનો નિકાલ કરવામાં આવે છે ત્યારે કંપની આ અનામતમાંથી જાળવી રાખેલી રકમ કંપાણીમાં સ્થાનાંતરિત કરે છે.

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ	શ્રી પંકજ જોષી	નિયામક મંડળના આદેશથી
મુકેશકુમાર જૈન કંપની વતી	(વહીવટી સંચાલક)	શ્રી સુનીલ તલાવી
સંસ્થા નોંધણી નં. ૧૦૬૬૧૯૬૯૬૯	(ડીન:૦૧૫૩૨૮૨૨)	(નિયામક)
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ		(ડીન:૦૦૬૨૧૯૪૭)
સહી	શ્રી નીતિન શાહ	શ્રી નિરજ જૈન
પિયુષ જૈન	(મુખ્ય નાણાકીય અધિકારી)	(કંપની સચિવ)
(ભાગીદાર)		(એસીએસ:૪૪૭૨૫)
સંબંધિત નં. ૪૧૩૩૭૭		
યુડીઆઈએન:૨૧૪૧૩૩૭૭એએએએપી૪૪૭૦		
સ્થળ : અમદાવાદ	સ્થળ : ગાંધીનગર	
તારીખ : ૨૨-૦૬-૨૦૨૧	તારીખ : ૨૨-૦૬-૨૦૨૧	

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ
૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ પુરા થતા વર્ષનું રોકડ પ્રવાહનું પત્રક

(₹ લાખમાં)

ભાગ	ના પૂરા થયેલા વર્ષ અંતિત	
	૩૧ માર્ચ, ૨૦૨૧	૩૧ માર્ચ, ૨૦૨૦
(ક) કામકાજ પ્રવૃત્તિઓમાંથી નાણા પ્રવાહ		
કર પહેલા નફો/ (નુકસાન)	૪૫૦૫૪.૯૫	૫૯૦૧૩.૮૦
ની સામે સરભર	૧૩.૬૨	૧૭.૨૫
ઘસારો	૫૧૭.૯૨	(૩૫૬૦.૧૫)
FVTPL રોકાણો પર અવાસ્તવિક (લાભ) / નુકસાન	(૬૪૧૭.૨૨)	(૪૩૫૪.૪૬)
ચડત વ્યાજ પરંતુ ગુજરાત સરકારની કંપનીને આપેલ લોન પર દેય નથી	(૨.૬૫)	(૨.૬૨)
વ્યાજ ઉપાર્જિત પરંતુ કર્મચારીઓને આપેલી લોન પર લેવાપાત્ર થતું નથી	(૮૫૫૫.૩૬)	(૮૫૨૭.૧૫)
વ્યાજ ઉપાર્જિત પરંતુ સરકારી જામીનગીરી અને બોન્ડ પર લેવાપાત્ર નહીં	(૭૭.૭૬)	(૨૨.૬૨)
વ્યાજ ઉપાર્જિત પરંતુ પ્રાથમિક વિકેતાના ભંડોળને લીધે નહીં	૧૧૫૩૦૩.૮	૧૧૭૦૦૫.૮૨
વ્યાજ ઉપાર્જિત પરંતુ આઈસીડી પર નહીં	૩૧૮૧.૦૯	૧૭૮૪.૫૫
લિક્વિડ ડિપોઝિટ યોજના પર ચુકવવાપાત્ર બાકી વ્યાજ	૬૯૪૨.૧૦	૬૦૮૯.૪૩
ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ પર ચુકવવાપાત્ર બાકી વ્યાજ	૫૫.૫૮	૪૭.૩૧
લાંબાગાળાના રોકાણ (ચોખ્ખા) પર ચૂકવેલ પ્રીમિયમની શ્રદ્ધિમુક્તિ	૪૪.૭૭	૭૩.૮૫
આવકવેરા પરનું વ્યાજ	૩.૮૩	૧.૦૭
રજાના રોકડમાં રૂપાંતર અને ગ્રેચ્યુટીની જોગવાઈ	(૪.૫૫)	(૬.૫૭)
નિર્ધારિત લાભ જવાબદારીઓનું પુનઃ મૂલ્યાંકન	(૦.૪૮)	(૦.૭૧)
મૂર્ત સંપત્તિના વેચાણ પર (નફો) / નુકસાન	(૨૬૧૦.૭૮)	(૭૮૬૫.૨૪)
મળેલ ડિવિડન્ડ	૧૫૨૪૪૮.૮૬	૧૫૯૭૦૩.૬૬
કાર્યકારી મૂડી પરિવર્તન પહેલાં કામકાજ નફો / (નુકસાન)		
કાર્યકારી મૂડીમાં પરિવર્તન:		
લોનમાં (વધારો) / ઘટાડો	(૧૨૦૭૭.૫૪)	(૧૯૪૦૪.૪૩)
રોકાણોમાં (વધારો) / ઘટાડો	(૪૭૮૪૪૬.૭૬)	(૧૮૮૩૮૩.૯૯)
અન્ય નાણાકીય સંપત્તિમાં (વધારો) / ઘટાડો	૧૨૯૦૬.૫૨	૧૦૫૮૭.૫૩
બિન નાણાકીય સંપત્તિમાં (વધારો) / ઘટાડો	(૦.૫૦)	(૧.૪૫)
અન્ય નાણાકીય જવાબદારીઓમાં વધારો/ (ઘટાડો)	(૧૩૯૦૦૫.૧૭)	(૧૨૪૯૧૦.૨૨)
અન્ય બિન નાણાકીય જવાબદારીઓમાં વધારો/ (ઘટાડો)	(૮૬૪.૦૬)	૦.૩૭
થાપણોમાં વધારો / (ઘટાડો)	૪૫૩૩૦૮.૨૧	૧૭૪૭૮૩.૨૩
ભરવાપાત્ર વેપારમાં વધારો/ (ઘટાડો)	૦.૩૬	(૨૨૭.૮૫)
કામકાજમાંથી પ્રાપ્ત થયેલ રોકડ:	(૧૧૭૩૦.૦૮)	૧૨૧૪૬.૮૫
ચૂકવેલા કર (ટિક્કડનો ચોખ્ખો)	(૮૮૭૩.૭૦)	(૧૯૨૮૯.૮૫)
કામકાજ પ્રવૃત્તિ (ક) માંથી ચોખ્ખો આવક	(૨૧૬૦૩.૭૮)	(૭૧૪૩.૧૦)
(ખ) રોકાણ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ		
મળેલ ડિવિડન્ડ	૨૬૧૦.૭૮	૭૮૬૫.૨૪
મૂર્ત સંપત્તિની ખરીદી	(૭.૨૯)	(૧૬.૨૮)
મૂર્ત સંપત્તિનું વેચાણ	૦.૬૯	૧.૦૨
રોકાણ પ્રવૃત્તિઓ (ખ) માંથી ચોખ્ખો રોકડ પ્રવાહ	૨૬૦૪.૧૮	૭૮૪૯.૯૮
(ગ) નાણાકીય પ્રવૃત્તિઓથી રોકડ પ્રવાહ		
ચૂકવેલ ડિવિડન્ડ (ડીડીટી સહિત)	(૩૪૪૯.૮૦)	(૧૨૯૧.૭૪)
નાણાકીય પ્રવૃત્તિઓ (ગ) માંથી ચોખ્ખો નાણા પ્રવાહ	(૩૪૪૯.૮૦)	(૧૨૯૧.૭૪)
રોકડ અને રોકડ સમકક્ષમાં ચોખ્ખો વધારો / (ઘટાડો) (ક + ખ + ગ)	(૨૨૪૪૯.૫૦)	(૫૮૪.૮૬)
વર્ષની શરૂઆતમાં રોકડ અને રોકડ સમકક્ષ	૪૩૬૯૯.૦૫	૪૪૨૮૩.૯૧
વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષ	૨૧૨૪૯.૫૫	૪૩૬૯૯.૦૫
રોકડ અને રોકડ સમકક્ષના ઘટકો		
હાથ પરની રોકડ	૦.૪૭	૦.૫૩
બેંકમાં રહેલ બેલેન્સ	૨૧૨૪૯.૦૨	૪૩૬૯૮.૪૬
હાથ પર રહેલ સ્ટેમ્પ	૦.૦૧	૦.૦૧
સરકારની ટેજરીમાં રહેલ બેલેન્સ	૦.૦૫	૦.૦૫
વર્ષના અંતે રહેલ રોકાણો રોકડ સમકક્ષ	૨૧૨૪૯.૫૫	૪૩૬૯૯.૦૫

સાથેની નોંધો નાણાકીય નિવેદનોનો અભિન્ન ભાગ બને છે.

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ
મુકેશકુમાર જૈન કંપની વતી
 સંસ્થા નોંધણી નં. ૧૦૬૬૧૯૬બલ્યુ
 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ

નિયામક મંડળના આદેશથી

શ્રી પંકજ જોષી
 (વહીવટી સંચાલક)
 (ડીન:૦૧૫૩૨૮૯૨)

શ્રી સુનીલ તલાટી
 (નિયામક)
 (ડીન:૦૦૬૨૧૯૪૭)

સહી
પિયુશ જૈન
 (ભાગીદાર)
 સભ્યપદ નં. ૪૧૩૩૭૭
 યુડીઆઈએન:૨૧૪૧૩૩૭૭એએએએબીપી૪૪૭૦

શ્રી નીતિન શાહ
 (મુખ્ય નાણાકીય અધિકારી)

શ્રી નિરજ જૈન
 (કંપની સચિવ)
 (એસીએસ:૪૪૭૨૫)

સ્થળ : અમદાવાદ
 તારીખ : ૨૨-૦૬-૨૦૨૧

સ્થળ : ગાંધીનગર
 તારીખ : ૨૨-૦૬-૨૦૨૧

ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ

૩૧ મી માર્ચ, ૨૦૨૧ અંતિત વર્ષનું નાણાંકીય પત્રકો પરની નોંધોનું પત્રક

૧ કંપનીનો દષ્ટિકોણ

ગુજરાત રાજ્ય નાણાંકીય સેવા લિમિટેડ ('કંપની') ભારત સ્થિત જાહેર લિમિટેડ કંપની છે અને કંપની અધિનિયમની જોગવાઈઓ હેઠળ વિંગ "બી", શ્રીજો માળ, ખનિજ ભવન, ૧૩૨ ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડની નજીક, વસ્ત્રાપુર, અમદાવાદ -૩૮૦૦૫૨ ખાતે આવેલી રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે. કંપની સુઆયોજિત મહત્વની થાપણ ન લેનારી-બેંકિંગ ધિરાણ કંપની (એનબીએફસી) ભારતીય રિઝર્વ બેંક સાથે નોંધાયેલ પણ છે.

ગુજરાત સરકાર કંપનીના ૭૭% ઇક્વિટી શેર ધરાવે છે. ગુજરાત સરકાર દ્વારા નિયંત્રિત વિવિધ સંસ્થાઓ અને રાજ્યના જાહેર ક્ષેત્રના એકમોના વધારાના ભંડોળનું સંચાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આમ, તે રાજ્યની વિવિધ માલિકીની કંપનીઓના આંતરિક તિજોરી વ્યવસ્થાપક તરીકે કાર્ય કરે છે.

૨૨ જૂન, ૨૦૨૧ ના રોજ કંપનીના નિયામક મંડળે નાણાંકીય પત્રકોને જાહેર કરવા માટે મંજૂરી આપી છે.

૨ તૈયારી કરવાનો આધાર

૨.૧ અનુપાલનનું નિવેદન

નાણાંકીય પત્રકો, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૩ હેઠળ બહાર પાડેલ, કંપની (ભારતીય હિસાબી ધોરણો) નિયમો, ૨૦૧૫ ના નિયમ ૩ અને કંપની (ભારતીય હિસાબી ધોરણો) સુધારા નિયમો, ૨૦૧૬ ને સાથે વાંચતા અને ભારતીય રીઝર્વ બેંકની વ્યવસ્થિત રીતે મહત્વપૂર્ણ બિન-થાપણ બેંકને લાગુ પડતી જોગવાઈઓના તમામ મહત્વના પાસાઓનું પાલન કરે છે.

૨.૨ નિર્ધારણનો આધાર

નાણાંકીય પત્રકો બજાર મૂલ્યો પર નિર્ધારણ કરેલ નીચેની બાબતો સિવાય ઐતિહાસિક ખર્ચ આધારે તૈયાર કરવામાં આવ્યા છે.

- ક. કેટલીક નાણાંકીય મિલકત અને જવાબદારીઓ
- ખ. નિર્ધારિત લાભ યોજના મિલકતો

૨.૩ કાર્યાત્મક અને પ્રસ્તુતિ ચલણ

ભારતીય રૂપિયો કાર્યાત્મક અને પ્રસ્તુતિ ચલણ છે.

૨.૪ અનુમાન અને નિર્ણયોનો ઉપયોગ

વ્યવસ્થાપકોએ ભારતીય હિસાબી ધોરણો સાથે સુસંગત રીતે નાણાંકીય પત્રકોની તૈયારી માટે અનુમાનો, નિર્ણયો અને ધારણાઓ બાંધવી જોઈએ.

આ અનુમાનો, નિર્ણયો અને ધારણાઓ હિસાબી નીતિઓને લાગુ કરવા અને મિલકતો અને જવાબદારીઓની દર્શાવેલ રકમો, નાણાંકીય પત્રકોની તારીખે સંભવિત મિલકતો અને જવાબદારીઓની જાહેરાતો અને સમયગાળા દરમિયાન આવક અને ખર્ચની દર્શાવેલ રકમો અહેવાલને અસર કરે છે.

હિસાબી અનુમાનો સમયે સમયે બદલાઈ શકે છે. વાસ્તવિક પરિણામો તે અનુમાનથી અલગ હોઈ શકે છે. અનુમાનોમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે છે કારણ કે અનુમાનની આસપાસના સંજોગોમાં થતા ફેરફારો વિશે વ્યવસ્થાપકો જાગૃત બને છે. જેમાં ફેરફારો કરવામાં એવા અનુમાનોમાં ફેરફાર તે સમયગાળાના નાણાંકીય પત્રકોમાં પ્રતિબિંબિત થાય છે અને, જે મહત્વનું હોય તો, તેની અસરો નાણાંકીય પત્રકોની નોંધોમાં જાહેર કરવામાં આવે છે.

આ નાણાંકીય પત્રકોમાં હિસાબી નીતિઓને લાગુ પાડવામાં નિર્ણાયક હિસાબી અનુમાનોમાં સંકળાયેલ જટિલ અને વ્યક્તિલક્ષી નિર્ણયો અને ધારણાઓનો ઉપયોગને જરૂરી એવા -

- મિલકત, સંયંત્રો અને ઉપકરણોનું ઉપયોગી જીવન
- નાણાંકીય સાધનોનું મૂલ્યાંકન
- જોગવાઈઓ અને આકસ્મિકતાઓ
- આવકવેરો અને વિલંબિત કર

- નોંધપાત્ર સંબંધિત પક્ષ વ્યવહારો ધ્યાનમાં લેવા
- નિર્ધારિત કર્મચારી લાભની જવાબદારીઓનું નિર્ધારણ

કોવિડ-૧૯ (“કોવિડ – ૧૯”) ના વૈશ્વિક આરોગ્ય રોગચાળાને લગતી અનિશ્ચિતતાઓનો અંદાજ

કોવિડ - ૧૯ વૈશ્વિક અને ભારતીય નાણાંકીય બજારો તેમજ વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ પર અસર ભવિષ્યના વિકાસ પર નિર્ભર રહેશે, જે અત્યંત અનિશ્ચિત છે. આમ છતાં, કંપની અપેક્ષા રાખી રહી છે કે કંપનીની નાણાંકીય સ્થિતિ અને કામગીરી પર કોવિડ-૧૯ ને કારણે સંભવિત અસરો નોંધપાત્ર ન હોઈ શકે કારણ કે કંપની માત્ર ગુજરાત સરકારની કંપનીઓને ધિરાણ કરે છે.

નાણાંકીય પત્રકોની મંજૂરીની તારીખ સુધી આંતરિક અને બાહ્યસ્ત્રોતના આધારે પ્રાથમિક વિકેટા અને જામીનગીરીના, ઇન્કિવેટી શેર, તરલ / દેવા યોજનાની મ્યુચ્યુઅલ ફંડ્સ, રોકાણની વહન રકમ પર કોવિડ-૧૯ ની આવનાર પરિણામની કંપનીએ સંભવિત અસરો અંગે પણ કંપનીએ વિચારણા કરી છે. કંપનીને અપેક્ષા છે કે આ સંપત્તિઓની વહન રકમ પુનઃ પ્રાપ્ત થશે.

૩ નોંધપાત્ર હિસાબી નીતિઓ

૩.૧ આવકની માન્યતા

આવક એ હદ સુધી માન્ય કરાય છે કે એવી સંભાવના હોય કે આર્થિક લાભ કંપનીમાં આવશે અને આવક વિશ્વસનીય રીતે નિર્ધારિત કરી શકાય.

વ્યાજ આવક

વ્યાજની આવકને અસરકારક વ્યાજ પદ્ધતિનો ઉપયોગ કરીને માન્યતા આપવામાં આવે છે. અસરકારક વ્યાજ દર એવો દર છે કે જે નાણાંકીય મિલકતના અપેક્ષિત જીવન દ્વારા અંદાજિત ભાવિ રોકડ આવકને નાણાંકીય મિલકતની કુલ વહન રકમ પર છૂટ આપે છે. અસરકારક વ્યાજના દરની ગણતરી કરતી વખતે, કંપની નાણાંકીય દસ્તાવેજોની બધી કરારની શરતો ધ્યાનમાં લઈને અપેક્ષિત રોકડ પ્રવાહનું અનુમાન લગાવે છે, પરંતુ અપેક્ષિત શાખ નુકસાનને ધ્યાનમાં લેતી નથી. પડતર વ્યાજ પરના વ્યાજને તે મળ્યાના વર્ષમાં માન્યતા આપવામાં આવે છે.

ડિવિડન્ડ

ડિવિડન્ડ મેળવવાનો હક સ્થાપિત થાય છે ત્યારે ડિવિડન્ડની આવકને માન્યતા આપવામાં આવે છે.

નાણાંકીય સંપત્તિની અમાન્યતા પર લાભ અથવા હાનિ

નાણાંકીય સંપત્તિની અમાન્યતા પર લાભ અથવા હાનિ, વેચાણ કિંમત (ચોખ્ખી વેચાણ કિંમત) અને નાણાંકીય સંપત્તિના વહન મૂલ્ય વચ્ચેના તફાવત તરીકે નક્કી થાય છે. રોકાણો પરના લાભો (હાનિ) એટલે મિલકત સંચાલન કંપનીઓના એકમોના વળતર / પ્રાપ્તિ સમયે FIFO પદ્ધતિ પર ગણવામાં આવે છે.

ડૂબત દેવાની વસૂલાત

ડૂબત દેવાની વસૂલાતને તે મળ્યાના વર્ષમાં આવક તરીકે માન્યતા આપવામાં આવે છે.

અન્ય બધી આવક માન્ય કરાય છે અને ઉપાર્જનના ધોરણે હિસાબમાં લેવામાં આવે છે.

૩.૨ મિલકતો, સંચંત્રો અને ઉપકરણો

મિલકત, સંચંત્રો અને ઉપકરણોની મૂળ કિંમત પર ચોખ્ખો સંચિત ઘસારો અને સંચિત ક્ષતિ નુકશાન, જે કોઈ હોય તો તે જણાવવામાં આવે છે.

જો મૂડીકરણ માપદંડને પૂર્ણ કરવામાં આવે અને તેના અપેક્ષિત ઉપયોગ માટે તેની વપરાશ સ્થિતિમાં લાવવા માટે સીધો આભારી ખર્ચમાં ખરીદી કિંમત, ઋણ કિંમતનો સમાવેશ થાય છે. કોઈપણ વેપારી વળતર અને છૂટ ખરીદ કિંમતમાંથી કાપવામાં આવે છે.

મિલકત, સંચંત્રો અને ઉપકરણોના હવે પછીનો ખર્ચ ત્યારે જ થાય છે જ્યારે સંભવિત હોય કે આની સાથે સંકળાયેલ ભાવિ આર્થિક લાભ કંપનીમાં આવશે અને વસ્તુની કિંમતને વિશ્વસનીય રીતે નિર્ધારિત કરી શકાય.

હાલની સ્થાવર મિલકત પરના અન્ય તમામ ખર્ચ, જેમાં દૈનિક મરામત અને જાળવણી ખર્ચ અને ભાગો બદલવાની કિંમતનો સમાવેશ થાય છે, અને તે સમયગાળા દરમિયાન નફા અને નુકસાનના પત્રકમાં દર્શાવવામાં આવે છે.

ભારતીય હિસાબી ધોરણમાં પરિવર્તન કરવા માટે, ૦૧ એપ્રિલ ૨૦૧૭ ની સ્થિતિએ અગાઉના જીએએપી હેઠળ મિલકત,

સંચિત્રો અને ઉપકરણોનું વહન મૂલ્ય તેની કિંમત તરીકે ગણવામાં આવે છે. વહન મૂલ્ય મૂળ કિંમતમાંથી સંચિત ઘસારો અને સંચિત હાનિ બાદ કરેલ હતી.

સરવૈયાની તારીખે મિલકત, સંચિત્રો અને ઉપકરણો અપેક્ષિત ઉપયોગ માટે તૈયાર ન હોય તેને “મૂડી કાર્ય-પ્રગતિ હેઠળ” તરીકે દર્શાવવામાં આવે છે.

અમાન્યતાને લીધે થતા લાભ અથવા હાનિની ગણતરી નિકાલ સમયે ચોખ્ખી નિકાલની આવક અને મિલકતની વહન રકમ વચ્ચેના તફાવત તરીકે કરવામાં આવે છે અને જ્યારે મિલકતને અમાન્ય કરવામાં આવે ત્યારે નફા અને નુકસાનના પત્રકમાં અમાન્ય ઠરાવવામાં આવે છે.

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની અનુસૂચિ-૨ હેઠળ ઠરાવેલ ઉપયોગી જીવન મુજબ ગુણોત્તરનો ઉપયોગ કરીને મિલકત, સંચિત્રો અને ઉપકરણો પરના ઘસારાની ગણતરી માંડવાળ પદ્ધતિ આધારે કરવામાં આવે છે.

વર્ષ દરમિયાન ખરીદેલી મિલકત, સંચિત્રો અને ઉપકરણોના સંદર્ભમાં, જે તારીખથી આવી મિલકત ઉપયોગ માટે તૈયાર હોય તે તારીખથી ગુણોત્તરના ધોરણે ઘસારો ગણવામાં આવે છે. પ્રત્યેક દસ હજાર રૂપિયાથી ઓછી કિંમતની મિલકતને ખરીદીના વર્ષમાં સંપૂર્ણ ઘસારો છે.

જો યોગ્ય હોય તો મિલકત, સંચિત્રો અને ઉપકરણોનો ઘસારો ઉપયોગી જીવંત અને ઘસારાની પદ્ધતિની દરેક નાણાંકીય વર્ષના અંતે શેષ મૂલ્યની સમીક્ષા કરવામાં અને સંભવિત રૂપે સમાયોજન કરવામાં આવે છે.

3.3 અમૂર્ત મિલકતો

અમૂર્ત મિલકતોને, ફક્ત એવી સંભાવના હોય કે મિલકતને આભારી ભાવિ આર્થિક લાભો સંસ્થાને મળશે અને કિંમત વિશ્વસનીય રીતે નિર્ધારિત કરી શકાય ત્યારે માન્યતા આપવામાં આવે છે.

અમૂર્ત મિલકતોની કિંમતને સંચિત્ર ઋણમુક્તિ અને હાનિ, જો કોઈ હોય તો બાદ કરીને જણાવવામાં આવે છે.

સરવૈયાની તારીખે તેના અપેક્ષિત ઉપયોગ માટે અમૂર્ત મિલકત તૈયાર ન હોય, તો “વિકાસ હેઠળની અમૂર્ત મિલકત” તરીકે જાહેર કરવામાં આવે છે.

અલગથી ખરીદેલી અમૂર્ત મિલકતને શરૂઆતમાં તેની કિંમત પર દર્શાવવામાં આવે છે. ત્યારબાદ, અમૂર્ત મિલકતો કોઈપણ સંચિત્ર ઋણમુક્તિ અને સંચિત્ર હાનિ, જો કોઈ હોય તો ઓછી વહન કિંમતે કરવામાં આવે છે.

અપેક્ષિત લાભનો સમયગાળો અથવા સરળ ધોરણના આધારે દસ વર્ષના સમયગાળા દરમિયાન અમૂર્ત મિલકતને અનુરૂપ ઋણમુક્ત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન સંપાદિત/ખરીદેલી અમૂર્ત મિલકતને જે તારીખથી આવી મિલકતો ઉપયોગ માટે તૈયાર હોય, તે તારીખથી ગુણોત્તર ધોરણે ઋણમુક્તિ આપવામાં આવે છે.

જો યોગ્ય હોય તો અમૂર્ત મિલકત ઘસારો ઉપયોગી જીવંત અને ઘસારાની પદ્ધતિની શેષ મૂલ્યની દરેક નાણાંકીય વર્ષના અંતે સમીક્ષા કરવામાં અને સંભવિત રૂપે સમાયોજન કરવામાં આવે છે.

3.4 નાણાંકીય દસ્તાવેજો

3.4.1 પ્રારંભિક માન્યતા

જ્યારે તે દસ્તાવેજ કરારની જોગવાઈઓનો પક્ષકાર બને ત્યારે કંપની નાણાંકીય મિલકતો અને નાણાંકીય જવાબદારીઓને માન્યતા આપે છે.

તમામ નાણાંકીય મિલકતો અને જવાબદારીઓને પ્રાથમિક માન્યતા બજાર મૂલ્ય પર આપે છે.

નાણાંકીય મિલકતોના સંપાદન અથવા જાહેર કરવા માટે સીધી રીતે જવાબદાર વ્યાવસાયિક કિંમત છે અને નફા અથવા નુકસાન દ્વારા બજાર મૂલ્ય માટે નાણાંકીય જવાબદારીઓ નથી તેને પ્રારંભિક માન્યતા પર નાણાંકીય મિલકતો અથવા નાણાંકીય જવાબદારીઓના બજાર મૂલ્યમાં ઉમેરવામાં અથવા કપાત કરવામાં આવે છે.

નફા અથવા નુકસાન દ્વારા બજાર મૂલ્ય પર નાણાંકીય મિલકતો અથવા નાણાંકીય જવાબદારીઓના હસ્તાંતરણને કારણે સીધા જ વ્યવહાર ખર્ચને નફા અથવા નુકસાનમાં તરત જ માન્ય કરવામાં આવે છે.

નાણાંકીય મિલકતોની ધોરણસરની ખરીદી અને વેચાણને વ્યવહારની તારીખે હિસાબમાં લેવામાં આવે છે.

3.4.2 અનુગામી મૂલવણી

ક ઊન-વ્યુત્પન્ન નાણાંકીય સાધનો

૧ નાણાંકીય મિલકતો ઋણમુક્તિ કિંમત ધરાવે છે

જો કરાર આધારિત રોકડ પ્રવાહ મેળવવા માટે મિલકત ધારણ કરવાનો ઉદ્દેશ હોય અને બાકી રહેલી મૂળ રકમ પર માત્ર

મૂળ રકમ અને વ્યાજની ચૂકવણી માટે અને નાણાંકીય મિલકતની કરારની શરતો રોકડ પ્રવાહને નિર્દિષ્ટ તારીખોમાં વધારો આપવા માટે નાણાંકીય મિલકતને ધંધાકીય આદર્શમાં ધારણ કરવામાં આવે તો પછીથી તેને ઋણમુક્ત કિંમતે નિર્ધારણ કરવામાં આવે છે.

૨ અન્ય સમગ્ર આવક દ્વારા બજાર મૂલ્ય પર નાણાંકીય મિલકત

જો નાણાંકીય મિલકતને ધંધાકીય આદર્શમાં રાખવામાં આવે અને નાણાંકીય મિલકતનું વેચાણ અને બાકી રહેલી મૂળ રકમ પર માત્ર મૂળ રકમ અને વ્યાજની ચૂકવણી માટે નાણાંકીય મિલકતની કરારની શરતો રોકડ પ્રવાહને નિર્દિષ્ટ તારીખોમાં વધારો આપવા માટે કરારનો રોકડ પ્રવાહ મેળવીને એમ બંને ઉદ્દેશ્ય હોય તો તેને પછીથી અન્ય સમગ્ર આવક દ્વારા બજાર મૂલ્ય પર નિર્ધારણ કરવામાં આવે છે.

કંપનીએ ધંધાકીય આદર્શના આધારે અન્ય સમગ્ર આવકમાં બજાર મૂલ્યમાં અનુગામી ફેરફારો દર્શાવવા માટે ઇક્વિટી દસ્તાવેજો તરીકે વર્ગીકૃત કરવામાં આવે એવા તેના રોકાણોને રદ ન કરી શકવાનું પસંદ કરેલ છે. આવા ઇક્વિટી દસ્તાવેજો માટે, બજાર મૂલ્યમાં અનુગામી ફેરફારોને અન્ય સમગ્ર આવકમાં માન્યતા આપવામાં આવે છે.

૩ નફા અથવા નુકસાન દ્વારા બજાર મૂલ્ય પર નાણાંકીય મિલકત

ઉપર જણાવેલી કોઈપણ કક્ષામાં વર્ગીકૃત ન કરી હોય એવી નાણાંકીય મિલકતને પછીથી નફા અથવા નુકસાન દ્વારા મૂલ્ય નિર્ધારિત કરવામાં આવે છે. બજાર મૂલ્યના ફેરફારોને આવક તરીકે નફા અથવા નુકસાનના પત્રકોમાં માન્યતા આપવામાં આવે છે.

૪ નાણાંકીય જવાબદારીઓ

નાણાંકીય જવાબદારીઓ પછીથી અસરકારક વ્યાજની પદ્ધતિનો ઉપયોગ કરીને ઋણમુક્ત ખર્ચ પર દર્શાવવામાં આવે છે.

ખ ઇક્વિટી દસ્તાવેજો

કંપનીની તમામ જવાબદારીઓ બાદ કર્યા પછી તેની મિલકતોમાં શેષ હિત દર્શાવતા ઇક્વિટી દસ્તાવેજો કરાર છે. ઇક્વિટી દસ્તાવેજો બહાર પાડવા માટે સીધી રીતે વધારાના ખર્ચને આભારી કોઈપણ કુલ કરની અસરો ઇક્વિટી દસ્તાવેજોમાંથી કપાત તરીકે માન્યતા આપવામાં આવે છે.

૩.૪.૩ અમાન્યતા

જ્યારે નાણાંકીય મિલકતમાંથી રોકડ પ્રવાહના કરાર આધારિત હકો સમાપ્ત થાય અથવા નાણાંકીય મિલકત સ્થાનાંતરિત કરે અને ભારતીય હિસાબી ધોરણ-૧૦૯ હેઠળ અમાન્યતા માટે સ્થાનાંતરિત માન્ય કરે ત્યારે કંપની નાણાંકીય મિલકતને અમાન્યતા આપે છે. જ્યારે કરારમાં ઉલ્લેખિત જવાબદારી પૂરી કરે અથવા રદ થાય અથવા સમાપ્ત થાય ત્યારે નાણાંકીય જવાબદારીને માન્યતા આપવામાં આવતી નથી.

૩.૪.૪ હિસાબી ખાતાના હવાલા

જ્યારે હાલમાં કંપની પાસે માન્ય રકમના હિસાબી હવાલા પાડવાનો કાયદેસર રીતે અમલ કરવાનો અધિકાર હોય અને કુલ ધોરણે કાં તો મૂળ ધોરણે પતાવટ કરવાનો અથવા તો મિલકતને મુક્ત કરવાનો અને જવાબદારી એક સાથે પતાવવાનો ઇરાદો ધરાવે ત્યારે નાણાંકીય મિલકતો અને નાણાંકીય જવાબદારીઓને સરવૈયામાં દર્શાવીને સરભર કરવામાં આવે છે.

૩.૪.૫ સુધારા

જ્યારે નાણાંકીય મિલકતના રોકડ પ્રવાહને નિયંત્રિત કરારની શરતોને પુનઃ વાટાઘાટો કરવામાં આવે અથવા અન્યથા નાણાંકીય મિલકતની પ્રારંભિક માન્યતા અને પરિપક્વતા વચ્ચે ફેરફાર કરવામાં આવે ત્યારે નાણાંકીય મિલકતોમાં સુધારો થાય છે. કરાર આધારિત રોકડ પ્રવાહની રકમ અને / અથવા સમયને તાત્કાલિક અથવા ભાવિ તારીખે સુધારો અસર કરે છે. કંપની નાણાંકીય મુશ્કેલીમાં મહત્તમ વસૂલાત અને ચૂકવણા જોખમને ઘટાડવા માટે ગ્રાહકોની લોન માટે ફરીથી વાટાઘાટો કરે છે. જ્યાં કરજ લેનારાએ મૂળ કરારની શરતો હેઠળ ચૂકવવાના તમામ વ્યાજબી પ્રયત્નો કર્યા હતા અને જ્યાં ચૂક અથવા ચૂકવણું ઊંચું જોખમ પહેલેથી જ હોય અને કરજ લેનાર સુધારેલી શરતોને પૂર્ણ કરવામાં સક્ષમ થવાની અપેક્ષા હોય, તેવા કિસ્સાઓમાં લોન સહિષ્ણુતા આપવામાં આવે છે. મોટાભાગના કેસમાં સુધારેલી શરતોમાં લોનની મુદતમાં વધારો કરવો, લોનના રોકડ પ્રવાહના સમયના ફેરફારો (મૂળ રકમ અને વ્યાજની ચૂકવણી), ચડત રોકડ પ્રવાહની માત્રામાં ઘટાડો કરવાનો (મૂળ રકમ અને વ્યાજ માફી) સમાવેશ થાય છે. લોનના સંદર્ભમાં તમામ સુધારાને પુનઃ વાટાઘાટ તરીકે ગણવામાં આવતા નથી અને મુદતવીતી ન હોય તેવા કરજદાર વર્ગના સંદર્ભમાં ફેરફારોને ફરીથી વાટાઘાટો તરીકે ગણવામાં આવતા નથી અને કામચલાઉ ક્ષતિ માટે ખટલો ચલાવાય નહીં.

3.4 બજાર મૂલ્ય નિર્ધારણ

બજાર મૂલ્ય એ કિંમત છે કે જે મિલકત વેચવાથી મળતી અથવા નિર્ધારણની તારીખે બજારના ભાગીદારો વચ્ચે કાયદેસર વ્યવહારની જવાબદારી સ્થાનાંતરિત કરવા માટે ચૂકવવામાં આવે છે.

બજાર મૂલ્ય નિર્ધારણ માને છે કે મિલકત વેચવા અથવા જવાબદારી સ્થાનાંતરિત કરવા માટેનો વ્યવહાર થાય છે, ક્યાં તો

- મિલકત અથવા જવાબદારી માટે મુખ્ય બજારમાં, અથવા
- મુખ્ય બજાર ન હોય તો, મિલકત અથવા જવાબદારી માટે સૌથી ફાયદાકારક બજારમાં.

બિન-નાણાંકીય મિલકતનું બજાર મૂલ્ય નિર્ધારણ બજારના ભાગીદારોની આર્થિક લાભ ઉત્પન્ન કરવાની ક્ષમતાને અથવા બજારમાં અન્ય સહભાગીને તેના ઉચ્ચતમ અને શ્રેષ્ઠ ઉપયોગ માટે વેચવાનું ધ્યાનમાં લે છે.

કંપની, સંબંધોમાં યોગ્ય હોય અને જેના માટે બજાર મૂલ્ય નિર્ધારણ કરવા માટે પૂરતી માહિતી ઉપલબ્ધ હોય, સંબંધિત અવલોકનક્ષમ સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને બિનસલાહભર્યા સાધનોનો ઉપયોગ ઘટાડે એવી મૂલ્યાંકન તકનીકોનો ઉપયોગ કરે છે.

નાણાંકીય પત્રકોમાં બજાર મૂલ્ય નિર્ધારણ અથવા જાહેર કરવામાં આવે, તે તમામ મિલકતો અને જવાબદારીઓ બજાર મૂલ્યના ક્રમમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બજાર મૂલ્ય ક્રમ મૂલ્યાંકન તકનીકોના સાધનો પર આધારિત છે જે બજાર મૂલ્યને નિર્ધારણ કરવા માટે વપરાય છે, જે ક્યાં તો અવલોકનક્ષમ અથવા બિન અવલોકનક્ષમ હોય છે અને નીચેના ત્રણ સ્તરો ધરાવે છે:

સ્તર-૧. સમાન મિલકતો અથવા જવાબદારીઓ માટે સક્રિય બજારોમાં સાધનોના ભાવો (અસંતુલિત) ખતાવવામાં આવે છે.

સ્તર-૨. સ્તર-૧ માં સમાવેશ કરેલી દર્શાવેલી કિંમતો સિવાયના સાધનો જે મિલકત અથવા જવાબદારી માટે સીધી (એટલે કે કિંમતો તરીકે) અથવા પરોક્ષ રીતે (એટલે કે તારવેલી કિંમતો) અવલોકનક્ષમ છે.

સ્તર-૩. સાધનો અવલોકનક્ષમ બજારની માહિતી (બિન અવલોકનક્ષમ સાધનો) પર આધારિત નથી. બજાર મૂલ્યો ધારણાના આધારે મૂલ્યાંકન પદ્ધતિનો ઉપયોગ કરીને સંપૂર્ણ અથવા આંશિક રીતે નક્કી કરવામાં આવે છે જે ન તો સમાન સાધનમાં નિરીક્ષણક્ષમ વર્તમાન બજાર વ્યવહારોના ભાવો દ્વારા સમર્થિત છે અને ન તો તે ઉપલબ્ધ બજાર માહિતી પર આધારિત છે.

3.5 આવક વેરો

આવકવેરા ખર્ચમાં વર્તમાન કર અને વિલંબિત કરનો સમાવેશ થાય છે.

3.5.1 વર્તમાન કર

વર્તમાન કર નફા અથવા નુકસાનમાં માન્ય કરવામાં આવે છે, સિવાય કે જ્યારે તે અન્ય સમગ્ર આવકમાં અથવા સીધી ઇક્વિટીમાં માન્યતા પ્રાપ્ત બાબતોને સંબંધિત હોય, તેવા કિસ્સામાં, વર્તમાન કરને અનુક્રમે અન્ય સમગ્ર આવકમાં અથવા સીધા ઇક્વિટીમાં પણ માન્ય કરવામાં આવે છે.

વર્તમાન અને અગાઉના સમયગાળા માટેના વર્તમાન કર જેને સંભવિત રકમ ચુકવવાની થાય અથવા કરવેરા અધિકારીઓ પાસેથી વસૂલ કરવાની થાય ત્યારે સરવૈયાની તારીખે લાગુ કરવામાં આવ્યા હોય અથવા નોંધપાત્ર રીતે લાગુ કરવામાં આવ્યા હોય એવા કરના દરો અને કરવેરા કાયદાઓનો ઉપયોગ કરીને માન્ય કરવામાં આવે છે.

કંપનીને જ્યાં માન્ય રકમ નક્કી કરવાનો કાયદેસર રીતે લાગુ કરવાનો અધિકાર છે અને જ્યાં તે કાં તો વાજબી ધોરણે પતાવટ કરવાનો ઇરાદો ધરાવે છે, અથવા તો મિલકત છૂટી કરે છે અને જવાબદારીની એક સાથે પતાવટ કરે છે ત્યાં વર્તમાન કર મિલકતો અને વર્તમાન કર જવાબદારીઓ સરભર કરવામાં આવે છે.

3.5.2 વિલંબિત કર

વિલંબિત કરને નફા અથવા નુકસાનમાં માન્યતા આપવામાં આવે છે, સિવાય કે જ્યારે તે અન્ય સમગ્ર આવકમાં અથવા સીધી ઇક્વિટીમાં માન્યતા પ્રાપ્ત બાબતોને સંબંધિત હોય, તેવા કિસ્સામાં, વિલંબિત કરને અનુક્રમે અન્ય સમગ્ર આવકમાં અથવા સીધા ઇક્વિટીમાં પણ માન્યતા આપવામાં આવે છે.

વિલંબિત કર જવાબદારીઓને તમામ કરપાત્ર અસ્થાયી તફાવતો માટે માન્યતા આપવામાં આવે છે, સિવાય કે વિલંબિત કર જવાબદારી સદ્ભાવનાની પ્રારંભિક માન્યતાથી ઊભી થાય તે હદ સિવાય; અથવા વ્યવહારમાં સંપત્તિ અથવા જવાબદારીની પ્રારંભિક માન્યતા જે વ્યવસાયિક સંયોજન નથી અને વ્યવહારના સમયે, ન તો હિસાબી નફો કે કરપાત્ર નફો કે નુકસાનને અસર કરતું નથી.

વણવપરાયેલ કર નુકસાન અને આગળ ખેંચેલ વણવપરાયેલ કર શાખને કરપાત્ર નફો કામચલાઉ તફાવતો, નુકસાન અને કર શાખને શક્ય હોય તે હદ સુધી ઉપયોગ કરી શકાય ત્યાં સુધી વિલંબિત કર મિલકત તમામ કપાતપાત્ર કામચલાઉ તફાવતો માટે માન્ય કરાય છે; સિવાય કે જ્યારે કપાતપાત્ર કામચલાઉ તફાવતો પર વિલંબિત કરવેરા મિલકત વ્યવહારમાં મિલકત અથવા જવાબદારીની પ્રારંભિક માન્યતામાંથી ઉદભવે છે, જે તે ઇંદાકીય સંયોજન નથી અને વ્યવહાર સમયે, ન તો હિસાબી નફો અથવા કરપાત્ર નફા અથવા નુકસાનને અસર કરે છે.

જ્યારે મિલકત છૂટી કરવામાં આવે અથવા જવાબદારી પતાવટ કરવામાં આવે અને જ્યારે કરવેરા નિયમો અને કર કાયદાના આધારે અહેવાલના સમયગાળાના અંત સુધીમાં ઘડવામાં આવ્યા હોય અથવા નોંધપાત્ર રીતે અમલમાં મૂકવામાં આવ્યા હોય ત્યારે જે સમયગાળાને લાગુ થવાની અપેક્ષા છે તે સમયગાળા માટે વિલંબિત કર મિલકત અને જવાબદારીઓને કર દર પર નિર્ધારણ કરવામાં આવે છે.

જ્યાં કંપનીને માન્ય રકમ નક્કી કરવાનો કાયદેસર રીતે અમલ કરવાનો અધિકાર છે અને જ્યાં તે કાં તો વાજબી ધોરણે પતાવટ કરવાનો અથવા તો મિલકતને છૂટી કરવાનો અને સાથોસાથ જવાબદારી પતાવવાનો ઇરાદો ધરાવે છે, ત્યાં વિલંબિત કર મિલકતો અને વિલંબિત કર જવાબદારીઓ સરભર કરવામાં આવે છે.

વિલંબિત કરની મિલકતોની દરેક અહેવાલની તારીખે સમીક્ષા કરવામાં આવે છે અને હવે સંબંધિત કર લાભ મળશે તેવી શક્યતા નથી એટલી હદ સુધી ઘટાડવામાં આવે છે.

૩.૭ ઘટાડો

૩.૭.૧ નાણાંકીય મિલકતો

કંપની ભારતીય હિસાબી ધોરણોમાં નિર્ધારિત અપેક્ષિત ધિરાણ નુકસાન (ઇસીએલ) પદ્ધતિનો ઉપયોગ કરીને બજાર મૂલ્યથી વહન કરવામાં આવતી નથી તેવી નાણાંકીય મિલકતો પરની હાનિને માન્ય કરે છે.

અપેક્ષિત ધિરાણ નુકસાન (ઇસીએલ) તમામ નાણાંકીય મિલકતો માટે ઋણમુક્ત ખર્ચ પર આગળ જોયેલી માહિતીના આધારે માન્ય કરવામાં આવે છે, ઇક્વિટી રોકાણો પર કોઈ હાનિ નુકસાન લાગુ પડતું નથી.

અહેવાલની તારીખે, ૧૨ મહિનાના અપેક્ષિત ધિરાણ નુકસાન માટે છૂટ છે. જે પ્રારંભિક માન્યતા (સ્તર-૧) થી ધિરાણ જોખમ નોંધપાત્ર રીતે વધ્યું હોય, જેના માટે પ્રારંભિક માન્યતા (સ્તર-૨) અથવા જે ધિરાણ હાનિ (સ્તર-૩) થી ધિરાણ જોખમ નોંધપાત્ર રીતે વધ્યું હોય તો છૂટ (અથવા જોગવાઈ) ને નાણાંકીય દસ્તાવેજો માટે આજીવન અપેક્ષિત ધિરાણ નુકસાન માટે માન્ય હોવી જોઈએ.

નિર્ધારણની ગણતરી ત્રણ મુખ્ય ઘટકોની મદદથી કરવામાં આવે છે: (૧) ચૂક થવાની શક્યતા (પીડી) (૨) ચૂકથી આપેલ નુકસાન (એલજીડી) અને (૩) ચૂકના સમયે જાહેર (ઇએડી) થવું. ૧૨ મહિનાના અપેક્ષિત ધિરાણ નુકસાન (ECLS) ની ગણતરી ૧૨ મહિનાના પીડી, એલજીડી અને ઇએડીનો ગુણાકાર કરીને કરવામાં આવે છે. ૧૨ મહિના અને આજીવન પીડી અનુક્રમે આવતા ૧૨ મહિનામાં થનારી પીડી અને દસ્તાવેજોની બાકીની પાકતી મુદત ૨૫૦ કરે છે. પ્રતિબદ્ધ સુવિધાઓના સ્તરના નીચે જવાની કોઈપણ અપેક્ષિત ઘટના સરવૈયાની તારીખે ચૂકના સમયે મૂળ રકમ અને વ્યાજની ચુકવણી ધ્યાનમાં લઈને ઇએડી ચૂક પર અપેક્ષિત સંતુલનનું પ્રતિનિધિત્વ કરે છે. ચૂકની ઘટનાને ધ્યાનમાં લઈને, અન્ય વિશેષતાઓમાં, જ્યારે તે ધારણાની અપેક્ષા રાખવામાં આવે છે તે સમયે સમાનાંતર મૂલ્યના ઘટાડાની અસર અને નાણાંકીય સમય મૂલ્ય એલજીડી ઇએડી પર અપેક્ષિત નુકસાનનું પ્રતિનિધિત્વ કરે છે.

ઋણમુક્તિ રકમ માટે નાણાંકીય મિલકતો પર ઇસીએલ નિર્ધારણ કરવા માટે કંપની ત્રણ તબક્કાનો અભિગમ લાગુ કરે છે. પ્રારંભિક માન્યતા આખેથી ધિરાણ ગુણવત્તામાં ફેરફારના આધારે મિલકતને નીચેના ત્રણ તબક્કાઓમાંથી સ્થળાંતર કરે છે.

સ્તર-૧. ૧૨-મહિનાનું ઇસીએલ

પ્રારંભિક માન્યતા પછી ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થયો ન હોય એવી જાહેરાત માટે અને શરૂઆતથી ધિરાણ હાનિ ન થઈ હોય, આજીવન ઇસીએલનો ભાગ આગામી ૧૨ મહિનાની અંદર ચૂકની ઘટનાઓની સંભાવના સાથે સંકળાયેલ હોય તેને માન્ય કરવામાં આવે છે. ચડત મહિનાઓ કરતા ઓછા અથવા ૨૯ દિવસ જેટલી જાહેરાતોને સ્તર-૧ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કંપનીએ શૂન્ય પતાવટ અને ડીપીડીની પતાવટ ૨૯ દિવસથી ઓછા અથવા એટલા દિવસ એમ બે અલગ અલગ પતાવટ તરીકે ઓળખાવી છે.

સ્તર-૨: આજીવન ECL - ધિરાણ નબળું પડેલ નથી

ધિરાણ જાહેરાત માટે જ્યાં શરૂઆતની માન્યતા પછી ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થયો હોય, પણ જે ધિરાણ નબળું પડેલ નથી, ત્યાં આજીવન ઇસીએલ માન્ય છે. ડીપીડી જાહેરાતના ૩૦ દિવસ પરંતુ ૮૯ દિવસ અથવા તેનાથી ઓછા દિવસને સ્તર-૨ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. કંપની, અહેવાલની દરેક તારીખે, પ્રારંભિક માન્યતા પછીથી નાણાકીય મિલકત માટે ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે કે કેમ તેનું અહેવાલની તારીખ અને પ્રારંભિક માન્યતાની તારીખ વચ્ચેના અપેક્ષિત જીવન પર થયેલી ચૂકના જોખમની તુલના કરીને મૂલ્યાંકન કરે છે. કંપનીએ ૩૦ દિવસ કરતા વધારે અને ૫૯ દિવસ અથવા તેનાથી ઓછા ડીપીડીના કેસો અને ૬૦ દિવસથી વધુ અથવા ૮૯ દિવસ અથવા તેનાથી ઓછા ડીપીડીના કેસો એમ બે બે અલગ પતાવટ તરીકે ઓળખ્યા છે.

સ્તર-૩: આજીવન ઇસીએલ

જ્યારે એક અથવા વધારે ઘટનાઓ જે તે મિલકતના સંભવિત ભાવિ રોકડ પ્રવાહ પર હાનિકારક અસર કરી હોય ત્યારે નબળા ધિરાણને નાણાકીય મિલકતના નબળા ધિરાણ તરીકે મૂલ્યાંકન કરવામાં આવે છે. નાણાકીય મિલકત માટે નબળા પડેલા ધિરાણને આજીવન ઇસીએલ તેનો સમયગાળો પૂરો થયેથી મૂળ બાકી રકમ પર માન્ય છે. ૯૦ દિવસ અથવા તેથી વધુ દિવસની ડીપીડીની જાહેરાતને સ્તર-૩ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

જ્યાં સુધી કરાર આધારિત રોકડ પ્રવાહ પ્રાપ્ત ન થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટ્યું છે અને નબળા પડવાના અન્ય કોઈ સંકેતોના પુરાવાઓ ન હોય ત્યાં સુધી લોન લેનારની નબળી પરિસ્થિતિના કારણે પુનઃવાટાઘાટો કરવામાં આવી હોય તેવી લોનને સામાન્ય રીતે નબળું ધિરાણ માનવામાં આવે છે.

ઈસીએલને ઈએડી પર સમયગાળાના અંતે માન્યતા મળે છે. જે નાણાકીય મિલકતની શરતો કરજ લેનારની નાણાકીય મુશ્કેલીઓને કારણે પુનઃ વાટાઘાટ અથવા ફેરફાર કરવામાં આવે તો, આવી મિલકતોને સ્તર-૩ માં ખસેડવામાં આવે છે, બાકી રકમ પર સ્તર-૩ હેઠળ આજીવન ઇસીએલ લાગુ પડે છે.

જ્યારે જથ્થાત્મક અને ગુણાત્મક મૂલ્યાંકનને આધારે ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થાય ત્યારે કંપની મૂલ્યાંકન કરે છે. જાહેરાતને લીધે ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું માનવામાં આવે છે અને સ્તર-૨ માં ખસેડવામાં આવે છે, જ્યારે:

જથ્થાત્મક પરિક્ષણ: ૩૦ કેલેન્ડર દિવસો કે તેથી વધુ સમય પહેલાના ખાતાઓ આપોઆપ સ્તર-૨ માં જાય છે. ૯૦ કેલેન્ડર દિવસો અથવા તેથી વધુ સમય પહેલાના ખાતાઓ સ્તર-૩ માં આપોઆપ જાય છે.

સ્તરમાં પરિવર્તન: એકવાર તેઓ ઉપર ઠરાવેલ માત્રાત્મક માપદંડને પૂર્ણ કરશે નહીં ત્યારે રજૂઆતો અનુક્રમે સ્તર-૨ અથવા સ્તર-૧ પરિવર્તિત થાય છે. ગુણાત્મક પરીક્ષણનો ઉપયોગ કરીને વર્ગીકૃત થયેલ રજૂઆત માટે, જ્યારે તેઓ ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારાના માપદંડને લાંબા સમય સુધી પૂર્ણ કરે નહીં અને જ્યારે ધિરાણ જોખમ વ્યવસ્થાપન માટે ઉપયોગમાં લેવામાં આવતા કોઈપણ ઉપાય માપદંડને પૂર્ણ કરવામાં આવે ત્યારે રજૂઆતને વર્ગીકૃત કરવામાં આવે છે.

કરજદારની ચૂકવવાની શક્યતા નથી એવા સંકેતોને ધ્યાનમાં લે છે અને જ્યારે જાહેરાત ૯૦ દિવસથી વધુ સમય જૂની હોય તેની ઇસીએલ નક્કી કરવાના હેતુ માટે ચૂકની વ્યાખ્યાને ચૂકને ભારતીય રિઝર્વ બેંકની વ્યાખ્યામાં ગોઠવાય છે,

અહેવાલની તારીખે ધારણ કરેલ નાણાકીય મિલકતના તમામ અપેક્ષિત ધિરાણ નુકસાનનું નિર્ધારણ ઐતિહાસિક અનુભવ, વર્તમાન પરિસ્થિતિઓ અને વાજબી અને સમર્થિત પુર્વાનુમાન પર આધારિત છે. ઇસીએલના નિર્ધારણમાં વધેલી જટિલતા અને નિર્ણયો જેમાં પીડી, એલજીડીનો અંદાજ, નિષ્પક્ષ ભાવિ આર્થિક દૃશ્યોની શ્રુષ્ઠલા, અપેક્ષિત જીવનનો અંદાજ અને ઇએડીનો અંદાજ અને ધિરાણ જોખમમાં નોંધપાત્ર વધારાનું મૂલ્યાંકનનો સમાવેશ થાય છે.

નાણાકીય મિલકત માટે ઈસીએલ છૂટની રજૂઆત:

શ્રદ્ધામુક્તિ ખર્ચ પર નિર્ધારિત કરવામાં આવેલી નાણાકીય મિલકતો જોગવાઈઓ હેઠળના સદરે અલગથી ખતાવવામાં આવે છે પણ મિલકતની કુલ વહન રકમમાંથી કપાત તરીકે નહીં.

માંડવાળ

નબળી અને મળવાપાત્ર લોનને કંપનીની આંતરિક કાર્યપદ્ધતિ પૂર્ણ થવા પર નબળી લોન માટે સંબંધિત છૂટ સામે અને જ્યારે કંપની એવા નિર્ણય પર આવે કે હવે અંશતઃ અથવા પૂરેપૂરી લોનની વસૂલાતની કોઈ વાસ્તવિક સંભાવના નથી ત્યારે માંડવાળ કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવતી નબળી લોન માટે, દરેક કેસના આધારે માંડવાળ કરવાનો સમય નક્કી કરવામાં આવે છે. માંડવાળ અમાન્યતા ઘટનાની બને છે. કંપનીને આવી માંડવાળ કરેલ નાણાકીય મિલકતોની વસૂલાત કરવા અમલ બજવણી કામગીરી લાગુ કરવાનો અધિકાર છે. અગાઉ માંડવાળ કરેલી રકમની પછીથી આવેલ વસૂલાત આવક પત્રકમાં જમા થાય છે.

૩.૭.૨ બિન નાણાંકીય મિલકતો

મૂર્ત અને અમૂર્ત મિલકતો

કંપની, મિલકત નબળી પડી તેવા સંકેતો છે કે કેમ તેનું દરેક અહેવાલની તારીખે મૂલ્યાંકન કરે છે. જો કોઈ સંકેત જણાય તો કંપની મિલકતની વસૂલાત યોગ્ય રકમનો અંદાજ કાઢે છે. મિલકતની વસૂલાત યોગ્ય રકમ મિલકતની ચોખ્ખી વેચાણ કિંમત અને વપરાશમાં તેની કિંમત કરતાં ઊંચી છે. વસૂલાતપાત્ર રકમ વ્યક્તિગત મિલકત માટે નક્કી કરવામાં આવે છે, સિવાય કે અન્ય મિલકતો અથવા મિલકતો જૂથોથી મોટા પ્રમાણમાં સ્વતંત્ર હોય એવી મિલકત રોકડ પ્રવાહ પેદા ન કરે.

જ્યારે મિલકતની વહન રકમ તેની વસૂલાતપાત્ર રકમ કરતાં વધી જાય, ત્યારે મિલકતને નબળી માનવામાં આવે છે અને તેની વસૂલાતપાત્ર રકમ માંડવાળ કરવામાં આવે છે. નફા અને નુકસાનના પત્રકમાં ક્ષતિ નુકસાન માન્ય કરવામાં આવે છે.

ઉપયોગી મૂલ્યનું મૂલ્યાંકન કરવામાં, તેના હાલના મૂલ્યને અંદાજિત ભવિષ્યના રોકડ પ્રવાહને કરવેરા પૂર્વ વળતરના દરનો ઉપયોગ કરીને તેના વર્તમાન મૂલ્યમાં વળતર આપવામાં આવે છે જે નાણાંના સમય મૂલ્યના વર્તમાન બજાર મૂલ્યાંકન અને મિલકતને લગતા જોખમોને પ્રતિબિંબિત કરે છે.

ચોખ્ખી વેચાણ કિંમત નક્કી કરવા તાજેતરના બજાર વ્યવહારો જો ઉપલબ્ધ હોય તો ધ્યાનમાં લેવામાં આવે છે. જો આવા કોઈ વ્યવહારો મળી શકે નહીં, તો યોગ્ય મૂલ્યાંકન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

૩.૮ કરજ ખર્ચ

કંપનીએ કરજ ભંડોળના સંબંધમાં કરેલ કરજ ખર્ચમાં વ્યાજ અને અન્ય કિંમતમાં સમાવેશ થાય છે.

કરજ ખર્ચ મિલકતના સંપાદન, નિર્માણ અથવા ઉત્પાદન માટે સીધી રીતે આભારી છે કે જે તેના હેતુસર ઉપયોગ અથવા વેચાણ માટે તૈયાર કરવા માટે જરૂરી સમયનો નોંધપાત્ર સમયગાળો લે છે, સંબંધિત મિલકતની કિંમતના ભાગ રૂપે મૂડીકરણ કરવામાં આવે છે.

અન્ય તમામ ખર્ચ જે વર્ષે થાય તે વર્ષમાં ઉદારવામાં આવે છે.

વિશિષ્ટ કરજના કામચલાઉ રોકાણ પર મળેલ રોકાણની આવક વિશેષ મિલકતો પર તેમનો બાકી ખર્ચ મૂડીકરણ માટે માન્ય કરજ ખર્ચમાંથી કાપવામાં આવે છે.

૩.૯ કર્મચારી લાભો

પગાર જેવા ટૂંકા ગાળાના કર્મચારી લાભોને કે જેમાં કર્મચારીઓ સંબંધિત સેવા બજાવે છે તે અહેવાલના સમયગાળાના અંતે ૧૨ મહિનાની અંદર સંપૂર્ણ રીતે પતાવટ થવાની અપેક્ષા રાખવામાં આવે છે તેને નફા અને નુકસાનના પત્રકમાં ખર્ચ તરીકે માન્ય કરવામાં આવે છે.

ભવિષ્ય નિધિના રૂપમાં નિવૃત્તિ લાભ એ એક નિર્ધારિત ફાળા યોજના છે. ભવિષ્ય નિધિમાં ચૂકવવાપાત્ર ફાળો આપવા સિવાય કંપનીની કોઈ જવાબદારી નથી. જ્યારે કોઈ કર્મચારી સંબંધિત સેવા આપે છે ત્યારે ભવિષ્ય નિધિ યોજનામાં ચૂકવવાપાત્ર ફાળાને કંપની ખર્ચ તરીકે માન્યતા આપે છે.

કંપની તેના કર્મચારીઓ માટે બે નિર્ધારિત લાભ યોજના- ગ્રેચ્યુઇટી યોજના અને રજાનું રોકડમાં રૂપાંતર યોજના ચલાવે છે. આ યોજનાઓ હેઠળ લાભ આપવાનો ખર્ચ દરેક વર્ષના અંતે વીમાકૃત મૂલ્યના આધારે નક્કી કરવામાં આવે છે. વીમાકૃત મૂલ્ય દરેક અહેવાલની તારીખના અંતે બનાવેલી અંદાજિત એકમ જમા પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ચોખ્ખી નિર્ધારિત લાભ જવાબદારી (અસ્કયામત) નું પુન-નિર્ધારણ વીમાકૃત ફાયદા અને નુકસાન, મિલકતની ટોચમર્યાદાની અસર, ચોખ્ખી વ્યાજ સાથે સમાવિષ્ટ રકમને બાદ કરતા ચોખ્ખી નિર્ધારિત લાભ જવાબદારી (મિલકત) અને યોજનાની મિલકત પર વળતર (રકમ સિવાય) નો સમાવેશ થાય છે. પુન: નિર્ધારણ અન્ય સમગ્ર આવકમાં માન્ય કરાય છે અને પછીના સમયગાળામાં નફા અથવા નુકસાનમાં પુન:વર્ગીકૃત કરવામાં આવશે નહીં.

૩.૧૦ જોગવાઈઓ

જ્યારે ભૂતકાળની ઘટનાના પરિણામે કંપનીની વર્તમાન જવાબદારી હોય અને એ શક્ય હોય કે આર્થિક લાભોનો સમાવેશ કરતા સંસાધનોનો પ્રવાહ જવાબદારી નિભાવવા માટે જરૂરી હોય અને જવાબદારીની રકમનો વિશ્વસનીય અંદાજ લગાવી શકાય તેમ હોય, તો જોગવાઈને માન્ય કરવામાં આવે છે

જો નાણાંના સમય મૂલ્યની અસર નોંધપાત્ર હોય, તો કરવેરા પૂર્વના વર્તમાન દરનો ઉપયોગ કરીને સામાન્ય કિંમતથી ઓછી કિંમતે જોગવાઈઓ કરવામાં આવે છે, જે નાણાંના સમય મૂલ્યના વર્તમાન બજાર મૂલ્યાંકન અને જવાબદારીને લગતા જોખમોને પ્રતિબિંબિત કરે છે. જ્યારે સામાન્ય કિંમતથી ઓછી કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે સમય જતાં જોગવાઈમાં વધારો નાણાંકીય ખર્ચ તરીકે માન્ય કરાય છે.

જોગવાઈઓને તેમના વર્તમાન મૂલ્યમાં છૂટ આપવામાં આવે નહીં અને અહેવાલની તારીખે જવાબદારીને પતાવવા માટે જરૂરી શ્રેષ્ઠ અંદાજના આધારે નક્કી કરવામાં આવે છે. આ અંદાજોની દરેક અહેવાલની તારીખે સમીક્ષા કરવામાં આવે છે અને વર્તમાન શ્રેષ્ઠ અંદાજોને પ્રતિબિંબિત કરવા ગોઠવવામાં આવે છે.

3.૧૧ સંભવિત જવાબદારી

ભૂતકાળની ઘટનાઓમાંથી ઊભી થતી આકસ્મિક જવાબદારી એ સંભવિત જવાબદારી છે, જેનું અસ્તિત્વ કંપનીના નિયંત્રણની બહાર ભવિષ્યની એક અથવા વધુ ઘટના અથવા અનિશ્ચિત ઘટનાઓની પુષ્ટિથી કરવામાં આવશે અથવા માન્ય ન કરેલ હાલની જવાબદારીના કારણે તે સંભવિત નથી કે સંસાધનોના પ્રવાહને જવાબદારીને પતાવવા માટે જરૂરી રહેશે. જ્યાં વિશ્વસનીય રીતે નિર્ધારણ ન કરી શકવાના કારણે એવી જવાબદારી હોય, ત્યાં સંભવિત જવાબદારી અત્યંત દુર્લભ કિસ્સાઓમાં પણ ઊભી થાય છે. કંપની સંભવિત જવાબદારીને માન્ય કરતી નથી પરંતુ નાણાકીય પત્રકોમાં તેનું અસ્તિત્વ જાહેર કરે છે.

3.૧૨ સંભવિત મિલકતો

ભૂતકાળની ઘટનાઓમાંથી ઊભી થતી આકસ્મિક મિલકત એ સંભવિત મિલકત છે, જેનું અસ્તિત્વ કંપનીના સંપૂર્ણ નિયંત્રણની બહાર ભવિષ્યની એક અથવા વધુ ઘટના અથવા અનિશ્ચિત ઘટનાઓની પુષ્ટિથી કરવામાં આવશે. કંપની સંભવિત મિલકતને માન્ય કરતી નથી પરંતુ નાણાકીય પત્રકોમાં તેનું અસ્તિત્વ જાહેર કરે છે.

3.૧૩ રોકડ અને રોકડ સમકક્ષ

રોકડ પ્રવાહ પત્રકના હેતુ માટે રોકડ અને રોકડ સમકક્ષ બેંકમાં રોકડ (માંગ થાપણો સહિત) અને હાથ પરની રોકડ અને ટૂંકા ગાળાની, જાણીતી રોકડ રકમમાં સરળતાથી રૂપાંતરિત કરી શકાય એવી ત્રણ મહિના કે તેથી ઓછી મુદતની મૂળ પરિપક્વતાવાળા અત્યંત પ્રવાહી રોકાણો અને મૂલ્યમાં ફેરફારના નજીવો જોખમને આધીન હોય તેની બનેલી છે.

3.૧૪ શેર દીઠ કમાણી

શેર દીઠ કમાણીને વર્ષ દરમિયાન બાકી ઇક્વિટી શેરની ભારિત સરેરાશ સંખ્યા દ્વારા શેરદારકોની ઇક્વિટી વર્ષ માટે ચોખ્ખો નફો અથવા નુકસાન વહેંચીને ગણવામાં આવે છે.

શેર દીઠ તરલ કમાણીની ગણતરી માટે, શેરદારકોની ઇક્વિટી વર્ષ માટે ચોખ્ખો નફો અથવા નુકસાન અને વર્ષ દરમિયાન બાકી શેરોની ભારિત સરેરાશ સંખ્યા તમામ આંશિક સંભવિત ઇક્વિટી શેરની અસરો માટે સરભર કરવામાં આવે છે.

3.૧૫ પહો

પહો લેનાર તરીકે કંપની

કંપનીની પહો મિલકતો પ્રાથમિક રીતે કચેરીના મકાન ભાડા પહોના બનેલા વર્ગમાં આવે છે. કરારની શરૂઆતમાં કંપની કરારમાં ભાડા પહો ધરાવે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરે છે. જો કરાર અવેજના બદલામાં ચોક્કસ સમયગાળા માટે ઓળખાયેલી મિલકતના ઉપયોગને નિયંત્રિત કરવાનો અધિકાર જણાવે તો તે કરાર છે અથવા તેમાં સમાવિષ્ટ છે. કરાર, એ ઓળખાયેલી મિલકતના ઉપયોગને નિયંત્રિત કરવાનો અધિકાર આપે છે કે કેમ તેનું કંપની મૂલ્યાંકન કરે છે, કાં તો – (૧) કરારમાં જણાવેલી મિલકતનો ઉપયોગ કરવાનું સામેલ છે (૨) કંપનીને ભાડાપહોના સમયગાળા દરમિયાન મિલકતના ઉપયોગથી નોંધપાત્ર રીતે બધા આર્થિક લાભો છે અને (૩) કંપનીને મિલકતના ઉપયોગને નિર્દેશિત કરવાનો અધિકાર છે.

ભાડાપહોની શરૂઆતની તારીખે, કંપની મિલકતના ઉપયોગ કરવાના અને તમામ ભાડાપહોની વ્યવસ્થાઓને અનુરૂપ ભાડે આપનાર સિવાય ૧૨ મહિના અથવા તેનાથી ઓછી મુદત (ટૂંકા ગાળાના ભાડાપહો) ના અને ઓછા ભાડાપહો મૂલ્યના ભાડાપહોની જવાબદારીના અધિકારને માન્ય કરે છે. આ ટૂંકા ગાળાના અને ઓછા મૂલ્યના ભાડાપહો માટે, કંપની ભાડાપહોની મુદત પર પ્રત્યક્ષ ધોરણે ભાડાપહોની ચૂકવણીને સંચાલન ખર્ચ તરીકે માન્ય કરે છે.

મિલકતના ઉપયોગ કરવાના અધિકારને શરૂઆતમાં કિંમત પર માન્યતા આપવામાં આવે છે, જેમાં ભાડાપહોની શરૂઆતની તારીખે અથવા તે પહેલાં કરવામાં આવેલી કોઈપણ ભાડાની ચૂકવણીઓ માટે સરભર કરાયેલી ભાડાની જવાબદારીની પ્રારંભિક રકમ વતી કોઈપણ પ્રારંભિક પ્રત્યક્ષ કિંમત કોઈપણ ભાડાના પ્રોત્સાહનોથી ઓછી હોય છે. બાદમાં તેને ઓછા સંચિત ઘસારા અને ક્ષતિના નુકશાન પર નિર્ધારિત કરવામાં આવે છે.

મિલકતના ઉપયોગ કરવાના અધિકારની ભાડાપહોની મુદતના ટૂંકા ગાળા અને અંતર્ગત મિલકતના ઉપયોગી જીવન પર પ્રત્યક્ષ આધારે પ્રારંભ તારીખથી ઘસારો થાય છે.

ભાડાપહોની જવાબદારી શરૂઆતમાં ભાવિ ભાડાપહો ચૂકવણીના વર્તમાન મૂલ્ય પર શ્રદ્ધામુક્ત ખર્ચ પર નિર્ધારિત કરવામાં આવે છે. જો આ ભાડાપહોના દેશમાં વધતા જતા કરજ દરનો ઉપયોગ કરીને અથવા સહેલાઈથી નિર્ધારિત ન કરી શકાય,

તો ભાડાપટ્ટામાં સમાવિષ્ટ વ્યાજ દરનો ઉપયોગ કરીને ભાડાપટ્ટા ચૂકવણીમાં છૂટ આપવામાં આવે છે.

ભાડાપટ્ટાની જવાબદારી અને મિલકતના ઉપયોગ કરવાના અધિકારને સરવૈયામાં અલગથી રજૂ કરવામાં આવે છે અને ભાડાપટ્ટાની ચૂકવણીને નાણાંકીય રોકડ પ્રવાહ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

3.૧૬ વિભાજિત અહેવાલ કરવો

સંચાલન વિભાજન કંપનીનો વ્યવસાયિક પ્રવૃત્તિમાં રોકાયેલ ઘટક છે, જેમાંથી કંપની આવક મેળવે છે અને ખર્ચ કરે છે, જેના માટે અલગ નાણાંકીય માહિતી ઉપલબ્ધ હોય છે અને જેના સંચાલન પરિણામોનો મુખ્ય સંચાલન નિર્ણયકર્તા દ્વારા વિભાજન અને તેની કામગીરીનું મૂલ્યાંકન કરવા ફાળવવામાં આવનારા સંસાધનો વિશે નિર્ણય લેવા નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે છે. કંપનીના મુખ્ય સંચાલન નિર્ણયકર્તા વહીવટી સંચાલક છે.

મિલકતો અને જવાબદારીઓ કે જે પ્રત્યક્ષ રીતે આરોપ્ય છે અથવા વિભાગોને ફાળવવામાં આવેલા દરેક અહેવાલ કરવા યોગ્ય વિભાગો હેઠળ જાહેર કરવામાં આવે છે. અન્ય તમામ મિલકતો અને જવાબદારીઓ બિન-ફાળવણીપાત્ર તરીકે જાહેર કરવામાં આવે છે.

દરેક અહેવાલ કરવા યોગ્ય વિભાગો હેઠળ વિભાગોને પ્રત્યક્ષ રીતે આરોપ્ય આવક અને ખર્ચની જાણ કરવામાં આવે છે. અન્ય તમામ ખર્ચ જે વિભાગોને આરોપ્ય અથવા ફાળવવા યોગ્ય નથી તે બિન-ફાળવણીપાત્ર ખર્ચ તરીકે જાહેર કરવામાં આવેલ છે.

કંપની તેના નાણાંકીય પત્રો તૈયાર કરવા અને રજૂ કરવા માટે અપનાવેલ હિસાબી નીતિઓ સાથે સુસંગત રીતે તેના વિભાગોની માહિતી તૈયાર કરે છે.

3.૧૭ રોકડ પ્રવાહ પત્રક

રોકડ પ્રવાહ પરોક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને નોંધવામાં આવે છે, જેના દ્વારા બિન-રોકડ પ્રકારના વ્યવહારોની અસરો, ભૂતકાળ અથવા ભવિષ્યના કોઈપણ સ્થગિત અથવા ઉપાર્જન રોકડ આવકો અને ચુકવણીઓ અને આવકની બાબતો અથવા રોકાણો અને ધિરાણ સાથે સંકળાયેલ રોકડ પ્રવાહ માટે સમયગાળા માટે નફામાં સરભર કરવામાં આવે છે, કંપનીના સંચાલન, રોકાણ અને ધિરાણ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ અલગ પડે છે.

3.૧૮ અહેવાલની તારીખ પછીની ઘટનાઓ

જ્યાં સરવૈયાની તારીખ પછી બનતી ઘટનાઓ ની સ્થિતિઓ સાબીત કરે કે અહેવાલના સમયગાળાને અંતે અસ્તિત્વમાં છે, ત્યાં આવી ઘટનાઓની અસર નાણાંકીય પત્રકોમાં સરભર કરવામાં આવે છે. અન્યથા, નોંધપાત્ર અથવા તેવા પ્રકારની સરવૈયાની તારીખ પછીની ઘટનાઓ જ જાહેર કરવામાં આવે છે.

૪ જાહેર કરાયેલા તાજેતરની હિસાબી જાહેરાતો પરંતુ હજુ સુધી અસર આપી નથી

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે હાલના ધોરણોમાં નવા ધોરણો અથવા સુધારા જાહેર કર્યા છે. ૧ એપ્રિલ, ૨૦૨૧ થી લાગુ થયું હોય એવું કોઈ જાહેરનામું બહાર પાડેલ નથી.

પ રોકડ અને રોકડ સમકક્ષ

(₹ લાખમાં)

નોંધ નં. બાબતો	૩૧ માર્ચની સ્થિતિએ	
	૨૦૨૧	૨૦૨૦
હાથ પર રોકડ	૦.૪૭	૦.૫૩
બેંકોમાં સિલક	૨૧૨૪૯.૦૨	૪૩૬૯૮.૪૬
હાથ પર ટિકિટો	૦.૦૧	૦.૦૧
સરકારી તિબોરીમાં જમા	૦.૦૫	૦.૦૫
કુલ	૨૧૨૪૯.૫૫	૪૩૬૯૯.૦૫

ફ લોન

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
ઋણમુક્તિ કિંમત પર માપવામાં આવેલ		
ક		
૧ મુદતી લોન	૧૧૯૬૯૯૯.૧૨	૧૧૮૪૯૩૩.૨૨
૨ અન્ય કર્મચારીઓને લોન	૧૩.૮૪	૨.૧૮
કુલ (ક) સમગ્ર	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦
બાદ- ઘટાડેલી લોન છૂટ	-	-
કુલ (ક) (ચોખ્ખું)	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦
ખ		
૧ મૂર્ત મિલકતો સામે સુરક્ષિત	૧૩.૨૨	૧.૬૭
૨ અમૂર્ત મિલકતો સામે સુરક્ષિત	-	-
૩ બેંક/ સરકારી બાયંધરીઓ દ્વારા આવરી લીધેલ	-	-
૪ બિનતારણવાળી	૧૧૯૬૯૯૯.૭૪	૧૧૮૪૯૩૩.૭૩
કુલ (ખ) સમગ્ર	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦
બાદ- ઘટાડેલી લોન છૂટ	-	-
કુલ (ખ) (ચોખ્ખું)	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦
ગ-૧ ભારતમાં લોન		
૧ જાહેર ક્ષેત્ર – ગુજરાત સરકારનાં એકમોને	૧૧૯૬૯૯૯.૧૨	૧૧૮૪૯૩૩.૨૨
૨ અન્યને કર્મચારીઓને	૧૩.૮૪	૨.૧૮
કુલ (ગ-૧) સમગ્ર	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦
બાદ- ઘટાડેલી લોન છૂટ	-	-
કુલ (ગ-૧) ચોખ્ખું	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦
ગ-૨ ભારત બહાર લોન	-	-
કુલ-ગ (૧+૨)	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦

ગુજરાત સરકારે કંપનીને ₹ ૬૦૦૪૨ લાખ (ગત વર્ષના ₹ ૩૮૭૩૧ લાખ) ની કુલ ગુજરાત સરકારની અમુક સંસ્થાઓને આપવામાં આવેલી લોન માટે બાયંધરી પત્રો જારી કર્યા છે.

નોંધ-૭ રોકાણો

(₹ લાખમાં)

રોકાણો	માર્ચ ૩૧, ૨૦૨૧				માર્ચ ૩૧, ૨૦૨૦			
	અધિકૃત કિંમત	નફા નુકસાન હારા બખાર કિંમતે	અન્ય સાર્વજિક આવક હારા બખાર કિંમતે	કુલ	અધિકૃત કિંમત	નફા નુકસાન હારા બખાર કિંમતે	અન્ય સાર્વજિક આવક હારા બખાર કિંમતે	કુલ
સ્વચ્છતા ઇન્ફ્રા વરલ/દેવા યોજના સરકારી જમીનગીરીઓ	૦.૦૦	૨૮૭૩૮૧૧.૦૬	૦.૦૦	૨૮૭૩૮૧૧.૦૬	૦.૦૦	૨૫૫૮૮૬૬.૫૨	૦.૦૦	૨૫૫૮૮૬૬.૫૨
પ્રાથમિક વિકાસને આપેલી ડિપોઝિટ દેવા જમીનગીરીઓ (બોન્ડ)	૫૮૧૬૩૫.૨૮	૦.૦૦	૦.૦૦	૫૮૧૬૩૫.૨૮	૪૩૮૪૫૧.૮૭	૦.૦૦	૦.૦૦	૪૩૮૪૫૧.૮૭
દેવા જમીનગીરીઓ (બોન્ડ) ઇક્વિટી દસ્તાવેજો	૩૭૮૬૧.૪૩	૦.૦૦	૦.૦૦	૩૭૮૬૧.૪૩	૧૭૧૧૬.૦૪	૦.૦૦	૦.૦૦	૧૭૧૧૬.૦૪
	૪૦૦૦૦.૦૦	૦.૦૦	૦.૦૦	૪૦૦૦૦.૦૦	૪૦૦૦૦.૦૦	૦.૦૦	૦.૦૦	૪૦૦૦૦.૦૦
	૦.૦૦	૦.૦૦	૨૨૭૯૦૮.૭૪	૨૨૭૯૦૮.૭૪	૦.૦૦	૦.૦૦	૧૫૨૫૦૨.૫૧	૧૫૨૫૦૨.૫૧
કુલ - સમગ્ર (ક)	૬૫૮૫૬૬.૭૨	૨૮૭૩૮૧૧.૦૬	૨૨૭૯૦૮.૭૪	૩૭૬૧૩૧૬.૫૨	૪૮૫૫૬૮.૦૧	૨૫૫૮૮૬૬.૫૨	૧૫૨૫૦૨.૫૧	૩૨૦૮૦૩૭.૦૪
(૧) ભારત બહાર રોકાણો	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦
(૨) ભારતમાં રોકાણો	૬૫૮૫૬૬.૭૨	૨૮૭૩૮૧૧.૦૬	૨૨૭૯૦૮.૭૪	૩૭૬૧૩૧૬.૫૨	૪૮૫૫૬૮.૦૧	૨૫૫૮૮૬૬.૫૨	૧૫૨૫૦૨.૫૧	૩૨૦૮૦૩૭.૦૪
કુલ - (ખ)	૬૫૮૫૬૬.૭૨	૨૮૭૩૮૧૧.૦૬	૨૨૭૯૦૮.૭૪	૩૭૬૧૩૧૬.૫૨	૪૮૫૫૬૮.૦૧	૨૫૫૮૮૬૬.૫૨	૧૫૨૫૦૨.૫૧	૩૨૦૮૦૩૭.૦૪
બાદ- ઘટાડેલ ક્વિટા નુકસાનની છૂટ (ગ)	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦
કુલ = ચોખ્ખુ ઘન (ક-ગ)	૬૫૮૫૬૬.૭૨	૨૮૭૩૮૧૧.૦૬	૨૨૭૯૦૮.૭૪	૩૭૬૧૩૧૬.૫૨	૪૮૫૫૬૮.૦૧	૨૫૫૮૮૬૬.૫૨	૧૫૨૫૦૨.૫૧	૩૨૦૮૦૩૭.૦૪

૭.૧ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ સુધી, પ્રાથમિક વિકેતા પાસે મૂકેલા ભંડોળ / થાપણોને રોકડ અને રોકડ સમકક્ષના ઘટક તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જોકે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ તેને રોકાણ તરીકે ગણવામાં આવ્યા હતા.

૮ અન્ય નાણાંકીય મિલકતો

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
ક ઉપાર્જિત વ્યાજ	૧૬૦૫૨.૯૯	૧૨૯૦૬.૮૫
ખ જમીનગીરી અને બીજી થાપણો	૩૭.૦૩	૩૭.૦૦
ગ અન્ય	૧.૧૨	૦.૮૪
કુલ	૧૬૦૯૧.૧૪	૧૨૯૪૪.૬૯
૮.૧ લાંબાગાળાની	૪૦.૮૦	૧૩૫૪.૧૭
૮.૨ ટુંકાગાળાની	૧૬૦૫૦.૩૪	૧૧૫૯૦.૫૨
કુલ	૧૬૦૯૧.૧૪	૧૨૯૪૪.૬૯

૯ મિલકતો, સંચંત્રો અને ઉપકરણો

(₹ લાખમાં)

૯.૧ મિલકતો, સંચંત્રો અને ઉપકરણોમાં સમાવેશ :

ક્રમ	બાબતો	કમ્પ્યુટરો	રાયચયિલું અને જડતર	કચેરી સાધનો	વાહનો	કુલ
ક સમગ્ર બ્લોક						
	એપ્રિલ ૦૧, ૨૦૧૯ ના રોજ સિલક	૨૯.૦૯	૩.૩૫	૧૧.૨૮	૪૨.૯૮	૮૬.૭૦
	વધારો	૦.૮૬	૯.૮૮	૫.૫૪	૦.૦૦	૧૬.૨૮
	બાદ	૧.૦૬	૦.૧૨	૦.૪૪	૦.૦૦	૧.૬૨
	માર્ચ ૩૧, ૨૦૨૦ ના રોજ સિલક	૨૮.૮૯	૧૩.૧૧	૧૬.૩૮	૪૨.૯૮	૧૦૧.૩૬
	વધારો	૩.૮૯	૧.૮૯	૧.૫૧	૦.૦૦	૭.૨૯
	બાદ	૦.૭૯	૦.૧૮	૦.૦૦	૦.૦૦	૦.૯૭
	માર્ચ ૩૧, ૨૦૨૧ ના રોજ સિલક	૩૧.૯૯	૧૪.૮૨	૧૭.૮૯	૪૨.૯૮	૧૦૭.૬૮
ખ સંચિત ઘસારો						
	એપ્રિલ ૦૧, ૨૦૧૯ ના રોજ સિલક	૨૧.૦૩	૦.૬૨	૬.૨૮	૧૮.૦૨	૪૫.૯૫
	વધારો	૩.૯૮	૧.૫૪	૪.૦૧	૭.૭૨	૧૭.૨૫
	બાદ	૦.૮૮	૦.૦૦	૦.૪૨	૦.૦૦	૧.૩૦
	માર્ચ ૩૧, ૨૦૨૦ ના રોજ સિલક	૨૪.૧૩	૨.૧૬	૯.૮૭	૨૫.૭૪	૬૧.૯૦
	વધારો	૨.૫૨	૨.૫૬	૩.૪૮	૫.૦૬	૧૩.૬૨
	બાદ	૦.૬૬	૦.૧૧	૦.૦૦	૦.૦૦	૦.૭૭
	માર્ચ ૩૧, ૨૦૨૧ ના રોજ સિલક	૨૫.૯૯	૪.૬૧	૧૩.૩૫	૩૦.૮૦	૭૪.૭૫
ગ ચોખ્ખો બ્લોક						
	એપ્રિલ ૦૧, ૨૦૧૯ ના રોજ સિલક	૮.૦૬	૨.૭૩	૫.૦૦	૨૪.૯૬	૪૦.૭૫
	માર્ચ ૩૧, ૨૦૨૦ ના રોજ સિલક	૪.૭૬	૧૦.૯૫	૬.૫૧	૧૭.૨૪	૩૯.૪૬
	માર્ચ ૩૧, ૨૦૨૧ ના રોજ સિલક	૬.૦૦	૧૦.૨૧	૪.૫૪	૧૨.૧૮	૩૨.૯૩

૯.૨ કંપનીએ તેની તમામ મિલકત, સંચંત્રો અને સાધનોને અગાઉની જુએએપી વહન રકમ એટલે કે ૩૧ માર્ચ, ૨૦૧૭ ના પરિવર્તનની તારીખ એટલે કે ૦૧ એપ્રિલ, ૨૦૧૭ ના રોજ તેની માનેલી કિંમત તરીકે માપવાનું પસંદ કર્યું છે.

૧૦ અન્ય ઊન નાણાકીય મિલકતો

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
અગાઉ ચૂકવેલ ખર્ચા	૪.૩૯	૩.૮૯
ખર્ચા માટે અન્ય પેશગીઓ	૦.૧૭	૦.૧૭
કુલ	૪.૫૬	૪.૦૬
૧૦.૧ લાંબાગાળાની	૦.૦૦	૦.૦૦
૧૦.૨ ટુંકાગાળાની	૪.૫૬	૪.૦૬
કુલ	૪.૫૬	૪.૦૬

૧૧ વેપારી ચૂકવવાપત્ર

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
સૂક્ષ્મ ઉદ્યોગો અને નાના ઉદ્યોગો માટે લેણાં	૪.૨૭	૪.૪૩
સૂક્ષ્મ ઉદ્યોગો અને નાના ઉદ્યોગો સિવાયના લેણદારોના લેણાં	૧૫.૮૬	૧૫.૩૪
કુલ	૨૦.૧૩	૧૯.૭૭
સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોના સંદર્ભમાં જાહેરાત:		
ક દરેક હિસાબી વર્ષના અંતે કોઈપણ વિક્રેતાને ચૂકવેલ બાકી મૂળ રકમ અને તેના પરનું વ્યાજ	૦.૦૦	૦.૦૦
ખ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો વિકાસ અધિનિયમ, ૨૦૦૬ ની કલમ ૧૬ ના સંદર્ભમાં દરેક હિસાબી વર્ષ દરમિયાન નિયત દિવસની બહાર વિક્રેતાને ચૂકવવામાં આવેલ વ્યાજની ચૂકવણીની રકમ સાથે	૦.૦૦	૦.૦૦
ગ ચૂકવણી કરવામાં વિલંબના સમયગાળા માટે ચડત અને ચૂકવવાપત્ર વ્યાજની રકમ પરંતુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો વિકાસ અધિનિયમ, ૨૦૦૬ હેઠળ નિર્દિષ્ટ વ્યાજ ઉમેર્યા વગર (ચૂકવેલ છે પરંતુ વર્ષ દરમિયાન નિયત દિવસ પછી).	૦.૦૦	૦.૦૦
ઘ દરેક હિસાબી વર્ષના અંતે ઉપાર્જિત અને વણચૂકવેલ બાકી વ્યાજની રકમ	૦.૦૦	૦.૦૦
ચ સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો વિકાસ અધિનિયમ, ૨૦૦૬ ની કલમ ૨૩ હેઠળ કપાતપાત્ર ખર્ચની ના પાડી શકાય તે હેતુથી, નાના ઉદ્યોગોને ખરેખર ચૂકવવામાં આવે ત્યારે, ઉપરના વ્યાજની બાકી રકમ વાસ્તવમાં આગામી વર્ષોમાં પણ બાકી રહેલા ચડત વ્યાજની રકમ બાકી છે અને ચૂકવવાપત્ર છે.	૦.૦૦	૦.૦૦

ઉપરોક્ત માહિતી કંપની પાસે ઉપલબ્ધ માહિતીના આધારે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો તરીકે ઓળખી શકાય તેટલી હદ સુધી પક્ષકારોના સંદર્ભમાં પાલન કરવામાં આવેલ છે.

૧૨ થાપણો

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
શ્રદ્ધા મુક્ત કિંમત પર માપેલ અન્ય તરફથી (ગુજરાત સરકારની સંસ્થાઓ)		
આંતર કોર્પોરેટ થાપણો	૪૦૯૩૬૦૮.૪૨	૩૭૨૨૫૨૨.૨૦
તરલ થાપણો	૨૮૬૦૬૫.૪૩	૧૯૩૮૪૩.૪૪
કુલ	૪૩૭૯૬૭૩.૮૫	૩૯૨૬૩૬૫.૬૪

૧૩ અન્ય નાણાંકીય જવાબદારી

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
ઉપાર્જિત વ્યાજ	૧૨૫૪૪૨૬.૯૯	૧૨૪૮૮૯.૮૦
વણચૂકવેલ પાકતી થાપણો	૦.૦૦	૧૧૩૮.૩૭
આઇસીડી/એલડીએસ પડતર મંજૂરી સામે મળેલી રકમ	૨૩.૦૦	૧૩૦૦૦.૦૦
કુલ	૧૨૫૪૪૯.૯૯	૧૩૯૦૨૮.૧૭
૧૩.૧ લાંબાગાળાની		
ઉપાર્જિત વ્યાજ	૯૧૨૨.૮૭	૯૦૮૨.૮૮
૧૩.૨ ટૂંકાગાળાની		
ઉપાર્જિત વ્યાજ	૧૧૬૩૦૪.૧૨	૧૧૫૮૦૬.૯૨
વણચૂકવેલ પાકતી થાપણો	૦.૦૦	૧૧૩૮.૩૭
આઇસીડી/એલડીએસ પડતર મંજૂરી સામે મળેલી રકમ	૨૩.૦૦	૧૩૦૦૦.૦૦

૧૪ જોગવાઈઓ

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
કર્મચારી લાભો માટે જોગવાઈ	૮.૮૫	૫.૦૨
કુલ	૮.૮૫	૫.૦૨

૧૪.૧ ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડને તા. ૨૧-૦૮-૨૦૧૭ ના નાણાં વિભાગના ઠરાવ નં.જેએનવી -૦૧૦૨૦૦૯૧૭૩-એ દ્વારા ૭ મા પગાર પંચના અમલની પરવાનગી મળી છે. જો કે, કંપનીને તેના કર્મચારીઓને પગાર તફાવત (ચડત) ચૂકવવાની ગુજરાત સરકાર તરફથી હજુ સુધી પરવાનગી મળી નથી. આથી, ૧ જાન્યુઆરી, ૨૦૧૬ થી ૩૧ જુલાઈ, ૨૦૧૭ ના સમયગાળા માટે પગાર તફાવત (ચડત) માટે આકસ્મિક જવાબદારીની જોગવાઈ કરવામાં આવી નથી. રાજ્ય સરકારની મંજૂરી મળ્યા પછી જ પગાર તફાવત (ચડત) ની ચુકવણી કરવી એ કંપનીની સામાન્ય પ્રથા છે અને આવી પરવાનગી મળ્યા પછી જ તેની જોગવાઈની માત્રા જાણી શકાય છે.

૧૫ અન્ય બિન નાણાંકીય જવાબદારી

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
મળેલી અન્ય પેશગીઓ	૨.૪૦	૧.૯૪
અન્ય		
વૈદ્યાનિક લેણાં	૨૪૬૩.૨૧	૩૩૨૭.૭૩
કુલ	૨૪૬૫.૬૧	૩૩૨૯.૬૭

૧૬ ઇક્વિટી શેર મૂડી

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
૧૬.૧ અધિકૃત મૂડી		
દરેક ₹ ૧૦ ના એક એવા ૨૦,૦૦,૦૦,૦૦૦ ઇક્વિટી શેરો (માર્ચ ૩૧, ૨૦૨૦ - ૨૦,૦૦,૦૦,૦૦૦)	૨૦૦૦૦.૦૦	૨૦૦૦૦.૦૦
૧૬.૨ બહાર પાડેલ, ભરપાઈ અને ચૂકવેલ મૂડી		
દરેક ₹ ૧૦ ના એક એવા ૧૩,૭૯,૯૬,૦૫૯ ઇક્વિટી શેરો (માર્ચ ૩૧, ૨૦૨૦ - ૧૩,૭૯,૯૬,૦૫૯)	૧૩૭૯૯.૬૧	૧૩૭૯૯.૬૧
૧૬.૩ બાકી શેરોનું મેળવણું:		
વર્ષની શરૂઆતમાં ઇક્વિટી શેરો	૧૩૭૯૯૬૦૫૯.૦૦	૧૩૭૯૯૬૦૫૯.૦૦
વધારો : સમયગાળા દરમિયાન બહાર પાડેલ	૦.૦૦	૦.૦૦
સમયગાળાના અંતે ઇક્વિટી શેરો	૧૩૭૯૯૬૦૫૯.૦૦	૧૩૭૯૯૬૦૫૯.૦૦

૧૬.૪ અધિકારો, પસંદગીઓ અને પ્રતિબંધો:

- ૧ કંપની પાસે ઇક્વિટી શેર કહી શકાય એવો દરેક ₹ ૧૦ ના મૂલ્યનો ઇક્વિટી શેરનો માત્ર એક વર્ગ છે. ઇક્વિટી શેરનો દરેક ધારક શેર દીઠ એક મતનો હકદાર છે.
- ૨ ડિવિડન્ડ, જે કોઈ હોય તો, ભારતીય રૂપિયામાં બહાર કરવામાં આવે છે અને ચૂકવવામાં આવે છે. નિયામક મંડળ દ્વારા પ્રસ્તાવિત ડિવિડન્ડ, જે હોય તો, આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે.
- ૩ કંપનીના ફંડચાની સ્થિતિમાં, ઇક્વિટી શેર ધારકો તમામ અગ્રતા રકમની ચુકવણી પછી કંપનીની બાકીની કોઈપણ મિલકત મેળવવા માટે હકદાર રહેશે. જે કે, હાલમાં આવી કોઈ અગ્રતા રકમ અસ્તિત્વમાં નથી. શેરધારકોએ ધારણ કરેલા ઇક્વિટી શેરની સંખ્યાના પ્રમાણમાં વહેંચણી કરાશે.

૧૬.૫ પ ટકાથી વધુ શેર ધરાવતા શેરધારકોની વિગતો:

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
	શેરની સંખ્યા %	શેરની સંખ્યા %
ગુજરાતના રાજ્યપાલ તેના મનોનિત વ્યક્તિઓ સાથે	૧૦૬૨૮૦૦૧૧.૦૦ ૭૭.૦૨%	૧૦૬૨૮૦૦૧૧.૦૦ ૭૭.૦૨%
ગુજરાત રાજ્ય મૂડી રોકાણ લિમિટેડ	૩૧૭૧૬૦૪૮.૦૦ ૨૨.૯૮%	૩૧૭૧૬૦૪૮.૦૦ ૨૨.૯૮%

૧૬.૬ મૂડી સંચાલન

કંપનીના મૂડી સંચાલનના હેતુ માટે, મૂડીમાં બહાર પાડેલ ઇક્વિટી મૂડી અને કંપનીના ઇક્વિટી ધારકોને આભારી અન્ય તમામ અનામતનો સમાવેશ થાય છે.

મૂડી સંચાલન માટે કંપનીનો ઉદ્દેશ શેર ધારકોના મૂલ્યને વધારવાનો અને ધંધાના સાતત્યને સુરક્ષિત કરવાનો છે. વાર્ષિક સંચાલન યોજનાઓ અને અન્ય વ્યૂહાત્મક યોજનાઓના આધારે કંપની મૂડીની જરૂરિયાત નક્કી કરે છે. ભંડોળની જરૂરિયાતો ઇક્વિટી અને સંચાલન રોકડ પ્રવાહ દ્વારા પૂરી થાય છે.

જથ્થાત્મક માહિતીનો સારાંશ નીચે આપેલ છે:

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
ઇક્વિટી	૧૩૭૯૯.૬૧	૧૩૭૯૯.૬૧
અન્ય ઇક્વિટી	૪૪૫૭૪૬.૦૭	૩૩૭૫૨૦.૮૪
કુલ	૪૫૯૫૪૫.૬૮	૩૫૧૩૨૦.૪૫

કંપનીને કોઈ બાહ્ય રીતે લાદવામાં આવેલી મૂડીની જરૂરિયાત નથી.

૧૭ અન્ય ઇક્વિટી

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
૧૭.૧ સામાન્ય અનામત		
અગાઉની સરવૈયા મુજબ સિલક	૨૭૦૭.૯૭	૨૭૦૭.૯૭
૧૭.૨ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ		
૪૫ ૪૫-આઈસી (૧) હેઠળ અનામત ભંડોળ		
અગાઉની સરવૈયા મુજબ સિલક	૧૪૦૯૭.૪૫	૫૫૧૯.૫૦
વર્ષ દરમિયાન વધારો	૮૫૬૨.૦૦	૮૫૭૭.૯૫
બંધ સિલક	૨૨૬૫૯.૪૫	૧૪૦૯૭.૪૫
૧૭.૩ જમીનગીરી પ્રીમિયમ		
અગાઉની સરવૈયા મુજબ સિલક	૧૩૯૪૦૭.૮૯	૧૩૯૪૦૭.૮૯
બંધ સિલક	૧૩૯૪૦૭.૮૯	૧૩૯૪૦૭.૮૯
૧૭.૪ અન્ય સમગ્ર આવક દ્વારા ઇક્વિટી દસ્તાવેજો		
અગાઉની સરવૈયા મુજબ સિલક	૬૦૯૨.૯૭	(૮૭૨.૩૦)
વર્ષ દરમિયાન વધારો	૬૮૮૭૧.૫૮	૬૯૬૫.૨૭
બંધ સિલક	૭૪૯૬૪.૫૫	૬૦૯૨.૯૭

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
૧૭.૫ જાળવી રાખેલ કમાણી		
અગાઉની સરવૈયા મુજબ સિલક	૧૭૦૪૫૭.૩૯	૧૩૭૫૨૭.૪૯
વર્ષનો નફો	૪૨૮૦૮.૧૦	૪૨૮૮૯.૭૩
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, ૧૯૩૪ ની કલમ		
૪૫ ૪૫-IC (૧) હેઠળ અનામત ભંડોળમાં તબદીલી	(૮૫૬૨.૦૦)	(૮૫૭૭.૯૫)
ક્ષતિ અનામતમાં સ્થાનાંતરિત	(૫૬.૫૬)	(૮૩.૫૭)
ડિવિડન્ડ (પાછલા વર્ષ સહિત ડિવિડન્ડ વિતરણ કર)	(૩૪૪૯.૯૦)	(૧૨૯૧.૭૪)
વર્ષની OCI ની બાબતો, કરની ચોખ્ખી		
નિર્ધારિત લાભ યોજનાઓનો પુનઃનિર્ધારણ	(૪.૫૫)	(૬.૫૭)
બંધ સિલક	૨૦૧૧૯૨.૪૮	૧૭૦૪૫૭.૩૯
૧૭.૬ ક્ષતિ અનામત *		
અગાઉની સરવૈયા મુજબ સિલક	૪૭૫૭.૧૭	૦.૦૦
વર્ષ દરમિયાન ઉમેરો/(ઘટાડો)	૫૬.૫૬	૮૩.૫૭
૦૧ એપ્રિલ, ૨૦૧૯ ના રોજની સિલક પ્રમાણભૂતની મિલકત સામે આકસ્મિક		
જોગવાઈમાંથી ક્ષતિ અનામતમાં તબદીલી	૦.૦૦	૪૬૭૩.૬૦
બંધ સિલક	૪૮૧૩.૭૩	૪૭૫૭.૧૭
* ૧૩ માર્ચ, ૨૦૨૦ ના ભારતીય રીઝર્વ બેંકના જાહેરનામા નં. આરબીઆઈ/		
૨૦૧૯-૨૦/૧૭૦ ડીઓઆર (એનબીએફસી).CC.PD.No.૧૦૯/૨૨.૧૦.૧૦૬/		
૨૦૧૯-૨૦ સાથે સુસંગત જાહેરાત.		
કુલ અન્ય ઇક્વિટી	૪૪૫૭૪૬.૦૭	૩૩૭૫૨૦.૮૪

૧૮ ડિવિડન્ડ

(₹ લાખમાં)

બાબતો	શેર દીઠ રૂપિયા	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
અહેવાલના અંતે સૂચિત ડિવિડન્ડ અને માન્ય ન કરેલ	₹ ૨.૫૦ (આગલા વર્ષના ₹ ૨.૫૦)	૩૪૪૯.૯૦	૩૪૪૯.૯૦
અહેવાલના સમય દરમિયાન ચુકવેલ ડિવિડન્ડ (આગલા વર્ષના ડિવિડન્ડ પર કર સહિત)	₹ ૨.૫૦ (આગલા વર્ષના ₹ ૧.૦૦)	૩૪૪૯.૯૦	૧૨૯૧.૭૪

૧૯ આકસ્મિક જવાબદારીઓ અને પ્રતિબદ્ધતા:

(₹ લાખમાં)

૧૯.૧ આકસ્મિક જવાબદારી			
બાબતો		માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
વિવાદિત આવકવેરા બાબતો		૭૩૭.૧૭	૮૨૭.૧૬
કંપની સામેના દાવા દેવા તરીકે સ્વીકારાયા નથી.		-	-
		૭૩૭.૧૭	૮૨૭.૧૬
૧૯.૨ પ્રતિબદ્ધતાઓ			
કારારની અંદાજિત રકમ કેપિટલ ખાતામાં અમલ બાકી છે અને તે માટે જોગવાઈ કરી નથી		-	-

૨૦ કામગીરીમાંથી થયેલ આવક

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
૨૦.૧ વ્યાજ આવક		
સુધારેલી કિંમત પર નિર્ધારણ કરેલી નાણાંકીય મિલકતો		
લોન પર વ્યાજ	૮૭૪૪૨.૧૯	૯૨૨૪૨.૮૧
રોકાણો પર વ્યાજ આવક	૪૩૭૪૮.૭૭	૩૯૩૩૬.૪૧
પ્રાથમિક વિક્રેતાને આપેલ ભંડોળમાંથી વ્યાજ આવક	૧૫૩૨.૯૨	૨૧૮૯.૩૩
આઈસીડી સામે આપેલ લોનનું વ્યાજ	૦.૦૦	૦.૫૩
કુલ	૧૩૨૭૨૩.૮૮	૧૩૩૭૬૯.૦૮
૨૦.૨ બજાર મૂલ્ય ફેરફારો પર ચોખ્ખો લાભ		
નફા અથવા નુકસાન દ્વારા બજાર મૂલ્ય પર નાણાંકીય સાધનો પર ચોખ્ખો લાભ		
૧ વ્યાપારિક પ્રવૃત્તિનો પોર્ટફોલિયો પર		
રોકાણો પર	૧૭૯૦૬૪.૧૯	૨૧૭૪૭૧.૫૨
બજાર મૂલ્ય ફેરફારો પર કુલ ચોખ્ખો લાભ	૧૭૯૦૬૪.૧૯	૨૧૭૪૭૧.૫૨
૨ બજાર મૂલ્ય ફેરફારો		
- અવાસ્તવિક	(૫૧૭.૯૨)	૩૫૬૦.૧૫
- વાસ્તવિક	૧૭૯૫૮૨.૧૧	૨૧૩૯૧૧.૩૭
બજાર મૂલ્ય ફેરફારો પર કુલ ચોખ્ખો લાભ	૧૭૯૦૬૪.૧૯	૨૧૭૪૭૧.૫૨

૨૧ અન્ય આવક

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
અન્ય		
મિલકત, સંયંત્ર અને ઉપકરણો (ચોખ્ખો)ની અમાન્યતા પર લાભ	૦.૪૮	૦.૭૧
લીઝ ભાડાથી આવક	૦.૦૦	૦.૯૭
ગ્રાહક લોન પર વ્યાજ	૦.૦૭	૦.૦૬
વાહન લોન પર વ્યાજ	૦.૭૯	૦.૧૭
આવકવેરા રિફંડ પર વ્યાજ	૨૪૨.૦૩	૦.૦૦
એફવીટીઓસીઆઈ પર નિર્ધારણ કરેલા રોકાણમાંથી ડિવિડન્ડ આવક		
સમયગાળા દરમિયાન અસ્વીકૃત રોકાણો સંબંધિત	૦.૦૦	૦.૦૦
સમયગાળાના અંતે કરેલા રોકાણોથી સંબંધિત	૨૬૧૦.૭૮	૭૮૬૫.૨૪
કુલ	૨૮૫૪.૧૫	૭૮૬૭.૧૫

૨૨ ધિરાણ ખર્ચ

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
૨૨ ઋણમુક્ત ખર્ચ પર નિર્ધારણ નાણાંકીય જવાબદારીઓ પર થાપણો પર વ્યાજ ખર્ચ		
આંતર કોર્પોરેટ થાપણો	૨૫૨૫૪૮.૪૮	૨૭૭૬૩૧.૮૧
તરલ થાપણ	૧૪૪૫૬.૦૬	૨૦૬૦૭.૫૪
કુલ ધિરાણ ખર્ચ	૨૬૭૦૦૪.૫૪	૨૯૮૨૩૯.૩૫

૨૩ કર્મચારી લાભ ખર્ચ

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
પગાર અને વેતન	૩૩૯.૫૪	૨૯૧.૨૭
ભવિષ્ય નિધિ અને બીજી નિધિમાં ફાળો	૩૦.૩૬	૨૬.૭૪
કર્મચારી કલ્યાણ ખર્ચ	૧૩.૨૨	૯.૮૪
કુલ	૩૮૩.૧૨	૩૨૭.૮૫

૨૪ અન્ય ખર્ચ

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
ભાડું, કર અને ઊર્જા ખર્ચ	૧૧૩.૯૯	૧૦૬.૬૨
સમારકામ અને જાળવણી	૮.૪૧	૯.૩૪
સંચાર ખર્ચ	૧.૭૬	૫.૧૬
છાપકામ અને સ્ટેશનરી	૪.૦૨	૬.૯૪
જાહેરાત અને પ્રચાર	૧.૫૮	૫.૭૮
નિયામકને ફી, ભથ્થા અને ખર્ચ	૦.૩૨	૪.૬૪
ઓડિટ ખર્ચ	૨.૩૬	૨.૩૬
કાનૂની અને વ્યાવસાયિક શુલ્ક	૧૮.૮૨	૫૨.૪૫
વીમો	૨.૦૫	૨.૨૭
મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન	૦.૦૦	૮૫૦.૦૦
આવકવેરા પર વ્યાજ ખર્ચ	૪૪.૮૬	૭૩.૯૫
સ્ટેમ્પ ડ્યુટી	૩૦૯.૬૪	૦.૦૦
અન્ય ખર્ચ	૨૮.૧૮	૩૨.૫૬
કુલ	૫૩૫.૯૯	૧૧૫૨.૦૭
૨૪.૧ ઓડિટરને ચુકવણી		
વૈધાનિક ઓડિટ માટે	૨.૩૬	૨.૩૬
પ્રમાણિકરણ અને બીજી બાબતો માટે	૦.૦૦	૦.૦૦
કુલ	૨.૩૬	૨.૩૬

૨૫ કર્મચારી લાભ પરની નોંધ**૨૫.૧ નિર્ધારિત ફાળા યોજનાઓ**

નિર્ધારિત ફાળા યોજનાઓ માટે વર્ષ દરમિયાન ખર્ચ તરીકે માન્ય કરેલ રકમની વિગતો.

(₹ લાખમાં)

બાબત	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
કર્મચારી ભવિષ્ય નિધિમાં ફાળો	૨૫.૭૬	૨૨.૯૪
કુલ	૨૫.૭૬	૨૨.૯૪

૨૫.૨ નિર્ધારિત લાભ યોજના - ગ્રેચ્યુઇટી

નિર્ધારિત લાભ યોજનાની લાક્ષણિકતાઓ

ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમ, ૧૯૭૨ સંચાલિત થાય છે. મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

નિર્ધારિત લાભ યોજનાની નોંધ લાક્ષણિકતાઓ

પ્રસ્તાવિત લાભ	પંદર વર્ષ કે તેથી વધુ સેવા માટે: દરેક પૂરા વર્ષ માટે એક મહિનાનો પગાર. દસ વર્ષ કે તેથી વધુ, પરંતુ પંદર વર્ષથી ઓછી સેવા: દરેક પૂરા વર્ષ માટે મહિનાના પગારનો ૩/૪ પગાર. પાંચ વર્ષ કે તેથી વધુ, પરંતુ દસ વર્ષથી ઓછી સેવા: દરેક પૂરા વર્ષ માટે ૧૫ દિવસનો પગાર
પગારની વ્યાખ્યા	મોંઘવારી ભથ્થા સહિત મૂળ પગાર (જો કોઈ હોય તો)
લાભની મર્યાદા	લાભની મર્યાદા ₹ ૨૦,૦૦,૦૦૦ લાગુ કરેલ છે.
સોંપણીની શરતો	પાંચ વર્ષની સતત સેવા (મૃત્યુ / અપંગતાના કિસ્સામાં લાગુ પડતી નથી)
લાભની પાત્રતા	મૃત્યુ અથવા રાજીનામું / ઉપાડ અથવા નિવૃત્તિ વખતે
વય નિવૃત્તિ	૫૮ વર્ષ

૨૫.૩ સંસ્થા યોજનાના સંચાલન માટે જવાબદાર છે.

૨૫.૪ યોજનાના જોખમો

સંસ્થાને યોજનાને ઉજાગર કરતું જોખમ નીચે મુજબ છે:

ક વાસ્તવિક જોખમ

લાભનું અપેક્ષિત કરતાં વધુ ખર્ચનું જોખમ હશે. આ નીચેના કારણોમાંથી એકને કારણે ઊભું થઈ શકે છે: પગાર વૃદ્ધિનો પ્રતિકૂળ અનુભવ: ધારેલા પગાર વધારા કરતા વધારે પગાર વધારો અપેક્ષા કરતા ઊંચો દર જવાબદારીમાં વધારો કરશે.

મૃત્યુ દરમાં પરિવર્તનશીલતા: જો વાસ્તવિક મૃત્યુ દર ધારણા કરતા વધારે મૃત્યુદર દર હોય તો ગ્રેચ્યુઇટી લાભ અપેક્ષા કરતા વહેલો ચૂકવવો પડશે. મૃત્યુ પ્રમાણપત્ર પર કોઈ શરત ન હોવાથી, રોકડ પ્રવાહની ગતિ ધારેલા પગાર વૃદ્ધિ અને વળતર દરના સંબંધિત મૂલ્યોના આધારે વીમાકૃત નુકશાન અથવા લાભ તરફ દોરી જશે.

ઉપાડ દરમાં પરિવર્તનશીલતા: જો વાસ્તવિક ઉપાડ દર ધારણા કરતા વધારે ઉપાડ દર હોય તો ગ્રેચ્યુઇટી લાભ અપેક્ષા કરતા વહેલા ચૂકવવામાં આવશે. આની અસર તેના પર નિર્ભર રહેશે કે શું લાભો રાજીનામાની તારીખે આપવામાં આવ્યા છે.

ખ રોકાણ જોખમ:

મિલકતના સંચાલન માટે વીમા કંપનીઓ પર આધાર રાખતા ભંડોળ યોજનાઓ માટે, વીમાદાતા દ્વારા પ્રમાણિત મિલકતોનું મૂલ્ય જવાબદારીને સમર્થન આપતા સાધનોનું યોગ્ય મૂલ્ય ન હોઈ શકે. આવા કિસ્સાઓમાં, મિલકતનું વર્તમાન મૂલ્ય ભાવિ વળતર દરથી સ્વતંત્ર છે. જો આંતર-મૂલ્યાંકન સમયગાળા દરમિયાન વળતર દરમાં નોંધપાત્ર ફેરફારો થાય તો આ ચોખ્ખી જવાબદારી અથવા ભંડોળની સ્થિતિમાં વ્યાપક વધઘટ તરફ દોરી શકે છે.

ગ પ્રવાહિતા જોખમ:

ઊંચા પગાર અને લાંબા ગાળાના કર્મચારીઓ અથવા ક્રમિકતામાં ઊંચા હોય તેવા કર્મચારીઓ નોંધપાત્ર સ્તરના લાભો મેળવે છે. જો આવા કેટલાક કર્મચારીઓ કંપનીમાંથી રાજીનામું આપે / નિવૃત્ત થાય તો રોકડ પ્રવાહ પર દબાણ આવી શકે છે.

ઘ બજાર જોખમ:

બજાર જોખમ એ નાણાકીય બજારોના ફેરફારો અને વધઘટ સાથે જોખમો માટે એક સંયુક્ત સંદર્ભને સંબંધિત છે. નોંધપાત્ર અસર ધરાવતી એક વીમાકૃત ધારણા વળતર દર છે. વળતર દર નાણાંના સમય મૂલ્યને પ્રતિબિંબિત કરે છે. વળતર દરમાં વધારો યોજના લાભોના નિર્ધારિત લાભ જવાબદારીમાં અને તેનાથી ઉલટું ઘટાડો તરફ દોરી જાય છે. આ ધારણા કોર્પોરેટ / સરકારી બોન્ડ્સ પરની ઉપજ પર આધારિત છે અને તેથી જવાબદારીનું મૂલ્યાંકન મૂલ્યાંકનની તારીખે ઉપજમાં વધઘટ સાથે ઉજાગર થાય છે.

ચ વૈધાનિક જોખમ:

કાયદાકીય / નિયમનમાં ફેરફારને કારણે યોજનાની જવાબદારીઓમાં વધારો અથવા યોજનાની મિલકતમાં ઘટાડો થવાનું જોખમ છે. સરકાર ગ્રેચ્યુઇટી ચુકવણી અધિનિયમમાં સુધારો કરી શકે છે જેથી કંપનીઓને કર્મચારીઓને વધારે લાભ આપવાની જરૂર પડશે. આ નિર્ધારિત લાભની જવાબદારીના વર્તમાન મૂલ્યને સીધી અસર કરશે અને આ પ્રકારનો કોઈ સુધારો અસરકારક હોય ત્યારે તેને તરત જ સ્વીકાર કરવો પડશે.

૨૫.૫ નિર્ધારિત લાભ જવાબદારીઓનું મેળવણું

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ	માર્ચ ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ
વર્ષની શરૂઆતમાં નિર્ધારિત લાભની જવાબદારીઓ	૧૩૩.૯૫	૧૪૮.૧૭
વર્તમાન સેવા ખર્ચ	૫.૬૩	૫.૭૦
વ્યાજ ખર્ચ	૮.૧૬	૮.૩૩
નાણાંકીય ધારણાના કારણે વીમાકૃત નુકસાન/(લાભ)	૪.૮૪	૧.૮૨
અનુભવને કારણે વીમાકૃત નુકસાન/(લાભ)	(૦.૫૫)	૩.૫૪
ભૂતકાળની સેવા ખર્ચ	૦.૦૦	૦.૦૦
ચુકવેલા લાભો	(૩.૭૦)	(૩૩.૬૧)
વર્ષની અંતે નિર્ધારિત લાભની જવાબદારીઓ	૧૪૮.૩૩	૧૩૩.૯૫

૨૫.૬ યોજના મિલકતનું મેળવણું

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ	માર્ચ ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ
વર્ષની શરૂઆતમાં મિલકત યોજના	૧૩૮.૧૭	૧૪૮.૯૭
વ્યાજ આવક	૯.૧૯	૧૦.૨૩
વ્યાજની આવકમાં સમાવિષ્ટ રકમ સિવાય યોજનાની સંપત્તિ પર વળતર	(૦.૨૬)	(૧.૨૧)
નોકારીદાતાનો ફાળો	૫.૯૯	૧૩.૭૯
ચુકવેલા લાભો	(૩.૭૦)	(૩૩.૬૧)
વર્ષના અંતે મિલકત યોજના	૧૪૯.૩૯	૧૩૮.૧૭

૨૫.૭ ભંડોળની સ્થિતિ

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ	માર્ચ ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ
સમયગાળાના અંતે લાભની જવાબદારીનું વર્તમાન મૂલ્ય	૧૪૮.૩૩	૧૩૩.૯૫
સમયગાળાના અંતે યોજના મિલકતનું બજાર મૂલ્ય	૧૪૯.૩૯	૧૩૮.૧૭
ભંડોળની સ્થિતિ/ખાધ	(૧.૦૬)	(૪.૨૨)

૨૫.૮ સમયગાળા માટે નફા અથવા નુકસાનના પત્રકમાં યોજ્ઞી આકારેલ રકમ

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
વર્તમાન સેવા ખર્ચ	૫.૬૩	૫.૭૦
ભૂતકાળની સેવા ખર્ચ	૦.૦૦	૦.૦૦
યોજ્ઞો વ્યાજ ખર્ચ	(૧.૦૩)	(૧.૯૦)
યોજ્ઞી માન્ય કરેલ રકમ	૪.૬૦	૩.૮૦

૨૫.૯ સમયગાળા માટે અન્ય સમગ્ર આવક

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
જવાબદારીઓ પર અધિકૃત લાભ/નુકસાનના ઘટકો:		
નાણાંકીય ધારણાઓમાં ફેરફારને કારણે	૪.૮૪	૧.૮૨
વસ્તી વિષયક ધારણામાં ફેરફારને કારણે	૦.૦૦	૦.૦૦
અનુભવ સરભરના કારણે	(૦.૫૫)	૩.૬૪
વ્યાજની આવકમાં સમાવિષ્ટ રકમ સિવાય યોજના મિલકત પર વળતર	૦.૨૬	૧.૨૧
અન્ય સમગ્ર આવકમાં માન્ય કરેલ રકમ	૪.૫૫	૬.૫૭

૨૫.૧૦ પ્લાન મિલકતનું વિભાજન

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ	માર્ચ ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ
વીમા પોલીસી	૧૦૦.૦૦%	૧૦૦.૦૦%
કુલ	૧૦૦.૦૦%	૧૦૦.૦૦%

૨૫.૧૧ વાસ્તવિક ધારણાઓ

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ	માર્ચ ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ
વળતર દર	૬.૨૦%	૬.૬૦%
પગાર વધારાનો દર	૭%	આગલા એક વર્ષ માટે ૩% વાર્ષિક અને તે પછી ૭% વાર્ષિક
ઉપાડ દર	નાની વચે ૩% થી મોટી વચે ઘટીને ૧%	નાની વચે ૩% થી મોટી વચે ઘટીને ૧%

૨૫.૧૨ વીમા ધારણા માટે સંવેદનશીલતા વિશ્લેષણ

માર્ચ, ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ	ધારણામાં ફેરફાર		નિર્ધારિત લાભ જવાબદારી પર અસર			
	વધારો	ઘટાડો	ધારણામાં વધારો		ધારણામાં ઘટાડો	
	%	%	₹ લાખમાં	%	₹ લાખમાં	%
વટાવ દર	૦.૫૦%	૦.૫૦%	(૪.૦૭)	-૨.૭૪%	૪.૨૬	૨.૮૭%
પગાર વધારાનો દર	૦.૫૦%	૦.૫૦%	૦.૪૫	૦.૩૦%	(૦.૪૧)	-૦.૨૮%
ઉપાડ દર	૧૦.૦૦%	૧૦.૦૦%	૦.૨૮	૦.૧૯%	(૦.૨૭)	-૦.૧૮%

માર્ચ, ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ	ધારણામાં ફેરફાર		નિર્ધારિત લાભ જવાબદારી પર અસર			
	વધારો	ઘટાડો	ધારણામાં વધારો		ધારણામાં ઘટાડો	
	%	%	₹ લાખમાં	%	₹ લાખમાં	%
વટાવ દર	૦.૫૦%	૦.૫૦%	(૩.૯૮)	-૨.૯૭%	૪.૧૭	૩.૧૧%
પગાર વધારાનો દર	૦.૫૦%	૦.૫૦%	૧.૨૫	૦.૯૩%	(૧.૦૬)	-૦.૭૯%
ઉપાડ દર	૧૦.૦૦%	૧૦.૦૦%	૦.૩૩	૦.૨૫%	(૦.૩૩)	-૦.૨૫%

સંવેદનશીલતા વિશ્લેષણ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિની મર્યાદા:

સંવેદનશીલતા વિશ્લેષણ એક પરિમાણને બદલીને અને અન્ય તમામ પરિમાણો યથાવત રાખીને પરિણામો આપે છે. સંવેદનશીલતા વિશ્લેષણ અંતર્ગત પરિમાણો વચ્ચેના આંતરસંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નિષ્ફળ જાય છે. તેથી, જો બે કે તેથી વધુ ચલો બદલવામાં આવે તો પરિણામો બદલાઈ શકે છે.

૨૫.૧૩ મિલકતોની વિગતો- જવાબદારી સાથે સુસંગત વ્યૂહરચના

ભારતમાં ગ્રેચ્યુઇટી લાભ યોજના માટે લઘુત્તમ ભંડોળ રાખવાની આવશ્યકતા નથી અને યોજના હેઠળ જવાબદારીઓને સંપૂર્ણ અથવા આંશિક રીતે પૂર્વ-ભંડોળ આપવા માટે કંપનીની કોઈ મજબૂતી નથી. યોજનાના ટ્રસ્ટીઓએ ભંડોળના રોકાણ વ્યવસ્થાપનને વીમા કંપનીને આઉટસોર્સ કર્યું છે. વીમા કંપની બદલામાં ટ્રસ્ટીઓ દ્વારા તેમને આપવામાં આવેલા આદેશ મુજબ આ ભંડોળનું સંચાલન કરે છે અને જે વીમા નિયમોમાં ઠરાવેલ મિલકત ફાળવણી માન્ય મર્યાદામાં છે. ભંડોળ દ્વારા રાખી શકાય તેવા રોકાણોના પ્રકારોને કારણે, પરંપરાગત ફંડમાં સક્રિય રીતે જોખમનું સંચાલન કરવા માટે મિલકત જવાબદારી સાથે સુસંગત વ્યૂહરચનાનું સ્પષ્ટપણે પાલન કરવું શક્ય નથી.

૨૫.૧૪ નિર્ધારિત લાભ ચુકવણીની પરિપક્વતા વૃત્તાંત

માર્ચ ૩૧, ૨૦૨૧ ના રોજ	₹ લાખમાં	%
૨૦૨૨	૩.૮૪	૧.૮૦%
૨૦૨૩	૨૨.૬૪	૧૦.૫૦%
૨૦૨૪	૩.૪૨	૧.૬૦%
૨૦૨૫	૫૧.૫૨	૨૩.૮૦%
૨૦૨૬	૩૭.૪૩	૧૭.૪૦%
૨૦૨૭-૨૦૩૧	૫૨.૧૯	૨૪.૨૦%
માર્ચ ૩૧, ૨૦૨૦ ના રોજ	₹ લાખમાં	%
૨૦૨૧	૩.૭૮	૧.૮૦%
૨૦૨૨	૩.૭૩	૧.૮૦%
૨૦૨૩	૨૨.૦૫	૧૦.૮૦%
૨૦૨૪	૩.૨૭	૧.૬૦%
૨૦૨૫	૪૯.૩૯	૨૪.૨૦%
૨૦૨૬-૨૦૩૦	૮૪.૦૧	૪૧.૧૦%

૨૬ આવકવેરા ખર્ચ

૨૬.૧ નફા અને નુકસાનના પત્રકમાં આવકવેરા ખર્ચમાં નીચેનાનો સમાવેશ થાય છે:

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
નફો અને નુકસાનના પત્રકોમાં વર્તમાન આવકવેરા અગાઉના વર્ષના કર સંબંધિત સરભર	૧૧૨૪૭.૧૯ (૯૫૫.૨૨)	૧૩૨૪૧.૬૨ ૪.૮૦
નફો અને નુકસાનના પત્રકમાં વિલંબિત કર		
કામચલાઉ તજાવતની ઉત્પત્તિ અને વિપરીત સાથે સંબંધિત વિલંબિત કર ખર્ચ / (આવક)	(૮૦૪૫.૧૨)	૨૮૭૭.૬૫
આવકવેરા ખર્ચ	(૮૦૪૫.૧૨)	૨૮૭૭.૬૫
	૨૨૪૬.૮૫	૧૬૧૨૪.૦૭

૨૬.૨ ઓસીઆઈને લગતી વિલંબિત કર બાબતો

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
કામચલાઉ તજાવતની ઉત્પત્તિ અને રિવર્સલ સાથે સંબંધિત ખર્ચ / (આવક)	૬૫૩૪.૬૫	૩૭૪૧.૩૦
	૬૫૩૪.૬૫	૩૭૪૧.૩૦

૨૬.૩ આવકવેરાની મિલકત અને જવાબદારીઓ અને વિલંબિત કર જવાબદારીઓની વિગતો:

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
આવકવેરા મિલકત	(૧૨૯૦૦.૮૦)	(૨૯૩૮૩.૬૧)
આવકવેરા જવાબદારી	૧૧૩૮૧.૧૦	૨૭૪૧૦.૮૮
ચોખ્ખી આવકવેરા (મિલકત) / જવાબદારી	(૧૫૦૯.૭૦)	(૧૯૭૨.૭૩)
વિલંબિત કર (મિલકત) / જવાબદારી	૩૦૦૫૩.૨૫	૩૧૫૬૩.૭૧

૨૬.૪ આવકવેરા પહેલાં વૈધાનિક આવકવેરા દર લાગુ કરીને ગણતરી કરેલ રકમને આવકવેરાની જોગવાઈનું મેળવણું નીચે સંક્ષેપ્તમાં આપેલ છે:

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
કર પહેલા નફાની ગણતરી	૪૫૦૫૪.૯૫	૫૮૦૧૩.૮૦
સામાન્ય કર દર	૨૫.૧૬૮%	૩૪.૯૪૪%
ગણતરી કરેલ નફા પર જવાબદારી	૧૧૩૩૯.૪૩	૨૦૬૨૧.૭૯
બિન કપાતપાત્ર ખર્ચની કર અસર	૫૭૫.૩૧	૯૭૩.૮૧
કપાતપાત્ર ખર્ચની કર અસર	(૬૬૭.૫૫)	(૪૩૬૦.૦૨)
મેટ શાખની ઉપયોગ	૦.૦૦	(૩૯૯૩.૯૬)
સામાન્ય કર દર મુજબ આવકવેરા ખર્ચ	૧૧૨૪૭.૧૯	૧૩૨૪૧.૬૨

૨૬.૫ વર્ષ દરમિયાન કંપનીએ કલમ ૧૧૫બીએએ હેઠળ કર ચૂકવવાનું સ્વીકાર્યું છે, તેથી લાગુ કર દર ૨૫.૧૬૮% છે જે અગાઉના વર્ષ દરમિયાન ૩૪.૯૪૪% હતો.

૨૬.૬ દરેક પ્રકારના માન્ય હંગામી તફાવતો, વણવપરાયેલ કર ખોટ અને વણવપરાયેલ કર જમાની વિગતો:

(₹ લાખમાં)

બાબતો	સરવૈયામાં ડીટીએ / ડીટીએલ માન્ય	
	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
વિલંબિત કર જવાબદારી મ્યુચ્યુઅલ ફંડની તરલતા/દેવા યોજના રોકાણ	૨૦૨૬૨.૮૪ ૯૮૦૭.૪૧	૨૮૩૧૪.૫૦ ૩૨૭૨.૭૬
વિલંબિત કર મિલકત	૩૦૦૭૦.૨૫	૩૧૫૮૭.૨૬
મિલકત, સંચંત્ર અને સાધનો	૧૪.૭૭	૨૧.૮૦
કર્મચારી લાભો	૨.૨૩	૧.૭૫
કુલ વિલંબિત કર મિલકત	૧૭.૦૦	૨૩.૫૫
કુલ માન્ય વિલંબિત કર જવાબદારી/(મિલકત)	૩૦૦૫૩.૨૫	૩૧૫૬૩.૭૧

૨૭ નાણાંકીય દસ્તાવેજો

૨૭.૧ કક્ષાવાર નાણાંકીય દસ્તાવેજોની જાહેરાત

માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ

(₹ લાખમાં)

વર્ગવાર નાણાંકીય દસ્તાવેજો	નોંધ નં.	FVTPL	FVTOCI	શ્રદ્ધામુક્ત કિંમત	કુલ વહન મૂલ્ય	બજાર મૂલ્ય
નાણાંકીય મિલકતો						
રોકડ અને રોકડ સમક્ષક લોન	૫ ૬			૨૧૨૪૯.૫૫ ૧૧૯૭૦૧૨.૯૬	૨૧૨૪૯.૫૫ ૧૧૯૭૦૧૨.૯૬	૨૧૨૪૯.૫૫ ૧૧૯૭૦૧૨.૯૬
મ્યુચ્યુઅલ ફંડની તરલતા/દેવા યોજના રોકાણ	૭	૨૮૭૩૮૧૧.૦૬		૦.૦૦	૨૮૭૩૮૧૧.૦૬	૨૮૭૩૮૧૧.૦૬
સરકારી જામીનગીરીઓમાં રોકાણ	૭			૫૮૧૬૩૫.૨૯	૫૮૧૬૩૫.૨૯	૬૧૯૧૨૫.૨૦
શ્રદ્ધા જામીનગીરીમાં રોકાણ	૭			૪૦૦૦૦.૦૦	૪૦૦૦૦.૦૦	૪૦૦૦૦.૦૦
ઇક્વિટી શેરોમાં રોકાણ	૭		૨૨૭૯૦૮.૭૪	૦.૦૦	૨૨૭૯૦૮.૭૪	૨૨૭૯૦૮.૭૪
પ્રાથમિક વિક્રેતા પાસેની થાપણ	૭			૩૭૯૬૧.૪૩	૩૭૯૬૧.૪૩	૩૭૯૬૧.૪૩
અન્ય નાણાંકીય મિલકતો	૮			૧૬૦૯૧.૧૪	૧૬૦૯૧.૧૪	૧૬૦૯૧.૧૪
કુલ નાણાંકીય મિલકતો		૨૮૭૩૮૧૧.૦૬	૨૨૭૯૦૮.૭૪	૧૮૯૩૯૫૦.૩૭	૪૯૯૫૬૭૦.૧૭	૫૦૩૩૧૬૦.૦૮
નાણાંકીય જવાબદારીઓ						
વેપારી ચુકવણા	૧૧			૨૦.૧૩	૨૦.૧૩	૨૦.૧૩
થાપણો	૧૨			૪૩૭૯૬૭૩.૮૫	૪૩૭૯૬૭૩.૮૫	૪૩૭૯૬૭૩.૮૫
અન્ય નાણાંકીય જવાબદારીઓ	૧૩			૧૨૫૪૪૯.૯૯	૧૨૫૪૪૯.૯૯	૧૨૫૪૪૯.૯૯
કુલ નાણાંકીય જવાબદારીઓ		૦.૦૦	૦.૦૦	૪૫૦૫૧૪૩.૯૭	૪૫૦૫૧૪૩.૯૭	૪૫૦૫૧૪૩.૯૭

માર્ચ ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ

(₹ લાખમાં)

વર્ગવાર નાણાંકીય દસ્તાવેજો	નોંધ નં.	FVTPL	FVTOCI	ઋણમુક્ત કિંમત	કુલ વહન મૂલ્ય	બજાર મૂલ્ય
નાણાંકીય મિલકતો						
રોકડ અને રોકડ સમક્ષક લોન	૫			૪૩૬૯૯.૦૫	૪૩૬૯૯.૦૫	૪૩૬૯૯.૦૫
મ્યુચ્યુઅલ ફંડની તરલતા/દેવા યોજના રોકાણ	૬			૧૧૮૪૯૩૫.૪૦	૧૧૮૪૯૩૫.૪૦	૧૧૮૪૯૩૫.૪૦
સરકારી જામીનગીરીઓમાં રોકાણ	૭	૨૫૫૯૯૬૬.૫૨		૦.૦૦	૨૫૫૯૯૬૬.૫૨	૨૫૫૯૯૬૬.૫૨
ઋણ જામીનગીરીમાં રોકાણ	૭			૪૩૮૪૫૧.૯૭	૪૩૮૪૫૧.૯૭	૪૭૭૨૩૬.૩૧
ઘડિવેટી શેરોમાં રોકાણ	૭		૧૫૨૫૦૨.૫૧	૪૦૦૦૦.૦૦	૪૦૦૦૦.૦૦	૪૦૦૦૦.૦૦
પ્રાથમિક વિક્રેતા પાસેની થાપણ	૭			૦.૦૦	૧૫૨૫૦૨.૫૧	૧૫૨૫૦૨.૫૧
અન્ય નાણાંકીય મિલકતો	૭			૧૭૧૧૬.૦૪	૧૭૧૧૬.૦૪	૧૭૧૧૬.૦૪
	૮			૧૨૯૪૪.૬૯	૧૨૯૪૪.૬૯	૧૨૯૪૪.૬૯
કુલ નાણાંકીય મિલકતો		૨૫૫૯૯૬૬.૫૨	૧૫૨૫૦૨.૫૧	૧૭૩૭૧૪૭.૧૫	૪૪૪૯૬૧૬.૧૮	૪૪૮૮૪૦૦.૫૨
નાણાંકીય જવાબદારીઓ						
વેપારી ચુકવણા	૧૧			૧૯.૭૭	૧૯.૭૭	૧૯.૭૭
થાપણો	૧૨			૩૯૨૬૩૬૫.૬૪	૩૯૨૬૩૬૫.૬૪	૩૯૨૬૩૬૫.૬૪
અન્ય નાણાંકીય જવાબદારીઓ	૧૩			૧૩૯૦૨૮.૧૭	૧૩૯૦૨૮.૧૭	૧૩૯૦૨૮.૧૭
કુલ નાણાંકીય જવાબદારીઓ		૦.૦૦	૦.૦૦	૪૦૬૫૪૧૩.૫૮	૪૦૬૫૪૧૩.૫૮	૪૦૬૫૪૧૩.૫૮

૨૭.૨ કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ગુજરાત રાજ્યના નાણાં વિભાગના નિર્દેશો મુજબ વિવિધ કંપનીઓના ઘડિવેટી શેરોમાં રોકાણ કર્યું હતું. રોકાણ વ્યૂહાત્મક માનવામાં આવે છે, કંપનીએ આવા રોકાણનું વર્ગીકરણ કર્યું છે જે વેપાર માટે ધારણ કરવામાં આવ્યું નથી. આને ધ્યાનમાં રાખીને, આવા રોકાણો અન્ય વ્યાપક આવક દ્વારા બજાર મૂલ્ય તરીકે માપવામાં આવે છે.

૨૮ બજાર મૂલ્યે નિર્ધારણ

નાણાંકીય મિલકતો અને જવાબદારીઓનું બજાર મૂલ્યે નિર્ધારણ

૨૮.૧ બજાર મૂલ્ય કમિકતા

(₹ લાખમાં)

માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ	નોંધ નં.	સ્તર-૧	સ્તર-૨	સ્તર-૩	કુલ
FVTPL પર નિર્ધારિત નાણાંકીય મિલકત - સંચિત FVM					
મ્યુચ્યુઅલ ફંડની તરલતા/ઋણ યોજનામાં રોકાણ	૭	૨૮૭૩૮૧૧.૦૬			૨૮૭૩૮૧૧.૦૬
		૨૮૭૩૮૧૧.૦૬	૦.૦૦	૦.૦૦	૨૮૭૩૮૧૧.૦૬
નાણાંકીય મિલકત નિર્ધારિત ઋણમુક્તિ કિંમતે - સંચિત FVM					
સરકારી જામીનગીરીમાં રોકાણ		૬૧૯૧૨૫.૨૦			૬૧૯૧૨૫.૨૦
ઋણ જામીનગીરીમાં રોકાણ		૪૦૦૦૦.૦૦			૪૦૦૦૦.૦૦
પ્રાથમિક વિક્રેતા પાસેની થાપણ		૩૭૯૬૧.૪૩			૩૭૯૬૧.૪૩
		૬૬૭૦૮૬.૬૩	૦.૦૦	૦.૦૦	૬૬૭૦૮૬.૬૩
FVTOCI પર નિર્ધારિત નાણાંકીય મિલકત - સંચિત FVM					
ઘડિવેટી શેરોમાં રોકાણ		૨૧૧૧૨૯.૭૪	૧૬૭૭૯.૦૦		૨૨૭૯૦૮.૭૪
		૨૧૧૧૨૯.૭૪	૧૬૭૭૯.૦૦	૦.૦૦	૨૨૭૯૦૮.૭૪

માર્ચ ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ	નોંધ નં.	સ્તર-૧	સ્તર-૨	સ્તર-૩	કુલ
FVTPL પર નિધરિલી નાણાંકીય મિલકત - સંચિત FVM					
મ્યુચ્યુઅલ ફંડની તરલતા/શ્રદ્ધા યોજનામાં રોકાણ	૭	૨૫૫૯૯૬૬.૫૨			૨૫૫૯૯૬૬.૫૨
		૨૫૫૯૯૬૬.૫૨	૦.૦૦	૦.૦૦	૨૫૫૯૯૬૬.૫૨
નાણાંકીય મિલકત નિધરિલી શ્રદ્ધામુક્તિ કિંમતે - સંચિત FVM					
સરકારી જામીનગીરીમાં રોકાણ		૪૭૭૨૩૬.૩૧			૪૭૭૨૩૬.૩૧
શ્રદ્ધા જામીનગીરીમાં રોકાણ		૪૦૦૦૦.૦૦			૪૦૦૦૦.૦૦
પ્રાથમિક વિક્રેતા પાસેની થાપણ		૧૭૧૧૬.૦૪			૧૭૧૧૬.૦૪
		૫૩૪૩૫૨.૩૫	૦.૦૦	૦.૦૦	૫૩૪૩૫૨.૩૫
FVTOCI પર નિધરિલી નાણાંકીય મિલકત - સંચિત FVM					
ઘડિવેટી શેરોમાં રોકાણ		૧૩૭૮૬૫.૫૧	૧૪૬૩૭.૦૦		૧૫૨૫૦૨.૫૧
		૧૩૭૮૬૫.૫૧	૧૪૬૩૭.૦૦	૦.૦૦	૧૫૨૫૦૨.૫૧

૨૮.૨ સરકારી સિક્યોરિટીઝમાં રોકાણનું વાજબી મૂલ્ય, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (જીએસપીસી)ના ઘડિવેટી શેર સિવાય મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઘડિવેટી શેરની તરલ/શ્રદ્ધા યોજના, દર્શાવેલા ભાવો પર આધારિત છે.

૨૮.૩ સ્તર-૨ માં વાજબી મૂલ્ય નક્કી કરવા માટે વપરાતી મૂલ્યાંકન તકનીક અને સાધનો જીએસપીસીના શેરમાં રોકાણનું બજાર મૂલ્ય ઘડિવેટી શેર દીઠ નોંધાયેલ મૂલ્યાંકનકાર (ચાલુ વર્ષે ₹ ૯.૮૭, આગલા વર્ષે ₹ ૮.૬૧) ના મૂલ્યાંકન અહેવાલ પર આધારિત છે કારણ કે આ શેરો અસૂચિબદ્ધ છે.

૨૮.૪ આપેલ લોનનું બજાર મૂલ્ય અંદાજિત વહન મૂલ્ય આ દસ્તાવેજોના વ્યાજના પ્રવર્તમાન બજારના વ્યાજ દરે છે.

૨૮.૫ શ્રદ્ધામુક્ત ખર્ચમાં વહન થતી નાણાંકીય જવાબદારીઓની રકમ તેમના બજાર મૂલ્યોનો વાજબી અંદાજ છે કારણ કે કંપનીને અંદાજ નથી કે વહન રકમ એ મૂલ્યોથી નોંધપાત્ર રીતે અલગ હશે જે આખરે મળશે અથવા પતાવટ થશે.

૨૮.૬ વર્તમાન નાણાંકીય મિલકતોનું બજાર મૂલ્ય અને અમૂર્ત કિંમત પર નિર્ધારણ કરેલી વર્તમાન નાણાંકીય જવાબદારીઓ તેમની વહન રકમ જેટલી જ ગણવામાં આવે છે કારણ કે તે ટૂંકા ગાળાની પ્રકારની હોય છે.

૨૮.૭ વર્ષ દરમિયાન સ્તર-૧ અને સ્તર-૨ વચ્ચે કોઈ તબદીલી થઈ નથી.

૨૮.૮ કંપનીની નીતિ અહેવાલના સમયગાળાના અંતમાં કમિડતાના સ્તરોમાં બજાર મૂલ્યોની અંદર અને બહાર માન્ય કરવાની છે

૨૯ નાણાંકીય જોખમ વ્યવસ્થાપન

૨૯.૧ નાણાંકીય દસ્તાવેજો જોખમ વ્યવસ્થાપનના હેતુઓ અને નીતિઓ

કંપનીને ગુજરાત સરકારની સંસ્થાઓના વધારાના ભંડોળનો સંચાલન કરવાનો મુખ્ય આદેશ છે. તે નાણાંકીય બજારોની બદલાતી પ્રકૃતિમાં કામ કરતી વખતે ગુજરાત સરકારની સંસ્થાઓને મહત્તમ લાભ આપવાના તેના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. આ ભંડોળના સંચાલનની સક્રિય કામગીરીની ખાતરી આપે છે. કંપની નાણાંકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલી હોવાથી, તે નાણાંકીય જોખમો એટલે કે બજારનું જોખમ, પ્રવાહિતા જોખમ અને ધિરાણ જોખમ સામે આવે છે. આ જોખમોનું નિરીક્ષણ અને સંચાલન બોર્ડની એકંદર નીતિના પાયા હેઠળ થાય છે. કંપનીના ધિરાણ અને રોકાણના નિયમો બોર્ડ દ્વારા ઘડવામાં આવે છે જેથી નાણાંકીય જોખમોને ઘટાડી શકાય અને સાથે સાથે કંપનીના ઉદ્દેશોની અનન્ય પ્રકૃતિને પરિપૂર્ણ કરી શકાય. સમયાંતરે બોર્ડ નાણાંકીય બજારની સ્થિતિની સમીક્ષા કરે છે અને જ્યારે જરૂરી હોય ત્યારે યોગ્ય દિશા નિર્દેશો આપે છે. બોર્ડની પેટા સમિતિ- ધિરાણ સમિતિને બોર્ડ દ્વારા નિર્દિષ્ટ ધોરણો હેઠળ વિવિધ ધિરાણ અને રોકાણ દરખાસ્તો મંજૂર કરવાની જવાબદારી સોંપવામાં આવે છે. આવી મંજૂરીઓ બોર્ડ સમક્ષ સારી રીતે રચેલી પદ્ધતિમાં બહાલી માટે મૂકવામાં આવે છે જેના દ્વારા બોર્ડ કંપનીના પાલન માળખાની દેખરેખ રાખે છે.

૨૯.૨ બજાર જોખમ

બજારનું જોખમ એ બજાર મૂલ્યના અથવા નાણાંકીય દસ્તાવેજોના ભાવિ રોકડ પ્રવાહને બજાર ભાવોમાં ફેરફારને કારણે વધઘટ થશે. બજાર જોખમમાં વ્યાજ જોખમ અને અન્ય ભાવ જોખમનો સમાવેશ થાય છે.

૨૯.૨.૧ વ્યાજ દરનું જોખમ

વ્યાજ દરનું જોખમ એ જોખમ છે કે જે બજારના વ્યાજ દરોમાં ફેરફારને કારણે બજાર મૂલ્ય અથવા નાણાકીય દસ્તાવેજોના ભાવિ રોકડ પ્રવાહ વધઘટ થશે. કંપનીને આંતર કોર્પોરેટ થાપણો (આઈસીડી), તરલ થાપણ યોજનાના (એલડીએસ) ઉદાર લીધેલા ભંડોળ પર વ્યાજ દરનું જોખમ નથી. ગુજરાત સરકારની જામીનગીરીઓમાં રોકાણ અને મહાનગરપાલિકાના બોન્ડ્સના રૂપમાં તેના કાર્યકાળ દરમિયાન વ્યાજ દર નક્કી કરવામાં આવતા હોવાથી વ્યાજ દરનું કોઈ જોખમ નથી. ધિરાણ પ્રવૃત્તિઓના કિસ્સામાં, કંપની ગુજરાત સરકાર દ્વારા નિયંત્રિત સંસ્થાઓને લોન પર પરિવર્તનીય વ્યાજ દર પ્રસ્તાવિત કરે છે અને પ્રાથમિક વિક્રેતાઓને આપેલા ભંડોળ વ્યાજના ચલ દર ધરાવે છે. તેથી, આ વ્યાજ દર જોખમ હેઠળ આવરી લેવામાં આવે છે. કંપની સંવેદનશીલતા વિશ્લેષણ દ્વારા જોખમ નિર્ધારણ કરે છે.

વ્યાજ દરના જોખમમાં કંપનીની જાહેરાત સંપર્ક નીચે મુજબ છે:

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
મિલકતો		
ગુજરાત સરકાર દ્વારા નિયંત્રિત સંસ્થાઓને લોન વિક્રેતાઓ પાસે રહેલી થાપણો	૧૧૯૬૯૯૯.૧૨ ૩૭૯૬૧.૪૩	૧૧૮૪૯૩૩.૨૨ ૧૭૧૧૬.૦૪
કુલ	૧૨૩૪૯૬૦.૫૫	૧૨૦૨૦૪૯.૨૬

વિશ્લેષણની સંવેદનશીલતા

(₹ લાખમાં)

બાબતો	કરવેરા પછી નફા અને નુકસાન પર અસર	
	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
મિલકત		
વ્યાજ દરમાં ૫૦ આધાર અંકનો વધારો	૪૬૨૧	૩૯૧૦
વ્યાજ દરમાં ૫૦ આધાર અંકનો ઘટાડો	(૪૬૨૧)	(૩૯૧૦)

૨૯.૨.૨ અન્ય ભાવ જોખમ

ભાવ જોખમ એ બજાર મૂલ્યના અથવા નાણાકીય દસ્તાવેજોના ભાવિ રોકડ પ્રવાહને બજાર ભાવોમાં ફેરફારને કારણે (વ્યાજ દરના જોખમથી ઉલ્લવતા હોય તે સિવાય) વધઘટ થશે. કંપની સેબી દ્વારા નિયંત્રિત મ્યુચ્યુઅલ ફંડની તરલતા અને શ્રદ્ધા યોજનામાં તેના દૈનિક વધારાના ભંડોળનો ઉપયોગ કરે છે. કંપની મુખ્યત્વે નિયમનકારની માર્ગદર્શિકા અનુસાર દૈનિક ધોરણે એક બજારથી બીજા બજારના મ્યુચ્યુઅલ ફંડના એકમોના એનએવીમાં ફેરફારને લઈને ભાવ જોખમમાં છે. કંપની મ્યુચ્યુઅલ ફંડની વિવિધ તરલતા/શ્રદ્ધા યોજના તેના વિસ્તરણના વૈવિધ્યીકરણ કરીને જોખમ ઘટાડે છે. કંપની સંવેદનશીલતા વિશ્લેષણ દ્વારા જોખમનું નિર્ધારણ કરે છે.

ક કંપનીની ભાવ જોખમમાં જાહેરાત નીચે મુજબ છે:

(₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
મ્યુચ્યુઅલ ફંડની તરલ/શ્રદ્ધા યોજનામાં રોકાણ	૨૮૭૩૮૧૧.૦૬	૨૫૫૯૯૬૬.૫૨
ઈક્વિટી શેરોમાં રોકાણ	૨૨૭૯૦૮.૭૪	૧૫૨૫૦૨.૫૧
કુલ	૩૧૦૧૭૧૯.૮૦	૨૭૧૨૪૬૯.૦૩

ખ વિશ્લેષણની સંવેદનશીલતા

(₹ લાખમાં)

બાબતો	કરવેરા પછી નફા અને નુકસાન પર અસર	
	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
એનએવી/શેરના ભાવમાં ૦.૫% નો વધારો	૧૧૬૦૫	૮૮૨૩
એનએવી/શેરના ભાવમાં ૦.૫% નો ઘટાડો	(૧૧૬૦૫)	(૮૮૨૩)

૨૯.૩ પ્રવાહિતા જોખમ

પ્રવાહિતા જોખમ એવું જોખમ છે કે રોકડ અથવા અન્ય નાણાકીય મિલકતો આપીને સમાધાન કરવામાં આવેલ નાણાકીય જવાબદારીઓ સાથે સંકળાયેલ જવાબદારીઓને પહોંચી વળવામાં સંસ્થાને મુશ્કેલી પડશે. તરલતાનું સંચાલન કરવા માટે કંપનીનો અભિગમ, શક્ય હોય ત્યાં સુધી તેની ખાતરી કરવાનો છે કે જ્યારે અસ્વીકાર્ય નુકસાન કર્યા વિના અથવા કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યા વિના તેની જવાબદારીઓ પૂરી કરવા માટે તેની પાસે હંમેશા પૂરતી પ્રવાહિતા હશે. પ્રવાહિતાના મુખ્ય સ્ત્રોત રોકડ અને રોકડ સમકક્ષ અને રોકડ પ્રવાહ છે, જે કામગીરીમાંથી પેદા થાય છે. કંપની ખાતરી કરે

છે કે તેની પાસે ધિરાણ પ્રવૃત્તિઓ , નાણાંકીય જવાબદારીઓની સેવા અને અપેક્ષિત સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે પૂરતું ભંડોળ છે. કંપની તેના ભંડોળનો પૂરતો હિસ્સો નાણાં બજાર સાધનોમાં જમા કરે છે જે ખૂબ જ ટૂંકી સૂચના પર મળી શકે છે અને તેનો ઉપયોગ તેના થાપણદારો પાસેથી મોટી ચુકવણીની અચાનક માંગણીઓને સંતોષ આપવા માટે પણ થઈ શકે છે. કંપની તેની પ્રવાહિતાની સ્થિતિની નજીકથી દેખરેખ રાખે છે અને ગુજરાત સરકારની સંસ્થાઓ પાસેથી તેની આવક અને ચુકવણીનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરે છે.

નીચે આપેલ કોષ્ટક નાણાંકીય જવાબદારીઓની કરારની પરિપક્વતા સંબંધિત વિગતો આપે છે: (₹ લાખમાં)

માર્ચ ૩૧, ૨૦૨૧ ની સ્થિતિએ	કરારની પૂર્ણતા	એક વર્ષ સુધી	૧ થી ૨ વર્ષ	૨ થી ૫ વર્ષ	પાંચ વર્ષથી વધુ
થાપણો	૪૩૭૯૬૭૩.૮૫	૪૦૫૫૭૮૬.૩૧	૨૦૯૮૨૯.૭૨	૧૧૪૦૫૭.૮૧	-
અન્ય નાણાંકીય જવાબદારીઓ	૧૨૫૪૪૯.૯૯	૧૧૬૩૨૭.૧૨	૫૯૧૦.૨૩	૩૨૧૨.૬૪	-
વેપારી ચુકવણીઓ	૨૦.૧૩	૨૦.૧૩	-	-	-
	૪૫૦૫૧૪૩.૯૭	૪૧૭૨૧૩૩.૫૬	૨૧૫૭૩૯.૯૫	૧૧૭૨૭૦.૪૫	-
માર્ચ ૩૧, ૨૦૨૦ ની સ્થિતિએ	કરારની પૂર્ણતા	એક વર્ષ સુધી	૧ થી ૨ વર્ષ	૨ થી ૫ વર્ષ	પાંચ વર્ષથી વધુ
થાપણો	૩૯૨૬૩૬૫.૬૪	૩૬૩૬૬૧૮.૭૩	૧૬૧૭૦૦.૦૦	૧૨૮૦૪૬.૯૧	-
અન્ય નાણાંકીય જવાબદારીઓ	૧૩૯૦૨૮.૧૭	૧૨૯૯૪૫.૨૯	૫૦૬૮.૯૨	૪૦૧૩.૯૭	-
વેપારી ચુકવણીઓ	૧૯.૭૭	૧૯.૭૭	-	-	-
	૪૦૬૫૪૧૩.૫૮	૩૭૬૬૫૮૩.૭૯	૧૬૬૭૬૮.૯૨	૧૩૨૦૬૦.૮૮	-

૨૯.૪ ધિરાણ જોખમ

ધિરાણ જોખમ એવું જોખમ છે કે જે નાણાંકીય સાધન માટે એક પક્ષ અન્ય પક્ષ માટે જવાબદારીનું પાલન કરવામાં નિષ્ફળ થવાથી આર્થિક નુકસાન કરશે. ધિરાણ જોખમમાં ચૂકવું સીધું જોખમ અને ધિરાણ પાત્રતાની ગુણવત્તાનું જોખમ એમ બંનેનો સમાવેશ થાય છે. ધિરાણ જોખમ મુખ્યત્વે સરકારી જામીનગીરીઓમાં રોકાણ, પ્રાથમિક વિક્રેતા પાસે મૂકેલા ભંડોળ, મ્યુચ્યુઅલ ફંડની પ્રવાહિતા/બ્રહ્મણ યોજનાઓમાં રોકાણ, લોન અને રોકડ અને રોકડ સમકક્ષ નાણાંકીય મિલકતોમાંથી ઊભું થાય છે. પ્રાથમિક વિક્રેતા પાસે મૂકેલા ભંડોળ, મ્યુચ્યુઅલ ફંડની પ્રવાહી/બ્રહ્મણ યોજના રોકાણ અને રોકડ અને રોકડ સમકક્ષમાંથી ઉદ્ભવતા ધિરાણ જોખમ સાથે રાખવામાં આવેલા ભંડોળમાંથી ઊભું થતું ધિરાણ જોખમ મર્યાદિત છે કારણ કે સામા પક્ષો ભારતીય રીઝર્વ બેંક અને સેબી દ્વારા નિયંત્રિત બેન્કો અને માન્ય કરેલ મિલકત વ્યવસ્થાપન કંપનીઓ છે. સરકારી જામીનગીરીઓ અને લોનમાં રોકાણથી ધિરાણ જોખમ મર્યાદિત છે કારણ કે ગુજરાત રાજ્ય વિકાસ લોનની સરકારી જામીનગીરીમાં હોવાથી અને ગુજરાત સરકારના એકમોને આપવામાં આવતી લોનમાં રાજ્ય સરકારનું વાલીપણું હોવાથી ધિરાણ જોખમ સામે કંપનીને પૂરતી રાહત આપે છે.

ધિરાણ જોખમની મહત્તમ રજૂઆત નીચે મુજબ છે : (₹ લાખમાં)

બાબતો	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
રોકડ અને રોકડ સમકક્ષ	૨૧૨૪૯.૫૫	૪૩૬૯૯.૦૫
લોન	૧૧૯૭૦૧૨.૯૬	૧૧૮૪૯૩૫.૪૦
મ્યુચ્યુઅલ ફંડની તરલ/બ્રહ્મણ યોજનામાં રોકાણ	૨૮૭૩૮૧૧.૦૬	૨૫૫૯૯૬૬.૫૨
સરકારી જામીનગીરીઓમાં રોકાણ	૫૮૧૬૩૫.૨૯	૪૩૮૪૫૧.૯૭
ઇક્વિટી શેરોમાં રોકાણ	૨૨૭૯૦૮.૭૪	૧૫૨૫૦૨.૫૧
બ્રહ્મણ જામીનગીરીઓમાં રોકાણ (બોન્ડ)	૪૦૦૦૦.૦૦	૪૦૦૦૦.૦૦
પ્રાથમિક વિક્રેતાઓ પાસે ભંડોળ	૩૭૯૬૧.૪૩	૧૭૧૧૬.૦૪
અન્ય નાણાંકીય મિલકતો	૧૬૦૯૧.૧૪	૧૨૯૪૪.૬૯
	૪૯૯૫૬૭૦.૧૭	૪૪૪૯૬૧૬.૧૮

૨૯.૫ નીચે આપેલ કોષ્ટક ધિરાણની ગુણવત્તા અને ધિરાણના પાછલા દિવસો અને વર્ષના અંતના તબક્કાના વર્ગીકરણના આધારે ધિરાણ જોખમની મહત્તમ રજૂઆત દર્શાવે છે. પ્રસ્તુત રકમ ક્ષતિ છૂટની કુલ છે. (₹ લાખમાં)

લોનની રકમ	માર્ચ ૩૧, ૨૦૨૧ ના અંતે				
	મુદતવીતી નથી	તબક્કો-૧	તબક્કો-૨	તબક્કો-૩	કુલ
ગુજરાત સરકારની સંસ્થાઓને આપવામાં આવેલી લોન	૧૧૯૬૯૯૯.૧૨	૦	૦	૦	૧૧૯૬૯૯૯.૧૨
ઈસીએલ પદ્ધતિ મુજબ ક્ષતિ છૂટ	૦	૦	૦	૦	૦
આરબીઆઈના નિયમો અનુસાર ક્ષતિ છૂટની જોગવાઈ	૪૮૧૩.૭૩	૦	૦	૦	૪૮૧૩.૭૩

લોનની રકમ	માર્ચ ૩૧, ૨૦૨૦ ના અંતે				
	મુદતવીતી નથી	તબક્કો-૧	તબક્કો-૨	તબક્કો-૩	કુલ
ગુજરાત સરકારની સંસ્થાઓને આપવામાં આવેલી લોન	૧૧૮૪૯૩૩.૨૨	૦	૦	૦	૧૧૮૪૯૩૩.૨૨
ઈસીએલ પદ્ધતિ મુજબ ક્ષતિ છૂટ	૦	૦	૦	૦	૦
આરબીઆઈના નિયમો અનુસાર ક્ષતિ છૂટની જોગવાઈ	૪૭૫૭.૧૭	૦	૦	૦	૪૭૫૭.૧૭

વૈશ્વિક અને ભારતીય નાણાંકીય બજારો તેમજ વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ પર કોવિડ-૧૯ ની અસર ભવિષ્યના વિકાસ પર નિર્ભર રહેશે, જે અત્યંત અનિશ્ચિત છે. જો કે, કંપની અપેક્ષા રાખી રહી છે કે કંપનીની નાણાંકીય સ્થિતિ અને કામગીરી પર કોવિડ-૧૯ ને કારણે સંભવિત અસરો નોંધપાત્ર ન હોઈ શકે કારણ કે કંપનીએ માત્ર ગુજરાત સરકારની કંપનીઓને ધિરાણ આપ્યું છે.

કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ્સ, ઇક્વિટી શેર, પ્રાથમિક વિક્રેતા સાથેના ભંડોળ અને ઋણ જામીનગીરીની માહિતીના આંતરિક અને બાહ્ય સ્ત્રોત પર આધારિત કોવિડ -૧૯ થી રોકાણની સંભવિત અસરો પર નાણાંકીય પત્રકોની મંજૂરીની તારીખ સુધી પણ વિચાર કર્યો છે. કંપની અપેક્ષા રાખે છે કે આવી મિલકતની વહન રકમ પુનઃ પ્રાપ્ત થશે.

૩૦ કંપનીએ ઓછા મૂલ્યના ભાડાપટ્ટા માટે વર્ષ દરમિયાન “ભાડુ” મથાળા હેઠળ નફા અને નુકશાનના પત્રકમાં ₹ ૧૦૧.૯૯ લાખ (ગત વર્ષના ₹ ૯૪.૮૭ લાખ)ની ભાડાપટ્ટાની ચુકવણી માન્ય રાખી છે.

૩૧ શેર દીઠ કમાણી

બાબતો		માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
વર્ષની શરૂઆતમાં ઇક્વિટી શેરની સંખ્યા		૧૩૭૯૯૬૦૫૯	૧૩૭૯૯૬૦૫૯
વર્ષ દરમિયાન વધારો		૦	૦
વર્ષના અંતે ઇક્વિટી શેરની સંખ્યા		૧૩૭૯૯૬૦૫૯	૧૩૭૯૯૬૦૫૯
ઇક્વિટી શેરની ભારિત સરેરાશ સંખ્યા		૧૩૭૯૯૬૦૫૯	૧૩૭૯૯૬૦૫૯
બાબતો	એકમ	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
EPS (અ)ની ગણતરી માટે ઇક્વિટી શેરની ભારિત સરેરાશ સંખ્યા	શેર	૧૩૭૯૯૬૦૫૯	૧૩૭૯૯૬૦૫૯
ઉમેરો: મંદ અસર જે કોઈ હોય તો	-	-	-
EPS (બ)ની ગણતરી માટે ઇક્વિટી શેરની ભારિત સરેરાશ સંખ્યા	શેર	૧૩૭૯૯૬૦૫૯	૧૩૭૯૯૬૦૫૯
શેર દીઠ નામાંકિત મૂલ્ય શેર	₹/ શેર	૧૦	૧૦
કરવેરા પછી ચોખ્ખો નફો (ક)	₹ લાખમાં	૪૨૮૦૮.૧૦	૪૨૮૮૯.૭૩
મૂળ EPS (ક/અ)	₹/ શેર	૩૧.૦૨	૩૧.૦૮
મંદ EPS (ક/બ)	₹/ શેર	૩૧.૦૨	૩૧.૦૮

૩૨ વિભાજન અહેવાલ

કંપની નાણાંકીય પ્રવૃત્તિમાં રોકાણ છે અને કંપનીની અન્ય તમામ પ્રવૃત્તિઓ મુખ્ય વ્યવસાયની આસપાસ ફરે છે અને તેથી કોઈ વિભાજન યોગ્ય અહેવાલ નથી.

33 કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૩૫ હેઠળ કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પ્રવૃત્તિઓની જાહેરાત નીચે મુજબ છે:

(ક) વર્ષ દરમિયાન કંપની દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃત્તિ માટે ખર્ચવામાં આવનારી કુલ રકમ ₹ ૫૭૬.૫૩ લાખ (આગલા વર્ષના ₹ ૩૫૭.૪૩ લાખ) છે.

(ખ) વર્ષ દરમિયાન કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) પ્રવૃત્તિ પર ખર્ચવામાં આવેલી રકમ:

(₹ લાખમાં)

ક્રમ	બાબતો	૨૦૨૦-૨૧		કુલ
		રોકડા	હજી કેશમાં ચૂકવવું બાકી	
૧	મિલકતનું બાંધકામ/સંપાદન	૦.૦૦	૦.૦૦	૦.૦૦
૨	સીએસઆર પ્રવૃત્તિ માટે “મુખ્યમંત્રી રાહત ફંડ” માં ઉપરોક્ત (૧) સિવાયના હેતુ માટે	૧૬૫૦.૦૦	૦.૦૦	૧૬૫૦.૦૦
૩	સીએસઆર માટે વહીવટી સદસ્યે પર ખર્ચ	૦.૦૦	૦.૦૦	૦.૦૦
	કુલ	૧૬૫૦.૦૦	૦.૦૦	૧૬૫૦.૦૦

ક્રમ	બાબતો	૨૦૧૯-૨૦		કુલ
		રોકડા	હજી કેશમાં ચૂકવવું બાકી	
૧	મિલકતનું બાંધકામ/સંપાદન	૦.૦૦	૦.૦૦	૦.૦૦
૨	સીએસઆર પ્રવૃત્તિ માટે “મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિ” માં ઉપરોક્ત (૧) સિવાયના હેતુ માટે ફાળો આપ્યો છે.	૩૫૭.૪૩	૦.૦૦	૩૫૭.૪૩
૩	સીએસઆર માટે વહીવટી સદસ્યે પર ખર્ચ	૦.૦૦	૦.૦૦	૦.૦૦
	કુલ	૩૫૭.૪૩	૦.૦૦	૩૫૭.૪૩

૩૪ ભારતીય હિસાબી ધોરણ-૨૪ મુજબ સંબંધિત પક્ષોની જાહેરાત :

૩૪.૧ સંબંધિત પક્ષકારો

સંબંધિત પક્ષકારોના નામ	સંબંધ
ગુજરાત સરકાર	નિયંત્રક કંપની
ગુજરાત રાજ્ય મૂડી રોકાણ લિમિટેડ	અહેવાલ કરનાર સંસ્થા પર નોંધપાત્ર પ્રભાવ ધરાવતી (૨૨ માર્ચ, ૨૦૧૯ થી)
શ્રી કે. કૈલાસનાથન, આઈએએસ	ચેરમેન
શ્રી પંકજ જોશી, આઈએએસ	વહીવટી સંચાલક
શ્રી મિલિંદ તોરવણે, આઈએએસ	મનોનિત નિયામક
શ્રીમતી આરતી કંવર, આઈએએસ	મનોનિત નિયામક
શ્રી યમલ વ્યાસ	સ્વતંત્ર નિયામક (માર્ચ ૨૨, ૨૦૨૦ સુધી)
શ્રી સુનીલ તલાટી	સ્વતંત્ર નિયામક (જૂલાઈ ૧૫, ૨૦૨૦ થી)
શ્રી ભદ્રેશ મહેતા	સ્વતંત્ર નિયામક
શ્રી કમલેશ કે. પટેલ	મનોનિત નિયામક (ઓક્ટોબર ૬, ૨૦૨૦ સુધી)
શ્રી મેહુલ કે વસાવા	મનોનિત નિયામક (ઓક્ટોબર ૧૪, ૨૦૨૦ થી)
શ્રી નિતીન શાહ, મુખ્ય નાણાં અધિકારી	મુખ્ય વ્યવસ્થાપકીય અધિકારી
શ્રી અનિલ માલુ, કંપની સચિવ	મુખ્ય વ્યવસ્થાપકીય અધિકારી ((ઓક્ટોબર ૬, ૨૦૨૦ સુધી)
શ્રી નિરજ જૈન, કંપની સચિવ	મુખ્ય વ્યવસ્થાપકીય અધિકારી ((ઓક્ટોબર ૭, ૨૦૨૦ થી)

૩૪.૨ ભારતીય હિસાબી ધોરણ-૨૪ મુજબ, જે એક જ સરકારી નિયંત્રણ અથવા સંયુક્ત નિયંત્રણ અથવા નોંધપાત્ર પ્રભાવ ધરાવે, તો બંને કંપની અને અન્ય સંસ્થા સંબંધિત પક્ષ છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકાર દ્વારા નિયંત્રિત અન્ય સંસ્થાઓ સાથે કંપની દ્વારા કરાયેલા વ્યવહારોને સંબંધિત પક્ષોએ કરેલા વ્યવહાર તરીકે ગણવામાં આવે છે.

૩૪.૩ ભારતીય હિસાબી ધોરણ-૨૪ મુજબ, કંપનીએ સામૂહિક રીતે નોંધપાત્ર પરંતુ વ્યક્તિગત રીતે ન હોય એવા દરેક વ્યક્તિગત રીતે નોંધપાત્ર વ્યવહાર અને અન્ય વ્યવહારોની પૂરતી વિગતો જાહેર કરવી જરૂરી છે.

કંપની દરેક કેસની હકીકતો અને સંબોગોના આધારે નોંધપાત્ર વ્યવહાર નક્કી કરે છે. વ્યક્તિગત વ્યવહાર નોંધપાત્ર છે કે કેમ તે નક્કી કરવામાં, વ્યવહારનો પ્રકાર અને માત્રાનું મૂલ્યાંકન એકસાથે કરવામાં આવે છે. સંબોગો પર આધાર રાખીને, ક્યાં તો વ્યવહારનો પ્રકાર અથવા માત્રાને નિર્ધારિત કરતું પરિબળ હોઈ શકે છે. માત્રાના સંદર્ભમાં, નોંધપાત્ર વ્યવહારની કસોટી લાગુ કરવાના હેતુથી, વર્ષ દરમિયાન કરેલા એક સંબંધિત પક્ષ સાથે જે તે પ્રકારના કુલ સંબંધિત પક્ષ વ્યવહારોના ૧૦% થી વધુ હશે તો તે તમામ પ્રકારના વ્યવહારોને નોંધપાત્ર માનવામાં આવે છે. પ્રકારને લાગે છે ત્યાં સુધી, કંપનીના સામાન્ય વ્યવસાયના ન હોય એવા સંબંધિત પક્ષને લગતા વ્યવહારોને કેસની હકીકતો અને સંબોગોને નોંધપાત્ર વિષય ગણવામાં આવે છે.

સામૂહિક રીતે નોંધપાત્ર વ્યવહારો પરંતુ વ્યક્તિગત રીતે ન હોય તેના સંદર્ભમાં તે પ્રકારના પક્ષકાર સંબંધિત કુલ વ્યવહારના ૧૦% થી વધારે હોય તેવા વર્ષ દરમિયાન થયેલા વ્યક્તિગત રીતે નોંધપાત્ર વ્યવહાર સિવાય અન્ય તમામ પ્રકારના સંબંધિત પક્ષના વ્યવહારોને નોંધપાત્ર માનવામાં આવશે.

૩૪.૪ સંબંધિત પક્ષને લગતા વ્યવહારોની જાહેરાત

૩૪.૪.૧ ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નિયંત્રિત સંસ્થાઓ સાથેના વ્યવહારો.

ક આપેલી લોન

૧ વર્ષ દરમિયાન લેવડદેવડ

વિતરણ કરેલી લોન

(₹ લાખમાં)

બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
ગુજરાત ઊર્જા વિતરણ નિગમ લિમિટેડ	૩૨૪૪૦૦.૦૦	૫૭૦૦૦.૦૦
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ	૦.૦૦	૧૧૦૦૦૦.૦૦
ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લિમિટેડ	૫૧૨૦૦.૦૦	૪૦૦૦.૦૦
ગુજરાત આંતરરાષ્ટ્રીય નાણાંકીય ટેક-સિટી કંપની લિ.	૯૮૧૦૦.૦૦	૦.૦૦
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.	૨૫૦૦૦.૦૦	૩૬૨૮૦૦.૦૦
ગુજરાત રાજ્ય વીજ નિગમ લિમિટેડ	૦.૦૦	૨૦૦૦.૦૦
જીએસપીસી એલએનજી લિમિટેડ	૪૮૧૦૦.૦૦	૯૫૨૦૦.૦૦
જીએસપીસી પીપાવાવ પાવર કંપની લિમિટેડ	૧૦૦૦.૦૦	૯૦૧૪૬.૪૧
સંયુક્ત રીતે નોંધપાત્ર વ્યવહારો ધરાવતા અને વ્યક્તિગત સિવાયના અન્ય દેવાદારો	૧૪૯૬૪૨.૦૦	૧૬૩૨૨૧.૦૧
	૬૯૭૪૪૨.૦૦	૮૮૪૩૬૭.૪૨

૨ બંધ સિલક

(₹ લાખમાં)

બાબતો	૩૧ માર્ચ, ૨૦૨૦	૩૧ માર્ચ, ૨૦૧૯
ગુજરાત ઊર્જા વિતરણ નિગમ લિમિટેડ	૪૦૭૫૪૭.૦૬	૧૬૭૧૭૬.૪૭
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ	૧૯૪૨૫૯.૨૬	૨૯૯૪૪૪.૪૪
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ	૧૬૨૪૦૦.૦૦	૨૧૦૦૦૦.૦૦
ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લિમિટેડ	૩૮૬૩૩.૩૩	૧૧૪૦૦૦.૦૦
ગુજરાત રાજ્ય વીજ નિગમ લિમિટેડ	૪૦૭૯૬.૨૯	૭૬૧૦૧.૮૫
જીએસપીસી પીપાવાવ પાવર કંપની લિમિટેડ	૭૦૫૫૩.૩૩	૮૬૦૪૮.૮૫
સંયુક્ત રીતે નોંધપાત્ર વ્યવહારો ધરાવતા અને વ્યક્તિગત સિવાયના અન્ય દેવાદારો	૨૮૨૮૦૯.૮૫	૨૩૨૧૬૧.૬૧
	૧૧૯૬૯૯૯.૧૨	૧૧૮૪૯૩૩.૨૨

ખ ગુજરાત સરકારની જમીનગીરીમાં રોકાણ

૧ વર્ષ દરમિયાન વ્યવહારો

કંપની ખુલ્લા બજારમાંથી ગુજરાત સરકારની જમીનગીરી ખરીદે છે, તેથી તેને સંબંધિત પાર્ટી વ્યવહારો તરીકે ગણવામાં આવતા નથી.

૨ બાકી સિલકો

ગુજરાત સરકાર કંપનીને નિયંત્રિત કરતી હોવાથી, ગુજરાત સરકારની જામીનગીરીમાં રોકાણ આ સાથે જાહેર કરવામાં આવે છે. (₹ લાખમાં)

બાબત	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
ગુજરાત સરકારની જામીનગીરીઓ મહાનગરપાલિકાના બોન્ડ	૫૮૧૬૩૫.૨૯ ૪૦૦૦૦.૦૦	૪૩૮૪૫૧.૯૭ ૪૦૦૦૦.૦૦

૩૧ લીધેલ ICDs**૧ વર્ષ દરમિયાન વ્યવહાર**

(₹ લાખમાં)

બાબત	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
સંયુક્ત રીતે નોંધપાત્ર વ્યવહારો ધરાવતા અને વ્યક્તિગત સિવાયના અન્ય થાપણદારો	૯૧૫૯૫૦૭.૪૨	૮૬૮૩૩૨૭.૦૩

૨ બાકી સિલક

(₹ લાખમાં)

બાબત	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ	૪૨૨૧૦૨.૩૨	૩૫૫૧૬૩.૦૮
સંયુક્ત રીતે નોંધપાત્ર બંધ સિલક ધરાવતા અને વ્યક્તિગત સિવાયના થાપણદારો	૩૬૭૮૪૪૮.૨૦	૩૩૮૪૫૬૫.૧૭
	૪૧૦૦૫૫૦.૫૨	૩૭૩૯૭૨૮.૨૫

૪ લીધેલી તરલ થાપણો**૧ વર્ષ દરમિયાન વ્યવહાર**

(₹ લાખમાં)

બાબત	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ	૫૫૨૭૭૩.૯૨	૮૧૮૬૯૪.૯૪
ગુજરાત ગેસ લિમિટેડ	૭૩૪૨૨૫.૦૦	૭૯૨૧૮૫.૦૦
ગુજરાત શહેરી વિકાસ મિશન	૨૬૧૨૨.૨૦	૬૫૯૨૦.૭૮
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ	૧૩૪૦૦૬૦.૦૦	૧૧૮૮૮૯૩.૧૫
સંયુક્ત રીતે નોંધપાત્ર વ્યવહારો ધરાવતા અને વ્યક્તિગત સિવાયના અન્ય થાપણદારો	૧૬૭૪૯૭૨.૨૪	૧૨૩૦૬૯૭.૨૦
	૪૩૨૮૧૫૩.૩૬	૪૦૯૬૩૯૧.૦૭

૨ બાકી સિલક

(₹ લાખમાં)

બાબત	માર્ચ ૩૧, ૨૦૨૧	માર્ચ ૩૧, ૨૦૨૦
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ	૧૨૨૪૭.૨૮	૧૦૨૩૯.૫૧
ગુજરાત શહેરી વિકાસ કંપની લિમિટેડ	૧૫૫૧૦.૭૦	૨૨૫૪૩.૯૧
ગુજરાત શહેરી વિકાસ મિશન	૧૮૭૪.૧૯	૧૧૭૯.૮૬
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિ	૩૩૦૦૦.૦૦	૦.૦૦
ગુજરાત શહેરી આબુવિકા મિશન	૫૪૪૩.૭૪	૩૦૦૭.૧૮
ગુજરાત રાજ્ય નાગરિક પુસ્તકાલય નિગમ લિ.	૨૫૦૦.૦૦	૧૨૨૦૦.૦૦
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ	૧૨૩૧.૦૦	૨૦૧૪૩.૧૫
ગુજરાત ગેસ લિમિટેડ	૨૬૧૦૦.૦૦	૩૮૨૫૦.૦૦
ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ	૪૪૭૦૦.૦૦	૪૪૭૦૦.૦૦
સંયુક્ત રીતે નોંધપાત્ર બાકી સિલક ધરાવતા અને વ્યક્તિગત સિવાયના થાપણદારો	૧૪૩૪૫૭.૭૨	૪૧૫૭૯.૮૩
	૨૮૬૦૬૫.૪૩	૧૯૩૮૪૩.૪૪

૫ વ્યાજ આવક

(₹ લાખમાં)

બાબત	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
ગુજરાત સરકારની જામીનગીરીઓ	૪૦૩૩૧.૭૩	૩૫૮૦૧.૯૭
ગુજરાત ઊર્જા વિતરણ નિગમ લિમિટેડ	૨૭૨૯૭.૦૩	૧૫૨૪૧.૭૨
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ	૧૪૦૧૧.૦૪	૧૫૧૧૧.૮૬
ગુજરાત રાજ્ય વીજ નિગમ લિમિટેડ	૩૮૧૭.૩૪	૬૪૪૨.૨૦
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ	૧૬૦૦૯.૯૪	૨૬૯૦૫.૯૨
ગુજરાત રાજ્ય પેટ્રોનેટ લિમિટેડ	૫૭૦૧.૦૫	૧૩૭૬૪.૨૯
સંયુક્ત રીતે નોંધપાત્ર બંધ સિલક ધરાવતા અને વ્યક્તિગત સિવાયના અન્ય ટેવાદારો	૨૦૬૦૫.૭૯	૧૪૭૭૬.૮૨
	૧૨૭૭૭૩.૯૨	૧૨૮૧૪૪.૭૮

છ ICDs ઉપર વ્યાજ ખર્ચ		(₹ લાખમાં)
બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ	૨૬૮૯૨.૨૫	૨૨૮૧૮.૭૪
સંયુક્ત રીતે નોંધપાત્ર બંધ સિલક ધરાવતા અને વ્યક્તિગત સિવાયના અન્ય થાપણદારો	૨૨૫૬૫૬.૨૪	૨૫૪૮૧૩.૦૭
	૨૫૨૫૪૮.૪૯	૨૭૭૬૩૧.૮૧

જ તરલ ડિપોઝિટ પર વ્યાજ ખર્ચ		(₹ લાખમાં)
બાબતો	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ	૨૫૯૩.૦૩	૬૨૭૮.૨૪
ગુજરાત શહેરી વિકાસ મિશન	૧૬૧.૪૭	૮૮૯.૫૯
ગુજરાત પ્રાથમિક શિક્ષણ પરિષદ	૧૮૨૬.૨૭	૨૭૧૩.૧૯
ગુજરાત ગેસ લિમિટેડ	૧૭૭૩.૭૮	૧૭૪૦.૪૩
સંયુક્ત રીતે નોંધપાત્ર બંધ સિલક ધરાવતા અને વ્યક્તિગત સિવાયના અન્ય થાપણદારો	૭૭૪૧.૫૧	૮૯૮૬૦૯
	૧૪૪૫૬.૦૬	૨૦૬૦૭.૫૪

જ ભાડા ખર્ચ		(₹ લાખમાં)
બાબત	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
ગુજરાત ખનીજ વિકાસ નિગમ	૧૦૧.૯૯	૯૪.૮૭

૩૪.૪.૨ બિન-કારોબારી નિયામકોને ચૂકવવામાં આવતી બેઠક ફી સિવાય અન્ય કોઈ વ્યવહારો નથી. વર્ષ દરમિયાન બિન-કારોબારી નિયામકોને ₹ ૦.૨૪ લાખ (આગલા વર્ષમાં ₹ ૦.૧૮ લાખ) બેઠક ફી માટે ચૂકવવામાં આવ્યા હતા. વિગતો નીચે મુજબ છે:

		(₹ લાખમાં)
નિયામકોના નામ	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦
(૧) શ્રી ભદ્રેશ મહેતા	૦.૧૫	૦.૦૩
(૨) શ્રી સુનીલ તલાટી	૦.૦૯	૦.૦૦
(૩) શ્રી યમલ વ્યાસ	૦.૦૦	૦.૧૫

૩૪.૪.૩ કંપનીના મુખ્ય વ્યવસ્થાપક વ્યક્તિને વળતર

		(₹ લાખમાં)	
		વહીવટી સંચાલક	
બાબત	૨૦૨૦-૨૦૨૧	૨૦૧૯-૨૦૨૦	
ટૂંકા ગાળાના કર્મચારી લાભો	૦.૦૦	૦.૭૦	
નોકરી પછીના લાભો	૦.૦૦	૦.૦૦	
સમાપ્તિ લાભો	૦.૦૦	૦.૦૦	
શેર આધારિત ચુકવણીઓ	૦.૦૦	૦.૦૦	
કંપનીના મુખ્ય સંચાલકીય અધિકારીઓને કુલ વળતર	૦.૦૦	૦.૭૦	

(₹ લાખમાં)				
બાબતો	ટૂંકા ગાળાના કર્મચારી લાભો	નોકરી પછીના લાભો	સમાપ્તિ લાભો	શેર આધારિત ચુકવણીઓ
૨૦૨૦-૨૦૨૧				
શ્રી નીતીન શાહ	૨૪.૯૦	૦.૦૦	૦.૦૦	૦.૭૦
શ્રી અનીલ માલુ (૦૬-૧૦-૨૦૨૦ સુધી)	૭.૫૮	૬.૫૪	૦.૦૦	૦.૦૦
શ્રી નિરવ જૈન (૦૭-૧૦-૨૦૨૦ થી)	૪.૫૩	૦.૦૦	૦.૦૦	૦.૦૦
૨૦૧૯-૨૦૨૦				
શ્રી નીતીન શાહ	૨૧.૭૯	૦.૦૦	૦.૦૦	૦.૦૦
શ્રી અનીલ માલુ	૧૩.૯૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦
શ્રી નિરવ જૈન	૦.૦૦	૦.૦૦	૦.૦૦	૦.૦૦

૩૫ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ મુખ્ય ઘોષણા પી.ડી. ૦૦૮/૦૩.૧૦.૧૧૯/૨૦૧૬-૧૭ તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ (૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ થી અદ્યતન કરેલ) મુજબ, કંપનીઝ અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૨(૪૫) ની પુષ્ટિ કરતી સરકારી એનબીએફસી ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની પ્રણાલીગત રીતે મહત્વની બિન-બેકિંગ નાણાંકીય (થાપણો ન સ્વીકારતી અથવા ધરાવતી) કંપનીઓ વિવેકાદીન ધોરણો (રિઝર્વ બેંક) નિર્દેશો, ૨૦૧૫ ના લાગુ કરવામાંથી આપેલી મુક્તિ પછીના ૩૧ મે ૨૦૧૮ જાહેરનામા નં. ડી.એન.બી.આર. (પી.ડી.) સી.સી.૦૮૨/૦૩.૧૦.૦૦૧/૨૦૧૭-૧૮ બહાર પાડવામાં આવે ત્યાં સુધી જેમાં ભારતીય રિઝર્વ બેંકે સરકારની માલિકીની એનબીએફસીને વિવેકાદીન ધોરણો અને અન્ય નિયમનકારી અને વૈધાનિક જોગવાઈઓના પાલન કરવાની અપાયેલી મુક્તિ રદ કરી છે. વિચારણા હેઠળના નાણાંકીય વર્ષ દરમિયાન કોઈ એનબીએ/ પુનર્ગઠિત પેશગીઓ નથી. ૩૧ મે, ૨૦૧૮ ના ઉપર જણાવેલ જાહેરનામા લાગુ થયા બાદ કંપનીએ કોઈપણ લોનનું પુનર્ગઠન કર્યું નથી.

૩૫.૧ મુખ્ય નિર્દેશોના સંદર્ભમાં જાહેરાત નોન-બેકિંગ નાણાંકીય કંપની - પ્રણાલીગત રીતે મહત્વની થાપણો ન સ્વીકારતી કંપની અને થાપણો સ્વીકારતી કંપની (રિઝર્વ બેંક) નિર્દેશો, ૨૦૧૬ તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૧૬ ને તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ થી અદ્યતન કરવામાં આવી.

૩૫.૧.૧ મૂડી

બાબત	૩૧-૦૩-૨૦૨૧	૩૧-૦૩-૨૦૨૦
(૧) સીઆરએઆર (%)	૭.૫૭	૭.૪૪
(૨) સીઆરએઆર-હરોળ-૧ મૂડી (%)	૭.૫૭	૭.૪૪
(૩) સીઆરએઆર-હરોળ-૨ મૂડી (%)	૦.૦૦	૦.૦૦
(૪) હરોળ-૨ મૂડી તરીકે ઊભા થયેલા ગૌણ દેવાની રકમ	૦.૦૦	૦.૦૦
(૫) વિવેકાદીન શ્રદ્ધ સાધનો બહાર પાડીને ઊભી કરેલી રકમ	૦.૦૦	૦.૦૦

૩૫.૧.૨ મૂડી રોકાણ

(₹ લાખમાં)

બાબત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
(૧) રોકાણોનું મૂલ્ય		
(૧) રોકાણોનું કુલ મૂલ્ય		
(ક) ભારતમાં	૩૭૬૧૩૧૬.૫૨	૩૨૦૮૦૩૭.૦૩
(ખ) ભારત બહાર	૦.૦૦	૦.૦૦
(૨) થાપણની જોગવાઈઓ		
(ક) ભારતમાં	૦.૦૦	૦.૦૦
(ખ) ભારત બહાર	૦.૦૦	૦.૦૦
(૩) રોકાણોનું ચોખ્ખું મૂલ્ય		
(ક) ભારતમાં	૩૭૬૧૩૧૬.૫૨	૩૨૦૮૦૩૭.૦૩
(ખ) ભારત બહાર	૦.૦૦	૦.૦૦
(૨) થાપણ બાબુ રાખેલ જોગવાઈઓની હિલચાલ.		
(૧) ખુલતી સિલક	૦.૦૦	૦.૦૦
(૨) વધારો: વર્ષ દરમિયાન કરેલ જોગવાઈઓ	૦.૦૦	૦.૦૦
(૩) બાદ: વર્ષ દરમિયાન વધારાની જોગવાઈ માંડવાળ/પરત માંડવાળ	૦.૦૦	૦.૦૦
(૪) બંધ સિલક	૦.૦૦	૦.૦૦

૩૫.૧.૩ મિલકત અને જવાબદારીઓની પરિપક્વતાની રીત

(₹ લાખમાં)

બાબત	અકસ્થામતો		જવાબદારીઓ	
	ગુજરાત સરકારની કંપનીઓને લોન/ પેશગીઓ	મૂડો રોકાણો	ગુજરાત સરકારની કંપનીઓમાંથી શ્રદ્ધા	વિદેશી ચલણ સંપત્તિ / જવાબદારી
૧ થી ૭ દિવસ સુધી	૨૫૯૭.૭૭	૩૧૦૧૯૭૬.૩૫	૫૯૮૩૯૬.૬૭	-
૮ થી ૧૪ દિવસ સુધી	૮૭૧૫.૬૪	૬૧૩૩.૭૩	૨૬૮૭૬૪.૪૨	-
૧૫ થી ૩૦/૩૧ દિવસ સુધી	૨૨૭૮૫.૪૭	૫૯૨૧.૯૪	૩૮૫૪૪૬.૭૩	-
૧ માસથી વધુ અને ૨ માસ સુધી	૩૦૯૬૦.૦૬	૧૭૦૭૮.૦૨	૫૫૦૯૪૫.૧૭	-
૨ માસથી વધુ અને ૩ માસ સુધી	૪૪૬૫૯.૨૦	૧૫૦૯૩.૧૬	૩૩૭૩૯૧.૦૧	-
૩ માસથી વધુ અને ૬ માસ સુધી	૯૧૭૯૦.૫૧	૩૧૧૧.૧૫	૯૦૫૪૮૨.૭૧	-
૬ માસથી વધુ અને ૧ વર્ષ સુધી	૧૮૪૭૯૭.૭૩	૦.૦૦	૧૧૨૫૬૮૬.૭૧	-
૧ વર્ષ વધુ અને ૩ વર્ષ સુધી	૩૩૦૯૬૮.૭૩	૬૦૦૦૦.૦૦	૩૩૩૦૧૦.૪૧	-
૩ વર્ષ વધુ અને ૫ વર્ષ સુધી	૨૨૬૭૩૦.૧૨	૫૩૨૧૫.૨૦	૦.૦૦	-
૫ વર્ષથી વધુ	૨૫૯૪૧૧.૧૧	૫૦૭૮૨૨.૪૦	૦.૦૦	-
કુલ	૧૨૦૩૪૧૬.૩૪	૩૭૭૦૩૫૧.૯૬	૪૫૦૫૧૨૩.૮૪	૦

૩૫.૧.૪ ધિરાણો

(ક) જમીનજાગીર ક્ષેત્રે કરેલ ધિરાણો

(₹ લાખમાં)

કક્ષા	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
પ્રત્યક્ષ ધિરાણ		
રહેણાંક ગીરો	શૂન્ય	શૂન્ય
વ્યાપારિક સ્થાવર મિલકત	શૂન્ય	શૂન્ય
ગીરો સમર્થિત જમીનગીરીઓ અને અન્ય જમીનગીરીઓની જાહેરાતમાં રોકાણ	શૂન્ય	શૂન્ય
અપ્રત્યક્ષ ધિરાણ		
નેશનલ હાઉસિંગ બેંક (એનએચબી) અને હાઉસિંગ નાણાંકીય કંપનીઓ (એચએફસી) પર ભંડોળ અને બિન ભંડોળ આધારિત ધિરાણ	શૂન્ય	શૂન્ય

(ખ) મૂડી બજારમાં કરેલ ધિરાણ

(₹ લાખમાં)

બાબત	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
(૧) વિશેષ રીતે રોકાણ જેનું કોર્પોરેટ માત્ર કોર્પોરેટ શ્રદ્ધામાં રોકાણ કરેલ ન હોય એવા ઇક્વિટી શેર, પરિવર્તનીય બોન્ડ, પરિવર્તનીય ડિબેન્ચર્સ અને ઇક્વિટી લક્ષી મ્યુચ્યુઅલ ફંડ્સના એકમોમાં સીધું રોકાણ;	૨૨૭૯૦૮.૭૪	૧૫૨૫૦૨.૫૧
(૨) શેર (બોન્ડ / ડિબેન્ચર્સ અથવા અન્ય જમીનગીરીઓ અથવા ચોખ્ખા ધોરણે વ્યક્તિઓને શેર (IPOs / ESOPs સહિત), પરિવર્તનીય બોન્ડ્સ, પરિવર્તનીય ડિબેન્ચર્સ અને ઇક્વિટી લક્ષી મ્યુચ્યુઅલ ફંડ્સના એકમો માટે રોકાણ સામે પેશગીઓ;	૦	૦
(૩) કોઈપણ અન્ય હેતુઓ માટે જ્યાં શેર અથવા પરિવર્તનીય બોન્ડ્સ અથવા પરિવર્તનીય ડિબેન્ચર્સ અથવા ઇક્વિટી લક્ષી મ્યુચ્યુઅલ ફંડ્સના એકમો માટે પેશગીઓ પ્રાથમિક સુરક્ષા તરીકે લેવામાં આવે છે;	૦	૦
(૪) શેર અથવા પરિવર્તનીય બોન્ડ્સ અથવા પરિવર્તનીય ડિબેન્ચર્સ અથવા ઇક્વિટી લક્ષી મ્યુચ્યુઅલ ફંડ્સના એકમોની જમીનગીરી દ્વારા સુરક્ષાની હદ સુધી અન્ય કોઈ હેતુઓ માટે પેશગીઓ એટલે કે જ્યાં શેર / પરિવર્તનીય બોન્ડ્સ/પરિવર્તનીય ડિબેન્ચર્સ/ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ્સના એકમો સિવાય પ્રાથમિક સુરક્ષા પેશગીને સંપૂર્ણપણે આવરી લેતું ન હોય;	૦	૦
(૫) દલાલોને સુરક્ષિત અને અસુરક્ષિત પેશગીઓ; અને દલાલો અને બજારકર્તા વતી બહાર પાડેલ બાંધારીઓ;	૦	૦

(દ) કોર્પોરેટોને શેર/બોન્ડ / ડિબેન્યુર્સ અથવા અન્ય જામીનગીરઓની સુરક્ષા સામે અથવા સંસાધનો વધારવાની અપેક્ષાએ નવી કંપનીઓની ઇક્વિટીમાં પ્રાયોજકના યોગદાનને પહોંચી વળવા માટે ચોખ્ખા ધોરણે મંજૂર કરાયેલી લોન;	૦	૦
(૭) અપેક્ષિત ઇક્વિટી પ્રવાહ / અંકો સામે કંપનીઓને સુતુ ઋણ;	૦	૦
(૮) ખાનગી મૂડી ભંડોળના ફંડના તમામ પ્રગટીકરણ (નોંધાયેલા અને વણનોંધાયેલા એમ બંને)	૦	૦
કુલ મૂડી બજાર ધિરાણ	૨૨૭૯૦૮.૭૪	૧૫૨૫૦૨.૫૧

(ગ) ૩૧ માર્ચ, ૨૦૨૧ ના રોજ એકાકી કરજદાર મર્યાદા (SGL)/જૂથ કરજદાર મર્યાદા (GBL)ની વિગતો NBFC દ્વારા ઓળંગાયાની વિગતો

ભારતીય રિઝર્વ બેંકના પત્ર નં. ડી.એન.બી.આર. (પી.ડી.) સીઓ. ૧૨૨૩ /૦૩.૧૦.૦૦૧/૨૦૧૮-૧૯ તા. ડિસેમ્બર ૧૮, ૨૦૧૮ થી એ જી.એસ.એફ.એસ. ને ગુજરાત સરકારની સંસ્થાઓના પ્રગટીકરણની હદ સુધી ધિરાણ ધોરણોની કેન્દ્રીકરણમાંથી મુક્તિ આપી છે. જે કે, પ્રગટીકરણના ધોરણો મુજબ, નીચેની માહિતી રજૂ કરવામાં આવે છે.

(₹ લાખમાં)

બાબત	રકમ
ચોખ્ખુ માલિકીનું ભંડોળ*	૩૧૯૫૧૯.૯૧
ચોખ્ખી માલિકીના ભંડોળના ૧૫% (એકાકી કરજદારના કિસ્સામાં)	૪૭૯૨૭.૯૯
ચોખ્ખી માલિકીના ભંડોળના ૨૫% (એકાકી જૂથ પક્ષોના કિસ્સામાં)	૭૯૮૭૯.૯૮
ચોખ્ખી માલિકીના ભંડોળના ૪૦% (પક્ષોના એકાકી જૂથને ધિરાણ અને રોકાણ)	૧૨૭૮૦૭.૯૬

* ભારતીય રીઝર્વ બેંકના જાહેરનામા નં. આરબીઆઈ/૨૦૧૯-૨૦/૧૭૦ ડીઓઆર (એનબીએફસી) સીસી.પી.ડી. નં. ૧૦૯/૨૨.૧૦.૧૦૬/૨૦૧૯-૨૦ તારીખ ૧૩ માર્ચ, ૨૦૨૦ અને જાહેરનામા નંબર આરબીઆઈ/૨૦૨૦-૨૧/૧૫ ડીઓઆર (એનબીએફસી) સીસી.પી.ડી. નં. ૧૧૬/૨૨.૧૦.૧૦૬/૨૦૨૦-૨૧ તારીખ ૨૪ જુલાઈ, ૨૦૨૦.

૧ ને ધિરાણ

(ક) તેના માલિકીના ભંડોળના ૧૫% કરતા વધારે કોઈપણ એકાકી કરજદારને ધિરાણ (₹ લાખમાં)

ગુજરાત સરકારની સંસ્થાઓનું નામ	રકમ
ગુજરાત ઊર્જા વિતરણ કંપની લિ.	૪૦૭૫૪૭.૦૬
ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.	૧૬૨૪૦૦.૦૦
જીએસપીસી પીપાવાવ પાવર કંપની લિ.	૭૦૫૫૩.૩૩
ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ લિ.	૬૦૦૪૨.૨૩
સરદાર સરોવર નર્મદા નિગમ લિ.	૧૯૪૨૫૯.૨૬
Giff સીટી કંપની લિ.	૯૮૧૦૦.૦૦
જીએસપીસી એલએનજી લિમિટેડ	૪૮૧૦૦.૦૦

(ખ) ચોખ્ખી માલિકીના ભંડોળના ૨૫% (એકાકી જૂથ પક્ષોના કિસ્સામાં) (₹ લાખમાં)

ગુજરાત સરકારની જૂથ કંપનીઓના નામ	રકમ
જીએસપીસી જૂથ	૩૪૧૨૫૪.૨૮
જીયુવીએનએલ જૂથ	૪૪૮૩૪૩.૩૫

(ર) માં રોકાણ:

(ક) પોતાની માલિકીના ભંડોળના ૧૫% કરતા અન્ય કંપનીના વધારે શેર (₹ લાખમાં)

કંપનીનું નામ	રકમ
ટોરેન્ટ પાવર લિમિટેડ *	૧૨૨૪૬૧.૦૦

(ખ) પોતાની માલિકીના ભંડોળના ૧૫% કરતા એકાકી જૂથ કંપનીના વધારે શેર (₹ લાખમાં)

જૂથનું નામ	રકમ
ટોરેન્ટ લિમિટેડ *	૧૨૨૪૬૧.૦૦

* આ રોકાણ ગુજરાત સરકારના વ્યૂહાત્મક રોકાણને જાળવી રાખવા અને જી.એસ.એફ.એસ. દ્વારા ભારતીય રીઝર્વ બેંકના નિયમોનું પાલન કરતા રાજ્ય સરકારના પ્રગતિશીલ પગલાને મદદ કરવા માટે કરવામાં આવ્યું છે.

(૩) ધિરાણ અને રોકાણ (લોન / રોકાણ એકસાથે લીધેલ) વધારે**(ક) એક પક્ષને પોતાની માલિકીના ભંડોળના ૨૫%**

(₹ લાખમાં)

ગુજરાત સરકારની કંપનીનું નામ	રકમ
ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ	૧૭૬૦૧૭.૦૦

(ખ) એક પક્ષ જૂથને પોતાની માલિકીના ભંડોળના ૪૦%

(₹ લાખમાં)

ગુજરાત સરકારની જૂથ સંસ્થાઓનું નામ	રકમ
જીએસપીસી જૂથ	૩૫૪૮૭૧.૨૮

(ઘ) અસુરક્ષિત પેશગી

(₹ લાખમાં)

બાબત	૨૦૨૦-૨૧
(ક) અસુરક્ષિત પેશગીની રકમ નક્કી કરવા માટે, અધિકારો, પરવાના, અધિકૃતતા વગેરેને લાગુ પડતા એનબીએફસીને પ્રોજેક્ટોના સંદર્ભમાં તેમના દ્વારા સમાનાંતર રીતે વસૂલવામાં આવેલ (આંતરમાળખા પ્રોજેક્ટો સહિત) મૂર્ત જામીનગીરી તરીકે ગણવામાં આવશે નહીં. આથી આવી પેશગીઓ અસુરક્ષિત ગણવામાં આવશે.	૧૧૯૬૯૯૯.૧૨
(ખ) અધિકારો, પરવાના, અધિકૃતતા વગેરે માટે વસૂલવામાં આવેલ અમૂર્ત જામીનગીરી માટે લાગુ પડતી એનબીએફસી પેશગીની કુલ રકમ પણ જાહેર કરશે આવા અમૂર્ત સમાનાંતર અંદાજિત કિંમત તરીકે પણ લેવામાં આવી છે. એનટીએના અલગ હેડ હેઠળ જાહેરાત કરવામાં આવશે. આવી લોનને અન્ય સંપૂર્ણપણે અસુરક્ષિત લોનથી અલગ પાડે છે.	શૂન્ય

૩૫.૧.૫. પરચુરણ

(ક) અન્ય નાણાંકીય ક્ષેત્રના નિયમનકારો પાસેથી મેળવેલી નોંધણી -

કંપની ભારતીય રિઝર્વ બેંક સિવાય અન્ય કોઈ નિયમનકાર હેઠળ નોંધાયેલ નથી.

(ખ) કંપની ભારતીય રિઝર્વ બેંક સિવાય અન્ય કોઈ નિયમનકારો દ્વારા લાદવામાં આવેલ દંડની જાહેરાત - શૂન્ય

(ગ) ધિરાણ શ્રેણી સંસ્થાઓએ આપેલ રેટિંગ અને વર્ષ દરમિયાન રેટિંગનું સ્થળાંતર - લાગુ પડતું નથી.

૩૫.૧.૬ વધારાની જાહેરાતો**(ક) જોગવાઈઓ અને આકસ્મિકતાઓ**

(₹ લાખમાં)

નફા અને ખોટ ખાતાના ખર્ચના શીર્ષક હેઠળ બતાવેલ 'જોગવાઈઓ અને આકસ્મિક' નું વિભાજન	૨૦૨૦-૨૧	૨૦૧૯-૨૦
રોકાણના મૂલ્યમાં ઘટાડો કરવા માટેની જોગવાઈઓ	શૂન્ય	શૂન્ય
એનબીએ માટે જોગવાઈ	શૂન્ય	શૂન્ય
આવકવેરા માટે જોગવાઈ *	૧૧૨૪૭.૧૯	૧૩૨૪૧.૬૨
માનક સંપત્તિઓ સામે આકસ્મિક જોગવાઈ	-	-

* મેટ જમા લીધા પછી, જો કોઈ હોય તો

(ખ) પેશગીઓ, ધિરાણો અને એનબીએનું કેન્દ્રીકરણ એકાગ્રતા

ડિસેમ્બર ૧૮, ૨૦૧૮ ના ભારતીય રિઝર્વ બેંકના પત્ર નં. ડી.એન.બી.આર. (પી.ડી.) સીઓ. ૧૨૨૩/૦૩.૧૦.૦૦૧/૨૦૧૮-૧૯ થી ગુજરાત સરકારની સંસ્થાઓના પ્રગટીકરણની હદ સુધી ધિરાણ ધોરણોની કેન્દ્રીકરણમાંથી મુક્તિ આપી છે.

(₹ લાખમાં)

(ક) કેન્દ્રીકરણ પેશગીઓ	
સૌથી મોટા વીસ દેવાદારોને કુલ પેશગી	૧૧૯૬૯૯૯.૧૨
એનબીએફસીના લાગુ પડતી કુલ પેશગીઓ માટે સૌથી મોટા વીસ ઉદ્યોગ લેનારાઓની પેશગીની ટકાવારી	૧૦૦%
(ખ) પ્રગટીકરણનું કેન્દ્રીકરણ	
સૌથી મોટા વીસ દેવાદારો / ગ્રાહકો માટે કુલ પ્રગટીકરણ	૧૧૯૬૯૯૯.૧૨
સૌથી મોટા વીસ દેવાદારો / ગ્રાહકોને પ્રગટીકરણની ટકાવારી ઉદ્યોગ લેનારાઓ/ ગ્રાહકો પર લાગુ પડતા એનબીએફસીના કુલ પ્રગટીકરણ માટે	૧૦૦%

(ગ) એનપીએનું કેન્દ્રીકરણ

ટોચના ચાર એનપીએ ખાતાઓમાં કુલ પ્રગટીકરણ

શૂન્ય

(ગ) વ્યુત્પન્ન

કંપનીએ વર્ષ દરમિયાન કોઈપણ વ્યુત્પન્ન કરાર કર્યો નથી.

(ઘ) ભારતીય રીઝર્વ બેંકના માસ્ટર નિર્દેશન અનુસાર છેતરપિંડી પર ખુલાસો - શૂન્ય

(ચ) અમૂર્ત જામીનગીરી સામે પેશગી

કંપનીએ અમૂર્ત જામીનગીરી સામે કોઈ લોન આપી નથી.

(છ) હાલની અનામતમાંથી ઉપાડ

કંપનીએ હાલના અનામતમાંથી કોઈ ઉપાડ કર્યો નથી.

(જ) જામીનગીરીકરણ

કંપનીએ વર્ષ દરમિયાન આવો કોઈ વ્યવહાર કર્યો નથી.

(ઝ) વ્યવહારોની સોંપણીની વિગતો

કંપનીએ વર્ષ દરમિયાન આવો કોઈ વ્યવહાર કર્યો નથી.

(ટ) પિવૃ કંપનીના ઉત્પાદનોના ધિરાણની વિગતો - લાગુ પડતું નથી

(ઠ) એસપીવી પ્રાયોજિત બંધ સરવૈયું - લાગુ પડતું નથી

(ડ) ગ્રાહકની ફરિયાદો

(ક) વર્ષની શરૂઆતમાં પડતર ફરિયાદોની સંખ્યા

શૂન્ય

(ખ) વર્ષની દરમિયાન મળેલી ફરિયાદોની સંખ્યા

શૂન્ય

(ગ) વર્ષની દરમિયાન નિકાલ કરેલ ફરિયાદોની સંખ્યા

શૂન્ય

(ઘ) વર્ષની અંતે પડતર ફરિયાદોની સંખ્યા

શૂન્ય

3૬ નોન-બેંકિંગ નાણાંકીય કંપનીઓ અને કેન્દ્રીય ધિરાણ કંપનીઓ માટે તરલતા જોખમ વ્યવસ્થાપન માળખા પર ભારતીય રીઝર્વ બેંકના તા. ૦૪ નવેમ્બર, ૨૦૧૯ ના પરિપત્ર મુજબ એલસીઆર (તરલતા સુરક્ષા ગુણોત્તર) જાહેર કરવો.

ભારતીય રીઝર્વ બેંકના તા. ૦૪ નવેમ્બર, ૨૦૧૯ ના પરિપત્રથી નોન બેંકિંગ નાણાંકીય કંપનીઓ અને કેન્દ્રીય ધિરાણ કંપનીઓ માટે તરલતા સુરક્ષા ગુણોત્તર) માળખા પર ઘડેલી માર્ગદર્શિકા છે, જે નોન બેંકિંગ નાણાંકીય કંપનીઓને પણ લાગુ પડે છે. તરલતા સુરક્ષા ગુણોત્તર (એલસીઆર) એ એનબીએફસીની અપેક્ષિત અને અણધારી ચુકવણીની જવાબદારીઓને વાજબી કિંમતે અને અસ્વીકાર્ય નુકસાની વિના ટૂંકા ગાળા દરમિયાન ઊભી થતી ક્ષમતાનો નિર્ધારણ માટેના મુખ્ય ગુણો છે.

એલસીઆરની ગણતરી ૩૦ દિવસના દબાણના સમયગાળા દરમિયાન એનબીએફસી ના એચક્યુએલએ ના જથ્થાને તેના કુલ ચોખ્ખા રોકડ પ્રવાહ દ્વારા ભાગાકાર કરીને કરવામાં આવે છે. એનબીએફસીને તેની પાસે અસંખ્ય ઉચ્ચ ગુણવત્તાની તરલ મિલકતો (એચક્યુએલએ)નો પૂરતો જથ્થો હોય જે ૩૦ કેલેન્ડર દિવસના તરલતા દબાણની પરિસ્થિતિ માટે તેમની તરલતા જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરળતાથી અને તરત જ રોકડમાં રૂપાંતરિત કરી શકાય એ જરૂરી છે. એલસીઆર નો ઉદ્દેશ એનબીએફસી ની તરલતા જોખમ રૂપરેખાના ટૂંકા ગાળાની સ્થિતિસ્થાપકતાને નાણાંકીય અને આર્થિક દબાણમાંથી ઉદ્ભવતા આંચકાઓને શમાવવા નાણાંકીય ક્ષેત્રની ક્ષમતામાં સુધારો કરી પછી સ્રોત ગમે તે હોય, વાસ્તવિક અર્થતંત્રને નાણાંકીય ક્ષેત્રક્રમંથી આગળ ખેંચવાનું જોખમ ઘટાડીને પ્રોત્સાહન આપવાનો છે.

એલસીઆર ની વ્યાખ્યા આ પ્રમાણે છે: ઉચ્ચ ગુણવત્તાની પ્રવાહી મિલકતનો જથ્થો (એચક્યુએલએ) આગામી ૩૦ કેલેન્ડર દિવસોનો કુલ ચોખ્ખો રોકડ પ્રવાહ

એલસીઆર પાલન માટે વ્યવસ્થિત સંક્રમણની ખાતરી કરવા માટે, એલસીઆર ની જરૂરિયાતોને ભારતીય રીઝર્વ બેંક દ્વારા ૧ લી ડિસેમ્બર, ૨૦૨૦ થી શરૂ કરીને ૫૦% પર લઘુત્તમ એલસીઆર જાળવી રાખી, ૧ લી ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં ક્રમશઃ ૧૦૦% ના જરૂરી સ્તર સુધી પહોંચવા એનબીએફસી પર પ્રગતિશીલ રીતે બંધનકર્તા બનાવવામાં આવી છે. હાલની એલસીઆરમાં ઠરાવેલ સમયમર્યાદા મુજબ જીએસએફએસ એ ૩૧ માર્ચ ૨૦૨૧ ની સ્થિતિની ૫૦% જાળવવી જરૂરી છે,

જથ્થાત્મક ખહેરાત

(₹ લાખમાં)

	નાણાંકીય વર્ષ ૨૦-૨૧ પ્રથમ ત્રિમાસિક		નાણાંકીય વર્ષ ૨૦-૨૧ દ્વિતીય ત્રિમાસિક		નાણાંકીય વર્ષ ૨૦-૨૧ તૃતીય ત્રિમાસિક		નાણાંકીય વર્ષ ૨૦-૨૧ ચોથો ત્રિમાસિક	
	કુલ બિન ભાદિત-૩ મૂલ્ય (સરેરાશ)	કુલ ભાદિત-૪ મૂલ્ય (સરેરાશ)	કુલ બિન ભાદિત-૩ મૂલ્ય (સરેરાશ)	કુલ ભાદિત-૪ મૂલ્ય (સરેરાશ)	કુલ બિન ભાદિત-૩ મૂલ્ય (સરેરાશ)	કુલ ભાદિત-૪ મૂલ્ય (સરેરાશ)	કુલ બિન ભાદિત-૩ મૂલ્ય (સરેરાશ)	કુલ ભાદિત-૪ મૂલ્ય (સરેરાશ)
ઉચ્ચ ગુણવત્તા તરલ મિલકતો								
૧ કુલ ઉચ્ચ ગુણવત્તા તરલ મિલકતો (એચક્યુએલએ)	૫૮૨૩૦૦	૫૧૭૭૦૦	૬૩૧૫૬૭	૫૬૬૯૬૭	૬૪૧૪૦૦	૫૭૬૮૦૦	૬૭૫૨૬૭	૬૧૦૬૬૭
બાહ્ય રોકડ પ્રવાહ								
૨ થાપણો (થાપણ લેતી કંપનીઓ માટે)								
૩ અસુરક્ષિત જથ્થાબંધ ભંડોળ								
૪ સુરક્ષિત જથ્થાબંધ ભંડોળ								
૫ જે માથી વધારાની આવશ્યકતાઓ								
(૧) બાહ્ય પ્રવાહ સંબંધિત વ્યુત્પન્ન પ્રગટીકરણ અને અન્ય સમાનાંતર જરૂરિયાતો								
(૨) ખરણ ઉત્પાદનો પર ભંડોળના નુકસાન સાથે સંબંધિત બાહ્ય પ્રવાહ								
(૩) ધિરાણ અને તરલતા સુવિધાઓ								
૬ અન્ય કરાર આધારિત ભંડોળ જવાબદારીઓ								
૭ અન્ય આકસ્મિક ભંડોળ જવાબદારીઓ								
૮ અન્ય રોકડ પ્રવાહ (ઉપરોક્ત કોઈપણ અન્ય સંદર્ભ હેઠળ આવતો ન હોય અને ગુજરાત સરકારની સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત ભંડોળની ચુકવણીની બહેરાત)	૧૧૧૩૪૯૫	૧૨૮૦૫૧૯	૧૦૧૬૨૫૦	૧૧૬૮૬૮૮	૮૯૦૮૨૧	૧૦૨૪૪૪૪	૯૮૦૮૩૦	૧૧૨૭૯૫૫
૮ કુલ બાહ્ય રોકડ પ્રવાહ	૧૧૧૩૪૯૫	૧૨૮૦૫૧૯	૧૦૧૬૨૫૦	૧૧૬૮૬૮૮	૮૯૦૮૨૧	૧૦૨૪૪૪૪	૯૮૦૮૩૦	૧૧૨૭૯૫૫
આંતર રોકડ પ્રવાહ								
૯ સુરક્ષિત ધિરાણ								
૧૦ સંપૂર્ણ કામગીરી પ્રગટીકરણમાંથી આંતર પ્રવાહ								
૧૧ અન્ય આંતર રોકડ પ્રવાહ (મુખ્યત્વે ગુજરાત સરકારની સંસ્થાઓ પાસેથી લોબની ચુકવણી અને મ્યુચ્યુઅલ ફંડની તરલ/ખરણ યોજનાના રોકાણમાંથી મુક્તિનો સમાવેશ થાય છે)	૨૬૧૪૧૯૩	૧૯૬૦૬૪૫	૨૬૫૭૮૫૮	૧૯૯૩૩૯૪	૨૮૦૩૩૧૮	૨૧૦૨૪૮૯	૨૮૭૫૦૧૭	૨૧૫૬૨૬૩
૧૨ કુલ આંતર રોકડ પ્રવાહ	૨૬૧૪૧૯૩	૧૯૬૦૬૪૫	૨૬૫૭૮૫૮	૧૯૯૩૩૯૪	૨૮૦૩૩૧૮	૨૧૦૨૪૮૯	૨૮૭૫૦૧૭	૨૧૫૬૨૬૩
		કુલ સરભર મૂલ્ય		કુલ સરભર મૂલ્ય		કુલ સરભર મૂલ્ય		કુલ સરભર મૂલ્ય
૧૩ કુલ (એચક્યુએલએ)		૫૧૭૭૦૦		૫૬૬૯૬૭		૫૭૬૮૦૦		૬૧૦૬૬૭
૧૪ કુલ આંતર રોકડ પ્રવાહ		૩૨૦૧૩૦		૨૯૨૧૭૨		૨૫૬૧૧૧		૨૮૧૯૮૯
૧૫ તરલતા સુરક્ષિત ગુણોત્તર (%)		૧૬૨%		૧૯૪%		૨૨૫%		૨૧૭%

^૩ ભારતિ વગરના મૂલ્યોને ૩૦ દિવસની અંદર (આંતર પ્રવાહ અને બાહ્યપ્રવાહ માટે) પરિપક્વ અથવા માંગણીપાત્ર બાકી રકમ તરીકે ગણવામાં આવેલ છે.

^૪ સંબંધિત એચક્યુએલએ અને આંતર પ્રવાહ અને બાહ્યપ્રવાહ પર દબાણના પરિબલોને લાગુ કર્યા પછી ભારતિ મૂલ્યોની ગણતરી કરવામાં આવી છે.

કંપનીના નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના ચોથા એલસીઆર ૨૧૭% થાય છે અને તે ૩૧ માર્ચ, ૨૦૨૧ ની સ્થિતિએ ૫૦% ની લઘુત્તમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે છે. ચોથા ત્રિમાસિક દરમિયાન સરેરાશ એચક્યુએલએ ૬૧૦૬૬૭ લાખ હતી, જેમાંથી સ્તર-૧ ની મિલકતો (એટલે કે જીએસડીએલ જામીનગીરી) ના કુલ એચક્યુએલએ ના ૮૧% ની થાય છે. સ્તર-૨ ની મિલકતો (એટલે કે સામાન્ય ઇક્વિટી શેર) કુલ એચક્યુએલએ ના ૧૯% થાય છે. ચાલુ ત્રિમાસિક દરમિયાન, એચક્યુએલએ (જીએસડીએલ રોકાણો)માં લગભગ ૭% નો વધારો થયો છે, જ્યારે સ્તર-૨ નું રોકાણ સ્થિર રહ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા ત્રિમાસિકની સરખામણીમાં ભંડોળના કદમાં વધારો થવાને કારણે વર્ષ ૨૦૨૦-૨૧ના ચોથા ત્રિમાસિક દરમિયાન ભારતિ અંદાજિત ચોખ્ખા રોકડ બાહ્ય પ્રવાહની સ્થિતિ ₹ ૨૫૮૭૮ લાખ વધી છે.

ભારતીય રીઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, કંપનીએ મિલકત-જવાબદારી સંચાલન સમિતિની રચના કરી છે. કંપનીની મિલકત-જવાબદારી સંચાલન સમિતિ બોર્ડ દ્વારા મંજૂર કરેલી મિલકત-જવાબદારી સંચાલન કંપનીના વિશિષ્ટ વ્યવસાય પદ્ધતિને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવેલી નીતિ દ્વારા સંચાલિત થાય છે.

૩૦ મુખ્ય નિર્દેશ - નોન -બેંકિંગ નાણાંકીય કંપની - પદ્ધતિસર મહત્વની બિન-થાપણ ન સ્વીકારતી કંપની અને થાપણ સ્વીકારતી કંપની (રિઝર્વ બેંક) નિર્દેશો , ૨૦૧૬ , તારીખ ૧ લી સપ્ટેમ્બર , ૨૦૧૬ ના રોજ ૧૭ ફેબ્રુઆરી , ૨૦૨૦ થી સુધારેલ સરવૈયાની અનુસૂચિ .

જવાબદારી બાજુ

(₹ લાખમાં)

વિગતો	બાકી રકમ		ચડત રકમ	
	૩૧ માર્ચ, ૨૧	૩૧ માર્ચ, ૨૦	૩૧ માર્ચ, ૨૧	૩૧ માર્ચ, ૨૦
(૧) બિન-બેંકિંગ નાણાંકીય કંપનીએ ચૂકવણી ન કરેલ ઉપાર્જિત વ્યાજ સહિત મેળવેલ લોન અને પેશગી				
(ક) ડિબેન્ચર્સ: સુરક્ષિત	-	-	-	-
અસુરક્ષિત: (જાહેર થાપણોના અર્થ સિવાયની)	-	-	-	-
(ખ) વિલંબિત ધિરાણ	-	-	-	-
(ગ) મુદતી લોન	-	-	-	-
(ઘ) આંતર-કોર્પોરેટ લોન અને કરજ	૪૨૧૫૮૭૭.૩૨	૩૮૫૬૭૫૫.૮૩	૬૯૪૨.૧૦	૭૨૨૭.૮૦
(ચ) જાહેર થાપણ	-	-	-	-
(છ) વેપારી પત્રો	-	-	-	-
(જ) અન્ય લોન (પ્રકાર જણાવો) - તરલ થાપણ યોજના	૨૮૯૨૪૬.૫૨	૨૦૮૬૩૭.૯૯	-	-

મિલકત બાજુ

(₹ લાખમાં)

વિગતો	બાકી રકમ	
	૩૧ માર્ચ, ૨૧	૩૧ માર્ચ, ૨૦
(૨) મળવાપાત્ર બીલ સહિત લોન અને પેશગીનું વિભાજન નીચે (૩) માં સમાવિષ્ટ સિવાય		
(ક) સુરક્ષિત	૧૪.૩૦	૨.૪૦
(ખ) અસુરક્ષિત	૧૨૦૩૪૧૯.૬૧	૧૧૮૯૨૯૦.૮૨
(૩) ભાડે લીધેલી મિલકતો અને જથ્થાનું વિભાજન અને એએફસી પ્રવૃત્તિઓ માટે ગણાતી અન્ય મિલકતો	લાગુ પડતું નથી	લાગુ પડતું નથી

(૪) રોકાણોનું વિભાજન

દુંકાગાળાનું રોકાણ

૧ દર્શાવેલ

શેર:

(ક) ઇક્વિટી

(ખ) પસંદગીના

ડીએન્યરો અને બોન્ડ

મ્યુચ્યુઅલ ફંડના યુનિટો

સરકારી જામીનગીરીઓ

અન્ય (જણાવો)

૨ દર્શાવ્યા સિવાયના

શેર:

(ક) ઇક્વિટી

(ખ) પસંદગીના

ડીએન્યરો અને બોન્ડ

મ્યુચ્યુઅલ ફંડના યુનિટો

સરકારી જામીનગીરીઓ

અન્ય (જણાવો)

લાંબા ગાળાના રોકાણો

૧ દર્શાવેલા

શેર:

(ક) ઇક્વિટી

(ખ) પસંદગીના

ડીએન્યરો અને બોન્ડ

મ્યુચ્યુઅલ ફંડના યુનિટો

સરકારી જામીનગીરીઓ

અન્ય (જણાવો)

૨ દર્શાવ્યા સિવાયના

શેર:

(ક) ઇક્વિટી

(ખ) પસંદગીના

ડીએન્યરો અને બોન્ડ

મ્યુચ્યુઅલ ફંડના યુનિટો

સરકારી જામીનગીરીઓ

અન્ય (જણાવો)

૨૮૭૩૮૧૧.૦૭

૨૫૫૮૯૬૬.૫૨

૩૭૯૬૧.૪૩

૧૭૧૧૬.૦૪

૨૧૧૧૨૯.૭૪

૧૩૭૮૬૫.૫૦

૪૦૦૦૦.૦૦

૪૦૦૦૦.૦૦

૫૮૧૬૩૫.૨૯

૪૩૮૪૫૧.૯૭

૧૬૭૭૯.૦૦

૧૪૬૩૭.૦૦

(૫) ઉપરોક્ત (૨) માં ધિરાણ મેળવેલ મિલકતનું કરજ લેનાર વૃથ મુજબ વર્ગીકરણ: (₹ લાખમાં)

બાબતો	ચોખ્ખી બેગવાઈની રકમ					
	સુરક્ષિત		અસુરક્ષિત		કુલ	
	૩૧ માર્ચ, ૨૧	૩૧ માર્ચ, ૨૦	૩૧ માર્ચ, ૨૧	૩૧ માર્ચ, ૨૦	૩૧ માર્ચ, ૨૧	૩૧ માર્ચ, ૨૦
૧ સંબંધિત પક્ષ	-	-	-	-	-	-
(ક) પેટાકંપનીઓ (સ્વૈચ્છિક ફંડચા હેઠળ)	-	-	-	-	-	-
(ખ) સમાન વૃથની કંપનીઓ	-	-	-	-	-	-
(ગ) અન્ય સંબંધિત પક્ષ	-	-	૧૨૦૩૪૧૬.૩૪	૧૧૮૮૨૮૭.૬૮	૧૨૦૩૪૧૬.૩૪	૧૧૮૮૨૮૭.૬૮
૨ સંબંધિત પક્ષ સિવાય કુલ	૧૪.૩૦	૨.૪૦	૩.૨૭	૩.૧૩	૧૭.૫૭	૫.૫૩

(૬) શેર અને જામીનગીરીઓ (જંને દર્શાવેલ અને ન દર્શાવેલ) માં તમામ રોકાણ (ટૂંકા અને લાંબા ગાળાના) નું રોકાણકાર વૃથ મુજબ વર્ગીકરણ: (₹ લાખમાં)

બાબત	બજાર મૂલ્ય/વિભાજન અથવા બજાર મૂલ્ય અથવા એનએવી		મૂળ કિંમત (બેગવાઈઓનું કુલ)	
	૩૧-૩-૨૦૨૧	૩૧-૩-૨૦૧૯	૩૧-૩-૨૦૨૦	૩૧-૩-૨૦૧૯
	(૧) સંબંધિત પક્ષો			
(ક) પેટાકંપનીઓ (સ્વૈચ્છિક ફંડચા હેઠળ)	-	-	-	-
(ખ) સમાન વૃથની કંપનીઓ	-	-	-	-
(ગ) અન્ય સંબંધિત પક્ષો	૧૬૭૭૯.૦૦	૧૪૬૩૭.૦૦	૧૬૭૭૯.૦૦	૧૪૬૩૭.૦૦
(૨) અન્ય સંબંધિત પક્ષો	૩૭૪૪૫૩૭.૫૩	૩૧૯૩૪૦૦.૦૩	૩૭૪૪૫૩૭.૫૩	૩૧૯૩૪૦૦.૦૩
કુલ	૩૭૬૧૩૧૬.૫૩	૩૨૦૮૦૩૭.૦૩	૩૭૬૧૩૧૬.૫૩	૩૨૦૮૦૩૭.૦૩

બજાર ભાવ / વિભાજન અથવા બજાર મૂલ્ય અથવા એનએવી ના અભાવે બજાર ભાવ / વિભાજન અથવા બજાર મૂલ્ય અથવા એનએવી દર્શાવેલ શેરના કિસ્સામાં મૂળ મૂલ્ય જેટલું જ લેવામાં આવે છે.

(૭) અન્ય માહિતી (₹ લાખમાં)

બાબત	૩૧ માર્ચ, ૨૧	૩૧ માર્ચ, ૨૦
(૧) બિન કાર્યક્ષમ મિલકતનું ચોખ્ખું		
(ક) પેટાકંપનીઓ (સ્વૈચ્છિક ફંડચા હેઠળ)	-	-
(ખ) અન્ય સંબંધિત પક્ષો	-	-
(૨) ચોખ્ખી બિન - કાર્યક્ષમ મિલકત		
(ક) પેટાકંપનીઓ (સ્વૈચ્છિક ફંડચા હેઠળ)	-	-
(ખ) અન્ય સંબંધિત પક્ષો	-	-
(૩) દેવાની પૂર્તિ માટે હસ્તગત કરેલી મિલકત	-	-

૩૮ ૧૩ માર્ચ, ૨૦૨૦ ના ભારતીય રીઝર્વ બેંકના જાહેરનામા નં. આરબીઆઈ / ૨૦૧૯-૨૦ / ૧૭૦ ડીઓઆર (એનબીએફસી) સીસી.પી.ડી.નં. ૧૦૯/૨૨.૧૦.૧૦૬/૨૦૧૯-૨૦ હેઠળ જાહેરાત.

(₹ લાખમાં)

ભારતીય રીઝર્વ બેંકના ધોરણો અનુસાર મિલકતનું વર્ગીકરણ	ભારતીય હિસાબી ધોરણ-૧૦૯ મુજબ મિલકતનું વર્ગીકરણ	ભારતીય હિસાબી ધોરણ મુજબ કુલ વહન રકમ	ભારતીય હિસાબી ધોરણ- હેઠળ ઓછા છૂટ/ જોગવાઈઓ	કુલ વહન રકમ	આઈઆરએસીપીના ધોરણો અનુસાર જોગવાઈઓ	ભારતીય હિસાબી ધોરણ-૧૦૯ અને આઈઆર-એસીપીના ધોરણો વચ્ચેનો તફાવત
૧	૨	૩	૪	૫=૩-૪	૬	૭=૪-૬
કાર્યશીલ મિલકતો						
માનક મિલકતો	મુદતવીતી નથી	૧૨૦૩૪૩૨.૮૩	-	૧૨૦૩૪૩૨.૮૩	૪૮૧૩.૭૩	(૪૮૧૩.૭૩)
કાર્યશીલ મિલકતો						
માનક મિલકતો	સ્તર-૧					
	સ્તર-૨	-	-	-	-	-
પેટા સરવાળો						
બિન કાર્યરત મિલકતો (NPAs)						
પેટા-માનક	સ્તર-૩	-	-	-	-	-
શંકાસ્પદ - એક વર્ષ સુધી	સ્તર-૩	-	-	-	-	-
૧ થી ૩ વર્ષ સુધી	સ્તર-૩	-	-	-	-	-
૩ વર્ષથી વધુ	સ્તર-૩	-	-	-	-	-
શંકાસ્પદનો પેટા સરવાળો		-	-	-	-	-
નુકશાન	સ્તર-૩	-	-	-	-	-
એનબીએનો પેટા સરવાળો		-	-	-	-	-
અન્ય બાબતો બાંધકામ, લોન પ્રતિબદ્ધતા વગેરે જેવી ભારતીય હિસાબી ધોરણ-૧૦૯ ના દાયરામાં છે પરંતુ વર્તમાન આવક માન્યતા, મિલકત વર્ગીકરણ અને જોગવાઈ (IRACP) ધોરણો હેઠળ આવરી લેવામાં આવેલ નથી.	સ્તર-૧	-	-	-	-	-
	સ્તર-૨	-	-	-	-	-
	સ્તર-૩	-	-	-	-	-
પેટા સરવાળો		-	-	-	-	-
કુલ	મુદતવીતી નથી	૧૨૦૩૪૩૨.૮૩	-	૧૨૦૩૪૩૨.૮૩	૪૮૧૩.૭૩	(૪૮૧૩.૭૩)
	સ્તર-૧					
	સ્તર-૨	-	-	-	-	-
	સ્તર-૩	-	-	-	-	-
કુલ		૧૨૦૩૪૩૨.૮૩	-	૧૨૦૩૪૩૨.૮૩	૪૮૧૩.૭૩	(૪૮૧૩.૭૩)

- ૩૯** નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન, સ્વતંત્ર નિયામકો પૈકી એકે ૨૨ માર્ચ, ૨૦૨૦ ના રોજ સતત બીજી મુદત પૂર્ણ કરી છે. જીએસએફએસ ગુજરાત સરકારની કંપની હોવાથી, સ્વતંત્ર નિયામકની નિમણૂક માટે ગુજરાત સરકારનો અભિપ્રાય લેવો જરૂરી છે. આને જોતા કંપનીએ જૂન, ૨૦૨૦ માં ગુજરાત સરકારના અભિપ્રાય માટે પ્રસ્તાવ મૂક્યો હતો. સરકારે ૧૫ જુલાઈ, ૨૦૨૦ ના તેના પત્ર દ્વારા સ્વતંત્ર નિયામકની નિમણૂકને મંજૂરી આપી હતી અને તે મુજબ કંપનીએ ૧૫ જુલાઈ, ૨૦૨૦ થી સ્વતંત્ર નિયામકની નિમણૂક કરી હતી.
- ૪૦** વર્ષ દરમિયાન, વ્યૂહાત્મક રોકાણોમાંથી ડિવિડન્ડ આવક, “કામગીરીમાંથી આવક” ને બદલે “અન્ય આવક” તરીકે દર્શાવવામાં આવી છે અને અગાઉના વર્ષની જાહેરાત તેમજ રોકડ પ્રવાહ પત્રકોમાં તે મુજબ ફેરફારો પણ કરવામાં આવ્યા છે. વર્ષ દરમિયાન, આઈસીડી / એલડીએસ પડતર મંજૂરી સામે મળેલી રકમ “થાપણ” ને બદલે “અન્ય નાણાંકીય જવાબદારીઓ” તરીકે દર્શાવવામાં આવી છે અને અગાઉના વર્ષની જાહેરાતમાં તે પ્રમાણે ફેરફાર પણ કરવામાં આવ્યો છે.
- ૪૧** કંપનીના યુનિક બિઝનેસ મોડલ અનુસાર ગુજરાત સરકારના એકમોને વધુ લાભ આપવાના હેતુથી, જીએસએફએસ છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી લિપ વર્ષમાં વ્યાજની ગણતરી વખતે આઈસીડી અને એલડીએસ પર ૩૬૫ દિવસ અને ધિરાણો પર ૩૬૬ દિવસ ધ્યાને લેવામાં આવેલ છે. જો કે, આગામી લીપ વર્ષથી, કંપની આઈસીડી અને એલડીએસ પર વ્યાજની ગણતરી માટે ૩૬૬ દિવસનો અને વ્યાજની ગણતરીનો એક જ આધાર ધરાવતી સામાન્ય હિસાબી પ્રથા મુજબ ધ્યાને લેશે.
- ૪૨** ચાલુ વર્ષના વર્ગીકરણ / જાહેરાતને અનુરૂપ જરૂરી હોય, ત્યાં પાછલા વર્ષના આંકડાઓનું પુનઃ જૂથ / પુનઃ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આંકડાઓ લાખ રૂપિયામાં બતાવવામાં આવ્યા છે.

સમાન તારીખના અમારા અહેવાલ મુજબ

મુકેશકુમાર જૈનની કંપની વતી

સંસ્થા નોંધણી નં. ૧૦૬૬૧૯૬બલ્યુ

સનદી હિસાબનીશ

સહી

પિયુષ જૈન

(ભાગીદાર)

સભ્યપદ નં. ૪૧૩૩૭૭

યુડીઆઈએન:૨૧૪૧૩૩૭૭એએએએબીપી૪૪૭૦

સ્થળ : અમદાવાદ

તારીખ : ૨૨-૦૬-૨૦૨૧

નિયામક મંડળના આદેશથી

શ્રી પંકજ જોષી

(વહીવટ સંચાલક)

(ડીન:૦૧૫૩૨૮૯૨)

શ્રી નીતિન શાહ

(મુખ્ય નાણાકીય અધિકારી)

સ્થળ : ગાંધીનગર

તારીખ : ૨૨-૦૬-૨૦૨૧

સુનીલ તલાટી

(નિયામક)

(ડીન:૦૦૬૨૧૯૪૭)

શ્રી નિરજ જૈન

(કંપની સચિવ)

(એફસીએસ:૪૪૭૨૫)

THIS PAGE HAS BEEN INTENTIONALLY LEFT BLANK

Gujarat State Financial Services Limited

29th Annual Report 2020-2021

Contents

	Page No.
Board of Directors	79
Notice	80
Boards' Report	82
CAG's Report	95
Auditors' Report	96
Balance Sheet	106
Statement of Profit and Loss	107
Notes on Financial Statements	110

THIS PAGE HAS BEEN INTENTIONALLY LEFT BLANK

Gujarat State Financial Services Limited

CIN: U65910GJ1992SGC018602

Board of Directors

Shri K. Kailashnathan, IAS (DIN:00587901)	Chairman
Shri Milind Torwane, IAS (DIN:03632394)	Director
Smt. Arti Kanwar, IAS (DIN:03535973)	Director
Shri Yamal Vyas (DIN:01308440) (Upto March 22, 2020)	Independent Director
Shri Sunil Talati (DIN:00621947) (From July 15, 2020)	Independent Director
Shri Bhadresh Mehta (DIN:02625115) (From December 12, 2019)	Independent Director
Shri Kamlesh K. Patel (DIN:08687563) (Upto October 6, 2020)	Director
Shri Mehul K. Vasava (DIN:08918906) (From October 14, 2020)	Director
Shri Pankaj Joshi, IAS (DIN:01532892)	Managing Director

Key Personnel

Shri Hemant Pant (Vice President)
Shri Vipul Sheth (Vice President)
Shri Nitin Shah (Chief Financial Officer)

Auditors

M/s. Mukeshkumar Jain & Company
Chartered Accountants
Ahmedabad

Bankers

ICICI Bank Ltd.
Bank of Baroda
Union Bank of India

Company Secretary

Shri Anil Maloo (Up to October 6, 2020)
Shri Neeraj Jain (From October 7, 2020)

Registered Office

Wing "B", 3rd Floor,
Khanij Bhavan, 132 Ft. Ring Road,
Nr. University Ground, Vastrapur,
Ahmedabad-380 052
Ph. : (079) 27912528-30
Fax : (079) 27912534
E-mail: info@gsfs.in
Web Site : www.gsfs.co.in

GUJARAT STATE FINANCIAL SERVICES LIMITED

CIN : U65910GJ1992SGC018602

NOTICE

NOTICE is hereby given that the Twenty-Nineth (29th) Annual General Meeting of the Members of the Gujarat State Financial Services Limited will be held on Tuesday, September 28, 2021 at 4.00 p.m. at the Registered Office at Wing “B”, 3rd Floor, Khanij Bhavan, 132 ft. Ring Road, Near University Ground, Vastrapur, Ahmedabad – 380 052 to transact the following businesses:

Ordinary Businesses:

1. To receive, consider and adopt the Audited Financial Statements of the Company for the financial year ended on 31st March, 2021 and the Reports of the Board of Directors and the Independent Auditors thereon and comments of Comptroller and Auditor General of India, thereon.
2. To declare dividend on Equity Shares for the year ended on 31st March, 2021.
3. To fix-up remuneration of Statutory Auditors and in this regard to consider and if thought fit, to pass with or without modification (s), the following **Ordinary Resolution:**

“RESOLVED THAT pursuant to the provisions of Section 139 (5), 142 and other applicable provisions, if any, of the Companies Act, 2013 and rules made there under, that the Board of Directors be and is hereby authorized to fix up remuneration of the Chartered Accountant Firm appointed by the Comptroller and Auditor General of India (CAG), Mukesh Kumar Jain & Co., Chartered Accountants, Ahmadabad as Statutory Auditors of the Company for the year 2021-22, who shall hold office up to the conclusion of next Annual General Meeting.”

By order of the Board,

Date : 22.09.2021
Place : Ahmedabad

Sd/-
Neeraj Jain
Company Secretary

Registered Office:

Gujarat State Financial Services Limited

CIN: U65910GJ1992SGC018602

Wing “B”, 3rd Floor, Khanij Bhavan, 132 ft. Ring Road,
Near University Ground, Vastrapur, Ahmedabad – 380 052

Notes:

1. The explanatory statement setting out the material facts pursuant to Section 102 of the Companies Act, 2013, relating to special business to be transacted at the Meeting is annexed.
2. A Member entitled to attend and vote at the Meeting is entitled to appoint a Proxy to attend and, on a poll, to vote instead of himself and the Proxy need not be a Member of the Company.
3. Proxies, in order to be effective, must be received in the enclosed Proxy Form at the Registered Office of the Company not less than forty-eight hours before the time fixed for the Meeting.
4. A person can act as a proxy on behalf of Members not exceeding 50 and holding in the aggregate not more than ten percent of the total share capital of the Company carrying voting rights. A Member holding more than ten percent of total share capital of the Company carrying voting rights may appoint a single person as proxy and such person shall not act as a proxy for any other person or shareholder.
5. A Corporate Member intending to send its authorised representatives to attend the Meeting in terms of Section 113 of the Companies Act, 2013 is requested to send to the company a certified copy of the Board Resolution authorizing such representative to attend and vote on its behalf at the Meeting.

6. The documents, if any, referred to in this Notice and the Explanatory Statement are available for inspection by any member of the Company at the Registered Office of the Company between 10.00 am and 1.00 pm on any working days (except Saturdays, Sundays and public holidays), upto the date of the ensuing Extra Ordinary General Meeting.
7. Attendance slip, proxy form and route map of the venue of the Meeting are annexed hereto.

BOARDS' REPORT

The Members,
Gujarat State Financial Services Limited,
Ahmedabad

Your Directors' have great pleasure in presenting the 29th Annual Report on the business and operations of the Company together with the Audited Accounts for the financial year ended 31st March, 2021.

FINANCIAL RESULTS: (Amount in ₹ in Lakhs)

Year ended March 31,	2021	2020
Total Revenue	3,14,642	3,59,108
Total Expenses:	2,69,587	3,00,094
- Operating Expenditure - Finance Cost	2,67,004	2,98,239
- Other Expenditure including depreciation	2,583	1,855
Profit / (Loss) before tax	45,055	59,014
Tax Expenses:		
Current Tax	(10,292)	(13,246)
Deferred Tax	8,045	(2,878)
Total Comprehensive Income	1,11,675	49,848
Earnings Per Equity Share (In Rupees)	31.02	31.08

PERFORMANCE:

During the year, your Company's total income was ₹ 3,14,642 Lakhs as compared to ₹ 3,59,108 Lakhs during the previous year. The Company earned a net profit of ₹ 42,808 Lakhs as compared to ₹ 42,890 Lakhs during the previous year.

DIVIDEND:

The Board of Directors has recommended a dividend at a rate of ₹ 2.50 per share on 13,79,96,059 Equity Shares of ₹ 10 each for the year 2020-21. The total dividend outgo would be ₹ 34,49,90,148 (rounded off) for the year 2020-21. The dividend distribution tax has been abolished and the dividend will be taxable in the hands of the shareholders.

No amount is proposed to be transferred to General Reserves of the Company out of the profits for the current year. As per provisions of the Reserve Bank of India Act, 1934, your Company has transferred ₹ 85.62 crore to Reserve Fund under Section 45-IC.

BUSINESS OPERATIONS:

During the year under review, your Company's main source of funds was Inter-Corporate Deposits (ICDs) from Government of Gujarat (GoG) entities, these funds were at ₹ 40,936.08 crore as on 31st March, 2021 as compared to ₹ 37,336.61 crore as on 31st March, 2020.

The Liquid Deposit Scheme of GSFS, under which surplus funds are accepted for less than 15 days, has continued to get lower preference as compared to ICD, as it is a short term product and preferred for parking very short term surplus funds. The funds under the scheme were at ₹ 2860.65 crore as on 31st March, 2021 as compared to ₹ 1938.43 crore as on 31st March, 2020.

CONTRIBUTION TO GOG ENTITIES/ GOVERNMENT:

It is heartening to note that, because of the efficiency in financial intermediation brought about by GSFS, the tangible as well as intangible benefits to the Government entities have been enormous and has been continued over the years. The financial benefits have become more visible on account of volatility in interest rates which have brought to the fore the advantages to the GoG entities from GSFS operations.

It is also pertinent to note that, with the increase in the size and corpus of funds under its management, GSFS has emerged as a credible vehicle for the optimum utilization of State Government fund. GSFS has ensured that the GoG entities have enjoyed better rates on their funds placed and better borrowing rates for their commercial borrowing and even today are able to access commercial market at favourable rates.

COVID – 19

The devastating second wave of COVID-19 is much more severe than the first wave like shortages of vaccines, hospital beds, oxygen cylinders and other necessary medicine in various State of the country including Gujarat. Various Central Ministries/ Departments have dedicated COVID hospitals and COVID beds since the beginning of this pandemic and have also committed to continue doing so.

While, the Government of Gujarat has initiated proactive and aggressive steps to curb the far spreading impact of the pandemic, it shall be very challenging job for Government to overcome such pandemic. The state-wide resources and services have been deployed to ensure that suffering patients are provided utmost

care while mechanism has been activated to quarantine potential citizens. Further, various actions related to bringing awareness towards COVID-19, measures for preventive health care and sanitation and disaster management are also being undertaken.

Your Company abided by the advisories issued by the Central Government, State Governments and various statutory and regulatory authorities, from time to time. In enforcing social distancing and keeping the safety of employees in mind, the office was operating in accordance with the guidelines/directions issued by various statutory, regulatory and local authorities. Your Company has proactively leveraged technology, enabling the employees to work from home.

LOAN MORATORIUM

None of your Company's borrowers has sought for moratorium of the loan amount. All the loans to GoG entities are regularly repaid and are standard in nature with zero NPA as on March 31, 2021.

APPLICABILITY OF PRUDENTIAL NORMS OF RESERVE BANK OF INDIA

NBFC (Systemically Important Non-Deposit taking Company and Deposit taking Company (Reserve Bank) Directions, 2016 (the Master Directions) by Reserve Bank of India were partially exempted from its applicability to the Government Companies. However, vide Master Directions updated on May 31, 2018, the exemption granted to Government Companies was withdrawn and was made applicable relating to prudential regulations, corporate governance, conduct of business regulations and statutory provisions in time bound manner.

Pursuant to the representations made, the Reserve Bank of India vide its letter no.DNBR(PD)CO.1223/03.10.001/2018-19 dated December 18, 2018 granted exemption from concentration of credit norms to the extent of exposure to the Government of Gujarat entities. Further to the request of the Company, Reserve Bank of India vide email dated March 03, 2021 expresses its inability to accede to company's request for reducing risk weight on loans and mutual fund investments that could have helped your Company to maintain prescribed CRAR level. Your Company shall continue to put its sincere efforts to comply with the prudential norms keeping in perspective the unique business model of the Company.

The Government of Gujarat has approved Credit and Investment Policy of the Company in October, 2020.

CAPITAL TO RISK WEIGHTED ASSETS RATIO (CRAR)

Your Company has CRAR at 7.57% as on 31st March, 2021, which was lower than the RBI prescribed level of 13%. GSFS provides loans to GoG entities only from the funds received from GoG entities and the circulation of funds remains within the ambit of Government of Gujarat. Such circulation of funds may be treated as sovereign in nature as State Government by itself, is sovereign in nature. Therefore, GSFS has requested RBI to reduce the risk weightage of such loans from 100% to 0%. Moreover, the Company invests in flagship debt schemes of top Asset Management Companies, GSFS has also requested RBI to reduce the risk weightage of investment in AMCs from 100% to atleast 18%. However, Reserve Bank of India vide email dated March 03, 2021 expresses its inability to accede to company's request for reducing risk weight on loans and mutual fund investments that could have helped your Company to maintain prescribed CRAR level. Your Company will continue to put its sincere efforts towards attaining the prescribed level of CRAR keeping in perspective the unique business model of the Company.

In addition to above, your Company has been paying dividend at a moderate rate, and also steadily increasing its portfolio of investment in Gujarat State Development Loans (GSDLs), which enable improvement in CRAR.

DIRECTORS:

Shri Yamal Vyas (DIN: 01308440), completed second consecutive term as an Independent Director on March 22, 2020 and as per provisions of the Companies Act, 2013, he was not eligible for reappointment. The Board noted the cessation at its meeting held on June 25, 2020.

Shri Sunil H. Talati (DIN: 00621947), was appointed as an Independent Director pursuant to the approval letter no. JNV/10/2009/149857/A dated July 15, 2020 received from Finance Department, Government of Gujarat. The Board of Directors co-opted him on July 15, 2020 through a circular resolution.

Shri Mehul K. Vasava (DIN:08918906), Deputy Secretary (Pension) was appointed as Director of the Company in place of Shri Kamlesh K. Patel (DIN: 08687563) vide letter no.JNV/10/2014/557212A dated October 06, 2020. The Board of Directors co-opted him on October 14, 2020 through a circular resolution.

The Board places on record its appreciation for the services rendered by them during their tenure as

Independent Director/ Nominee Director of the Company.

None of the Directors shall retire by rotation in view of exemption granted to the Government Companies vide Notification dated June 5, 2015 of Ministry of Corporate Affairs, Government of India and amended vide notification dated June 13, 2017.

STATEMENT ON DECLARATION GIVEN BY INDEPENDENT DIRECTORS UNDER SUB-SECTION (6) OF SECTION 149:

As at March 31, 2021, Shri Sunil Talati and Shri Bhadresh Mehta Independent Directors of the Company have given their declaration to the Board

that they met the criteria of Independence as provided in Section 149 (6) of the Companies Act, 2013.

NUMBER OF MEETINGS OF THE BOARD AND AUDIT COMMITTEE:

The Board meets at regular interval with a gap between two meetings not exceeding 120 days. Additional meetings are held as and when necessary. During the year under review, the Board met four times. The meetings were held on June 25, 2020, September 25, 2020, December 24, 2020 and March 24, 2021.

The details of the attendance by the Directors during the year 2020-21, of the Board meetings and Audit Committee meetings are as under:

Name of Directors	Attendance at Board meeting				Attendance at Audit Committee			
	25/06/2020	25/09/2020	24/12/2020	24/03/2021	25/06/2020	25/09/2020	24/12/2020	24/03/2021
Shri K. Kailashnathan, IAS	Yes	Yes	Yes	Yes	NA	NA	NA	NA
Shri Pankaj Joshi, IAS	Yes	Yes	Yes	Yes	Yes	Yes	Yes	Yes
Shri Milind Torawane, IAS	Yes	Yes	Yes	Yes	NA	NA	NA	NA
Smt. Arti Kanwar, IAS	Yes	No	No	Yes	NA	NA	NA	NA
Shri Sunil Talati ⁽¹⁾	NA	Yes	Yes	Yes	NA	Yes	Yes	Yes
Shri Bhadresh Mehta	Yes	Yes	Yes	Yes	Yes	Yes	Yes	Yes
Shri Kamlesh K. Patel ⁽²⁾	Yes	Yes	NA	NA	NA	NA	NA	NA
Shri Mehul K. Vasava ⁽³⁾	NA	NA	Yes	Yes	NA	NA	NA	NA

(1) Appointed with effect from July 15, 2020 (2) Ceased with effect from October 6, 2020

(3) Appointed with effect from October 14, 2020

CORPORATE SOCIAL RESPONSIBILITY (CSR):

The Company has constituted a Corporate Social Responsibility (CSR) Committee in accordance with Section 135 of the Companies Act, 2013 read with Companies (Corporate Social Responsibility Policy) Rules, 2014 as amended time to time.

The composition of the Corporate Social Responsibility Committee as during the year was as under:

Name of the Director	Category	Designation
Shri Pankaj Joshi, IAS	Managing Director	Chairman
Shri Milind Torawane, IAS	Nominee Director	Member
Shri Bhadresh Mehta	Independent Director	Member

The Company has also formulated a Corporate Social Responsibility Policy which is available on the website of the Company at www.gsfs.co.in. The Annual Report on CSR activities as required under the Companies

(Corporate Social Responsibility Policy) Rules, 2014, as amended, is annexed herewith and marked as **Annexure A** to this Report.

During the year 2020-21, MCA issued circular dated March 23, 2020, on spending of CSR funds for COVID-19. Your Company had made contribution of ₹ 16.50/- crore to Chief Minister Relief Fund of Gujarat for the purpose of COVID-19 activities under item nos. (i) and (xii) of Schedule VII relating to promotion of health care including preventive health care and sanitation and disaster management respectively.

AUDIT COMMITTEE:

The composition of the Audit Committee as during the year was as under:

Name of the Director	Category	Designation
Shri Sunil Talati (w.e.f. July 15, 2020)	Independent Director	Chairman
Shri Bhadresh Mehta	Independent Director	Member
Shri Pankaj Joshi, IAS	Managing Director	Member

There were no instances where the Board has not accepted the recommendations of the Audit Committee.

The Company has established the vigil mechanism through Whistle Blower Policy for all the stakeholders of the Company which also provides for direct access to the Nominee Director/ member of the Audit Committee as per Policy. The said policy can be viewed on www.gsfs.co.in.

The Whistle Blower Policy will be applicable to all the stakeholders of the Company, which seeks to provide a mechanism for the Stakeholders to disclose their concerns and grievances on Unethical Behavior and Improper/Illegal Practices and Wrongful Conduct taking place in the Company for appropriate action. The Policy provides necessary safeguards to all Whistle Blowers for making Protected Disclosures in Good Faith and any Stakeholder assisting the investigation. It also provides the detailed scope and role of Whistle Blower and the manner in which concern can be raised. Further, the Policy contains provisions relating to investigation of the protected disclosures, protection to the whistle blower and reporting & monitoring by the Company.

There is no fraud reported by the Independent Auditors of the Company under Section 143 (12) of the Companies Act, 2013, during the period under review.

ASSET LIABILITY MANAGEMENT (ALM) COMMITTEE AND RISK MANAGEMENT COMMITTEE OF THE BOARD

During the year under review, the Asset Liability Management (ALM) Committee and Risk Management Committee of Board of Directors met one time and reviewed the details of deployment of funds in various asset classes of different tenors, pricing of deposits, interest rate on loans, mix of maturity profile of assets and liabilities etc. and found that the Company is presently in comfortable liquidity position with respect to the existing RBI liquidity risk management framework and operates within the parameters set by the Board.

During the year under review, the Risk Management Committee of Board of Directors also met one time and reviewed present position of the outstanding loans to GoG entities, investments in Liquid / Debt Schemes of approved Mutual Funds and investment in other avenues by GSFS. The Committee reviewed the risk parameters associated with funds deployed, risk monitoring mechanism and credit ratings of the invested portfolio. The Committee acknowledged that

while certain types of risks are inherent, unforeseen, systemic and therefore difficult to evaluate and anticipate in advance for any entity into business of lending and investment, it also acknowledged that GSFS, while providing credit, deals with management of its financial resources within the ambit of state entities only as per its unique business model. The Committee noted that credit and investments are done as per the Credit and Investment Policy of the Company which is approved by the Government of Gujarat.

RISK MANAGEMENT POLICY:

In order to manage the risks, the Board of Directors has constituted Finance Committee of Board to oversee the finance functions of the Company. In addition to above, your Company has constituted Risk Management Committee and your Company has also appointed Shri Vipul Sheth, a Chartered Accountant, working as Vice President with the Company, as Chief Risk Officer with effect from July 11, 2021 for a period of two years as per the guidelines of RBI. Your Company assesses the risk keeping in view the unique business nature of the Company.

DIRECTORS' RESPONSIBILITY STATEMENT

In terms of Section 134 (3) of the Companies Act, 2013, in relation to the financial statements for Financial Year 2020-21, the Board of Directors states that:

- a) In preparation of the annual accounts, the applicable accounting standards have been followed along with proper explanation relating to material departures, if any;
- b) The directors have selected such accounting policies and applied them consistently and made judgments and estimates that are reasonable and prudent so as to give a true and fair view of the state of affairs of the Company as on 31st March, 2021 and of the profits for the year ended 31st March, 2021;
- c) The directors have taken proper and sufficient care for maintenance of adequate accounting records in accordance with the provisions of the Companies Act, 2013 for safeguarding the assets of the Company and for preventing and detecting fraud and other irregularities; and
- d) The financial statements have been prepared on a going concern basis.
- e) The Directors had laid down internal financial controls to be followed by the company and that such internal financial controls are adequate and were operating effectively.

- f) The Directors have devised proper systems to ensure compliance with the provisions of all applicable laws, by way of a periodic report from management of the Company and reviewing the same in their meeting as a regular agenda and that such systems are adequate and operating effectively.

INTERNAL FINANCIAL CONTROLS WITH REFERENCE TO FINANCIAL STATEMENTS

Your Company has adequate internal financial control procedures commensurate with its size and nature of business. These controls include well defined Standard Operating Procedures, Policies, Guidelines, Authorisation and Approval Process. The internal financial controls of the Company are adequate to ensure the accuracy and completeness of the accounting records, timely preparation of reliable financial information, prevention of errors, safeguarding of assets and orderly and efficient conduct of its business.

AUDITORS AND AUDITORS' REPORT

Statutory Auditor:

The Comptroller and Auditor General of India had appointed M/s. Mukeshkumar Jain & Co, Chartered Accountants, Ahmedabad as Statutory Auditors of the Company for the financial year 2020-21 and the Auditors' Report is enclosed.

Secretarial Auditor:

Pursuant to the provisions of Companies Act, 2013, Shri Ashwin Shah, Practicing Company Secretary, Ahmedabad (CP No.1640) was appointed as Secretarial Auditor of the Company from the year 2016-17. The Secretarial Audit Report for the financial year ended March 31, 2021 is annexed herewith and marked as **Annexure B** to this Report.

EXPLANATION OR COMMENTS BY THE BOARD ON EVERY QUALIFICATION, RESERVATION OR ADVERSE REMARK OR DISCLAIMER MADE BY THE STATUTORY AUDITOR IN HIS REPORT AND BY THE COMPANY SECRETARY IN PRACTICE IN HIS SECRETARIAL AUDIT REPORT:

Statutory:

The Auditor's Report does not contain any Qualification, Reservation or Adverse Remarks or Disclaimer

Secretarial:

During the financial year 2020-21, one of the

Independent Directors completed his second term on March 22, 2020. Since, GSFS is Government of Gujarat (GoG) Company, it was necessary to seek an opinion of the GoG for appointment of Independent Director. In view of the same, the Company had proposed for opinion of the GoG. The Government had approved appointment of Independent Director vide its letter dated July 15, 2020 and accordingly, the Company had appointed Shri Sunil Talati as an Independent Director w.e.f. July 15, 2020. Hence, your Company could not constitute Audit Committee and Nomination & Remuneration Committee as per the requirements of the Section 177 and 178 of the Companies Act, 2013 and rules made thereunder, for that period only.

COMMENTS MADE BY COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA ON FINANCIAL STATEMENTS OF THE COMPANY:

The Comptroller and Auditor General of India has given NIL comment on financial statements of the Company for the financial year ended March 31, 2021. The NIL comment Report for the financial year ended March 31, 2021 is annexed herewith and marked as **Annexure C** to this Report.

THE ANNUAL RETURN

Pursuant to the Section 92 (3) of the Companies Act, 2013 and Rule 12 (1) of the Companies (Management and Administration) Rules, 2014, the Annual Return of the Company as on March 31, 2021 is available on the Company's website and can be accessed at www.gsfs.co.in.

PUBLIC DEPOSITS:

Your Company has not accepted any deposits from the public. There is no deposit which remained unpaid or unclaimed as at the end of the year. Since, your Company has not accepted any public deposit, there is no question of default in repayment of deposits or payment of interest thereon. There were no public deposits which were not in compliance with the requirement of Chapter V of the Companies Act, 2013 and rules made thereunder.

Your Company do not have any unclaimed dividend. There was no amount due for transfer to Investor Education and Protection fund (IEPF) during the year.

PARTICULARS OF CONTRACTS OR ARRANGEMENTS WITH RELATED PARTIES:

In accordance with the provisions of section 188 of the Companies Act, 2013 and rules made there under,

the transactions entered into with related parties are in the ordinary course of business and on an arm's length pricing basis, the details of which are included in the notes forming part of the financial statements. There are no material related party transactions entered during the year, which falls into the purview of Section 188. The financial transactions are not covered under the aforesaid Section, accordingly, information in form AOC - 2 is not annexed.

PARTICULARS OF LOANS, GUARANTEES OR INVESTMENTS MADE:

Since, your Company is Non-Banking Finance Company, the disclosure regarding particulars of loans given, guarantees given and security provided is exempt under the provisions of Section 186 (11) of the Companies Act, 2013. Further, your Company being a Government Company, is exempted from the applicability of the Section 186 in view of the exemptions granted vide notification of Ministry of Corporate Affairs on June, 5, 2015.

As regards investments made by the Company, the details of the same are provided under Note to Accounts forming part of the annual accounts of the Company for the year ended March 31, 2021.

DISCLOSURE UNDER THE SEXUAL HARASSMENT OF WOMEN AT WORKPLACE (PREVENTION, PROHIBITION AND REDRESSAL) ACT, 2013:

In accordance with the requirements of the Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition & Redressal) Act, 2013 ("POSH Act") and Rules made thereunder, The Company has in place a robust mechanism for prevention and redressal of complaints of sexual harassment. There were no complaints reported during the year.

CONSERVATION OF ENERGY, TECHNOLOGY ABSORPTION, FOREIGN EXCHANGE EARNINGS AND OUTGO:

In view of the nature of activities which are being carried-out by the Company, Section 134 of the Companies Act, 2013 read with Rule 8(3) Companies (Accounts) Rules, 2014, concerning conservation of energy and technology absorption, respectively, are not applicable to the Company. During the year, the Company has not expended any amount in foreign currency. The Company has also not earned any foreign exchange during the year under review.

SUBSIDIARIES, JOINT VENTURES AND ASSOCIATE COMPANIES:

Your Company does not have any subsidiary, joint Ventures and Associate Company.

KEY MANAGERIAL PERSONNEL:

During the year under review, Shri Anil Maloo has resigned from the post of Company Secretary and Whole-time Key Managerial Person with effect from October 06, 2020 and Shri Neeraj Jain has been appointed as Company Secretary and Whole-time Key Managerial Person with effect from October 7, 2020.

HUMAN RESOURCE MANAGEMENT:

The Company regards its human resources as amongst its most valuable assets and is in the process of reviewing the policies and processes to create a work environment that encourages initiative, provides challenges and opportunities and recognizes the performance and potentials of its employees. The company is also in the process of investing in people competencies for the business requirements of tomorrow.

REMUNERATION POLICY OF EMPLOYEES:

Your Company has adopted the salary scale of Government of Gujarat (as in force from time to time) as per the respective grades of the employees. As at March 31, 2021, your Company has pay scale as recommended by Seventh Pay Commission and as adopted by the Government of Gujarat for the employees of concerned GoG entities.

The names and other details as required under Rule 5 (2) and (3) of Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014 of top ten employees in terms of remuneration drawn, are annexed to the Board's Report. However, the Board's Report is being sent to the shareholders excluding the annexure. In terms of Section 136 of the Companies Act, 2013, the annexure is available for inspection by the members at the registered office during the business hours on working days upto the date of ensuing Annual General Meeting. Any shareholder interested in obtaining a copy of the said annexure may write to the Company. There was no employee who was in receipt of remuneration in excess of the limits set out under Rule 5 (2) of the aforesaid Rules.

REQUIREMENT FOR MAINTENANCE OF COST RECORDS:

Since the Company is Non-banking finance Company, it is not required to maintain cost records as specified by the Central Government under section 148(1) of the Companies Act, 2013.

DEMATERIALISATION OF SHARES:

Your Company has secured International Security Identification Number (ISIN: INE02MG01017) from Central Depository Services (India) Limited and has facilitated the dematerialisation of the shares through its Registrar and Transfer Agent.

MATERIAL CHANGES AND LITIGATIONS:

There is no material change and commitment, affecting the financial position of the Company which has occurred between the end of the financial year to which the financial statements relate and the date of the report. There has been no change in the nature of business of the Company. No significant or material orders have been passed by the regulators / courts or tribunals impacting the going concern status of the Company and / or the Company's operations in future.

SECRETARIAL STANDARDS

Your Company has followed the applicable Secretarial Standards, i.e. SS-1 and SS-2, relating to 'Meetings of the Board of Directors' and 'General Meetings' respectively.

PROSPECTS:

GSFS consolidated its position further in the financial services sector because of its inherent strengths and prudent management. Your Company will continue to act as the agency for efficiently managing the surplus funds of GoG entities.

ACKNOWLEDGEMENT:

Your Directors are pleased to place on record their sincere appreciation of the continued patronage received from the Government of Gujarat and support from GoG controlled entities, depositors, customers, shareholders, Reserve Bank of India, Company's bankers and other associates whose continued support have gone a long way in ensuring a creditable performance of the Company. Your Directors convey their sincere gratitude to all for the trust reposed in the Company. Your Directors also wish to place on record their appreciation of the contribution made by the employees at all levels for the growth of your Company.

For and on behalf of the Board

Sd/-

K. Kailashnathan, IAS
Chairman
(DIN: 00587901)

Place : Gandhinagar

Date : 22.09.2021

BOARD'S REPORT - ANNEXURE - A

The Annual Report on CSR activities

1. Brief outline on CSR Policy of the Company:

Introduction

Your Company formulated CSR Policy pursuant to the provisions of Section 135 of the Companies Act, 2013 and rules made there under and the Board of Directors at its meeting held on August 21, 2015 based on the recommendation of Corporate Social Responsibility Committee of the Board, approved the same. Further, as per amended rules, the Company has revised CSR policy accordingly in their board meeting held on September 22, 2021.

Thrust Areas

Your Company gives due importance to welfare activities in the social sectors covered under Human Development Index (HDI) for the well being of the people of area of its operations. Your Company would endeavour to enhance value creation in the society in which it operates, through its services, conduct and initiatives, so as to promote sustained growth for the society and community, in fulfillment of its role as a social responsible corporate citizen with utmost environment concern.

The CSR Policy provides the thrust areas where the Company proposes to undertake the relevant CSR activities on priority basis. The thrust areas are in line with Schedule VII of the Companies Act, 2013 and consist of the following:

- (i) Promoting preventive health care and sanitation including community Toilets.
- (ii) Diagnostic healthcare
- (iii) Malnutrition and Entrepreneurship and
- (iv) Skilling for Livelihood enhancement projects.
- (v) Promoting education / special education among all including differently abled persons (*)
- (vi) Rural Development Projects including projects related to irrigation – Construction of Check Dam and Installation of Lift Irrigation. (**)

* (inserted as per approval of Board at 119th Board meeting held on November 30, 2017

** (inserted as per approval of Board at 125th Board meeting held on March 16, 2019.

Identification, Approval and Implementation

The Policy provides for identification of the CSR Projects, in-particular in thrust areas, and approval by the CSR Committee, with estimated expenditure and implementation schedules. Total expenditure in the CSR Annual Plan is approved by the Board upon recommendation by the CSR Committee.

Your Company may directly contribute to any project (s) or identified by Gujarat CSR Authority or to other implementing agency / agencies for the purpose of the same, within the broad categories of thrust areas.

The CSR Policy further lists the monitoring and reporting mechanism, duties and responsibilities of the Board, the CSR Committee; details about allocation of funds for CSR activities; and the review periodicity/ amendment of the CSR Policy and CSR Plan.

2. Composition of CSR Committee:

Sl. No.	Name of Director	Designation/Nature of Directorship	Number of meetings of CSR Committee held during the year*	Number of meetings of CSR Committee attended during the year*
1.	Shri Pankaj Joshi, IAS	Chairman (Managing Director)	0	0
2.	Shri Milind Torawane, IAS	Member (Nominee Director)	0	0
3.	Shri Bhadresh Mehta	Member (Independent Director)	0	0

***Due to pandemic situation and paucity of time, the CSR Committee had recommended the CSR contribution by passing circular resolution on April 1, 2020.**

- Provide the web-link where Composition of CSR committee, CSR Policy and CSR projects approved by the board are disclosed on the website of the company; www.gsfs.co.in
- Provide the details of Impact assessment of CSR projects carried out in pursuance of sub-rule (3) of rule 8 of the Companies (Corporate Social Responsibility Policy) Rules, 2014, if applicable (attach the report); **Not Applicable to the Company for the financial year under review.**
- Details of the amount available for set off in pursuance of sub-rule (3) of rule 7 of the Companies (Corporate Social Responsibility Policy) Rules, 2014 and amount required for set off for the financial year, if any

Sl. No.	Financial Year	Amount available for set-off from preceding financial years (in ₹)	Amount required to be set off for the financial year, if any (in ₹)
Nil			

- Average net profit of the company as per section 135(5): ₹ 288,26,47,391.81
- Two percent of average net profit of the company as per section 135(5); ₹ 5,76,52,948.00
 - Surplus arising out of the CSR projects or programmes or activities of the previous financial years. Nil
 - Amount required to be set off for the financial year, if any: Nil
 - Total CSR obligation for the financial year (7a+7b-7c). ₹ 5,76,52,948.00
- CSR amount spent or unspent for the financial year:

Total Amount Spent for the Financial Year. (in ₹)	Amount Unspent (in ₹)				
	Total Amount transferred to Unspent CSR Account as per Section 135(6).		Amount transferred to any fund specified under Schedule VII as per second proviso to section 135(5).		
	Amount (in ₹)	Date of transfer	Name of Fund	Amount (in ₹)	Date of transfer
₹ 16,50,00,000.00	Nil				

(b) Details of CSR amount spent against **ongoing projects** for the financial year:

1.	2.	3.	4.	5.		6.	7.	8.	9.	10.	11.	
Sl. No.	Name of the Project	Item from the list of activities in Schedule VII to the Act.	Local area (Yes/No)	Location of the project		Project Duration	Amount Allocated for the project (in ₹)	Amount spent in the current financial Year (in ₹)	Amount transferred to Unspent CSR Account for the project as per Section 135(6) (in ₹)	Mode of Implementation - Direct (Yes/No)	Mode of Implementation -Through Implementing Agency	
				State	District						Name	CSR Registration number
Nil												

(c) Details of CSR amount spent against **other than ongoing projects** for the financial year:

1.	2.	3.	4.	5.		6.	7.	8.	
Sl. No.	Name of the Project	Item from the list of activities in schedule VII to the Act.	Local area (Yes/No).	Location of the project.		Amount spent for the project (in ₹)	Mode of implementation Direct (Yes/No).	Mode of implementation - Through implementing Agency.	
				State	District			Name	CSR registration number
1.	Chief Minister Relief Fund, Gujarat	promotion of health care, including preventive health care and sanitation, and disaster management	Yes	Gujarat	-	₹16,50,00,000.00	No	Chief Minister Relief Fund	-

(d) Amount spent in Administrative Overheads; Nil

(e) Amount spent on Impact Assessment, if applicable: Not Applicable

(f) Total amount spent for the Financial Year: ₹ 16,50,00,00,000.00

(8b+8c+8d+8e)

(g) Excess amount for set off, if any: ₹ 10,73,47,052.00

Sl.	Particular	Amount (in ₹)
i.	Two percent of average net profit of the company as per section 135(5)	5,76,52,948.00
ii.	Total amount spent for the Financial Year	16,50,00,000.00
iii.	Excess amount spent for the financial year [(ii)-(i)]	10,73,47,052.00
iv.	Surplus arising out of the CSR projects or programmes or activities of the previous financial years, if any	-
v.	Amount available for set off in succeeding financial years[(iii)-(iv)]	10,73,47,052.00

9. (a) Details of Unspent CSR amount for the preceding three financial years:

Sl. No.	Preceding Financial Year.	Amount transferred to Unspent CSR Account under section 135 (6) (in ₹)	Amount spent in the reporting Financial Year (in ₹)	Amount transferred to any fund specified under Schedule VII as per section 135(6), if any.			Amount remaining to be spent in succeeding financial years. (in ₹)
				Name of the Fund	Amount (in ₹)	Date of transfer.	
Nil							

(b) Details of CSR amount spent in the financial year for **ongoing projects** of the preceding financial year(s):

1)	2)	3)	4)	5)	6)	7)	8)	9)
Sl. No.	Project ID.	Name of the Project.	Financial Year in which the project was commenced.	Project duration.	Total amount allocated for the project (in ₹)	Amount spent on the project in the reporting Financial Year (in ₹)	Cumulative amount spent at the end of reporting Financial Year (in ₹)	Status of the project - Completed /Ongoing.
Nil								

10. In case of creation or acquisition of capital asset, furnish the details relating to the asset so created or acquired through CSR spent in the financial year (**asset-wise details**).

- Date of creation or acquisition of the capital asset(s). Not Applicable
- Amount of CSR spent for creation or acquisition of capital asset. Not Applicable
- Details of the entity or public authority or beneficiary under whose name such capital asset is registered, their address etc. Not Applicable
- Provide details of the capital asset(s) created or acquired (including complete address and location of the capital asset). Not Applicable

11. Specify the reason(s), if the company has failed to spend two per cent of the average net profit as per section 135(5). Not Applicable

Place : Gandhinagar
Date : 22.09.2021

Sd/-
Shri Milind Torawane, IAS
Director
(DIN:03632394)

Sd/-
Shri Pankaj Joshi, IAS
Chairman CSR Committee
(DIN:01532892)

BOARD'S REPORT - ANNEXURE - B

SECRETARIAL AUDIT REPORT

FORM NO. MR-3

FOR THE FINANCIAL YEAR ENDED 31st March 2021

Pursuant to section 204 (1) of the Companies Act, 2013 and rule No. 9 of the Companies (Appointment and Remuneration of Managerial Personnel) Rules, 2014

To,
The Members,
GUJARAT STATE FINANCIAL SERVICES LTD.

We have conducted the secretarial audit of the compliance of applicable statutory provisions and the adherence to good corporate practices by Gujarat State Financial Services Ltd. (hereinafter called the company). Secretarial Audit was conducted in a manner that provided us a reasonable basis for evaluating the corporate conducts/ statutory compliances and expressing our opinion thereon.

Based on our verification of books, papers, minute books, forms and returns filed and other records maintained by the company and also the information provided by the Company, its officers, agents and authorized representatives during the conduct of secretarial audit, we hereby report that in our opinion, the company has, during the audit period covering the financial year ended on 31st March, 2021 complied with the statutory provisions listed hereunder and also that the Company has proper Board-processes and compliance-mechanism in place to the extent, in the manner and subject to the reporting made hereinafter:

We have examined the books, papers, minute books, forms and returns filed and other records maintained by the Company for the financial year ended on 31st March 2021 according to the provisions of:

- i. The Companies Act, 2013 (the Act) and the rules made thereunder;
- ii. The law as applicable specifically to the Company is as under:
 - a. Reserve Bank of India Act, 1934

We have also examined compliance with the applicable clauses of the following:

- i. Secretarial Standards issued by The Institute of Company Secretaries of India.

During the period under review the Company has complied with the provisions of the Act, Rules, Regulations, Guidelines, Standards, etc. mentioned above.

The company was not required to comply with the provision of other regulation listed in the Form No. MR-3 prescribed under the companies Rules, 2014 as there were no instance / events falling within the purview of these regulations during the financial year.

We further report that

During the period under audit, composition of board of Directors of the Company was not in compliance with section 149 of the Act. Consequently the Company could not comply with the provisions of section 177 and 178 of the Act.

Adequate notice is given to all directors to schedule the Board Meetings, agenda and detailed notes on agenda were sent generally seven days in advance, and a system exists for seeking and obtaining further information and clarifications on the agenda items before the meeting and for meaningful participation at the meeting.

Majority decision is carried through and recorded as part of the minutes.

We further report that there are adequate systems and processes in the company commensurate with the size and operations of the company to monitor and ensure compliance with applicable laws, rules, regulations and guidelines.

Place : Ahmedabad
Date : 22nd September, 2021
UDIN: F001640C000990122

Sd/-
CS Ashwin Shah
Company Secretary
C. P. No. 1640

Note: This report is to be read with our letter of even date which is annexed as "ANNEXURE I" and forms an integral part of this report.

ANNEXURE “I” TO SECRETARIAL AUDIT REPORT

To,
The Members,
GUJARAT STATE FINANCIAL SERVICES LTD.

Our report of even date is to be read along with this letter.

1. Maintenance of secretarial record is the responsibility of the management of the company. Our responsibility is to express an opinion on these secretarial records based on our audit.
2. We have followed the audit practices and processes as were appropriate to obtain reasonable assurance about the correctness of the contents of the Secretarial records. The verification was done on test basis to ensure that correct facts are reflected in secretarial records. We believe that the processes and practices, we followed provide a reasonable basis for our opinion.
3. We have not verified the correctness and appropriateness of financial records and Books of Accounts of the company.
4. Where ever required, we have obtained the Management representation about the compliance of laws, rules and regulations and happening of events etc.
5. The compliance of the provisions of Corporate and other applicable laws, rules, regulations, standards is the responsibility of management. Our examination was limited to the verification of procedures on test basis.
6. The Secretarial Audit report is neither an assurance as to the future viability of the company nor of the efficacy or effectiveness with which the management has conducted the affairs of the company.

Place : Ahmedabad
Date : 22nd September, 2021
UDIN : F001640C000990122

Sd/-
CS Ashwin Shah
Company Secretary
C. P. No. 1640

Annexure C

CAG'S REPORT

COMMENTS OF THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA UNDER SECTION 143(6)(b) OF THE COMPANIES ACT, 2013 ON THE FINANCIAL STATEMENTS OF GUJARAT STATE FINANCIAL SERVICES LIMITED FOR THE YEAR ENDED 31 MARCH 2021

The preparation of financial statements of **Gujarat State Financial Services Limited** for the year ended 31 March 2021 in accordance with the financial reporting framework prescribed under the Companies Act, 2013 (Act) is the responsibility of the Management of the Company. The Statutory Auditors appointed by the Comptroller and Auditor General of India under Section 139(5) of the Act are responsible for expressing opinion on the financial statements under Section 143 of the Act based on independent audit in accordance with the standards on Auditing prescribed under Section 143(10) of the Act. This is stated to have been done by them vide their Audit Report dated 22 June 2021.

I, on the behalf of the Comptroller and Auditor General of India, have conducted a supplementary audit of the financial statements of **Gujarat State Financial Services Limited** for the year ended 31 March 2021 under Section 143(6)(a) of the Act. This supplementary audit has been carried out independently without access to the working papers of the Statutory Auditors and is limited primarily to inquiries of the Statutory Auditors and Company Personnel and a selective examination of some of the accounting records.

On the basis of my supplementary audit nothing significant has come to my knowledge which would give rise to any comment upon or supplement to Statutory Auditors' report under Section 143(6)(b) of the Act.

**For and on behalf of the
Comptroller and Auditor General of India**

Sd/-
(H. K. Dharamadarshi)
Principal Accountant General (Audit II), Gujarat

Place : Ahmedabad

Date : 23/08/2021

INDEPENDENT AUDITOR'S REPORT

To The Members of GUJARAT STATE FINANCIAL SERVICES LIMITED

Report on the Audit of Ind AS Financial Statements

Opinion

We have audited the Ind AS Financial Statements of Gujarat State Financial Services Limited (“the Company”), which comprise the Balance Sheet as at 31 March 2021, and the statement of Profit and Loss (including other comprehensive income), statement of changes in equity and statement of cash flows for the year then ended, and notes to the Financial Statements, including a summary of the significant accounting policies and other explanatory information (hereinafter referred to as “the Ind AS Financial Statements”).

In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid Ind AS Financial Statements give the information required by the Companies Act, 2013 (the “Act”) in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India, of the state of affairs of the Company as at 31st March 2021, and profit and other comprehensive income, changes in equity and its cash flows for the year ended on that date.

Basis of Opinion

We conducted our audit in accordance with the Standards on Auditing (SAs) specified under section 143(10) of the Companies Act, 2013. Our responsibilities under those Standards are further described in the Auditor’s Responsibilities for the Audit of the Ind AS Financial Statements section of our report. We are independent of the Company in accordance with the Code of Ethics issued by the Institute of Chartered Accountants of India together with the ethical requirements that are relevant to our audit of the Ind AS Financial Statements under the provisions of the Act and the Rules there under, and we have fulfilled our other ethical responsibilities in accordance with these requirements and the Code of Ethics. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.

Emphasis of Matter

Without qualifying our Independent Auditors Report

1. We draw attention to Note No. 41 of Ind AS Financial Statements which describes that the company has different base for calculation of interest on deposits and loans in case of leap year. The company had a policy of taking 365 as base for calculating interest on deposit and for the purpose of loans the company took 366 as the base. During the year the company has decided to adopt a uniform policy from next leap year. A comparative table of the basis is mentioned below. Our opinion is not modified in this respect.

(₹ in Crores)

Particulars	As per the Account of Company	Interest Calculation Considering different Basis		
		Base of 366 Days	Base of 365 Days	Difference
Interest paid on Deposit (ICD & LDS)	2041.93	2036.35	2041.93	5.58
Interest received on Loans	667.89	667.89	666.07	1.82

2. We draw attention to Note No. 39 of Ind AS Financial Statements which describes that the company has only single independent director from the period 01.04.2020 to 15.07.2020 instead of having two independent directors. However, the company has appointed second independent director on 15.07.2020.
3. We draw attention to Note No. 7 & 28.3 Ind AS of the Financial Statements with respect to valuation of quoted and unquoted equity shares. Our opinion is not modified in this respect.

Other Information

The Company's management and Board of Directors are responsible for the other information. The other information comprises the information included in the Company's annual report, but does not include the Ind AS Financial Statements and our auditors' report thereon.

Our opinion on the Ind AS Financial Statements does not cover the other information and we do not express any form of assurance conclusion thereon.

In connection with our audit of the Ind AS Financial Statements, our responsibility is to read the other information and, in doing so, consider whether the other information is materially inconsistent with the Ind AS Financial Statements or our knowledge obtained in the audit or otherwise appears to be materially misstated. If, based on the work we have performed, we conclude that there is a material misstatement of this other information; we are required to report that fact. We have nothing to report in this regard.

Responsibility of Management and Those Charged with Governance for the Ind AS Financial Statements

The Company's management and Board of Directors are responsible for the matters stated in Section 134(5) of the Act with respect to the preparation of these Ind AS Financial Statements that give a true and fair view of the state of affairs, profit and other comprehensive income, changes in equity and cash flows of the Company in accordance with the accounting principles generally accepted in India, including the Indian Accounting Standards (Ind AS) specified under section 133 of the Act. This responsibility also includes maintenance of adequate accounting records in accordance with the provisions of the Act for safeguarding of the assets of the Company and for preventing and detecting frauds and other irregularities; selection and application of appropriate accounting policies; making judgments and estimates that are reasonable and prudent; and design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the accuracy and completeness of the accounting records, relevant to the preparation and presentation of the Ind AS Financial Statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

In preparing the Ind AS Financial Statements, management and Board of Directors are responsible for assessing the Company's ability to continue as a going concern, disclosing, as applicable, matters related to going concern and using the going concern basis of accounting unless management either intends to liquidate the Company or to cease operations, or has no realistic alternative but to do so.

Those Board of Directors is also responsible for overseeing the Company's financial reporting process.

Auditor's Responsibilities for the Audit of the Ind AS Financial Statements

Our objectives are to obtain reasonable assurance about whether the Ind AS Financial Statements as a whole are free from material misstatement, whether due to fraud or error, and to issue an auditor's report that includes our opinion. Reasonable assurance is a high level of assurance, but is not a guarantee that an audit conducted in accordance with SAs will always detect a material misstatement when it exists. Misstatements can arise from fraud or error and are considered material if, individually or in the aggregate, they could reasonably be expected to influence the economic decisions of users taken on the basis of these Ind AS Financial Statements.

As part of an audit in accordance with SAs, we exercise professional judgment and maintain professional skepticism throughout the audit. We also:

- Identify and assess the risks of material misstatement of the Ind AS Financial Statements, whether due to fraud or error, design and perform audit procedures responsive to those risks, and obtain audit evidence that is sufficient and appropriate to provide a basis for our opinion. The risk of not detecting a material misstatement resulting from fraud is higher than for one resulting from error, as fraud may involve collusion, forgery, intentional omissions, misrepresentations, or the override of internal control.
- Obtain an understanding of internal control relevant to the audit in order to design audit procedures that are appropriate in the circumstances. Under section 143(3) (i) of the Act, we are also responsible for expressing our opinion on whether the Company has adequate internal financial controls with reference to Ind AS Financial Statements in place and the operating effectiveness of such controls.

- Evaluate the appropriateness of accounting policies used and the reasonableness of accounting estimates and related disclosures made by management.
- Conclude on the appropriateness of management’s use of the going concern basis of accounting and, based on the audit evidence obtained, whether a material uncertainty exists related to events or conditions that may cast significant doubt on the Company’s ability to continue as a going concern. If we conclude that a material uncertainty exists, we are required to draw attention in our auditor’s report to the related disclosures in the Ind AS Financial Statements or, if such disclosures are inadequate, to modify our opinion. Our conclusions are based on the audit evidence obtained up to the date of our auditor’s report. However, future events or conditions may cause the Company to cease to continue as a going concern.
- Evaluate the overall presentation, structure and content of the Ind AS Financial Statements, including the disclosures, and whether the Ind AS Financial Statements represent the underlying transactions and events in a manner that achieves fair presentation.

We communicate with those charged with governance regarding, among other matters, the planned scope and timing of the audit and significant audit findings, including any significant deficiencies in internal control that we identify during our audit.

We also provide those charged with governance with a statement that we have complied with relevant ethical requirements regarding independence, and to communicate with them all relationships and other matters that may reasonably be thought to bear on our independence, and where applicable, related safeguards.

From the matters communicated in with those charged with governance, we determine those matters that were of most significance in the audit of the Ind AS Financial Statements of the current period and are therefore the key audit matters. We describe these matters in our auditor’s report unless law or regulation precludes public disclosure about the matter or when, in extremely rare circumstances, we determine that a matter should not be communicated in our report because the adverse consequences of doing so would reasonably be expected to outweigh the public interest benefits of such communication.

Report on Other Legal and Regulatory Requirements

- (1) As required by the Companies (Auditor’s Report) Order, 2016 (“the Order”) issued by the Central Government in terms of Section 143(11) of the Act, we give in “**Annexure A**” a statement on the matters specified in paragraphs 3 and 4 of the Order.
- (2) The Comptroller and Auditor General have issued the directions and sub directions indicating the area to be examined in term of subsection (5) of Section 143 of The Companies Act, 2013. The compliance of which is set out in “**Annexure B**”
- (3) As required by Section 143(3) of the Act, we report that:
 - a) We have sought and obtained all the information and explanations which to the best of our knowledge and belief were necessary for the purposes of our audit.
 - b) In our opinion, proper books of account as required by law have been kept by the Company so far as it appears from our examination of those books.
 - c) The balance sheet, the statement of profit and loss (including other comprehensive income), the statement of changes in equity and the statement of cash flows dealt with by this Report are in agreement with the books of account.
 - d) In our opinion, the aforesaid IndAS Financial Statements comply with the Indian Accounting Standards prescribed under section 133 of the Act.
 - e) On the basis of the written representations received from the directors of the Company as on March 31, 2021 taken on record by the Board of Directors, none of the directors is disqualified as on March 31, 2021 from being appointed as a director in terms of Section 164(2) of the Act.
 - f) With respect to the adequacy of the internal financial controls over financial reporting of the Company and the operating effectiveness of such controls, refer to our separate Report in “**Annexure C**”.

- g) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with the requirement of section 197(16) of the Act, as amended:

The company being government company provision of section 197(16) of the Act is not applicable to the company.

- h) With respect to the other matters to be included in the Auditor's Report in accordance with Rule 11 of the Companies (Audit and Auditors) Rules, 2014, as amended, in our opinion and to the best of our information and according to the explanations given to us:

(i) The Company has disclosed the impact of pending litigations on its financial position in its Ind AS Financial Statements - **Refer Note 19.1**

(ii) The Company has made provision, as required under the applicable law or accounting standards, for material foreseeable losses, if any, on long-term contracts, - **Refer Note 17 of Change in Equity** to the Ind AS Financial Statements; and the company has made necessary changes in accounts to comply with RBI Circular RBI/2019-20/170 DOR (NBFC) C.C. PD No. 109/22.10.106/2019-20 dated 13th March, 2020.

(iii) There were no amounts which were required to be transferred to the Investor Education and Protection Fund by the Company.

Place: Ahmedabad
Date : 22 June 2021

For Mukeshkumar Jain & Co.
Chartered Accountants
(FRN: 106619W)

Sd/-
CA. Piyush Jain
Partner
(Membership No. 413377)
UDIN: 21413377AAAABP4470

ANNEXURE “A” TO THE INDEPENDENT AUDITOR’S REPORT

(Referred to in paragraph under ‘Report on Other Legal and Regulatory Requirements’ section of our report to the Members of Gujarat State Financial Services Limited of even date)

- (i) In respect of the Company’s Property Plant and Equipment:
- The Company is maintaining register for property plant and equipment, however details in respect of specific identification of assets is incomplete.*
 - As explain to us the company has a program of verification to cover all the items of property plant and equipment in once in a three year which, in our opinion, is reasonable having regard to the size of the Company and the nature of its assets. Pursuant to the program, certain assets were physically verified by the management during the year. According to the information and explanations given to us, no material discrepancies were noticed on such verification.
 - According to the information and explanations given to us, the records examined by us, the company doesn’t hold any immovable properties in its name and hence, clause related to title deeds of immovable properties are held in the name of the company is not applicable.
- (ii) The Company is a Non-Banking Finance Company. Accordingly it does not have any inventory. Thus, clause 3(ii) of the Companies (Auditor’s Report) Order, 2016 is not applicable.
- (iii) According to the information and explanations given to us, the Company has neither granted any loans, secured or unsecured to companies, firms or other parties covered in the register maintained under section 189 of the Companies Act, 2013 and the rules framed there under, are not applicable for the year under audit.
- (iv) The Company has not given any loans, investment, guarantees and securities which may be covered under section 185 and 186 of the Companies Act, 2013.
- (v) In our opinion and according to the information and explanations given to us, the Company has not accepted deposits, and the directives issued by Reserve Bank of India and the provisions of Sections 73 to 76 or any other relevant provisions of the Companies Act, 2013 and the companies (Acceptance of Deposits) Rules, 2014 framed there under, are not applicable for the year under audit.
- (vi) The company is not engaged in production, processing, manufacturing or mining activities. Therefore, the provisions of maintenance of cost records specified by the Central Government under section 148(1) of the Companies Act, 2013 mentioned under clause 3(vi) of the order is not applicable to the Company.
- (vii) According to the information and explanations given to us, in respect of statutory dues:
- The Company has generally been regular in depositing undisputed statutory dues, including Provident Fund, Employees’ State Insurance, Income Tax, Goods and Services Tax, and other material statutory dues applicable to it with the appropriate authorities and no undisputed amounts payable in respect of same were in arrears as at March 31, 2021 for a period of more than six months from the date they become payable.
 - Details of statutory dues which have not been deposited as at March 31, 2021 on account of dispute are given below:

S. No.	Name of Statute	Nature of Dues	Amount (Rs)	Period to which the amount relates (A.Y.)	Forum where the dispute is pending
1	Income Tax Act	Income Tax	7,198,522	2003-04	Gujarat High Court, ITAT set aside
2	Income Tax Act	Income Tax	66,518,271	2005-06	Gujarat High Court
3	Income Tax Act	Income Tax	-	2007-08	Assessing Officer - Set Aside Assessment

4	Income Tax	Income Tax	-	2011-12	Gujarat High Court
5	Income Tax	Income Tax	-	2010-11	Gujarat High Court
				2009-10	Gujarat High Court
6	Income Tax	Income Tax	-	2006-07	Gujarat High Court
7	Income Tax	Income Tax	-	2004-05	High Court
8	Income Tax	Income Tax	-	2002-03	High Court
	Total		73,716,793		

- (viii) In our opinion and according to the information and explanations given to us, there are no such dues to financial institutions or bank to the company. The Company did not have any outstanding debenture during the year. Hence reporting under clause 3 (viii) of the order is not applicable to the company.
- (ix) The Company has not raised moneys by way of initial public offer or further public offer (including debt instruments) or term loans and hence reporting under clause 3 (ix) of the Order is not applicable to the Company.
- (x) To the best of our knowledge and according to the information and explanations given to us, no fraud by the Company or no material fraud on the Company by its officers or employees has been noticed or reported during the year.
- (xi) In our opinion and according to the information and explanations given to us, and based on our examination of the records of the company, no managerial remuneration is paid/provided hence this clause is not applicable to the company.
- (xii) In our opinion and according to the information and explanations given to us, the Company is not a Nidhi Company and hence reporting under clause 3 of the Order is not applicable to the Company.
- (xiii) In our opinion and according to the information and explanations given to us, the Company is in compliance with Section 177 and 188 of the Companies Act, 2013 where applicable, for all transactions with the related parties and the details of related party transactions have been disclosed in the notes to Ind AS Financial Statements as required by the applicable Indian Accounting Standard (AS) 24, Related Party Disclosure.
- (xiv) According to information and explanations given to us and on the basis of our examination of the records of the Company, the Company has not made any preferential allotment or private placement of shares or fully or partly convertible debentures during the year.
- (xv) In our opinion and according to the information and explanations given to us, during the year the Company has not entered into any non-cash transactions with its Directors or persons connected to its directors and accordingly, clause (xv) of paragraph 3 of the Order is not applicable.
- (xvi) The Company is a Non – Banking Financial Company and necessary registration under section 45-IA of Reserve Bank of India Act, 1934 has been obtained.

Place: Ahmedabad
Date : 22 June 2021

For Mukeshkumar Jain & Co.
Chartered Accountants
(FRN: 106619W)

Sd/-
CA. Piyush Jain
Partner
(Membership No. 413377)
UDIN: 21413377AAAABP4470

ANNEXURE 'B' TO THE INDEPENDENT AUDITOR'S REPORT

(Referred to in paragraph 3 under 'Report on Other Legal and Regulatory Requirements' section of our report to the Members of Gujarat State Financial Services Limited of even date)

DIRECTIONS UNDER SECTION 143(5) OF THE COMPANIES ACT, 2013 ISSUED BY THE COMPTROLLER AND AUDITOR GENERAL OF INDIA TO THE STATUTORY AUDITORS OF GUJARAT STATE FINANCIAL SERVICES LIMITED FOR CONDUCTING AUDIT OF ACCOUNTS FOR THE YEAR 2020-21:

S. No.	Directions / Sub Directions	Observations / Findings
(A)	Directions – General	
1	Whether the company has system in place to process all accounting transactions through IT system? If yes, the implications of processing of accounting transactions outside IT system on the integrity of the accounts along with the financial implications, if any, may be stated.	The company is using FAS (Fox Pro) for accounting of all transactions and Oracle software for recording ICD and LDS through IT system.
2	Whether there has been any restructuring of an existing loan or cases of waiver/write off of Loans/Interest etc. made by lender to the company due to the company's inability to repay the loan? If yes, the financial impact may be stated.	On the basis of our audit and information & explanations given to us there is no such case during the financial year 2020-21. Therefore no any impact on Ind AS Financial Statements.
3	Whether funds received/receivable for specific scheme from central/state agencies were properly accounted for/utilized as per its term and conditions? List the cases of deviation.	On the basis of our audit and information & explanations given to us, no funds have been received/ receivable from central or state agencies hence not applicable.
4	Whether the Company has clear title/lease deeds for freehold and leasehold respectively? If not please state the area of freehold and leasehold land for which title/ lease deeds are not available.	The Clause is not applicable to Company as the Company is not having any freehold / leasehold land.
5	Whether there are any cases of waiver/ write off of debts/ loans/ interest etc., if yes, the reasons therefore and the amount involved.	In our opinion and explanations given to us there are no cases of wavier / write off of debts / loan / interest etc. during the year 2020-21.
6	Whether the proper records are maintained for inventories lying with third parties & assets received as gift/grant(s) from Govt. or other authorities.	The Company is a Non-Banking Finance Company. Accordingly it does not have any inventory. This clause is not applicable.
(B)	Sector Specific Sub – Directions – Finance Sector	
1	Whether the Company has complied with the directions issued by Reserve Bank of India for” Non-Banking Finance Companies (NBFCs)	In our Opinion and according to explanation given to us the Company has complied with the directions issued by Reserve Bank of India for Non-Banking Financial Companies

	<p>Classification of Non-Performing Assets; and</p> <p>Capital adequacy norms for NBFCs</p>	<p>During the Financial Year 2020-21, the Company do not have any Non-Performing Assets, the clause is not applicable to the Company</p> <p>As on 31/03/2021, Company is having CRAR of 7.57% (P.Y. 7.44% as against prescribed CRAR of 12%) as against prescribed CRAR of 13%.</p> <p>The above CRAR is as per RBI Notification No. RBI/2019-20/170/DOR (NBFC) CC. PD. No. 109/22.10.106/2019-20 dated 13th March, 2020 & RBI Notification No. RBI/2020-21/15 DOR (NBFC) CC. PD. No. 116/22.10.106/2020-21 dated July 24, 2020.</p> <p>Master Direction DNBR.PD.008/03.10.119/2016-17 (Updated as on February 17, 2020) issued by Reserve Bank of India, Government NBFCs confirming to Section 2(45) of the Companies Act, 2013 for Systemically Important Non-Deposit taking Company or Deposit taking Company (Reserve Bank) Directions, 2016 of the RBI Act is made applicable on the company from May 31, 2018.</p> <p>As per the above notification, timeline for government NBFC to comply with CRAR of year ended March 31, 2021 prescribed CRAR for government NBFC is 13%.</p> <p><i>Therefore the company is not maintaining with prescribed CRAR of 13%.</i></p> <p>As per directives mentioned Para 1.1 of Section A of Master Direction DNBS.PPD. No. 04/66.15.001/2016-17 dated June 8, 2017 the company has failed to form IT Strategy Committee.</p>
2	Whether the Company has a system to ensure that loans were secured by adequate security free from encumbrances and have first charge on mortgaged assets. Further instances of undue delay in disposal of seized units may be reported.	Since the Company has been sanctioning and disbursing loans to Government of Gujarat Entities only, the said clause is not applicable.
3	Whether introduction of any scheme for settlement of dues and extensions thereto complied with policy / guidelines of Company / Government.	The policy for settlement of dues and extensions thereto has been defined By the Company. However there was no such settlement of dues or extension done during the F.Y.:2020-21.
4	Comment on the confirmation of balances of trade receivables, trade payables, term deposits, bank accounts and cash obtained.	Yes, the Confirmation for loans, bank accounts & Cash Balances are obtained.
5	Whether the bank guarantees have been revalidated in time?	Not Applicable.

Place: Ahmedabad
Date : 22 June 2021

For Mukeshkumar Jain & Co.
Chartered Accountants
(FRN: 106619W)

Sd/-
CA. Piyush Jain
Partner
(Membership No. 413377)
UDIN: 21413377AAAABP4470

ANNEXURE ‘C’ TO THE INDEPENDENT AUDITOR’S REPORT

(Referred to in paragraph 1(f) under ‘Report on Other Legal and Regulatory Requirements’ section of our report to the Members of Gujarat State Financial Services Limited of even date)

Report on the Internal Financial Controls Over Financial Reporting under Clause (i) of Sub- section 3 of Section 143 of the Companies Act, 2013 (“the Act”)

We have audited the internal financial controls over financial reporting of GUJARAT STATE FINANCIAL SERVICES LIMITED (“the Company”) as of March 31, 2021 in conjunction with our audit of the Ind AS Financial Statements of the Company for the year ended on that date.

Management’s Responsibility for Internal Financial Controls

The Board of Directors of the Company is responsible for establishing and maintaining internal financial controls based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India. These responsibilities include the design, implementation and maintenance of adequate internal financial controls that were operating effectively for ensuring the orderly and efficient conduct of its business, the safeguarding of its assets, the prevention and detection of frauds and errors, the accuracy and completeness of the accounting records, and the timely preparation of reliable financial information, as required under the Companies Act, 2013.

Auditor’s Responsibility

Our responsibility is to express an opinion on the internal financial controls over financial reporting of the Company based on our audit. We conducted our audit in accordance with the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting (the “Guidance Note”) issued by the Institute of Chartered Accountants of India and the Standards on Auditing prescribed under Section 143(10) of the Companies Act, 2013, to the extent applicable to an audit of internal financial controls. Those Standards and the Guidance Note require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether adequate internal financial controls over financial reporting was established and maintained and if such controls operated effectively in all material respects.

Our audit involves performing procedures to obtain audit evidence about the adequacy of the internal financial controls system over financial reporting and their operating effectiveness. Our audit of internal financial controls over financial reporting included obtaining an understanding of internal financial controls over financial reporting, assessing the risk that a material weakness exists, and testing and evaluating the design and operating effectiveness of internal control based on the assessed risk. The procedures selected depend on the auditor’s judgment, including the assessment of the risks of material misstatement of the Ind AS Financial Statements, whether due to fraud or error.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion on the Company’s internal financial controls system over financial reporting.

Meaning of Internal Financial Controls over Financial Reporting

A company’s internal financial control over financial reporting is a process designed to provide reasonable assurance regarding the reliability of financial reporting and the preparation of Ind AS Financial Statements for external purposes in accordance with generally accepted accounting principles. A company’s internal financial control over financial reporting includes those policies and procedures that

- (1) Pertain to the maintenance of records that, in reasonable detail, accurately and fairly reflect the transactions and dispositions of the assets of the company;
- (2) Provide reasonable assurance that transactions are recorded as necessary to permit preparation of Ind AS Financial Statements in accordance with generally accepted accounting principles, and that receipts and expenditures of the company are being made only in accordance with authorizations of management and directors of the company; and

- (3) Provide reasonable assurance regarding prevention or timely detection of unauthorized acquisition, use, or disposition of the company's assets that could have a material effect on the Ind AS Financial Statements.

Inherent Limitations of Internal Financial Controls over Financial Reporting

Because of the inherent limitations of internal financial controls over financial reporting, including the possibility of collusion or improper management override of controls, material misstatements due to error or fraud may occur and not be detected. Also, projections of any evaluation of the internal financial controls over financial reporting to future periods are subject to the risk that the internal financial control over financial reporting may become inadequate because of changes in conditions, or that the degree of compliance with the policies or procedures may deteriorate.

Opinion

In our opinion, the Company has, in all material respects, an internal financial controls system with reference to Ind AS Financial Statements and such internal financial controls with reference to Ind AS Financial Statements were operating effectively as at 31st March, 2021, based on the internal control over financial reporting criteria established by the Company considering the essential components of internal control stated in the Guidance Note on Audit of Internal Financial Controls Over Financial Reporting issued by the Institute of Chartered Accountants of India.

Place: Ahmedabad
Date : 22 June 2021

For Mukeshkumar Jain & Co.
Chartered Accountants
(FRN: 106619W)

Sd/-
CA. Piyush Jain
Partner
(Membership No. 413377)
UDIN: 21413377AAAABP4470

GUJARAT STATE FINANCIAL SERVICES LIMITED

CIN: U65910GJ1992SGC018602

Balance Sheet As At March 31, 2021

(₹ in Lakhs)

PARTICULARS	Note No	As at	
		March 31, 2021	March 31, 2020
ASSETS			
(1) Financial assets			
(a) Cash and cash equivalents	5	21249.55	43699.05
(b) Loans	6	1197012.96	1184935.40
(c) Investments	7	3761316.52	3208037.04
(d) Other Financial Assets	8	16091.14	12944.69
Total Financial Assets		4995670.17	4449616.18
(2) Non-Financial assets			
(a) Current tax assets (Net)	26.3	1509.70	1972.73
(b) Property, Plant and Equipment	9	32.93	39.46
(c) Other non-financial assets	10	4.56	4.06
Total Non-Financial Assets		1547.19	2016.25
Total assets		4997217.36	4451632.43
LIABILITIES AND EQUITY			
LIABILITY			
(1) Financial liabilities			
(a) Payables			
Trade Payables	11		
i) total outstanding dues to micro enterprises and small enterprises	-	4.27	4.43
ii) total outstanding due to creditors other than micro enterprises and small enterprises	-	15.86	15.34
(b) Deposits	12	4379673.85	3926365.64
(c) Other financial liabilities	13	125449.99	139028.17
Total Financial Liabilities		4505143.97	4065413.58
(2) Non-Financial Liabilities			
(a) Current tax liabilities (Net)		0.00	0.00
(b) Provisions	14	8.85	5.02
(c) Deferred Tax Liabilities (Net)	26.6	30053.25	31563.71
(d) Other non - financial Liabilities	15	2465.61	3329.67
Total Non-Financial Liabilities		32527.71	34898.40
(3) EQUITY			
(a) Equity share capital	16	13799.61	13799.61
(b) Other equity	17	445746.07	337520.84
Total Equity		459545.68	351320.45
Total Liabilities and Equity		4997217.36	4451632.43

The accompanying notes form an integral part of the Financial Statements

As per our Report of even date

For Mukeshkumar Jain & Co.
Firm's Registration No: 106619W
Chartered Accountants

Sd/-
Pankaj Joshi
Managing Director
(DIN:01532892)

Sd/-
Sunil Talati
Director
(DIN:00621947)

Sd/-
Piyush Jain
Partner
Membership No:413377
UDIN : 21413377AAAABP4470

Sd/-
Nitin Shah
Chief Financial Officer

Sd/-
Neeraj Jain
Company Secretary
(ACS:44725)

Place : Ahmedabad
Date : 22/06/2021

Place : Gandhinagar
Date : 22/06/2021

GUJARAT STATE FINANCIAL SERVICES LIMITED
Statement of Profit and Loss for the year ended March 31, 2021

(₹ in Lakhs)

PARTICULARS	Note No	For the year ended	
		March 31, 2021	March 31, 2020
Revenue from operations			
i Interest Income	20.1	132723.88	133769.08
ii Net gain on fair value changes	20.2	179064.19	217471.52
(I) Total Revenue from Operations		311788.07	351240.60
(II) Other Income	21	2854.15	7867.15
(III) Total revenue (I + II)		314642.22	359107.75
Expenses			
i Finance cost	22	267004.54	298239.35
ii Employee benefits expense	23	383.12	327.85
iii Depreciation and amortisation expenses	9	13.62	17.25
iv Corporate Social Responsibility Expenses	33	1650.00	357.43
v Other Expense	24	535.99	1152.07
(IV) Total expenses		269587.27	300093.95
V Profit before tax (III - IV)		45054.95	59013.80
VI Tax Expenses ::	26.1		
a Current tax		(11247.19)	(13241.62)
b Deferred tax		8045.12	(2877.65)
c Adjustment of earlier year tax		955.22	(4.80)
Total tax expense		(2246.85)	(16124.07)
VII Profit for the Year (V - VI)		42808.10	42889.73
VIII Other comprehensive income			
a Items that will not be reclassified to profit or loss			
Remeasurement of defined benefit obligations	25.9	(4.55)	(6.57)
Fair value gain / (loss) on investment in equity instruments measured as fair value through OCI		75406.23	10706.57
b Income tax relating to Items that will not be reclassified to profit or loss	26.2	(6534.65)	(3741.30)
		68867.03	6958.70
IX Total Comprehensive Income (VII+VIII)		111675.13	49848.43
X Earnings per Equity Share (face value of ₹ 10 each)			
Basic - ₹	31	31.02	31.08
Diluted - ₹		31.02	31.08

The accompanying notes form an integral part of the Financial Statements

As per our Report of even date

For Mukeshkumar Jain & Co.
 Firm's Registration No: 106619W
 Chartered Accountants

Sd/-
Pankaj Joshi
 Managing Director
 (DIN:01532892)

Sd/-
Sunil Talati
 Director
 (DIN:00621947)

Sd/-
Piyush Jain
 Partner
 Membership No:413377
 UDIN : 21413377AAAABP4470

Sd/-
Nitin Shah
 Chief Financial Officer

Sd/-
Neeraj Jain
 Company Secretary
 (ACS:44725)

Place : Ahmedabad
 Date : 22/06/2021

Place : Gandhinagar
 Date : 22/06/2021

STATEMENT OF CHANGES IN EQUITY FOR THE YEAR ENDED MARCH 31, 2021

A. Equity share capital

(₹ in Lakhs)

Particulars	As at	
	March 31, 2021	March 31, 2020
Balance at the beginning of the reporting period	13799.61	13799.61
Changes during the year	0.00	0.00
Balance at the reporting period	13799.61	13799.61

B. Other equity

(₹ in Lakhs)

Particulars	Reserves & Surplus					Equity Instruments through Other comprehensive Income	Total
	General Reserves	Retained Earnings	Reserve fund u/s 45-IC (1) Of Reserve Bank Of India Act, 1934	Securities premium	Impairment Reserve		
Balance as at April 01, 2020	2707.97	170457.39	14097.45	139407.89	4757.17	6092.97	337520.84
Profit for the period		42808.10					42808.10
Transfer from Retained Earnings		(8562.00)	8562.00				0.00
Transfer to impairment reserve		(56.56)			56.56		0.00
Items of the OCI for the year, net of tax							
Remeasurement benefit of defined benefit plans		(4.55)					(4.55)
Net fair value gain/(loss) on investment in equity instruments through OCI (Net of Taxes)						68871.58	68871.58
Dividends		(3449.90)					(3449.90)
Balance as at March 31, 2021	2707.97	201192.48	22659.45	139407.89	4813.73	74964.55	445746.07
Balance as at April 01, 2019	2707.97	137527.49	5519.50	139407.89	0.00	(872.30)	284290.55
Profit for the period		42889.73					42889.73
Transfer from Retained Earnings		(8577.95)	8577.95				0.00
Transfer to Impairment Reserve from contingent provision against standard assets of balance lying on April 01, 2019					4673.60		4673.60
Transfer to impairment reserve		(83.57)			83.57		0.00
Items of the OCI for the year, net of tax							
Remeasurement benefit of defined benefit plans		(6.57)					(6.57)
Net fair value gain/(loss) on investment in equity instruments through OCI (Net of Taxes)						6965.27	6965.27
Dividends (including tax on dividend)		(1291.74)					(1291.74)
Balance as at March 31, 2020	2707.97	170457.39	14097.45	139407.89	4757.17	6092.97	337520.84

1 General reserve

The general reserve is a free reserve which is used on time to time to transfer profits from retained earnings for appropriation purposes.

2 Reserve fund u/s 45-IC (1) Of Reserve Bank of India Act, 1934

As required by section 45-IC of the RBI Act 1934, the company maintains a reserve fund and transfers there in a sum not less than twenty per cent of its net profit every year as disclosed in the profit and loss account and before any dividend is declared. The company cannot appropriate any sum from the reserve fund except for the purpose specified by Reserve Bank of India from time to time. Till date RBI has not specified any purpose for appropriation of Reserve fund maintained under section 45-IC of RBI Act, 1934.

3 Impairment Reserve

As per RBI circular no. RBI/2019-20/170 DOR(NBFC).CC.PD.No. 109/22.10.106/2019-20 dated March 13, 2020, impairment reserve is created on excess of provisioning required as per Income Recognition, Asset Classification and Provision norms of RBI over impairment allowance under Ind AS – 109.

As per RBI circular no. RBI/2019-20/170 DOR(NBFC).CC.PD.No. 109/22.10.106/2019-20 dated March 13, 2020, NBFCs are required to provide for impairment on financial assets in accordance with Ind AS. Further, as per the circular, impairment reserve is required to be created on excess of provisioning required as per Income Recognition, Asset Classification and Provision (IRACP) norms of RBI (including standard assets) over impairment allowance under Ind AS – 109. In accordance with ECL method as prescribed in Ind AS - 109, impairment allowance worked out as Nil. Consequently, excess amount of contingent provision against standard assets as computed as per IRAC norms is transferred to "Impairment Reserve"

4 Securities Premium

Securities premium is used to record the premium on issue of shares. The reserve is utilised in accordance with the provisions of section 52 of the Companies Act, 2013.

5 Equity Instruments through Other Comprehensive Income

The company has elected to recognise changes in the fair value of investments in equity securities in other comprehensive income. This reserve represents the cumulative gains and losses arising on the revaluation of equity instruments measured at fair value through other comprehensive income. The company transfers amounts from this reserve to retained earnings when the relevant equity securities are disposed off.

As per our Report of even date
For Mukeshkumar Jain & Co.
 Firm's Registration No: 106619W
 Chartered Accountants

Sd/-
Pankaj Joshi
 Managing Director
 (DIN:01532892)

Sd/-
Sunil Talati
 Director
 (DIN:00621947)

Sd/-
Piyush Jain
 Partner
 Membership No:413377
 UDIN : 21413377AAAABP4470

Sd/-
Nitin Shah
 Chief Financial Officer

Sd/-
Neeraj Jain
 Company Secretary
 (ACS:44725)

Place : Ahmedabad
 Date : 22/06/2021

Place : Gandhinagar
 Date : 22/06/2021

Statement of Cash Flow For The Year Ended March 31, 2021

(₹ in Lakhs)

	Particulars	For the year ended	
		March 31, 2021	March 31, 2020
(A)	Cash flow from Operating Activities		
	Profit / (Loss) before tax	45054.95	59013.80
	Adjustments for:		
	Depreciation	13.62	17.25
	Unrealised (gain)/loss on FVTPL investments	517.92	(3560.15)
	Interest Accrued but not due on Loans provided to GOG entities	(6417.22)	(4354.46)
	Interest Accrued but not due on Loans given to employees	(2.65)	(2.62)
	Interest accrued but not due on Government securities and Bond	(9555.36)	(8527.15)
	Interest Accrued but not due on Funds with Primary Dealers	(77.76)	(22.62)
	Interest accrued but not due on ICDs	115303.80	117005.82
	Interest Accrued and due on Liquid Deposit Scheme	3181.09	1794.55
	Interest accrued and due on Inter Corporate Deposits	6942.10	6089.43
	Amortization of Premium paid on Non Current Investment (Net)	55.58	47.31
	Interest on Income Tax	44.77	73.95
	Provision for Leave Encashment & Gratuity	3.83	1.07
	Remeasurement of defined benefit obligations	(4.55)	(6.57)
	(Profit) / Loss on Sale of Tangible Assets	(0.48)	(0.71)
	Dividend Received	(2610.78)	(7865.24)
	Operating profit / (loss) before working capital changes	152448.86	159703.66
	Changes in working capital:		
	(Increase) / Decrease in Loans	(12077.54)	(19404.44)
	(Increase) / Decrease in Investments	(478446.76)	(188383.99)
	(Increase) / Decrease in other financial assets	12906.52	10587.54
	(Increase) / Decrease in other non financial assets	(0.50)	(1.45)
	Increase / (Decrease) in other financial Liabilities	(139005.17)	(124910.22)
	Increase / (Decrease) in other non financial Liabilities	(864.06)	0.37
	Increase / (Decrease) in Deposits	453308.21	174783.23
	Increase / (Decrease) in Trade payables	0.36	(227.85)
	Cash Generated from Operations:	(11730.08)	12146.85
	Taxes Paid (net of refunds)	(9873.70)	(19289.95)
	Net Cash from Operating Activities (A)	(21603.78)	(7143.10)
(B)	Cash Flow from Investing Activities		
	Dividend Received	2610.78	7865.24
	Purchase of Tangible Assets	(7.29)	(16.28)
	Sale of Tangible Assets	0.69	1.02
	Net Cash Flow from Investing Activities (B)	2604.18	7849.98
(C)	Cash Flow from Financing Activities		
	Dividend paid (Including DDT if any)	(3449.90)	(1291.74)
	Net Cash Flow from Financing Activities (C)	(3449.90)	(1291.74)
	Net Increase/ (decrease) in Cash & Cash equivalents (A+B+C)	(22449.50)	(584.86)
	Cash & Cash equivalents at beginning of the Year	43699.05	44283.91
	Cash & Cash equivalents at end of the Year	21249.55	43699.05
	Component of Cash & Cash Equivalents		
	Cash on hand	0.47	0.53
	Balances with banks	21249.02	43698.46
	Stamp on hand	0.01	0.01
	Balance in Government Treasury	0.05	0.05
	Cash & Cash equivalents at end of the Year	21249.55	43699.05

The accompanying notes form an integral part of the standalone financial statements.

As per our Report of even date
For Mukeshkumar Jain & Co.
 Firm's Registration No: 106619W
 Chartered Accountants

Sd/-
Pankaj Joshi
 Managing Director
 (DIN:01532892)

Sd/-
Sunil Talati
 Director
 (DIN:00621947)

Sd/-
Piyush Jain
 Partner
 Membership No:413377
 UDIN : 21413377AAAABP4470

Sd/-
Nitin Shah
 Chief Financial Officer

Sd/-
Neeraj Jain
 Company Secretary
 (ACS:44725)

Place : Ahmedabad
 Date : 22/06/2021

Place : Gandhinagar
 Date : 22/06/2021

GUJARAT STATE FINANCIAL SERVICES LIMITED

Notes to the Financial Statements for the Year ended March 31, 2021

1 Company overview

Gujarat State Financial Services Limited (the 'Company') is a public limited company domiciled in India and is incorporated under the provisions of the Companies Act with its registered office located at Wing "B", 3rd floor, Khanij bhavan, 132 ft. Ring Road, Near University Ground, Vastrapur, Ahmedabad – 380052. The company is also Systematically Important Non-deposit Taking Non-Banking Finance Company (NBFC) registered with Reserve Bank of India (RBI).

Government of Gujarat is holding 77% equity shares of the company. The Company has been given the mandate by the State Government to manage the surplus funds of various Government of Gujarat controlled entities and Public Sector Units of the State. Thus it acts as an in-house treasury manager to the various State owned entities.

The financial statements are approved for issue by the Company's Board of Directors on June 22, 2021.

2 Basis of preparation

2.1 Statement of compliance

The financial statements comply in all material aspects with Indian Accounting Standards (Ind AS) notified under section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and Companies (Indian Accounting Standards) Amendment Rules, 2016 and the provisions of the RBI as applicable to Systematically Important Non-deposit Taking NBFC.

2.2 Basis of measurement

The Financial Statements have been prepared on the historical cost basis except for the following items which are measured at fair values:

- a. certain financial assets and liabilities
- b. defined benefit plans assets

2.3 Functional and presentation currency

Indian rupee is the functional and presentation currency.

2.4 Use of estimates and judgments

The preparation of the financial statements in conformity with Ind AS requires management to make estimates, judgments and assumptions.

These estimates, judgments and assumptions affect the application of accounting policies and the reported amounts of assets and liabilities, the disclosures of contingent assets and liabilities at the date of the financial statements and reported amounts of revenues and expenses during the period.

Accounting estimates could change from period to period. Actual results could differ from those estimates. Appropriate changes in estimates are made as management becomes aware of changes in circumstances surrounding the estimates. Changes in estimates are reflected in the financial statements in the period in which changes are made and, if material, their effects are disclosed in the notes to the financial statements.

Application of accounting policies that require critical accounting estimates involving complex and subjective judgments and the use of assumptions in these financial statements are:

- Useful lives of property, plant and equipment
- Valuation of financial instruments
- Provisions and contingencies
- Income tax and deferred tax
- Consideration of significant related party transactions
- Measurement of defined employee benefit obligations

Estimation of Uncertainties relating to the Global Health Pandemic from COVID – 19 (“Covid – 19”)

The COVID – 19 impact on global and Indian Financial Markets as well as global and local economic activities will depend on the future developments, which are highly uncertain. However, the Company is expecting that the possible effects due to COVID – 19 on the financial position and performance of the company may not be significant as the Company financed only to the Government of Gujarat companies.

The company has also considered the possible effects that may result from the COVID – 19 on the carrying amount of investments in Liquid/debt schemes of mutual funds, equity shares, funds with primary dealers and debt securities based on the internal and external source of information up to the date of approval of the financial statements. The company expects that the carrying amount of these assets will be recovered.

3 Significant accounting policies

3.1 Revenue Recognition

Revenue is recognized to the extent that it is probable that the economic benefits will flow to the Company and the revenue can be reliably measured.

Interest income

Interest income is recognised using effective interest method. The effective interest rate is the rate that exactly discounts estimated future cash receipts through expected life of the financial asset to the gross carrying amount of the financial asset. When calculating the effective interest rate, the company estimates the expected cash flows by considering all the contractual terms of the financial instrument but does not consider the expected credit losses. Interest on overdue interest is recognized in the year of its receipts.

Dividend

Dividend income is recognised when the right to receive the dividend is established.

Gain or loss on derecognition of financial assets

Gain or Loss on derecognition of financial asset is determined as the difference between the sale price (net of selling costs) and carrying value of financial asset. Gains/(loss) on Investments i.e. from units of Asset Management Companies is accounted on FIFO method at the time of redemption/ realisation made.

Bad Debt Recovery

Bad debt recovery is recognised as income in the year of receipt.

All other incomes are recognised and accounted for on accrual basis.

3.2 Property, plant and equipments

Property, plant and equipments are stated at cost, net of accumulated depreciation and accumulated impairment losses, if any.

The cost comprises the purchase price, borrowing cost if capitalization criteria are met and directly attributable cost of bringing the asset to its working condition for its intended use. Any trade discounts and rebates are deducted in arriving at the purchase price.

Subsequent expenditures relating to property, plant and equipment is capitalized only when it is probable that future economic benefits associated with these will flow to the company and the cost of the item can be measured reliably.

All other expenses on existing fixed assets, including day-to-day repair and maintenance expenditure and cost of replacing parts, are charged to the statement of profit and loss for the period during which such expenses are incurred.

For transition to Ind AS, the carrying value of property plant and equipment under previous GAAP as on 01 April 2017 is regarded as its cost. The carrying value was original cost less accumulated depreciation and cumulative impairment.

Property, plant and equipment not ready for the intended use on the date of the Balance Sheet are disclosed as “Capital work-in-progress”.

Gains or losses arising from derecognition of property, plant and equipments are measured as the difference between the net disposal proceeds and the carrying amount of the asset at the time of disposal and are recognized in the statement of profit and loss when the asset is derecognized.

Depreciation on property, plant and equipment is calculated on written down value method basis using the ratio arrived as per the useful life prescribed under Schedule II to the Companies Act, 2013.

In respect of property, plant and equipment purchased during the year, depreciation is provided on a pro-rata basis from the date on which such asset is ready to use. Assets costing less than rupees ten thousand each is fully depreciated in the year of purchase.

The residual value, useful live and method of depreciation of property, plant and equipment are reviewed at each financial year end and adjusted prospectively, if appropriate.

3.3 Intangible assets

An intangible asset is recognised, only where it is probable that future economic benefits attributable to the asset will accrue to the enterprise and the cost can be measured reliably.

Intangible assets are stated at cost, less accumulated amortization and impairment losses, if any.

Intangible assets not ready for the intended use on the date of the Balance Sheet are disclosed as "Intangible Assets Under Development".

Separately purchased intangible assets are initially measured at cost. Subsequently, intangible assets are carried at cost less any accumulated amortization and accumulated impairment losses, if any.

Intangible assets are amortized over the expected duration of benefit or a period of ten years on a straight-line basis. Intangible assets acquired / purchased during the year are amortised on a pro-rata basis from the date on which such assets are ready to use.

The residual value, useful live and method of amortization of intangible assets are reviewed at each financial year end and adjusted prospectively, if appropriate.

3.4 Financial Instruments

3.4.1 Initial recognition

The company recognizes financial assets and financial liabilities when it becomes a party to the contractual provisions of the instrument.

All financial assets and liabilities are recognized at fair value on initial recognition.

Transaction costs that are directly attributable to the acquisition or issue of financial assets and financial liabilities that are not at fair value through profit or loss are added to or deducted from the fair value of financial assets or financial liabilities on initial recognition.

Transaction costs directly attributable to the acquisition of financial assets or financial liabilities at fair value through profit or loss are recognised immediately in profit or loss.

Regular way purchase and sale of financial assets are accounted for at trade date.

3.4.2 Subsequent measurement

a Non-derivative financial instruments

i Financial assets carried at amortized cost

A financial asset is subsequently measured at amortized cost if it is held within a business model whose objective is to hold the asset in order to collect contractual cash flows and the contractual terms of the financial asset give rise on specified dates to cash flows that are solely payments of principal and interest on the principal amount outstanding.

ii Financial assets at fair value through other comprehensive income

A financial asset is subsequently measured at fair value through other comprehensive income if it is held within a business model whose objective is achieved by both collecting contractual cash flows and selling financial assets and the contractual terms of the financial asset give rise on specified dates to cash flows that are solely payments of principal and interest on the principal amount outstanding.

The Company has made an irrevocable election for its investments which are classified as equity instruments to present the subsequent changes in fair value in other comprehensive income based on its business model. For such equity instruments, the subsequent changes in fair value are recognized in other comprehensive income.

iii Financial assets at fair value through profit or loss

A financial asset which is not classified in any of the above categories are subsequently measured at fair valued through profit or loss. Fair value changes are recognised as income in the Statement of Profit or Loss.

iv Financial liabilities

Financial liabilities are subsequently carried at amortized cost using the effective interest method.

b Equity instruments

An equity instrument is a contract that evidences residual interest in the assets of the company after deducting all of its liabilities. Incremental costs directly attributable to the issuance of equity instruments are recognised as a deduction from equity instrument net of any tax effects.

3.4.3 Derecognition

The company derecognizes a financial asset when the contractual rights to the cash flows from the financial asset expire or it transfers the financial asset and the transfer qualifies for derecognition under Ind AS 109. A financial liability is derecognized when obligation specified in the contract is discharged or cancelled or expires.

3.4.4 Off-setting

Financial assets and financial liabilities are offset and the net amount is presented in the balance sheet when the company currently has a legally enforceable right to offset the recognised amount and intends either to settle on a net basis or to realize the asset and settle the liability simultaneously.

3.4.5 Modification

A modification of a financial asset occurs when the contractual terms governing the cash flows of a financial asset are renegotiated or otherwise modified between initial recognition and maturity of the financial asset. A modification affects the amount and/or timing of the contractual cash flows either immediately or at a future date. The Company renegotiates loans to customers in financial difficulty to maximize collection and minimize the risk of default. A loan forbearance is granted in cases where although the borrower made all reasonable efforts to pay under the original contractual terms, there is a high risk of default or default has already happened and the borrower is expected to be able to meet the revised terms. The revised terms in most of the cases include an extension of the maturity of the loan, changes to the timing of the cash flows of the loan (principal and interest repayment), reduction in the amount of cash flows due (principal and interest forgiveness).

Not all changes in terms of loans are considered as renegotiation and changes in terms of a class of obligors that are not overdue is not considered as renegotiation and is not subjected to deterioration in staging.

3.5 Fair Value Measurement

Fair value is the price that would be received to sell an asset or paid to transfer a liability in an orderly transaction between market participants at the measurement date.

The fair value measurement assumes that the transaction to sell the asset or transfer the liability takes place either:

- In the principal market for the asset or liability, or
- In the absence of a principal market, in the most advantageous market for the asset or liability

A fair value measurement of a non-financial asset takes into account a market participant's ability to generate economic benefit by using the asset in its highest and best use or by selling it to another market participant that would use the asset in its highest and best use.

The company uses valuation techniques that are appropriate in the circumstances and for which sufficient data are available to measure fair value, maximizing the use of relevant observable inputs and minimizing the use of unobservable inputs.

All assets and liabilities for which fair value is measured or disclosed in the financial statements are categorized within the fair value hierarchy. The fair value hierarchy is based on inputs to valuation techniques that are used to measure fair value that are either observable or unobservable and consists of the following three levels:

Level 1 – inputs are quoted prices (unadjusted) in active markets for identical assets or liabilities

Level 2 – inputs are other than quoted prices included within level 1 that are observable for the asset or liability either directly (i.e. as prices) or indirectly (i.e. derived prices)

Level 3 – inputs are not based on observable market data (unobservable inputs). Fair values are determined in whole or in part using a valuation model based on assumption that are neither supported by prices from observable current market transactions in the same instrument nor are they based on available market data.

3.6 Income tax

Income tax expense comprises current tax and deferred tax.

3.6.1 Current Tax

Current tax is recognised in profit or loss, except when it relates to items that are recognised in other comprehensive income or directly in equity, in which case, the current tax is also recognised in other comprehensive income or directly in equity, respectively.

Current tax for current and prior periods is recognized at the amount expected to be paid to or recovered from the tax authorities, using the tax rates and tax laws that have been enacted or substantively enacted by the balance sheet date.

Current tax assets and current tax liabilities are offset, where company has a legally enforceable right to set off the recognised amounts and where it intends either to settle on a net basis, or to realize the asset and settle the liability simultaneously.

3.6.2 Deferred Tax

Deferred tax is recognised in profit or loss, except when it relates to items that are recognised in other comprehensive income or directly in equity, in which case, the deferred tax is also recognised in other comprehensive income or directly in equity, respectively.

Deferred tax liabilities are recognised for all taxable temporary differences, except to the extent that the deferred tax liability arises from initial recognition of goodwill; or initial recognition of an asset or liability in a transaction which is not a business combination and at the time of transaction, affects neither accounting profit nor taxable profit or loss.

Deferred tax assets are recognised for all deductible temporary differences, carry forward of unused tax losses and carry forward of unused tax credits to the extent that it is probable that taxable profit will be available against which those temporary differences, losses and tax credit can be utilized, except when deferred tax asset on deductible temporary differences arise from the initial recognition of an asset or liability in a transaction that is not a business combination and at the time of the transaction, affects neither accounting profit nor taxable profit or loss.

Deferred tax assets and liabilities are measured at the tax rates that are expected to apply to the period when the asset is realized or the liability is settled, based on the tax rules and tax laws that have been enacted or substantively enacted by the end of the reporting period.

Deferred tax assets and deferred tax liabilities are offset, where company has a legally enforceable right to set off the recognized amounts and where it intends either to settle on a net basis, or to realize the asset and settle the liability simultaneously.

Deferred tax assets are reviewed at each reporting date and are reduced to the extent that it is no longer probable that the related tax benefit will be realized.

3.7 Impairment

3.7.1 Financial assets

The Company recognizes impairment on financial assets, which are not carried at fair value, using expected credit loss (ECL) model as prescribed in Ind AS.

The expected credit losses (ECLs) is recognized based on forward-looking information for all financial assets at amortized cost, no impairment loss is applicable on equity investments.

At the reporting date, an allowance is required for the 12 month ECLs. If the credit risk has significantly increased since initial recognition (Stage 1), an allowance (or provision) should be recognized for the

lifetime ECLs for financial instruments for which the credit risk has increased significantly since initial recognition (Stage 2) or which are credit impaired (Stage 3).

The measurement of ECL is calculated using three main components: (i) probability of default (PD) (ii) loss given default (LGD) and (iii) the exposure at default (EAD). The 12 month ECL is calculated by multiplying the 12 month PD, LGD and the EAD. The 12 month and lifetime PDs represent the PD occurring over the next 12 months and the remaining maturity of the instrument respectively. The EAD represents the expected balance at default, taking into account the repayment of principal and interest from the balance sheet date to the default event together with any expected drawdowns of committed facilities. The LGD represents expected losses on the EAD given the event of default, taking into account, among other attributes, the mitigating effect of collateral value at the time it is expected to be realised and the time value of money.

The Company applies a three-stage approach to measure ECL on financial assets accounted for at amortized cost. Assets migrate through the following three stages based on the change in credit quality since initial recognition.

Stage 1: 12-months ECL

For exposures where there has not been a significant increase in credit risk since initial recognition and that are not credit impaired upon origination, the portion of the lifetime ECL associated with the probability of default events occurring within the next 12 months is recognized. Exposures with days past due (DPD) less than or equal to 29 days are classified as stage 1. The Company has identified zero bucket and bucket with DPD less than or equal to 29 days as two separate buckets.

Stage 2: Lifetime ECL – not credit impaired

For credit exposures where there has been a significant increase in credit risk since initial recognition but that are not credit impaired, a lifetime ECL is recognized. Exposures with DPD equal to 30 days but less than or equal to 89 days are classified as stage 2. At each reporting date, the Company assesses whether there has been a significant increase in credit risk for financial asset since initial recognition by comparing the risk of default occurring over the expected life between the reporting date and the date of initial recognition. The Company has identified cases with DPD equal to or more than 30 days and less than or equal to 59 days and cases with DPD equal to or more than 60 days and less than or equal to 89 days as two separate buckets.

Stage 3: Lifetime ECL – credit impaired

Financial asset is assessed as credit impaired when one or more events that have a detrimental impact on the estimated future cash flows of that asset have occurred. For financial asset that have become credit impaired, a lifetime ECL is recognized on principal outstanding as at period end. Exposures with DPD equal to or more than 90 days are classified as stage 3.

A loan that has been renegotiated due to a deterioration in the borrower's condition is usually considered to be credit-impaired unless there is evidence that the risk of not receiving contractual cash flows has reduced significantly and there are no other indicators of impairment.

ECL is recognized on EAD as at period end. If the terms of a financial asset are renegotiated or modified due to financial difficulties of the borrower, then such asset is moved to stage 3, lifetime ECL under stage 3 on the outstanding amount is applied.

The Company assesses when a significant increase in credit risk has occurred based on quantitative and qualitative assessments. Exposures are considered to have resulted in a significant increase in credit risk and are moved to Stage 2 when:

Quantitative test: Accounts that are 30 calendar days or more past due move to Stage 2 automatically. Accounts that are 90 calendar days or more past due move to Stage 3 automatically.

Reversal in Stages: Exposures will move back to Stage 2 or Stage 1 respectively, once they no longer meet the quantitative criteria set out above. For exposures classified using the qualitative test, when they no longer meet the criteria for a significant increase in credit risk and when any cure criteria used for credit risk management are met.

The definition of default for the purpose of determining ECLs has been aligned to the Reserve Bank of India definition of default, which considers indicators that the debtor is unlikely to pay and is no later than when the exposure is more than 90 days past due.

The measurement of all expected credit losses for financial assets held at the reporting date are based on historical experience, current conditions and reasonable and supportable forecasts. The measurement of ECL involves increased complexity and judgement, including estimation of PDs, LGD, a range of unbiased future economic scenarios, estimation of expected lives and estimation of EAD and assessing significant increases in credit risk.

Presentation of ECL allowance for financial asset:

Financial assets measured at amortized cost are shown separately under the head provisions and not as a deduction from the gross carrying amount of the assets.

Write off

Impaired loans and receivables are written off, against the related allowance for loan impairment on completion of the Company's internal processes and when the Company concludes that there is no longer any realistic prospect of recovery of part or all of the loan. For loans that are individually assessed for impairment, the timing of write off is determined on a case by case basis. A write-off constitutes a de-recognition event. The Company has a right to apply enforcement activities to recover such written off financial assets. Subsequent recoveries of amounts previously written off are credited to the income statement.

3.7.2 Non-financial assets

Tangible and intangible assets

The company assesses at each reporting date whether there is an indication that an asset may be impaired. If any indication exists the company estimates the asset's recoverable amount.

An asset's recoverable amount is the higher of an assets net selling price and its value in use. The recoverable amount is determined for an individual asset, unless the asset does not generate cash inflows that are largely independent of those from other assets or groups of assets.

Where the carrying amount of an asset exceeds its recoverable amount, the asset is considered impaired and is written down to its recoverable amount. The impairment loss is recognised in the statement of profit and loss.

In assessing value in use, the estimated future cash flows are discounted to their present value using a pre-tax discount rate that reflects current market assessments of the time value of money and the risks specific to the asset.

In determining net selling price, recent market transactions are taken into account, if available. If no such transactions can be identified, an appropriate valuation model is used.

3.8 Borrowing costs

Borrowing cost includes interest and other costs that company has incurred in connection with the borrowing of funds.

Borrowing costs directly attributable to the acquisition, construction or production of an asset that necessarily takes a substantial period of time to get ready for its intended use or sale are capitalized as part of the cost of the respective asset.

All other borrowing costs are expensed in the year they occur.

Investment income earned on temporary investment of specific borrowing pending their expenditure on qualifying assets is deducted from the borrowing costs eligible for capitalization.

3.9 Employee Benefits

Short term employee benefits for salary that are expected to be settled wholly within 12 months after the end of the reporting period in which employees render the related service are recognized as an expense in the statement of profit and loss.

Retirement benefit in the form of provident fund is a defined contribution scheme. The company has no obligation, other than the contribution payable to the provident fund. The company recognizes contribution payable to the provident fund scheme as an expenditure, when an employee renders the related service.

The company operates two defined benefit plan for its employees, viz., gratuity plan and leave encashment plan. The costs of providing benefits under the plans are determined on the basis of actuarial valuation at

each year-end. Actuarial valuation is carried out using the projected unit credit method made at the end of each reporting date. Re-measurement of the net defined benefit liability (asset) comprise of actuarial gains and losses, the effect of the asset ceiling, excluding amounts included in net interest on the net defined benefit liability (asset) and the return on plan assets (excluding amounts included in net interest on the net defined benefit liability / (asset)). Re-measurement are recognised in other comprehensive income and will not be reclassified to profit or loss in a subsequent period.

3.10 Provisions

A provision is recognized when the company has a present obligation as a result of past event and it is probable that an outflow of resources embodying economic benefits will be required to settle the obligation and a reliable estimate can be made of the amount of the obligation.

If the effect of the time value of money is material, provisions are discounted using a current pre-tax rate that reflects current market assessments of the time value of money and the risks specific to the liability. When discounting is used, the increase in the provision due to the passage of time is recognised as a finance cost.

Provisions are not discounted to their present value and are determined based on the best estimate required to settle the obligation at the reporting date. These estimates are reviewed at each reporting date and adjusted to reflect the current best estimates.

3.11 Contingent Liability

A contingent liability is a possible obligation that arises from past events whose existence will be confirmed by the occurrence or non-occurrence of one or more uncertain future events beyond the control of the company or a present obligation that is not recognized because it is not probable that an outflow of resources will be required to settle the obligation. A contingent liability also arises in extremely rare cases where there is a liability that cannot be recognized because it cannot be measured reliably. The company does not recognize a contingent liability but discloses its existence in the financial statements.

3.12 Contingent Asset

A contingent asset is a possible asset that arises from past events and whose existence will be confirmed only by occurrence or non-occurrence of one or more uncertain future events not wholly within the control of the company. The company does not recognize a contingent asset but discloses its existence in the financial statements.

3.13 Cash and cash equivalent

Cash and cash equivalents for the purposes of cash flow statement comprise cash at bank (including demand deposits) and in hand and short-term, highly liquid investments with original maturities of three months or less that are readily convertible to known amounts of cash and which are subject to an insignificant risk of changes in value.

3.14 Earnings per share

Basic earnings per share is calculated by dividing the net profit or loss for the year attributable to equity shareholders by the weighted average number of equity shares outstanding during the year.

For the purpose of calculating diluted earnings per share, the net profit or loss for the year attributable to equity shareholders and the weighted average number of shares outstanding during the year are adjusted for the effects of all dilutive potential equity shares.

3.15 Lease

Company as lessee

The Company's lease asset classes primarily consist of leases for Office building. The Company assesses whether a contract contains a lease, at inception of a contract. A contract is, or contains, a lease if the contract conveys the right to control the use of an identified asset for a period of time in exchange for consideration. To assess whether a contract conveys the right to control the use of an identified asset, the Company assesses whether: (i) the contract involves the use of an identified asset (ii) the Company has substantially all of the economic benefits from use of the asset through the period of the lease and (iii) the Company has the right to direct the use of the asset.

At the date of commencement of the lease, the Company recognizes a right-of-use (ROU) asset and a corresponding lease liability for all lease arrangements in which it is a lessee, except for leases with a

term of 12 months or less (short-term leases) and low value leases. For these short-term and low-value leases, the Company recognizes the lease payments as an operating expense on a straight-line basis over the term of the lease.

The ROU assets are initially recognized at cost, which comprises the initial amount of the lease liability adjusted for any lease payments made at or prior to the commencement date of the lease plus any initial direct costs less any lease incentives. They are subsequently measured at cost less accumulated depreciation and impairment losses.

ROU assets are depreciated from the commencement date on a straight-line basis over the shorter of the lease term and useful life of the underlying asset.

The lease liability is initially measured at amortized cost at the present value of the future lease payments. The lease payments are discounted using the interest rate implicit in the lease or, if not readily determinable, using the incremental borrowing rates in the country of domicile of these leases.

Lease liability and ROU assets have been separately presented in the Balance Sheet and lease payments have been classified as financing cash flows.

3.16 Segment Reporting

An operating segment is component of the company that engages in the business activity from which the company earns revenues and incurs expenses, for which discrete financial information is available and whose operating results are regularly reviewed by the chief operating decision maker, in deciding about resources to be allocated to the segment and assess its performance. The company's chief operating decision maker is the Managing Director.

Assets and liabilities that are directly attributable or allocable to segments are disclosed under each reportable segment. All other assets and liabilities are disclosed as un-allocable.

Revenue and expenses directly attributable to segments are reported under each reportable segment. All other expenses which are not attributable or allocable to segments have been disclosed as un-allocable expenses.

The company prepares its segment information in conformity with the accounting policies adopted for preparing and presenting the financial statements of the company as a whole.

3.17 Cash Flow Statement

Cash flows are reported using indirect method whereby profit for the period is adjusted for the effects of the transactions of non-cash nature, any deferrals or accruals of past or future operating cash receipts and payments and items of income or expenses associated with investing and financing cash flows. The cash flows from operating, investing and financing activities of the Company are segregated.

3.18 Events after reporting date

Where events occurring after the Balance Sheet date provide evidence of conditions that existed at the end of the reporting period, the impact of such events is adjusted within the financial statements. Otherwise, events after the Balance Sheet date of material size or nature are only disclosed.

4 Recent accounting pronouncements issued but not yet effective

Ministry of Corporate Affairs ("MCA") notifies new standard or amendments to the existing standards. There is no such notification which would have been applicable from April 1, 2021.

GUJARAT STATE FINANCIAL SERVICES LTD.

NOTES TO THE FINANCIAL STATEMENTS FOR THE YEAR ENDED MARCH 31, 2021

5 Cash and Cash Equivalents

(₹ In Lakhs)

Particulars	As at 31-03-2021	As at 31-03-2020
Cash on hand	0.47	0.53
Balances with banks	21249.02	43698.46
Stamp on hand	0.01	0.01
Balance in Government Treasury	0.05	0.05
Total	21249.55	43699.05

6 Loans

(₹ In Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
A Measured at amortised cost		
i Term loans	1196999.12	1184933.22
ii Others		
Employee loan	13.84	2.18
Total (A) - Gross	1197012.96	1184935.40
Less: Impairment loss allowance	-	-
Total (A) - Net	1197012.96	1184935.40
B		
i Secured by tangible assets	13.22	1.67
ii Secured by intangible assets	-	-
iii Covered by bank / Government guarantees	-	-
iv Unsecured	1196999.74	1184933.73
Total (B) - Gross	1197012.96	1184935.40
Less: Impairment loss allowance	-	-
Total (B) - Net	1197012.96	1184935.40
C - I Loans in India		
i Public Sector - Government of Gujarat Entities	1196999.12	1184933.22
ii Others		
Employees	13.84	2.18
Total (C - I) - Gross	1197012.96	1184935.40
Less: Impairment loss allowance	-	-
Total (C - I) - Net	1197012.96	1184935.40
C - II Loans outside India	-	-
Total C (I+II)	1197012.96	1184935.40

Government of Gujarat has issued letter of undertaking towards the loan given to certain GoG entities aggregating to ₹ 60042 lakhs (Previous Year ₹ 38731 lakhs) to the Company.

(₹ in Lakhs)

7 Investments

Investments	March 31, 2021				March 31, 2020			
	Amortised cost	At Fair Value Through Profit or loss	At Fair Value Through Other Comprehensive Income	Total	Amortised cost	At Fair Value Through Profit or loss	At Fair Value Through Other Comprehensive Income	Total
	Liquid/debt schemes of Mutual Funds	0.00	2873811.06	0.00	2873811.06	0.00	2559966.52	0.00
Government Securities	581635.29	0.00	0.00	581635.29	438451.97	0.00	0.00	438451.97
Deposit Placed with Primary Dealers	37961.43	0.00	0.00	37961.43	17116.04	0.00	0.00	17116.04
Debt Securities (Bonds)	40000.00	0.00	0.00	40000.00	40000.00	0.00	0.00	40000.00
Equity instruments	0.00	0.00	227908.74	227908.74	0.00	0.00	152502.51	152502.51
Total - Gross (A)	659596.72	2873811.06	227908.74	3761316.52	495568.01	2559966.52	152502.51	3208037.04
(i) Investment outside India	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
(ii) Investment in India	659596.72	2873811.06	227908.74	3761316.52	495568.01	2559966.52	152502.51	3208037.04
Total - (B)	659596.72	2873811.06	227908.74	3761316.52	495568.01	2559966.52	152502.51	3208037.04
Less: Allowance for impairment loss (C)	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Total - Net D = (A - C)	659596.72	2873811.06	227908.74	3761316.52	495568.01	2559966.52	152502.51	3208037.04

7.1 Till F. Y. 2018 - 2019, Funds / Deposits placed with primary dealers were shown as component of cash and cash equivalents, however from F. Y. 2019 - 2020 the same were considered as Investments.

8 Other Financial Assets (₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
a Interest accrued	16052.99	12906.85
b Security and Other Deposits	37.03	37.00
c Others	1.12	0.84
Total	16091.14	12944.69
8.1 Non Current	40.80	1354.17
8.2 Current	16050.34	11590.52
Total	16091.14	12944.69

9 Property, Plant and Equipment (₹ in Lakhs)**9.1 Property, Plant and Equipments consist of :**

No.	Particulars	Computers	Furniture & Fixtures	Office Equipment	Vehicles	Total
a	Gross Block					
	Balance as at April 01, 2019	29.09	3.35	11.28	42.98	86.70
	Additions	0.86	9.88	5.54	0.00	16.28
	Deductions	1.06	0.12	0.44	0.00	1.62
	Balance as at March 31, 2020	28.89	13.11	16.38	42.98	101.36
	Additions	3.89	1.89	1.51	0.00	7.29
	Deductions	0.79	0.18	0.00	0.00	0.97
	Balance as at March 31, 2021	31.99	14.82	17.89	42.98	107.68
b	Accumulated Depreciation					
	Balance as at April 01, 2019	21.03	0.62	6.28	18.02	45.95
	Additions	3.98	1.54	4.01	7.72	17.25
	Deductions	0.88	0.00	0.42	0.00	1.30
	Balance as at March 31, 2020	24.13	2.16	9.87	25.74	61.90
	Additions	2.52	2.56	3.48	5.06	13.62
	Deductions	0.66	0.11	0.00	0.00	0.77
	Balance as at March 31, 2021	25.99	4.61	13.35	30.80	74.75
c	Net Block					
	Balance as at April 01, 2019	8.06	2.73	5.00	24.96	40.75
	Balance as at March 31, 2020	4.76	10.95	6.51	17.24	39.46
	Balance as at March 31, 2021	6.00	10.21	4.54	12.18	32.93

9.2 Company has elected to measure all its property, plant and equipments at the previous GAAP carrying amount i.e. March 31, 2017 as its deemed cost on the date of transition i.e. April 01, 2017.

10 Other non-financial assets (₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Prepaid Expenses	4.39	3.89
Other advances for Expenses	0.17	0.17
Total	4.56	4.06
10.1 Non Current	0.00	0.00
10.2 Current	4.56	4.06
Total	4.56	4.06

11 Trade Payable**(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
Dues to micro enterprises and small enterprises	4.27	4.43
Due to creditors other than micro enterprises and small enterprises	15.86	15.34
Total	20.13	19.77
Disclosure in respect of Micro and Small Enterprises :		
A the principal amount and the interest due thereon remaining unpaid to any supplier at the end of each accounting year	0.00	0.00
B the amount of interest paid by the buyer in terms of section 16 of the Micro, Small and Medium Enterprises Development Act, 2006, along with the amount of the payment made to the supplier beyond the appointed day during each accounting year	0.00	0.00
C the amount of interest due and payable for the period of delay in making payment (which have been paid but beyond the appointed day during the year) but without adding the interest specified under the Micro, Small and Medium Enterprises Development Act, 2006;	0.00	0.00
D the amount of interest accrued and remaining unpaid at the end of each accounting year	0.00	0.00
E the amount of further interest remaining due and payable even in the succeeding years, until such date when the interest dues above are actually paid to the small enterprise, for the purpose of disallowance of a deductible expenditure under section 23 of the Micro, Small and Medium Enterprises Development Act, 2006.	0.00	0.00

The above information has been compiled in respect of parties to the extent to which they could be identified as Micro and Small Enterprise on the basis of information available with the Company.

12 Deposits**(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
Measured at Amortised Cost		
From Others (GOG entities):		
Inter Corporate Deposits	4093608.42	3732522.20
Liquid deposit	286065.43	193843.44
Total	4379673.85	3926365.64

13 Other Financial Liability**(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
Interest accrued	125426.99	124889.80
Unpaid matured deposits	0.00	1138.37
Amount received against ICD/LDS pending clearance	23.00	13000.00
Total	125449.99	139028.17
13.1 Non Current		
Interest accrued	9122.87	9082.88
13.2 Current		
Interest accrued	116304.12	115806.92
Unpaid matured deposits	0.00	1138.37
Amount received against ICD/LDS pending clearance	23.00	13000.00

14 Provisions**(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
Provision for employee benefits	8.85	5.02
Total	8.85	5.02

14.1 GSFS has received the permission for implementation of the 7th Pay Commission vide FD Resolution No.JNV-01020091173-A dated 21.08.2017. However, the company has not yet received the permission from Government of Gujarat to make payment of differential salary (arrears) to its employees. Hence the provision for contingent liability for differential salary (arrears) for the period from 1st January, 2016 to 31st July, 2017 is not made. It is the general practice of the company to make payment of differential salary (arrears) only after it receives the approval from the State Government and the quantum of provision for the same can be ascertainable only after such permission is received.

15 Other Non-Financial Liabilities**(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
Other Advance Received	2.40	1.94
Others		
Statutory dues	2463.21	3327.73
Total	2465.61	3329.67

16 Equity Share Capital**(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
16.1 Authorized Capital		
20,00,00,000 equity shares of ₹ 10/- each (March 31, 2020: 20,00,00,000)	20000.00	20000.00
16.2 Issued, Subscribed and Paid Up Capital		
13,79,96,059 equity shares of ₹ 10/- each (March 31, 2020 : 13,79,96,059)	13799.61	13799.61
16.3 Reconciliation of number of shares outstanding:		
Equity Shares at the beginning of the year	137996059.00	137996059.00
Add: Issued during the Period	0.00	0.00
Equity Shares at the end of the period	137996059.00	137996059.00

16.4 Rights, preferences and restrictions :

- The Company has only one class of equity shares referred to as equity shares having a par value of ₹ 10/-. Each holder of equity share is entitled to one vote per share.
- Dividends, if any, is declared and paid in Indian Rupees. The dividend, if any, proposed by the Board of Directors is subject to the approval of the shareholders in the ensuing Annual General Meeting.
- In the event of liquidation of the company, the holders of equity shares will be entitled to receive any of the remaining assets of the company, after distribution of all preferential amounts. However, no such preferential amounts exist currently. The distribution will be in proportion to the number of equity shares held by the shareholders.

16.5 Details of shareholders holding more than 5 percent shares :

Name of the Shareholder	As at March 31,	
	2021	2020
	No. of Shares %	No. of Shares %
Governor of Gujarat along with its nominees	106280011.00 77.02%	106280011.00 77.02%
Gujarat State Investments Limited	31716048.00 22.98%	31716048.00 22.98%

16.6 Capital Management

For the purpose of the Company's capital management, capital includes issued equity capital and all other reserves attributable to the equity holders of the Company.

The Company's objective for capital management is to maximize shareholder value and safeguard business continuity. The Company determines the capital requirement based on annual operating plans and other strategic plans. The funding requirements are met through equity and operating cash flows.

Summary of Quantitative Data is given hereunder:

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Equity	13799.61	13799.61
Other Equity	445746.07	337520.84
Total	459545.68	351320.45

The company does not have any externally imposed capital requirement.

17 Other Equity

(₹ in Lakhs)

Particulars	As at March 31, 2021	As at March 31, 2020
17.1 General Reserve		
Balance as per previous balance sheet	2707.97	2707.97
17.2 Reserve fund u/s 45-IC (1) Of Reserve Bank Of India Act, 1934		
Balance as per previous balance sheet	14097.45	5519.50
Addition During the year	8562.00	8577.95
Closing balance	22659.45	14097.45
17.3 Securities Premium		
Balance as per previous balance sheet	139407.89	139407.89
Closing balance	139407.89	139407.89
17.4 Equity Instruments through Other comprehensive Income		
Balance as per previous balance sheet	6092.97	(872.30)
Addition During the year	68871.58	6965.27
Closing balance	74964.55	6092.97
17.5 Retained Earnings		
Balance as per previous balance sheet	170457.39	137527.49
Profit for the period	42808.10	42889.73
Transferred to Reserve fund u/s 45-IC (1) Of Reserve Bank Of India Act, 1934	(8562.00)	(8577.95)
Transfer to impairment reserve	(56.56)	(83.57)
Dividend (P.Y.Including Dividend distribution tax)	(3449.90)	(1291.74)
Items of the OCI for the year, net of tax		
Remasurement benefit of defined benefit plans	(4.55)	(6.57)
Closing balance	201192.48	170457.39
17.6 Impairment Reserve*		
Balance as per previous balance sheet	4757.17	0.00
Addition/(Reduction) During the year	56.56	83.57
Transfer to Impairment Reserve from contingent provision against standard assets of balance lying on April 01, 2019	0.00	4673.60
Closing balance	4813.73	4757.17
*Disclosure in compliance with RBI notification No.RBI/2019-20/170 DOR (NBFC).CC.PD.No.109/22.10.106/2019-20 dated March 13, 2020.		
Total Other Equity	445746.07	337520.84

18 Dividend

(₹ in Lakhs)

Particulars	₹ Per Share	2020-2021	2019-2020
Dividend Proposed and not recognized at the end of reporting period	₹ 2.50 (P.Y.₹ 2.50)	3449.90	3449.90
Dividend (P.Y.Including tax on Dividend) paid during the reporting period	₹ 2.50 (P.Y.₹ 1.00)	3449.90	1291.74

19 Contingent liabilities and Commitments:**19.1 Contingent Liability****(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
Disputed Income Tax Matters	737.17	827.16
Claims against company not acknowledged as debt.	-	-
	737.17	827.16

19.2 Commitments**(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
Estimated amount of contracts remaining to be executed on capital account and not provided for	-	-

20 Revenue From Operations**(₹ in Lakhs)**

Particulars	2020-2021	2019-2020
20.1 Interest income		
On Financial Assets measured at Amortized Cost		
Interest on Loans	87442.19	92242.81
Interest income from Investments	43748.77	39336.41
Interest on funds placed with Primary Dealers	1532.92	2189.33
Interest on Loan Against ICD	0.00	0.53
Total	132723.88	133769.08
20.2 Net gain on Fair value changes		
Net Gain on financial instruments at fair value through profit or loss		
i On Trading Portfolio		
On Investments	179064.19	217471.52
Total Net gain on fair value changes	179064.19	217471.52
ii Fair Value Changes:		
- Unrealised	(517.92)	3560.15
- Realised	179582.11	213911.37
Total Net gain on fair value changes	179064.19	217471.52

21 Other Income**(₹ in Lakhs)**

Particulars	2020-2021	2019-2020
Others		
Gain on derecognition of Property, Plant and Equipment (NET)	0.48	0.71
Income from Lease Rental	0.00	0.97
Interest on Consumer Loan	0.07	0.06
Interest on Vehicle Loan	0.79	0.17
Interest on Income Tax Refund	242.03	0.00
Dividend income from investment measured at FVTOCI		
Related to investmets derecognised during the period	0.00	0.00
Related to investmets held at the end of the period	2610.78	7865.24
Total	2854.15	7867.15

22 Finance Cost**(₹ in Lakhs)**

Particulars	2020-2021	2019-2020
22 Interest expenses on deposits on financial liabilities measured at amortized cost		
Inter Corporate Deposits	252548.48	277631.81
Liquid Deposit	14456.06	20607.54
Total Finance Cost	267004.54	298239.35

23 Employee Benefits Expense**(₹ in Lakhs)**

Particulars	2020-2021	2019-2020
Salaries & Wages	339.54	291.27
Contribution to Provident and other funds	30.36	26.74
Employees Welfare Expenses	13.22	9.84
Total	383.12	327.85

24 Other expenses**(₹ in Lakhs)**

Particulars	2020-2021	2019-2020
Rent, taxes and energy cost	113.99	106.62
Repairs and Manitenance	8.41	9.34
Communication Cost	1.76	5.16
Printing and stationery	4.02	6.94
Advertisement and Publicity	1.58	5.78
Director Fees, allowances & expenses	0.32	4.64
Auditor's Fees and expenses	2.36	2.36
Legal and professional charges	18.82	52.45
Insurance	2.05	2.27
Donation to Chief Minister Relief Fund Account	0.00	850.00
Interest expenses on Income tax	44.86	73.95
Stamp duty expenses	309.64	0.00
Other Expenditure	28.18	32.56
Total	535.99	1152.07
24.1 Payment to auditor		
For Statutory Audit	2.36	2.36
For Certification and other matters	0.00	0.00
Total	2.36	2.36

25 Employee Benefits Note**25.1 Defined Contribution Plans**

Details of amount recognized as expenses during the year for the defined contribution plans. (₹ in Lakhs)

Particulars	2020 - 2021	2019 - 2020
Employer's Contribution to Provident Fund	25.76	22.94
Total	25.76	22.94

25.2 Defined Benefit Plan - Gratuity**Information about the characteristics of defined benefit plan**

The benefit is governed by the Payment of Gratuity Act, 1972. The Key features are as under:

Features of the defined benefit plan	Remarks
Benefit offered	For service Fifteen years or more: One month's Salary for each completed year. Service Ten years or more, but less than fifteen years: 3/4th of a month's salary for each completed year. Service Five years or more, but less than ten years: 15days salary for each completed year
Salary definition	Basic Salary including Dearness Allowance (if any)
Benefit ceiling	Benefit ceiling of ₹ 20,00,000 was applied
Vesting conditions	5 years of continuous service (Not applicable in case of death / disability)
Benefit eligibility	Upon Death or Resignation / Withdrawal or Retirement
Retirement age	58 years

25.3 The trust is responsible for the governance of the plan.

25.4 Risk to the Plan

Following are the risk to which the plan exposes the entity :

A Actuarial Risk:

It is the risk that benefits will cost more than expected. This can arise due to one of the following reasons:

Adverse Salary Growth Experience: Salary hikes that are higher than the assumed salary escalation will result into an increase in Obligation at a rate that is higher than expected.

Variability in mortality rates: If actual mortality rates are higher than assumed mortality rate assumption than the Gratuity benefits will be paid earlier than expected. Since there is no condition of vesting on the death benefit, the acceleration of cashflow will lead to an actuarial loss or gain depending on the relative values of the assumed salary growth and discount rate.

Variability in withdrawal rates: If actual withdrawal rates are higher than assumed withdrawal rate assumption than the Gratuity benefits will be paid earlier than expected. The impact of this will depend on whether the benefits are vested as at the resignation date.

B Investment Risk:

For funded plans that rely on insurers for managing the assets, the value of assets certified by the insurer may not be the fair value of instruments backing the liability. In such cases, the present value of the assets is independent of the future discount rate. This can result in wide fluctuations in the net liability or the funded status if there are significant changes in the discount rate during the inter-valuation period.

C Liquidity Risk:

Employees with high salaries and long durations or those higher in hierarchy, accumulate significant level of benefits. If some of such employees resign / retire from the company there can be strain on the cashflows.

D Market Risk:

Market risk is a collective term for risks that are related to the changes and fluctuations of the financial markets. One actuarial assumption that has a material effect is the discount rate. The discount rate reflects the time value of money. An increase in discount rate leads to decrease in Defined Benefit Obligation of the plan benefits & vice versa. This assumption depends on the yields on the corporate / government bonds and hence the valuation of liability is exposed to fluctuations in the yields as at the valuation date.

E Legislative Risk:

Legislative risk is the risk of increase in the plan liabilities or reduction in the plan assets due to change in the legislation / regulation. The government may amend the Payment of Gratuity Act thus requiring the companies to pay higher benefits to the employees. This will directly affect the present value of the Defined Benefit Obligation and the same will have to be recognized immediately in the year when any such amendment is effective.

25.5 Reconciliation of defined benefit obligations

(₹ in Lakhs)

Particulars	As at March 31,	
	2021	2020
Defined benefit obligations as at beginning of the year	133.95	148.17
Current service cost	5.63	5.70
Interest cost	8.16	8.33
Actuarial Loss/(Gain) due to change in financial assumptions	4.84	1.82
Actuarial Loss/(Gain) due to experience	(0.55)	3.54
Past Service Cost	0.00	0.00
Benefits Paid	(3.70)	(33.61)
Defined benefit obligations as at end of the year	148.33	133.95

25.6 Reconciliation of Plan Asset

(₹ in Lakhs)

Particulars	As at March 31,	
	2021	2020
Plan Asset as at beginning of the year	138.17	148.97
Interest Income	9.19	10.23
Return on plan assets excluding amounts included in interest income	(0.26)	(1.21)
Contributions by Employer	5.99	13.79
Benefits paid	(3.70)	(33.61)
Plan Asset as at end of the year	149.39	138.17

25.7 Funded Status

(₹ in Lakhs)

Particulars	As at March 31,	
	2021	2020
Present Value of Benefit Obligation at the end of the Period	148.33	133.95
Fair Value of Plan Assets at the end of the Period	149.39	138.17
Funded Status / Deficit	(1.06)	(4.22)

25.8 Net amount Charged to Statement of Profit or Loss for the period

(₹ in Lakhs)

Particulars	2020-2021	2019-2020
Current Service Cost	5.63	5.70
Past Service Cost	0.00	0.00
Net Interest cost	(1.03)	(1.90)
Net amount recognized	4.60	3.80

25.9 Other Comprehensive income for the period

(₹ in Lakhs)

Particulars	2020-2021	2019-2020
Components of actuarial gain/losses on obligations:		
Due to Change in financial assumptions	4.84	1.82
Due to change in demographic assumption	0.00	0.00
Due to experience adjustments	(0.55)	3.54
Return on plan assets excluding amounts included in interest income	0.26	1.21
Amounts recognized in Other Comprehensive Income	4.55	6.57

25.10 Break up of Plan Assets

Particulars	As at March 31,	
	2021	2020
Policy of Insurance	100.00%	100.00%
Total	100.00%	100.00%

25.11 Actuarial Assumptions

Particulars	As at March 31, 2021	As at March 31, 2020
Discount Rate	6.20%	6.60%
Salary Growth Rate	7%	3% p.a. for next 1 year and 7% p.a. thereafter
Withdrawal Rate	3% at younger ages reducing to 1% at older ages	3% at younger ages reducing to 1% at older ages

25.12 Sensitivity Analysis for Actuarial Assumption

As at 31.03.2021	Change in Assumptions		Impact on Defined Benefit Obligation			
	Increase	Decrease	Increase in Assumptions		Decrease in Assumptions	
	%	%	₹ in Lakhs	%	₹ in Lakhs	%
Discount Rate	0.50%	0.50%	(4.07)	-2.74%	4.26	2.87%
Salary Growth Rate	0.50%	0.50%	0.45	0.30%	(0.41)	-0.28%
Withdrawal rate	10.00%	10.00%	0.28	0.19%	(0.27)	-0.18%

As at 31.03.2020	Change in Assumptions		Impact on Defined Benefit Obligation			
	Increase	Decrease	Increase in Assumptions		Decrease in Assumptions	
	%	%	₹ in Lakhs	%	₹ in Lakhs	%
Discount Rate	0.50%	0.50%	(3.98)	-2.97%	4.17	3.11%
Salary Growth Rate	0.50%	0.50%	1.25	0.93%	(1.06)	-0.79%
Withdrawal rate	10.00%	10.00%	0.33	0.25%	(0.33)	-0.25%

Limitation of method used for sensitivity analysis :

Sensitivity analysis produces the results by varying a single parameter & keeping all the other parameters unchanged. Sensitivity analysis fails to focus on the interrelationship between underlying parameters. Hence, the results may vary if two or more variables are changed.

25.13 Details of Asset- Liability Matching Strategy

There are no minimum funding requirements for a Gratuity benefits plan in India and there is no compulsion on the part of the Company to fully or partially pre-fund the liabilities under the Plan. The trustees of the plan have outsourced the investment management of the fund to an insurance company. The insurance company in turn manages these funds as per the mandate provided to them by the trustees and the asset allocation which is within the permissible limits prescribed in the insurance regulations. Due to the restrictions in the type of investments that can be held by the fund, it may not be possible to explicitly follow an asset-liability matching strategy to manage risk actively in a conventional fund.

25.14 Maturity Profile of the Defined Benefit Obligation

As at March 31, 2021	₹ in lakhs	%
2022	3.84	1.80%
2023	22.64	10.50%
2024	3.42	1.60%
2025	51.52	23.90%
2026	37.43	17.40%
2027 - 2031	52.19	24.20%
As at March 31, 2020	₹ in lakhs	%
2021	3.78	1.90%
2022	3.73	1.80%
2023	22.05	10.80%
2024	3.27	1.60%
2025	49.39	24.20%
2026 - 2030	84.01	41.10%

26 Income Tax expense**26.1 Income tax expense in the statement of profit and loss comprises of:****(₹ in Lakhs)**

Particulars	2020 - 2021	2019 - 2020
Current income tax in statement of profit and loss	11247.19	13241.62
Adjustments related to earlier year tax	(955.22)	4.80
Deferred tax in statement of profit and loss		
Relating to origination and reversal of temporary difference	(8045.12)	2877.65
Deferred tax expense / (income)	(8045.12)	2877.65
Income tax expense	2246.85	16124.07

26.2 Deferred tax items relating to OCI**(₹ in Lakhs)**

Particulars	2020 - 2021	2019 - 2020
Relating to origination and reversal of temporary difference	6534.65	3741.30
Deferred tax expense / (income)	6534.65	3741.30

26.3 The details of income tax assets and liabilities and Deferred tax liabilities :**(₹ in Lakhs)**

Particulars	March 31, 2021	March 31, 2020
Income tax assets	(12900.80)	(29383.61)
Income tax liabilities	11391.10	27410.88
Net Income Tax (Assets) / Liability	(1509.70)	(1972.73)
Deferred tax (Assets) / Liability	30053.25	31563.71

26.4 A reconciliation of the income tax provision to the amount computed by applying the statutory income tax rate to the income before income taxes is summarized below: (₹ in Lakhs)

Particulars	2020 - 2021	2019 - 2020
a Accounting profit before tax	45054.95	59013.80
Normal tax rate	25.168%	34.944%
Tax liability on accounting profit	11339.43	20621.79
Tax Effect of non deductible expenses	575.31	973.81
Tax Effect of deductible expenses	(667.55)	(4360.02)
MAT credit utilization	0.00	(3993.96)
Income tax expenses as per normal tax rate	11247.19	13241.62

26.5 During the year Company has elected to pay tax u/s 115BAA, hence applicable tax rate is 25.168% as against 34.944% during the previous year.

26.6 Details of each type of recognized temporary differences, unused tax losses and unused tax credits:

(₹ in Lakhs)

Particulars	Recognized DTA / DTL in balance sheet	
	March 31, 2021	March 31, 2020
Deferred tax liability		
Liquid/debt schemes of Mutual Funds	20262.84	28314.50
Investment	9807.41	3272.76
Total Deferred tax liability	30070.25	31587.26
Deferred tax asset		
Property, plant and equipment	14.77	21.80
Employee benefits	2.23	1.75
Total Deferred tax asset	17.00	23.55
Net Deferred Tax Liability / (Assets) Recognized	30053.25	31563.71

27 Financial Instruments

27.1 Disclosure of Financial Instruments by Category

(₹ in Lakhs)

As at March 31, 2021

Financial instruments by categories	Note No.	FVTPL	FVTOCI	Amortized cost	Total Carrying Value	Fair Value
Financial Assets						
Cash and Cash Equivalents	5			21249.55	21249.55	21249.55
Loans	6			1197012.96	1197012.96	1197012.96
Investment in Liquid/debt schemes of Mutual Funds	7	2873811.06		0.00	2873811.06	2873811.06
Investment in Government Securities	7			581635.29	581635.29	619125.20
Investment in Debt Securities	7			40000.00	40000.00	40000.00
Investment in Equity Shares	7		227908.74	0.00	227908.74	227908.74
Deposit Placed with Primary Dealers	7			37961.43	37961.43	37961.43
Other Financial Assets	8			16091.14	16091.14	16091.14
Total Financial Assets		2873811.06	227908.74	1893950.37	4995670.17	5033160.08
Financial Liabilities						
Trade Payables	11			20.13	20.13	20.13
Deposits	12			4379673.85	4379673.85	4379673.85
Other Financial Liabilities	13			125449.99	125449.99	125449.99
Total Financial Liabilities		0.00	0.00	4505143.97	4505143.97	4505143.97

As at March 31, 2020

(₹ in Lakhs)

Financial instruments by categories	Note No.	FVTPL	FVTOCI	Amortized cost	Total Carrying Value	Fair Value
Financial Assets						
Cash and Cash Equivalents	5			43699.05	43699.05	43699.05
Loans	6			1184935.40	1184935.40	1184935.40
Investment in Liquid/debt schemes of Mutual Funds	7	2559966.52		0.00	2559966.52	2559966.52
Investment in Government Securities	7			438451.97	438451.97	477236.31
Investment in Debt Securities	7			40000.00	40000.00	40000.00
Investment in Equity Shares	7		152502.51	0.00	152502.51	152502.51
Deposit Placed with Primary Dealers	7			17116.04	17116.04	17116.04
Other Financial Assets	8			12944.69	12944.69	12944.69
Total Financial Assets		2559966.52	152502.51	1737147.15	4449616.18	4488400.52
Financial Liabilities						
Trade Payables	11			19.77	19.77	19.77
Deposits	12			3926365.64	3926365.64	3926365.64
Other Financial Liabilities	13			139028.17	139028.17	139028.17
Total Financial Liabilities		0.00	0.00	4065413.58	4065413.58	4065413.58

27.2 The company invested in equity shares of various companies as per the directives of Finance Department of Government of Gujarat during F.Y. 2018-19. The investment being considered as strategic, the company has classified such investment as not held for trading. In view of this, such investments are measured as fair value through other comprehensive income.

28 Fair Value Measurement

Fair Value Measurement (FVM) of Financial Assets and Liabilities

28.1 Fair value hierarchy

(₹ in Lakhs)

As at March 31, 2021	Note No.	Level 1	Level 2	Level 3	Total
Financial Assets Measured at FVTPL - Recurring FVM					
Investments in Liquid/debt schemes of Mutual Funds	7	2873811.06			2873811.06
		2873811.06	0.00	0.00	2873811.06
Financial Assets measured at Amortized Cost - Recurring FVM					
Investments in Government Securities		619125.20			619125.20
Investments in Debt Securities		40000.00			40000.00
Deposit Placed with Primary Dealers		37961.43			37961.43
		697086.63	0.00	0.00	697086.63
Financial Assets Measured at FVTOCI - Recurring FVM					
Investments in Equity Shares		211129.74	16779.00		227908.74
		211129.74	16779.00	0.00	227908.74

(₹ in Lakhs)

As at March 31, 2020	Note No.	Level 1	Level 2	Level 3	Total
Financial Assets Measured at FVTPL - Recurring FVM					
Investments in Liquid/debt schemes of Mutual Funds	7	2559966.52			2559966.52
		2559966.52	0.00	0.00	2559966.52
Financial Assets measured at Amortized Cost - Recurring FVM					
Investments in Government Securities		477236.31			477236.31
Investments in Debt Securities		40000.00			40000.00
Deposit Placed with Primary Dealers		17116.04			17116.04
		534352.35	0.00	0.00	534352.35
Financial Assets Measured at FVTOCI - Recurring FVM					
Investments in Equity Shares		137865.51	14637.00		152502.51
		137865.51	14637.00	0.00	152502.51

28.2 Fair Value of Investments in Government Securities, Liquid/debt schemes of Mutual Funds and Equity Shares, except equity shares of Gujarat State Petroleum Corporation Limited (GSPC), are based on quoted prices.

28.3 Valuation technique and inputs used to determine fair value in level 2

Fair Value of Investment in shares of GSPC is based on the Valuation report of the Registered Valuer (C.Y. ₹ 9.87, P.Y. ₹ 8.61) per Equity Share as these shares are unlisted.

28.4 The Fair value of Loan given approximate carrying value as the interest rate of the said instruments are at the prevailing market rate of interest.

28.5 The carrying amount of financial liabilities carried at amortized cost are a reasonable approximation of their fair values since the Company does not anticipate that the carrying amounts would be significantly different from the values that would eventually be received or settled.

28.6 The Fair value of current financial assets and current financial Liabilities measured at amortised cost are considered to be the same as their carrying amount because they are of short term nature.

28.7 There are no transfer between level 1 and level 2 during the year.

28.8 The policy of the company is to recognise transfers into and transfer out of fair values hierarchy levels as at the end of the reporting period.

29 Financial Risk Management

29.1 Financial Instruments Risk management objectives and Policies

The Company has the principal mandate of management of surplus Funds of GoG entities. It endeavours to fulfil its objective of providing maximum benefit to the GoG entities while operating in the changing nature of financial markets. This warrants an active operations of funds management. Since the company is engaged in financial activities, it is exposed to financial risks i.e. market risk, liquidity risk and credit risk. These risks are monitored and managed by the Management under the overall policy formulation of the Board. The Credit and Investment norms of the Company are formulated by the Board so as to mitigate the financial risks and at the same time to fulfil the unique nature of objectives of the Company. Periodically the Board reviews financial market conditions and gives appropriate directions, whenever required. The Finance Committee, a sub-Committee of the Board, is delegated with the task of sanctioning various credit and investment proposals which are within the norms specified by the Board. Such sanctions are put up before the Board for ratification in a well laid out mechanism through which the board oversees the Compliance framework of the Company.

29.2 Market Risk

The market risk is the risk that the fair value or future cash flows of a financial instrument will fluctuate because of changes in market prices. Market risk comprises interest risk and other price risk.

29.2.1 Interest Rate Risk

Interest rate risk is the risk that fair value or future cash flows of a financial instrument will fluctuate because of changes in market interest rates. The company has no interest rate risk on borrowed fund in the form of Inter Corporate Deposits (ICDs), Liquid Deposit scheme (LDS), investments in Gujarat Government Securities and Municipal Corporation Bonds as rate of interest on the same is fixed during its tenure. In case of lending activities, the company offers floating interest rates on loans to entities controlled by Government of Gujarat and funds placed with primary dealers carry variable rate of interest. Therefore, these are covered under interest rate risk. The Company measures risk through sensitivity analysis.

The company's exposure to interest rate risk is as follows :

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Assets		
Loans to entities controlled by Government of Gujarat	1196999.12	1184933.22
Deposit with Primary Dealers	37961.43	17116.04
	1234960.55	1202049.26

Sensitivity Analysis

(₹ in Lakhs)

Particulars	Impact on Profit and Loss after tax	
	March 31, 2021	March 31, 2020
Assets		
Interest rate increase by 50 basis point	4621	3910
Interest rate decrease by 50 basis point	(4621)	(3910)

29.2.2 Other price risk

Price risk is the risk that the fair value or future cash flows of a financial instrument will fluctuate because of changes in market prices (other than those arising from interest rate risk). The company deploys its daily surplus funds in the Liquid and Debt schemes of mutual funds that are regulated by SEBI. The company is exposed to price risk mainly because of changes in NAVs of units of mutual funds, which are marked to market on daily basis as per guidelines of the Regulator. The company mitigates the risk by diversifying its deployment in various Liquid / Debt schemes of mutual funds. The company measures risk through sensitivity analysis.

a The company's exposure to price risk is as follows:

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Investments in Liquid/debt schemes of Mutual Funds	2873811.06	2559966.52
Investments in Equity Shares	227908.74	152502.51
Total	3101719.80	2712469.03

b Sensitivity Analysis

(₹ in Lakhs)

Particulars	Impact on Profit after Tax	
	March 31, 2021	March 31, 2020
NAV/Share Price increases by 0.5%	11605	8823
NAV/Share Price decreases by 0.5%	(11605)	(8823)

29.3 Liquidity Risk

Liquidity risk is the risk that an entity will encounter difficulty in meeting obligations associated with financial liabilities that are settled by delivering cash or another financial assets. The Company's approach to managing liquidity is to ensure, as far as possible, that it will always have sufficient liquidity to meet its liabilities when due without incurring unacceptable losses or risking damage to the Company's reputation. The Company's principal source of liquidity are cash and cash equivalents and the cash flow that is generated from operations. The Company ensures that it has sufficient fund to meet lending activities, servicing of financial obligations and expected operational expenses. The Company deploys sufficient portion of its funds into the Money Market instruments which are available at very short notice and can be used to honour even the sudden demands of large repayments from its depositors. The Company closely monitors its liquidity position and manages its receipts and repayments from / to GoG entities in an optimal manner.

The table below provide details regarding the contractual maturities of financial liabilities as at:

(₹ in Lakhs)

As at March 31, 2021	Contractual Maturity	upto 1 year	1 - 2 years	2 - 5 years	> 5 years
Deposits	4379673.85	4055786.31	209829.72	114057.81	-
Other Financial liabilities	125449.99	116327.12	5910.23	3212.64	-
Trade Payables	20.13	20.13	-	-	-
	4505143.97	4172133.56	215739.95	117270.45	
As at March 31, 2020	Contractual Maturity	upto 1 year	1 - 2 years	2 - 5 years	> 5 years
Deposits	3926365.64	3636618.73	161700.0	128046.91	-
Other Financial liabilities	139028.17	129945.29	5068.92	4013.97	-
Trade Payables	19.77	19.77	-	-	-
	4065413.58	3766583.79	166768.92	132060.88	

29.4 Credit Risk

Credit risk is the risk that one party to a financial instrument will cause a financial loss for the other party by failing to discharge an obligation. Credit risk encompasses both, the direct risk of default and the risk of deterioration of credit worthiness. Credit risk arises primarily from financial assets such as investments in government securities, funds placed with primary dealers, investments in liquid/debt schemes of mutual funds, loans and cash and cash equivalent. Credit risk arising from funds placed with primary dealers, investments in liquid/debt schemes of mutual funds and cash and cash equivalent is limited as the counterparties are banks and recognized Assets Management Companies which are regulated by RBI and SEBI. Credit risk arising from investments in government securities and loans is limited as the exposure in the Government Securities of Gujarat State Development Loans and the loans provided to the GoG entities have the parentage of the State Government which provides adequate comfort to the company against the credit risk.

The maximum exposure to the credit risk is as follows :

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Cash and Cash Equivalents	21249.55	43699.05
Loans	1197012.96	1184935.40
Investment in Liquid/debt schemes of Mutual Funds	2873811.06	2559966.52
Investment in Government Securities	581635.29	438451.97
Investment in Equity Shares	227908.74	152502.51
Investment in Debt Securities (Bonds)	40000.00	40000.00
Funds with Primery Dealers	37961.43	17116.04
Other Financial Assets	16091.14	12944.69
	4995670.17	4449616.18

The table below shows the credit quality based on credit concentration and the maximum exposure to credit risk based on the days past due and year-end stage classification of Loans. The amounts presented are gross of impairment allowances.

(₹ in Lakhs)

Loan amount	As on March 31, 2021				
	Not overdue	Stage 1	Stage 2	Stage 3	Total
Loan given to Government of Gujarat Entities	1196999.12	0	0	0	1196999.12
Impairment Allowances as per ECL Method	0	0	0	0	0
Provision for impairment allowance as per RBI Regulations	4813.73	0	0	0	4813.73

Loan amount	As on March 31, 2020				
	Not overdue	Stage 1	Stage 2	Stage 3	Total
Loan given to Government of Gujarat Entities	1184933.22	0	0	0	1184933.22
Impairment Allowances as per ECL Method	0	0	0	0	0
Provision for impairment allowance as per RBI Regulations	4757.17	0	0	0	4757.17

The COVID – 19 impact on global and Indian Financial Markets as well as global and local economic activities will depend on the future developments, which are highly uncertain. However, the Company is expecting that the possible effects due to COVID – 19 on the financial position and performance of the company may not be significant as the Company has financed only to the Government of Gujarat companies.

The company has also considered the possible effects that may result from the COVID – 19 on the carrying amount of investments in liquid/debt schemes of mutual funds, equity shares, funds with primary dealers and debt securities based on the internal and external source of information up to the date of approval of the financial statements. The company expects that the carrying amount of these assets will be recovered.

- 30** The Company has recognised lease payment of ₹ 101.99/- Lakhs (Previous Year ₹ 94.87/- Lakhs) in the statement of profit and loss under the head "Rent" during the year for low value leases.

31 Earning Per Share

Particulars	March 31, 2021	March 31, 2020
Number of Equity Shares at the beginning of the year	137996059	137996059
Addition During the year	0	0
Number of Equity Shares at year end	137996059	137996059
Weighted Average number of Equity Shares	137996059	137996059

Particulars	Units	2020-2021	2019-2020
Weighted Average number of Equity shares for calculation of Basic EPS (A)	Shares	137996059	137996059
Add: Dilutive effect if any		-	-
Weighted Average number of Equity shares for calculation of Diluted EPS (B)	Shares	137996059	137996059
Nominal Value per Share	₹ / Share	10	10
Net Profit after Tax (C)	₹ in lakhs	42808.10	42889.73
Basic EPS (C/A)	₹ / Share	31.02	31.08
Diluted EPS (C/B)	₹ / Share	31.02	31.08

32 Segment Reporting

The company is engaged in financial activity and all other activities of the company revolve around the main business and therefore there are no reportable segments.

33 Disclosure of Corporate Social Responsibility (CSR) activities u/s 135 of the Companies Act, 2013 is as under:

- Gross Amount required to be spent by the Company towards Corporate Social Responsibility (CSR) Activity during the year is ₹ 576.53 lakhs (P.Y. ₹ 357.43 lakhs).
- Amount spent on Corporate Social Responsibility (CSR) Activity during the year :

(₹ in Lakhs)

Sr.No.	Particulars	2020-2021		
		In Cash	Yet to be paid in Cash	Total
(i)	Construction / acquisition of any assets	0.00	0.00	0.00
(ii)	On purpose other than (i) above Contribution to "Chief Minister Relief Fund" for CSR activity	1650.00	0.00	1650.00
(iii)	Expenditure on Administrative Overheads for CSR	0.00	0.00	0.00
	Total	1650.00	0.00	1650.00

Sr.No.	Particulars	2019-2020		
		In Cash	Yet to be paid in Cash	Total
(i)	Construction / acquisition of any assets	0.00	0.00	0.00
(ii)	On purpose other than (i) above Contribution to "Mukhya Mantri Swachta Nidhi" for CSR activity	357.43	0.00	357.43
(iii)	Expenditure on Administrative Overheads for CSR	0.00	0.00	0.00
	Total	357.43	0.00	357.43

34 Related Parties Disclosure as per Ind AS 24 :**34.1 Related Parties**

Name of Related Parties	Relationship
Government of Gujarat	Controlling the company
Gujarat State Investments Limited	Entity having significant influence over the reporting entity (w.e.f. March 22, 2019)
Shri K. Kailashnathan, IAS	Chairman
Shri Pankaj Joshi, IAS	Managing Director
Shri Milind Torawane, IAS	Nominee Director

Smt. Arti Kanwar, IAS	Nominee Director
Shri Yamal Vyas	Independent Director (till March 22, 2020)
Shri Sunil Talati	Independent Director (w.e.f. July 15, 2020)
Shri Bhadresh Mehta	Independent Director
Shri Kamlesh K. Patel	Nominee Director (till October 6, 2020)
Shri Mehul K. Vasava	Nominee Director (w.e.f. October 14, 2020)
Shri Nitin Shah, Chief Financial Officer	Key Managerial Personnel
Shri Anil Maloo, Company Secretary	Key Managerial Personnel (till October 6, 2020)
Shri Neeraj Jain, Company Secretary	Key Managerial Personnel (w.e.f. October 7, 2020)

34.2 As per Ind AS 24, another entity is a related party if the same government has control or joint control of, or significant influence over, both the company and the other entity. In view of this, transactions entered by the Company with other entities, which are controlled by the Government of Gujarat, are considered as transactions with related parties.

34.3 As per Ind AS 24, the company is required to disclose sufficient details for each individually significant transaction and other transactions that are collectively significant but not individually.

The Company determines significant transaction based on facts and circumstances of each case. In deciding whether an individual transaction is significant, the nature and the size of the transaction are evaluated together. Depending on the circumstances, either the nature or the size of the transaction could be the determining factor. As regards size, for the purpose of applying the test of significant transaction, all same type of transactions with one related party entered during the year which is in excess of 10% of total related party transactions of that type is considered as significant. As regards nature, ordinarily the related party transactions which are not entered in the normal course of the business of the Company are considered significant subject to the facts and circumstances of the case.

As regards collectively significant transactions but not individually, all same type of related party transactions, other than individually significant transaction, entered during the year which is in excess of 10% of total related party transactions of that type is considered as significant.

34.4 Disclosure of related party transactions.

34.4.1 Transactions with Government of Gujarat and entities controlled by Government of Gujarat.

a Loan Given

i Transaction during the year

Loan Disbursed

(₹ in Lakhs)

Particulars	2020-2021	2019-2020
Gujarat Energy Transmission Corporation Limited	324400.00	57000.00
Gujarat State Petroleum Corporation Limited	0.00	110000.00
Gujarat State Petronet Limited	51200.00	4000.00
Gujarat International Finance Tec-City Co Ltd.	98100.00	0.00
Gujarat State Fertilizers & Chemicals Ltd	25000.00	362800.00
Gujarat State Electricity Corporation Limited	0.00	2000.00
GSPC LNG Limited	48100.00	95200.00
GSPC Pipavav Power Company Limited	1000.00	90146.41
Other borrowers with collectively significant transactions and not individually	149642.00	163221.01
	697442.00	884367.42

ii Balance outstanding

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Gujarat Energy Transmission Corporation Limited	407547.06	167176.47
Sardar Sarovar Narmada Nigam Limited	194259.26	299444.44
Gujarat State Petroleum Corporation Limited	162400.00	210000.00
Gujarat State Petronet Limited	38633.33	114000.00
Gujarat State Electricity Corporation Limited	40796.29	76101.85
GSPC Pipavav Power Company Limited	70553.33	86048.85
Other borrowers with collectively significant closing balance and not individually	282809.85	232161.61
	1196999.12	1184933.22

b Investments in Government of Gujarat Securities**i Transaction during the year**

Company purchases securities of Government of Gujarat from the open market, hence the same are not considered as related party transactions.

ii Outstanding balances

As Government of Gujarat is controlling the company, investments in Gujarat Government securities are disclosed herewith.

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Securities of Government of Gujarat	581635.29	438451.97
Bonds of Municipal Corporation	40000.00	40000.00

c ICDs taken**i Transactions during the year**

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Depositors with collectively significant transactions and not individually	9159507.42	8683327.03

ii Balance outstanding

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Gujarat Industrial Development Corporation	422102.32	355163.08
Depositors with collectively significant closing balances and not individually	3678448.20	3384565.17
	4100550.52	3739728.25

d Liquid Deposits Taken**i Transactions during the year**

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Gujarat Municipal Finance Board	552773.92	818694.94
Gujarat Gas Limited	734225.00	792185.00
Gujarat Urban Development Mission	26122.20	65920.78
Gujarat State Petroleum Corporation Limited	1340060.00	1188893.15
Other Depositors with collectively significant transactions and not individually	1674972.24	1230697.20
	4328153.36	4096391.07

ii Balance outstanding

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Gujarat Municipal Finance Board	12247.28	10239.51
Gujarat Urban Development Company Limited	15510.70	22543.91
Gujarat Urban Development Mission	1874.19	1179.86
Gujarat Alkalies and Chemicals Ltd	33000.00	0.00
Gujarat Urban Livelihood Mission	5443.74	3007.18
Gujarat State Civil Supplies Corporation Limited	2500.00	12200.00
Gujarat State Petroleum Corporation Limited	1231.80	20143.15
Gujarat Gas Limited	26100.00	38250.00
Gujarat Council of Primary Education	44700.00	44700.00
Depositors with collectively significant outstanding balances and not individually	143457.72	41579.83
	286065.43	193843.44

e Interest Income

(₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Government of Gujarat Securities	40331.73	35901.97
Gujarat Energy Transmission Corporation Limited	27297.03	15241.72
Gujarat State Petroleum Corporation Limited	14011.04	15111.86
Gujarat State Electricity Corporation Limited	3817.34	6442.20
Sardar Sarovar Narmada Nigam Limited	16009.94	26905.92
Gujarat State Petronet Limited	5701.05	13764.29
Other borrowers with collectively significant closing balance and not individually	20605.79	14776.82
	127773.92	128144.78

f Interest Expenses on ICDs (₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Gujarat Industrial Development Corporation	26892.25	22818.74
Depositors with collectively significant interest expenses and not individually	225656.24	254813.07
	252548.49	277631.81

g Interest Expenses on Liquid Deposits (₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Gujarat Municipal Finance Board	2953.03	6278.24
Gujarat Urban Development Mission	161.47	889.59
Gujarat Council of Primary Education	1826.27	2713.19
Gujarat Gas Limited	1773.78	1740.43
Depositors with collectively significant interest expenses and not individually	7741.51	8986.09
	14456.06	20607.54

h Rent Expenses (₹ in Lakhs)

Particulars	March 31, 2021	March 31, 2020
Gujarat Mineral Development Corporation	101.99	94.87

34.4.2 There are no transactions other than sitting fees paid to non-executive directors. During the year, ₹ 0.24 lakhs (P.Y ₹ 0.18 lakhs) was paid to non-executive directors towards sitting fees. Details are as under: (₹ in Lakhs)

Name of Directors	2020-2021	2019-2020
1) Shri Bhadresh Mehta	0.15	0.03
2) Shri Sunil Talati	0.09	0.00
2) Shri Yamal Vyas	0.00	0.15

34.4.3 Compensation of Key Managerial Personnel of the Company (₹ in Lakhs)

Particulars	Managing Director	
	2020-2021	2019-2020
Short Term Employee Benefits	0.00	0.70
Post employment benefits	0.00	0.00
Termination Benefits	0.00	0.00
Share Based Payments	0.00	0.00
Total Compensation of Key Managerial Personnel	0.00	0.70

(₹ in Lakhs)

Particulars	Short Term Employee Benefits	Post employment benefits	Termination Benefits	Share Based Payments
2020-2021				
Shri Nitin Shah	24.90	0.00	0.00	0.00
Shri Anil Maloo (till to 06.10.2020)	7.58	6.54	0.00	0.00
Shri Neeraj Jain (w.e.f. 07.10.2020)	4.53	0.00	0.00	0.00
2019-2020				
Shri Nitin Shah	21.79	0.00	0.00	0.00
Shri Anil Maloo	13.90	0.00	0.00	0.00
Shri Neeraj Jain	0.00	0.00	0.00	0.00

35 As per the Master Direction DNBR. PD. 008/03.10.119/2016-17 dated September 01, 2016 (Updated as on February 17, 2020) issued by Reserve Bank of India, Government NBFCs confirming to Section 2 (45) of the Companies Act, 2013 are exempt from applicability of the Systemically Important Non-Banking Financial (Non-Deposit Accepting or Holding) Companies Prudential Norms (Reserve Bank) Directions, 2015 of the RBI Act till the issuance of further notification no.DNBR (PD) CC No.092/03.10.001/2017-18 dated May 31, 2018 where in RBI has withdrawn exemptions granted to Government Owned NBFCs from adherence to prudential norms and other regulatory & statutory provisions. During the financial year under consideration there is no NPA /Restructured advances. The Company has not restructured any loan after applicability of the above mentioned notification dated May 31, 2018.

35.1 Disclosure in terms of Master Direction - Non-Banking Financial Company - Systemically Important Non-Deposit taking Company and Deposit taking Company (Reserve Bank) Directions, 2016 dated September 1, 2016 updated as on February 17, 2020.

35.1.1

Particulars	31.03.2021	31.03.2020
i) CRAR (%)	7.57%	7.44%
ii) CRAR - Tier I Capital (%)	7.57%	7.44%
iii) CRAR - Tier II Capital (%)	0.00%	0.00%
iv) Amt of subordinated debt raised as Tier-II capital	0	0
v) Amt raised by issue of Perpetual Debt Instruments	0	0

35.1.2 Investments

(₹ in Lakhs)

Particulars	2020-21	2019-20
(1) Value of Investments		
(i) Gross Value of Investments		
(a) In India	3761316.52	3208037.03
(b) Outside India	0	0
(ii) Provisions for Dep.		
(a) In India	0	0
(b) Outside India	0	0
(iii) Net Value of Investments		
(a) In India	3761316.52	3208037.03
(b) Outside India	0	0
(2) Movement of provisions held towards Dep.	0	0
(i) Opening balance	0	0
(ii) Add : Provisions made during the year	0	0
(iii) Less : Write-off / write-back of excess provisions during the year	0	0
(iv) Closing balance	0	0

35.1.3 Maturity Pattern of Assets and Liabilities

(₹ in Lakhs)

Particulars	Assets		Liabilities	
	Loans / Advances to GOG entities	Investments	Borrowings from GoG entities	Foreign Currency Assets / Liabilities
1 day to 7 days	2597.77	3101976.35	598396.67	
8 day to 14 days	8715.64	6133.73	268764.42	
15 days to 30/31 days	22785.47	5921.94	385446.73	-
Over 1 month to 2 months	30960.06	17078.02	550945.17	-
Over 2 month to 3 months	44659.20	15093.16	337391.01	-
Over 3 month to 6 months	91790.51	3111.15	905482.71	-
Over 6 month to 1 year	184797.73	0.00	1125686.71	-
Over 1 year to 3 years	330968.73	60000.00	333010.41	-
Over 3 year to 5 years	226730.12	53215.20	0.00	-
Over 5 years	259411.11	507822.40	0.00	-
Total	1203416.34	3770351.96	4505123.84	0

35.1.4 Exposures**a) Exposure to Real Estate Sector :-**

(₹ in Lakhs)

Category	2020-21	2019-20
Direct Exposure		
Residential Mortgage	NIL	NIL
Commercial Real Estate	NIL	NIL
Investment in Mortgage backed Securities and other Securitised Exposure	NIL	NIL
Indirect Exposure		
Fund based and non fund based exposure on National Housing Bank (NHB) and Housing Finance Companies (HFCs)	NIL	NIL

b) Exposure to Capital Market :-**(₹ in Lakhs)**

Particulars	2020-21	2019-20
(i) direct investment in equity shares, convertible bonds, convertible debentures and units of equity-oriented mutual funds the corpus of which is not exclusively invested in corporate debt;	227908.74	152502.51
(ii) advances against shares / bonds / debentures or other securities or on clean basis to individuals for investment in shares (including IPOs / ESOPs), convertible bonds, convertible debentures, and units of equity-oriented mutual funds;	0	0
(iii) advances for any other purposes where shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds are taken as primary security;		
(iv) advances for any other purposes to the extent secured by the collateral security of shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds i.e. where the primary security other than shares / convertible bonds / convertible debentures / units of equity oriented mutual funds 'does not fully cover the advances;	0	0
(v) secured and unsecured advances to stockbrokers and guarantees issued on behalf of stockbrokers and market makers;	0	0
(vi) loans sanctioned to corporates against the security of shares / bonds / debentures or other securities or on clean basis for meeting promoter's contribution to the equity of new companies in anticipation of raising resources;	0	0
(vii) bridge loans to companies against expected equity flows / issues;	0	0
(viii) all exposures to Venture Capital Funds (both registered and unregistered)	0	0
Total Exposure to Capital Market	227908.74	152502.51

c) Details of Single Borrower Limit(SGL)/ Group Borrower Limit (GBL) exceeded by NBFC as on 31st March, 2021

Reserve Bank of India vide its letter no.DNBR(PD)CO. 1223 /03.10.001 /2018-19 dated December 18, 2018 granted exemption to GSFS from concentration of credit norms to the extent of exposure to the Government of Gujarat entities. However, as per disclosure norms, the following information is submitted.

(₹ in Lakhs)

Particulars	Amt
Net owned funds*	319519.91
15% of net owned fund(in case of single borrower)	47927.99
25% of net owned fund(in case of Single group of parties)	79879.98
40% of net owned fund(in case of lend and invest to Single group of parties)	127807.96

*As per RBI notification No.RBI/2019-20/170 DOR (NBFC).CC.PD.No.109/22.10.106/2019-20 dated March 13, 2020 & RBI Notification No.RBI/2020-21/15 DOR(NBFC).CC.PD.No.116/22.10.106/2020-21 dated July 24, 2020.

i) Lend to**a) Lend to any single borrower exceeding 15% of its owned funds****(₹ in Lakhs)**

Name of GoG entities	Amt
Gujarat Energy Transmission Co. Ltd.	407547.06
Gujarat State Petroleum Corporation Ltd.	162400.00
Gspc Pipavav Power Co. Ltd.	70553.33
Gujarat State Road Development Corporation Ltd.	60042.23
Sardar Sarovar Narmada Nigam Ltd.	194259.26
Gift City Co. Ltd.	98100.00
GSPC LNG Ltd.	48100.00

b) Lend to a single group of borrowers exceeding 25 % of its owned fund**(₹ in Lakhs)**

Name of GoG entity Group	Amt
GSPC Group	341254.28
GUVNL Group	448343.35

ii) Invest in

a) the shares of another company exceeding 15% of its owned fund (₹ in Lakhs)

Name of the Company	Amt
Torrent Power Ltd.*	122461.00

b) the shares of a single group of companies exceeding 25% of its owned fund (₹ in Lakhs)

Name of the Group	Amt
Torrent Group*	122461.00

* This investment is undertaken in order to retain the strategic investment of Government of Gujarat and aid the progressive move by the State Government towards compliance of RBI regulations by GSFS.

iii) Lend and Invest (Loans / Investment taken together) exceeding

a) 25% of its owned fund to a single party; (₹ in Lakhs)

Name of GoG entity	Amt
Gujarat State Petroleum Corporation Limited	176017.00

b) 40% of its owned fund to a single group of parties (₹ in Lakhs)

Name of GoG entity Group	Amt
GSFC Group	354871.28

d) Unsecured Advance (₹ in Lakhs)

Particulars	2020-21
a) For determining the amount of unsecured advances the rights, licenses, authorisations, etc., charged to the applicable NBFCs as collateral in respect of projects (including infrastructure projects) financed by them, shall not be reckoned as tangible security. Hence such advances shall be reckoned as unsecured.	1196999.12
b) Applicable NBFCs shall also disclose the total amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. has been taken as also the estimated value of such intangible collateral. The disclosure shall be made under a separate head in NTA. This would differentiate such loans from other entirely unsecured loans.	NIL

35.1.5 Miscellaneous

a) Registration obtained from other financial sector regulators -

The Company is not registered under any other regulator other than Reserve Bank of India (RBI).

b) Disclosure of Penalties imposed by RBI and Other regulators -NIL

c) Ratings assigned by credit rating agencies and migration of ratings during the year -NA

35.1.6 Additional Disclosures

a) Provisions and Contingencies (₹ in Lakhs)

Break up of 'Provisions and Contingencies' shown under the head Expenditure in Profit and Loss Account	2020-21	2019-20
Provisions for diminution in value of Investment	NIL	NIL
Provision towards NPA	NIL	NIL
Provision made towards Income tax *	11247.19	13241.62
Contingent Provision against Standard Assets	-	-

*after availing MAT credit, if any

b) Concentration of Advances, Exposures and NPAs

Reserve Bank of India vide its letter no.DNBR(PD)CO. 1 223 /03.10.001 /2018-19 dated December 18,2018 granted exemption from concentration of credit norms to the extent of exposure to the Government of Gujarat entities.

(₹ in lakhs)

(a) Concentration of Advances Total Advances to twenty largest borrowers Percentage of Advances to twenty largest borrowers to Total Advances of the applicable NBFC	1196999.12 100%
(b) Concentration of Exposures Total Exposure to twenty largest borrowers / customers Percentage of Exposures to twenty largest borrowers / customers to Total Exposure of the applicable NBFC on borrowers / customers	1196999.12 100%
(c) Concentration of NPAs Total Exposure to top four NPA accounts	NIL

c) Derivatives

Company has not entered in to any derivatives contracts during the year.

d) Disclosure on frauds pursuant to RBI Master direction -NIL

e) Advances against Intangible Securities

The Company has not given any loans against intangible securities.

f) Drown Down from existing Reserves

The Company has made no drawdown from existing reserves.

g) Securitization

Company has not entered in to any such transaction during the year.

h) Details of Assignment transactions

Company has not entered in to any such transaction during the year.

i) Details of financing of Parent Company products - N.A.

j) Off Balance sheet SPVs Sponsored - N.A.

k) Customer Complaints

(a) No. of complaints pending at the beginning of the year	NIL
(b) No. of complaints received during the year	NIL
(c) No. of complaints redressed during the year	NIL
(d) No. of complaints pending at the end of the year	NIL

36 Disclosure of LCR (Liquidity Coverage Ratio) as per requirement of RBI Circular dated November 04, 2019 on Liquidity Risk Management Framework for Non-Banking Financial Companies and Core Investment Companies.

The RBI, vide its circular dated November 04, 2019 has made the guidelines on Liquidity Risk Management Framework for Non Banking Financial Companies and Core Investment Companies, applicable even to the Non Banking Finance Companies. The Liquidity Coverage Ratio (LCR) is one of the key ratios to measure the NBFC's capacity to meet its expected and unexpected repayment obligations arising over a shorter time frame at reasonable cost and without incurring unacceptable losses.

The LCR is calculated by dividing a NBFC's stock of HQLA by its total net cash outflows over a 30-day stress period. It requires an NBFC to have an adequate stock of unencumbered high-quality liquid assets (HQLA) that can be converted easily and immediately into cash to meet their liquidity needs for a 30 calendar day liquidity stress scenario. The objective of the LCR is to promote the short-term resilience of the liquidity risk profile of NBFCs with a view to improve the financial sector's ability to absorb shocks arising from financial and economic stress, whatever the source, thereby reducing the risk of spillover from the financial sector to the real economy.

LCR has been defined as:
$$\frac{\text{Stock of high quality liquid assets (HQLAs)}}{\text{Total net cash outflow over the next 30 calendar days}}$$

In order to ensure an orderly transition towards LCR compliance, the LCR requirements have been made binding on NBFCs by the RBI in a progressive manner starting from December 1, 2020 with minimum LCR to be maintained at 50%, progressively reaching upto the required level of 100% by December 1, 2024. The present LCR required to be maintained by GSFS, as per the proposed timeline is 50% as on 31st March 21.

Quantitative Disclosure:

(₹ in Lakhs)

		Q1 FY20-21		Q2 FY20-21		Q3 FY20-21		Q4 FY20-21	
		Total Unweighted 3 Value (average)	Total weighted 4 Value (average)	Total Unweighted 3 Value (average)	Total weighted 4 Value (average)	Total Unweighted 3 Value (average)	Total weighted 4 Value (average)	Total Unweighted 3 Value (average)	Total weighted 4 Value (average)
	High Quality Liquid Assets								
1	Total High Quality Liquid Assets (HQLA)	582300	517700	631567	566967	641400	576800	675267	610667
	Cash Outflows								
2	Deposits (for deposit taking companies)								
3	Unsecured wholesale funding								
4	Secured wholesale funding								
5	Additional requirements, of which								
(i)	Outflows related to derivative exposures and other collateral requirements								

(ii)	Outflows related to loss of funding on debt products								
(iii)	Credit and liquidity facilities								
6	Other contractual funding obligations								
7	Other contingent funding obligations								
8	Other cash outflows (not falling under any other above mentioned heads and discloses repayment of funds received from GoG entities)	1113495	1280519	1016250	1168688	890821	1024444	980830	1127955
8	TOTAL CASH OUTFLOWS	1113495	1280519	1016250	1168688	890821	1024444	980830	1127955
	Cash Inflows								
9	Secured lending								
10	Inflows from fully performing exposures								
11	Other cash inflows (majorly includes loan repayments from GoG entities and redemptions from Investments in Liquid/Debt Schemes of Mutual Funds)	2614193	1960645	2657858	1993394	2803318	2102489	2875017	2156263
12	TOTAL CASH INFLOWS	2614193	1960645	2657858	1993394	2803318	2102489	2875017	2156263
			Total Adjusted Value		Total Adjusted Value		Total Adjusted Value		Total Adjusted Value
13	TOTAL HQLA		517700		566967		576800		610667
14	TOTAL NET CASH OUTFLOWS		320130		292172		256111		281989
15	LIQUIDITY COVERAGE RATIO (%)		162%		194%		225%		217%

³ Unweighted values has been calculated as outstanding balances maturing or callable within 30 days (for inflows and outflows).

⁴ Weighted values have been calculated after the application of respective haircuts (for HQLA) and stress factors on inflow and outflow

Company's LCR for the Q4 of F.Y. 2020-21 comes to 217% and is above the minimum regulatory requirement of 50% as on March 31, 2021. Average HQLA held during the 4th quarter was ₹ 610667 Lakhs, of which Level 1 assets (i.e. GSDL securities) constituted 81% of total HQLA. Level 2 Assets (i.e Common Equity shares) constituted 19% of total HQLA. During the current quarter, HQLA (GSDL investments) have increased by around 7% whereas level 2 investments have remained constant. The weighted projected net cash outflow position during Q4 20-21 has gone up by ₹ 25878 Lakhs as compared to Q3 20-21 on account of increase in fund size.

As per the RBI guidelines, the company has formed an Asset-Liability Management Committee (ALCO). The Liquidity Risk Management of the company is governed by the Asset-Liability Management (ALM) Policy approved by the Board, which was devised keeping in view the unique business model of the company.

- 37** Schedule to the Balance Sheet as required in terms of Master Direction - Non-Banking Financial Company - Systemically Important Non-Deposit taking Company and Deposit taking Company (Reserve Bank) Directions, 2016 dated September 1, 2016 updated as on February 17, 2020.

Liabilities side :

(₹ in Lakhs)

Particulars	Amount Outstanding		Amount Overdue	
	31-Mar-21	31-Mar-20	31-Mar-21	31-Mar-20
(1) Loans and advances availed by the non-banking financial company inclusive of interest accrued thereon but not paid:				
(a) Debentures : Secured	-	-	-	-
Unsecured : (other than falling within the meaning of public deposits)	-	-	-	-
(b) Deferred Credits	-	-	-	-
(c) Term Loans	-	-	-	-
(d) Inter-corporate loans and borrowing	4215877.32	3856755.83	6942.10	7227.80
(e) Public Deposits	-	-	-	-
(f) Commercial Paper	-	-	-	-
(g) Other Loans (specify nature)-Liquid deposit scheme	289246.52	208637.99	-	-

Assets side :

(₹ in Lakhs)

Particulars	Amount Outstanding	
	31-Mar-21	31-Mar-20
(2) Break-up of loans and Advances including bills receivables [other than those included in (3) below]		
(a) Secured	14.30	2.40
(b) Unsecured	1203419.61	1189290.82
(3) Break-up of Leased Assets and Stock on hire and other assets counting towards AFC activities	———— N.A. ————	
(4) Break-up of Investments :		
Current Investments :		
1 Quoted :		
Shares :		
(a) Equity	-	-
(b) Preference	-	-
Debentures and Bonds	-	-
Units of mutual funds	2873811.07	2559966.52
Government Securities	-	-
Others (please specify)	-	-
2 Unquoted :		
Shares :		
(a) Equity	-	-
(b) Preference	-	-
Debentures and Bonds	-	-
Units of mutual funds	-	-
Government Securities	-	-
Others (please specify)	37961.43	17116.04
Long Term investments :		
1 Quoted :		
Shares :		
(a) Equity	211129.74	137865.50
(b) Preference	-	-
Debentures and Bonds	40000.00	40000.00
Units of mutual funds	-	-
Government Securities	581635.29	438451.97
Others (please specify)	-	-
2 Unquoted :		
Shares :		
(a) Equity	16779.00	14637.00
(b) Preference	-	-
Debentures and Bonds	-	-
Units of mutual funds	-	-
Government Securities	-	-
Others (please specify)	-	-

(5) Borrower group-wise classification of assets financed as in (2) above :**(₹ in Lakhs)**

Particulars	Amount net of Provisions*					
	Secured		Unsecured		Total	
	31-Mar-21	31-Mar-20	31-Mar-21	31-Mar-20	31-Mar-21	31-Mar-20
1 Related Parties						
(a) Subsidiaries (under voluntary liquidation)	-	-	-	-	-	-
(b) Companies in the same group	-	-	-	-	-	-
(c) Other related parties	-	-	1203416.34	1189287.69	1203416.34	1189287.69
2 Other than related parties	14.30	2.40	3.27	3.13	17.57	5.53
Total						

(6) Investor group-wise classification of all investments (current and long term) in shares and securities (both quoted and unquoted) :**(₹ in Lakhs)**

Particulars	Market Value / Break up or fair value or NAV		Book Value (Net of Provisions)	
	31-Mar-21	31-Mar-20	31-Mar-21	31-Mar-20
1 Related Parties				
(a) Subsidiaries (under voluntary liquidation)	-	-	-	-
(b) Companies in the same group	-	-	-	-
(c) Other related parties	16779.00	14637.00	16779.00	14637.00
2 Other than related parties	3744537.53	3193400.03	3744537.53	3193400.03
Total	3761316.53	3208037.03	3761316.53	3208037.03

Market Value / Break up or fair value or NAV is taken as same as book value in case of unquoted shares in absence of Market Value / Break up or fair value or NAV.

(7) Other Information**(₹ in Lakhs)**

Particulars	31-Mar-21	31-Mar-20
1 Gross Non - Performing Assets		
(a) Subsidiaries (under voluntary liquidation)	-	-
(b) Other related parties	-	-
2 Net Non - Performing Assets		
(a) Subsidiaries (under voluntary liquidation)	-	-
(b) Other related parties	-	-
3 Assets acquired in satisfaction of debt	-	-

38 Disclosure in compliance with RBI notification No.RBI/2019-20/170 DOR (NBFC).CC.PD.No.109/22.10.106/2019-20 dated March 13, 2020.**(₹ in Lakhs)**

Asset Classification as per RBI Norms	Asset Classification as per IND AS 109	Gross Carrying amt as per IND AS	Less Allowances/ Provisions as required under IND AS 109	Net Carrying Amt	Provisions required as per IRACP norms	Difference between IND AS 109 & IRACP norms
1	2	3	4	5=3-4	6	7=4-6
Performing Assets						
Standard	Not Overdue	1203432.83	-	1203432.83	4813.73	(4813.73)
Performing Assets						
Standard	Stage 1					
	Stage 2	-	-	-	-	-
Sub total						
Non Performing Assets (NPAs)						
Substandard	Stage 3	-	-	-	-	-
Doubtful - up to 1 year	Stage 3	-	-	-	-	-
1 to 3 years	Stage 3	-	-	-	-	-
More than 3 years	Stage 3	-	-	-	-	-
Subtotal for doubtful	-	-	-	-	-	-

Loss	Stage 3	-	-	-	-	-
Subtotal for NPA	-	-	-	-	-	-
Other items such as guarantees, Loan commitments, etc which are in scope of IND AS 109 but not covered under current income recognition, Asset classification, and provisioning (IRACP) norms	Stage 1	-	-	-	-	-
	Stage 2	-	-	-	-	-
	Stage 3	-	-	-	-	-
Sub total	-	-	-	-	-	-
Total	Not Overdue	1203432.83	-	1203432.83	4813.73	(4813.73)
	Stage 1	-	-	-	-	-
	Stage 2	-	-	-	-	-
	Stage 3	-	-	-	-	-
	Total	1203432.83	-	1203432.83	4813.73	(4813.73)

- 39** During the financial year 2020-21, one of the Independent Directors completed his second consecutive term on March 22, 2020. Since GSFS is Government of Gujarat (GoG) Company, it is necessary to seek an opinion of the GoG for appointment of Independent Director. In view of the same the Company in June, 2020 had proposed for opinion of the GoG. The Government had approved appointment of Independent Director vide its letter dated July 15, 2020 and accordingly Company had appointed the Independent Director w.e.f. July 15, 2020.
- 40** During the year, dividend income, from strategic investments, has been shown as "Other Income" instead of "Revenue from operations" and consequential changes have also been made in the previous year disclosure as well as cash flow statements.
During the year, amount received against ICD / LDS pending clearance has been shown as "Other financial liabilities" instead of "Deposits" and consequential change has also been made in the previous year disclosure.
- 41** With a view to provide more benefit to GoG entities as per the unique business model of the Company, for working of interest in a leap year, GSFS has been considering 365 days on ICD & LDS and 366 days on loans for last more than two decades. However, from the next leap year, the Company will consider 366 days for working of Interest on ICD and LDS also as per usual accounting practice of having same basis of interest calculation.
- 42** Previous year's figures have been re-grouped / re-classified wherever necessary to correspond with current year's classification / disclosure. Figures have been rounded off to rupees in lakhs.

As per our Report of even date

For Mukeshkumar Jain & Co.
Firm's Registration No: 106619W
Chartered Accountants

Sd/-
Pankaj Joshi
Managing Director
(DIN:01532892)

Sd/-
Sunil Talati
Director
(DIN:00621947)

Sd/-
Piyush Jain
Partner
Membership No:413377
UDIN : 21413377AAAABP4470

Sd/-
Nitin Shah
Chief Financial Officer

Sd/-
Neeraj Jain
Company Secretary
(ACS:44725)

Place : Ahmedabad
Date : 22/06/2021

Place : Gandhinagar
Date : 22/06/2021

